

શ્રી સુધર્માસ્વામી જ્ઞાનભંડર

બિલ્ડિંગ પ્રોપરીટી

ફોન : ૦૨૬૮-૨૨૩૮૮૯
એલારાસાથી, ગુજરાત.
૩૦૦૮૮૮૫

2837



અનુષ્ઠાનિક
અનુષ્ઠાનિક

ડૉ. પ્રિભુવનદાસ લહેરચંદ શાહ ટ્રેસ્ટ સંસ્થાપિત
સંસ્કૃતિ રક્ષક સસ્તું સાહિત્ય
(પ્રથમ અષ્ટી-પુણ્ય નીજું)

સતીશિરેમણ્ણી

ચંદનબાળ

—: લેખક :—

મોહનલાલ દીપચંદ ચોકશી



—: પ્રકાશકો :—

શારીકાન્ત એન્ડ કું.

રાવપુરા, વડોદરા

(સર્વ હુક્કું પ્રકાશકોને સ્વાધીન રાખ્યા છે)

સોલ એજન્ટ્સ :—

સંસ્કૃતિ રક્ષક સસ્તું સાહિત્ય કાર્યાલય

મહાઠનગરી, રાવપુરા, વડોદરા

આવૃત્તિ ૧૬૦]

મૂલ્ય અંગેથિયા

[જાન્યુઆરી ૧૯૪૮

મુદ્રક :

મહિલાલ પ્રભાશંકર વ્યાસ
શ્રી લક્ષ્મી છલેકટ્રીક પ્રિ. પ્રેસ
મોહિખાના રોડ, વડોદરા
૧૫-૧-૪૮

ભૂમિકા

ડોક્ટર ત્રિલુનનદાસ શાહના નિકટ પરિચયમાં હું તેમની કૃતિ-પ્રાચીન ભારતવર્ષ નામા બૃહ્દી અંથના વાંચન પછી આવ્યો. તેઓના મનમાં જૈનસમાજમાં ચાલુ કાળને અતુર્ધ્ર સાહિત્ય તૈયાર કરી પ્રચારવાની અને એ રીતે માતા સરસ્વતીનાં ખડુમાન કરવાની ધગશ - અગ્રપદે હતી. વિશેષમાં આમજન સમૂહને સરળ ભાષામાં, વર્તમાન કાળની નવલક્ષ્યા ડેઝે જૈન ધર્મનું ઐતિહાસિક સાહિત્ય સર્તા મૂલ્યે આપવામાં આવે તો ધર કરી એકેલ સુધુપિત અને જડતા આપો આપ નાશ પામે અને જગૃતિ તેમજ વીરતાની ઉપા બેગે; એવું મંતવ્ય સચોટ હોવાથી આ અંથમાળાનાં મંડાણ થયાં. મારે પણ એકાદ કૃતિકારા એમાં સાથ પૂરાવો એવી તેમની આશ્રદ્ધભરી માંગણો થઈ.

મારો લેખન વ્યવસાય એક શોખના વિષય તરીકેનો છે. મેં હાતો ભણી પણ પાત્ર આદેખન સખંધી નિશ્ચય તો પછી થયો. મારાજ વહિલ ભાતા સ્વર્ગરથ કરતુરચંદ હીપચંદ ચોકશીની પુત્રી સુલદાએ આળવયમાં ભાગવતી દીક્ષા સ્વીકારેલી હતી. જો કે એ બાળનો ધાર્મિક અભ્યાસ મધ્યમ પ્રકારનોં હતો પણ સંરક્ષારી જીવન હોવાથી સંયમ-રંગ પાડો હતો. સાધ્વીજીવનમાં પદ્મલાં પાડયાં. પછી વિવિધ પ્રકારની તપ કરણીમાં લગ્બલગ અગીયાર વર્ષ તેમણે ગાય્યાં હતાં. હસમુખો ચંદેરો અને સમતાભાવ હરફોઈને આશ્ર્ય મુખ કરે તેવા હતા. એકાદ મેળાપ ટાણે એ સુદૃશનાશી તરીકે પૂજ્ય સૌભાગ્યશ્રીજીના સંધારામાં વિચરતા સાધ્વીને જોઈ, આળ અલયારી સાધ્વી ચંદ્નખાળા સખંધી કંઈક લખવાની છચ્છા ઉદ્ભવી. સામાન્ય ગુંથણીની વિચારણા પણ કરી. દરમિયાન ડો. શાહ તરફથી અંથમાળાનો આરંભ થઈ ચૂફેલ હોવાથી માંગણી પણ થઈ. સતી શિરોમણી ચંદ્નખાળાની રચના સખંધી આ ભૂમિકા.

આ નાનકડી પુર્સિતકા પ્રગટ થાય છે ત્યારે સુદર્શનાશ્રીજીનું અરસ્તિતવ નથી. છેલ્લાં એ વર્ષમાં તેઓ પીતપાંડુ રોગથી ધેરાયા હતા; અને સં. ૨૦૦૪ના કારતક સુદ ૨ ની સંધ્યાકાળે પ્રભુસમરણુમાં લીન બની આ ઝાની દુનિયા પરથી વિદ્યાય થયા. તેર વર્ષના દીક્ષા પર્યાયમાં સંયમ જીવનની સુવાસ પાથરી ગયા. જે નિમિત્ત પાંચી આ પ્રયાસ મેં આરંભેલ તે રમૃતિપથમાં સતેજ રહે એ અર્થે ખંભાતના મારા ‘ગ્રેમકુટિર’ ના વાસમાંજ આ ભૂમિકાના રેખાંકન થયેલા, જે અહીં કાળળ પર ચઢે છે; અરસ્તુ.

ઉપરની અંગત વાત પછી પુર્સિતકા સંબંધમાં થોડુંક સ્પષ્ટી-કરણ કરવું જરૂરી છે. જૈન સાહિત્યમાં તેમજ શ્રી કલ્પસૂત્ર અને અદ્વાધ્યરમાં વંચાતાં વ્યાખ્યાનમાં સાધ્વી ચંદ્નબાળા સંબંધી આવતા ઉલ્લેખેને નજર સન્મુખ રાખી આ ઐતિહાસિક પાત્રની આસપાસ વર્તમાન કાળની પદ્ધતિએ બિન્ન બિન્ન પ્રસંગેની સંકલના કરી છે. એ માટે ખાસ વિવેચન કરવાની અગત્ય જરા પણ નથી; કેમકે જૈનો એથી પરિચિત છે. અહીં તો એ સર્વને શંખલાઘ્વ કરી સંતોષ માન્યો છે.

પદ્માવતીનો પુત્ર કરકંદૂ છે. એના જન્મ પછી તેણુંએ દીક્ષા લીધી હતી એ વાત નિશ્ચિત હોવાથી પદ્માવતી ચંદ્નબાળાની માતાન થઈ રાહે. કેટલાક ધારિણી પદ્માવતીનું બીજું નામ જણાવે છે એ ભૂલ ભર્યું છે. ચંદ્નબાળા ઉર્ફ વસુમતીની મા ધારિણી છે અને એ પદ્માવતીના અપહરણ પછી દ્વિવાહન ભૂપ સાથે લમ અંથીથી જોડાયેલી છે. સપત્નિપદે હોવાથી કુલ્ય બ્હેનો જણાય. એ ન્યાયે જ ચંદ્નબાળાની મૃગાવતી માસી થાય.

ચંપાના સ્વામીની અભયા નામે રાણી હતી. ઉપર જેથું તેમ ચંપાપતિનું નામ દ્વિવાહન છે એ જોતાં, અને ધારિણીનું જે રીતે અવસ્થાન થાય છે એ વિચારતાં તેમણે ત્રીજી વાર લમ કર્યું હોય એ-

સંભવિત છે. કોઈ રથાને દ્વિવાહનને બદલે 'જીતશરૂ' તરિકે ઉત્સેખ છે. એ કણે મૂળ નામને ઠેકાણે પરાક્રમથી ગ્રાપી કરેલ બિરુદ્ધથી વધુ જ્યાતી થતી એવું જોવાય છે. જેમ 'બિબિસાર'ને બદલે 'શ્રેણીક' 'કૂણીક'ને બદલે 'અન્જાતશરૂ' અને 'અવકર્ષિક'ની જગાએ 'કરકંડું' એ ધોરણે યુદ્ધમાં વધુ વાર જ્યાશી વરનાર રાજ્યી દ્વિવાહનનું બીજું નામ 'જીતશરૂ' હોય એ સંભવિત છે. શેડ સુર્દર્શનનો પ્રસંગ ચરમ તીર્થપતિના શાસન સથાંધવાળો હોવાથી, અને અભયારાણુંએ એમાં અગ્ર ભાગ ભજવ્યો હોવાથી, ઉપરના મંતવ્યને પુષ્ટિ મળે છે. કથાનાયિકા ચંદ્નયાળા હોવા છતાં, આસપાસ કૌદુર્યિક સર્જન એવી રીતે થયું છે કે ઘડીભર પહેલી નજરે એ પૂર્ણ સ્વાંગમાં ન પણ આંખે ચઢે. પણ એ બાળાએ જીવનમાં જે ભાગ ભજવ્યો અને વયમાં નાની છતાં પ્રૌઢાને પણ ટક્કર મારે તેવી કાર્યવાહી કરી દેખાડી, એનો વિચાર કરતાં, એ જતના ઘડતરમાં-એનામાં એ પ્રકારના સંસ્કાર સૃજન કરવામાં-જે જે પાત્રોનો ફાળો નોંધાયો હતો એ વાત યાદ કર્યા વિના ન જ ચાલે.

આ કૃતિમાં લેખકને ડેવા પ્રકારની સફળતા પ્રાપ્ત થઈ છે એ તો વાચ્યકોજ કંદી શકે મુશ્ક જોવામાં ડેટલીક ભૂલો રહી છે, અને ડેટલાંક સ્થાને 'ત' તથા 'ન' તેમજ 'લ' તથા 'વ'ના ઉકેલમાં ગર્ણી થઈ છે એ વખતસર અંથ પ્રગટ કરવાની ઉત્તાપણને આભારી છે.

અંતમાં જણ્ણાવવાનું કે શોખથી આલેખાયેલા પ્રભાવિક પુરુષો ભાગ ૧ તથા ભાગ ૨ માદ્ક આ પુસ્તક પણ જનતના આદરને પાત્ર નિવડો એવ અભ્યર્થના.

પ્રેમકુટીર-ખંદાન
ભાઈઓ
સં. ૨૦૦૪

મોહનલાલ દીપચંદ ચોકશી

અનુક્રમ

પ્રકરણ	વિષય	પૃષ્ઠ
૧ લું	કૂવા કાઠે	૧
૨ જીં	ભાગીના વાસ્ત્વા	૧૨
૩ જીં	પદ્માવતીનો સહવાસ	૨૬
૪ થું	ગ્રેપ્સીનો વિરહ	૩૪
૫ મું	ધારિણીનું સ્વરૂપ	૪૧
૬ કું	મસલતગૃહના કમરામાં	૪૬
૭ મું	રમણી તો એજ	૫૫
૮ મું	બાળિકા વસુમતી	૬૬
૯ મું	અરણ્યના એકીત પ્રેશ્યમાં	૭૭
૧૦ મું	શું ધારિણી ચાલી ગઈ ?	૮૭
૧૧ મું	લીલામના બળરમાં વસુમતી	૯૮
૧૨ મું	ઉપરનમાં મેળાપ	૧૧૦
૧૩ મું	ધર્મનિષ્ઠ દંપતી	૧૨૦
૧૪ મું	કૌસુદી મહોત્સવ	૧૪૧
૧૫ મું	શૂળનું સિંહાસન	૧૪૨
૧૬ મું	કષ્ટ વાડીનો ભૂળો !	૧૪૧
૧૭ મું	સમરભૂમિ ઉપર ચમત્કાર	૧૬૧
૧૮ મું	ચમત્કારોની પરંપરા	૧૭૨
૧૯ મું	કૌશાભ્યીમાં ભાગવાન	૧૮૨
૨૦ મું	કમળસમ નિદેંપ	૧૮૫
૨૧ મું	અમણ્યાજીવનની સુવાસ	૨૦૮
૨૨ મું	મહાસેન વત્તમાં સંધસ્યાપના	૨૨૫
૨૩ મું	અમણ્યતરમાં ધર્મ રમણીપતરમ	૨૪૦
૨૪ મું	હદ્દ્ય પદ્દો એજ જીવન પદ્દો	૨૪૬
૨૫ મું	અમતભામણીનું મહત્વ	૨૬૫

સતી શિરો મણિ
ચંદ્રનભાગ





શ્રીયુત લેખકે વિના પુરસ્કારે આ પુસ્તક લખી અધ્યું હોવાથી
અમારા મંડળના નિયમાતુસાર તેમને પ્રથમ એણુંના આજુવન સભ્ય
નીમવામાં આવે છે.

લેખક મહારાય આ પ્રકારના પ્રથમજ સભ્ય શતા હોવાથી અમે
તેમને હાર્દિક અભિનાંદન આપીએ છીએ.

બેનાલાંબ ફ્રોસ્ટી



પ્રકરણ ૧ લુ

કુવા કાંઠે



લૂરી ગળારવ અને વારંવાર વિજળાના ચમકારા પછી ખરે-
ખર મુસળખાર વરસાદ વરસ્યો. જાણે પ્રલયકાળ ટૂંક સમયમાં જ પથ-
રાધ જવાનો હોથ એ રીતે કાળા મેઘના આગમનથી ચારે દિશામાં
અંધકાર બ્યાપી રહ્યો. અંગ દેશના આ પ્રહેશમાં પ્રતિવર્ષ વરસાદ તો
પડતો પણ આજના પાણીએ તો ભય પમાડે એવું તાંડવ નૃત્ય આદ્યું
હતું. નદી નાળાના કાંદા ઉભરાધ ગયા હતા. અરે અવર જવરના
માર્ગો પણ એટલી હૃદે ચાકાર અને જળથી બંધાકાર બની ગયા કે સૌ
ક્રોધના હૃદયમાં એક જ પ્રશ્ન ઉઠવા લાગ્યો. કે આ મેઘરાજ જગતને
જ્યાંયા માર્ગ છે કે એનો વિનાશ કરવા ? અનુભવી વૃદ્ધોના શખ્ફો
હતા કે તેઓએ જીવનભરમાં આટલા વિપુલ પ્રમાણમાં એક દિવસમાં
આટલું બધું પાણી પડેલું જેયું નથી. મેઘનું આજનું સ્વરૂપ જોઈ
કેટલાકને પુરિખાદાની પાર્થીનાથ ભગવાંત ઉપર મેઘમાળા—કમઠ દારા
કરાયેલ ઉપસર્ગ યાદ આવતો. ચોડાકને કોઈ દેવ ઝઠ્યાની શંકાએ
પણ અટી.

૧

જળની ઝડીયેના જખરા સપાટાથી પાણી વહી જવાના માર્ગો સંકુદાઈ થયા. પાણીને ઉભરાવે સામ સામેના મફાનો ઉપર ઉભરાવા માંડયો. અને કેટલાક ધરોનાં પગથીયાં જળની સપાટી નીચે અદ્રસ્ય થવા લાગ્યાં. ગામ અહારના નીચા ધરોમાં તો જળદેવતાનો પ્રવેશ પણ થઈ ચૂક્યો. આમ કષ્ટ પરંપરાનો પાર નહોંતો, છતાં વરસાદ બેંચાયાથી હુંકાળ પડવાની ને શાંકા બેતીકારોના દિલમાં જર્નમી હતી અને છેલ્લા કેટલાક દિનોના એક ધારા ઉકળાટથી જનતા મલરાઈ ગઈ હતી, એ સર્વનો પાછલી રાતથી વરસવા માંદેલ પાણીએ અંત અધ્યાણી દીધે. જરૂર કરતાં વધારે પડેલ વર્ષી હવે તો થંબી જય તો સારં એમ માનવ હદ્દ્યો. છુંછવા લાગ્યાં. જે કે કુદરતના કાનુન પર માનવ અલિપ્રાયનું કંઈ જ વજન નથી પડતું એ સત્ય હકીકત હોવા છતાં, ગામજન સમૃહની મૂંગી પ્રાથના જણે સંભળાઈ ન હોય તેમ મધ્યાહ્ન વીત્યા પણી મેઘરાજ થંબી ગયા, અને વાદળમાં છૂપાઈ ગયેલા સહસ્રરક્ષિમ મહારાજ પ્રગટ થયા. પાણી ઉત્તરતાં માર્ગો મેઝળા બન્યા. અને જોત જોતામાં અવર જવર થિ થઈ. સુર્યના આછા છતાં કુમશઃ ધેરા બનતાં કિરણે હેઠળ સુષ્ઠિ સુંદરી એકદી નવોદા માફક નાચી ઉડી. પદ્મિગણ પણ માણા છોડી કલ્લોલ કરતો ચણું અથે ચોતરક ઉડી રહ્યો અને જન સમૃદ્ધાય આવસ્યક કાર્યોમાં રત બન્યો. સંધ્યા સુંદરીના આગમનની ઘડીઓ જણ્યાય તે પૂર્વે ગામની સમિપ આવેલ, છતાં અવર જવરસના ચાલુ માર્ગથી કંઈક અંશે છૂટી પડેલી વાપિકા. પર નારીષુદ્ધની સપત્ત લીડ જમી હતી. વરસાને કારણે ધરમાં ભરાઈ રહેલ નારીગણ અહીં આની છૂટથી કામમાં લાગી જ્યો હોનો. કોઈ વામાઓ પોતાના તાંબા પિતાળના બેંગા માંજ રહી હતી તો ખીજ કેટલીક વાતડીમાંથી જળ બેંગી રહી હતી. આ હિયા જાણે જાત જતના વર્વાલાય, જાલી, રથા હતા. એમાં ધરતાં ઉંઠાયુંાં જ્યાંદે કોણારમાં રહેલા ધાન, સાનુઝા કપુરા વર્તાવ, સસરાજની કંડે નબરું.

નાવલિઓએ ધડાવેલાં ધરેણું અને સમાજની કંઈ કંઈ વાતોનો। સંભાર ભરાતો. ગામગાં નવી આવેલ એક લલનાએ ચંપાના સ્વામી દ્વિનાહન અને પ્રેયસી પદ્માનતીની વાત પણ છેઠેલી. વાપિકાનો કાઠો ડેળ પાણી જ પૂરું પાડતો એમ નહીં પણ એ સિવાય તાજ, આતમી આપનાર ગામના ‘ચોરા’ ની ગરજ પણ સારતો.

કૃલીંક તરણુંનો આ સ્થળથી આગળ વધી સમિપતર્તી ઉદ્ઘાનતા નાંડા પર આવેલા કુવા પર પહેંચી ગઈ હતી. કુદરતે સર્જેલા મનોરમ ચાતાવરણુંના જળ ભરવાના કાયને થંભાવી, સંગીતની મોજ માનતી મધુર રાતે ગરખાનો આનંદ લૂંટી રહી હતી. ટેળ ટાપાં અને હાસ્ય મસણી પણ શૂટથી અહીં ચાલી રહ્યાં હતાં. એકખારી સ્વતંત્રતા અને પુરુષ વર્ગની ગેરહાજરી એમાં પૂર્ણ સાથ આપી રહ્યાં હતાં. ઉગતી વય, ભીજતી જીવાની, પાંગરતાં અંગોપાંગ, સુસંનિષ્ઠત કેશ કર્કાપથી શોલિત ચહેરાના વિવિધ પ્રકારી ડેલન, હેંકિલ કંડે થઈ રહેણુંના મધુરાં ગાન, અને તાલી હેતાં થતાં ડોમળ દેહલતાના વિવિધ પ્રકારના અંગ-મરોડથી જમાવટ એવી તો સુંદર થઈ હતી કે એ વેળા ત્યાં એકાદ ત્યાગીના પગલાં પડ્યાં હોત તો, એ પણ બડીભર મુંખ થયા વિના ન રહેવા પામત. રાગી માનવોનું તો કહેનું જ શું? મન માણી મળ લુંટતી આ રમણીએ સૂર્ય દેવની કળાના સંક્રાંતને અને નજીક આવતી સંધ્યાની પગલીને પણ જોવા જેટલા ભાનમાં નહોતી રહી.

ચંદ્રાનના નામા એક યુવતિ એકાએક બોલી ઉડી. અરરર! સખી બિન્હુ ! પાણી ભરવા આવેલી હું મારી માતાની સૂચના તો સાત વીસરી થઈ ! મારે તો જદ્દી બેદું ભરી ધેર પહેંચવાનું હતું. મારા નાના ભાઈની વૈષ રામગોપાળ પાસે લઈ જવાનો હતો. જેને સંધ્યા તો આવી લાગી. વૈષરાજ હવે મળવાના નહીં, હૃપ્કો સાંભળવો પડ્યો.

કનકમાળા—ઓહો ! એમાં આટલી તળે ઉપર શું થાય છે ? ચંદ્રા, હુને વિલંબ થયો જાણી, ત્હારા મોટાભાઈ વિરોચન કેમ ધાર્યું કે વૈષ-પાસે નહીં ગયા હોય !

કનકમાળા, તું પણ શું કહેતી હોઈથ. દેરેક કામ મોટા ભાઈના માથે જ ઠોડું એમ? પિતાજના ભરણું પછી ધરનો ભારું તો તેજ ઉપાડી રહ્યા છે. એ તો અધું કરી છૂટે પણ આપણે કંઈ જોવું કે નહિ? ચાલો, જરૂરી આટોપો. હું તો ચાલી. બિન્હુ, તું આવે છે કે? આટલો ધારણીયાનો ગરબો થઈ જવા હે. સંગીતનો આનંદ માણવાનો આજે આગ્રહ કરી તેડી લાગી છું. આવા રસ લુંટણું રોજ નથી સાંપુત્રાં અને કુંવરીયાના આગમન પણ રેઢાં નથી પડ્યાં! કોઈક જ વાર સરખી જોડો જમતાં રંગ જમે છે. મારે નિકટના સહીપણું હોવા છતાં સંગીત દ્રષ્ટામાં એ આટલી હુદે આગળ વધી ગયા છે એ મેં તો આજે જ જાણ્યું.

તેમના કંઠની મધુરતાથી ગામમાં હોણ અજણ છે? વારણી આંઝો મટમટાવતાં બોલી અને કહેવા લાગી કે—

એ રહ્યાં જમીનદારના પુત્રી! ક્ષત્રિય કુમારિકા! વળી ભાતુઅના શુજરી જવાથી પિતા એવા હરનામસિંગના એમના પર ચાર હાથ છે. કુંવરી સિવાય ફરજંદમાં અન્ય ન હોનાથી એમની પાછળ આપણા જમીનદાર ધન તો પાણી માઝક વાપરે છે. પછી એ સંગીત નિષ્ણાત બને એમાં શી નવાઈ! સારો દિન ગાયા કરે તો રોકનાર કોણું છે? આપણી માઝક એછી જ એમને લપણ્ય વળગેલી હોય છે. અભ્યાસથી સર્વ કંઈ સિદ્ધ થાય છે. તો એકાદી સંગીત કળા માટે શું કહેવું?

માલિકા—વારણી, તું તો દરેક વાતમાં રામની રામાયણ સર્જે છે. બિન્હુનો આશય તો આપણ સર્વેમાં ધારણીએને સંગીતકળામાં ઓછ છે એ બતાવવાનો હતો. તેં તો એના ઉપર ભાષ્ય રચી નાખ્યું. ઉતાવળ સૌને છે પણ આ છેલ્સો ગરબો ગાયા પછી જ ખીજ વાત.

મલિલિકાની હાડુલ પછી સૌ એક ચિત્ત ગરબો ગાવામાં પરોવાયા. ખૂઅ આનંદ માણ્યો. ગરબો પૂરો થતાં જ ગાગર ભરવાની હસ્તિકાઈ આરંભાઈ.

અચાનક એક અશ્વારોહી સૈનિકના ત્યાં પણ્ણાં પડ્યાં એને જેતાં જ સૌના હાથ દોરડા પર ચંબી ગયા. ત્યાં તો એ સ્વારના ઇવાઅદાર શખ્દો સંભળાયાં. ‘મારી સાથે જલ્દીથી પાણીથી ભરેલો કુંભ લઈ એક જણી ચાલો, પેંબા ઘેારી માર્ગ પર મારા સરદાર થોષ્યા છે. તેમને તરસ છીપાવવા પાણીની જરૂર છે.’

આ સાંભળા સૌ ધારિણી સામે જેવા લાગ્યો.

એને ધારિણી જરાપણું ચહેરા પર વિકૃતિ આણ્યા સિવાય સૈનિક તરફ જોઈ એલી,

‘ભલા ભાઈ, તરશ લાગી હોય તો અહીં કંઈ જણનો ટોટો નથી. અમો ઉતાવળમાં છીએ. રોજ કરતાં આજ વધુ વિકંબ થયો છે. કદાચ ત્હારા માલિકને ઘોડા ઉપરથી ઉતરી, જીતે પાણી પીવાનું ન પાવવતું હોય તો, એ અહીં આવેથી અમો એ સગવડ કરી દઈશું. એ માટે મીઠાં વચ્ચે માંગણી હોય. આવા કરડાકીના વચ્ચન ન ચાલે. ત્હારી આજા ઉદ્ઘાવવાની અમને નથી તો જરૂર, કે ત્યાં પાણી લઈ આવવાની અમને કંઈ કુરસદ. જવાબ સાંભળતાં જ સૈનિકની આંખો રાતીચોણ થઈ, એને એ તદ્દૂકી ઉદ્ઘ્યો—

રમણી ! ત્હારો મર્વ ઉતારનર હજુ ડોઈ મરદ મળ્યો નથી લાગતો ! નારી જતિને આવો તે મર્વ શોભે ? પૂર્વે ફેટલીયે વાર આ માર્ગ જતાં આવતાં પાણી પીવા થોષ્યા છીએ એને ઘોડા ઉપરથી ઉત્તરવાની જરૂર નથી પડી. મરદ જાત પ્રત્યેના સામાન્ય વિવેકનું ખલુ ભાન ન મળે ! એરત જેત એટલે ખુદ્ધિનું દેવાળું ! પાણી પણ પાવું પડે એને સેવા પણ કરવી પડે !

ખખરદાર ! ત્હારી લુલીને આગળ ન ચલાવતો ? ખફુંબાદ બંધું કરી ત્હારા માર્ગ પડ. ત્હારી જીવના—સમજણું હે ઉપહેશ અહીં છાર પર લીંપણ જેવાં છે.

સૈનિક પણ ગુર્સામાં આવી જેરથી બોલી જયો. ‘ અરે બોકડી ! મારી શક્તિને જોવી છે ! ભવભનસાઈથી નહીં માને તો ચોટલો પકડી એંચી જાઈશા.’

તરત જ હોડા ઉપરથી ઉતરી પડ્યો અને દમાખથી કુવા તરફ ડગ ભરવા લાગ્યો. ધારિણી અને એની એક સખી સિવાયની બીજી નારીએ તો પ્રેરજવા લાગી. એકાદનાથી બોલી પણ દેવાયું—

એન જવા હો, પાણી પાઈને વિદ્ધાય ફરો.

પણ ધારિણી તો ક્ષત્રિય બાળા રહી. સૈનિકના અપમાન જર્યો શર્ઝદોએ એની નાડી ભરમ બનાવી દીધી. હાથમાંનો તાંખાનો ધડેં જોરથી પેલાની સામે ઝોક્યો. એનો ધા છાતીમાં લાગતાં જ એને તમભર આવ્યાં એને જમીનપર પછડાઈ પડ્યો ! એ ઉઠે તે પૂર્વે તો છંછેડાયેલી નાગણી માઝક ધારિણી હોડી જઈ એની છાતીપર ચડી એઠી, એને બિનદુને કભરપર લટકતી તલવાર છોડી દેવાની આગ્ના કરી. સૈનિકની બેટમાંથી જમૈયો. એંચી કહાડી, એ વડે તલવારનો બંધ કાપી નાંખ્યો. સૈનિકને નિઃશર્કો બનાવી દીધા. રણ્યાંડિકા માઝક ડોળા તગતગાવી ગજીના કરતી કહેવા લાગી—

‘ જીઓલતિનું અપમાન કરનાર એંચો નરપિશાય ! અજમાવ તહારી બહાદુરી ! ચોટલો પકડી ધસડી જ મને ! તહારા સરખી નિર્બન્જતા હું ધારણું કરું તો અહીં જ તહારા રામ રમી જાય ! પણ એમ કરવા જતાં મારી જ કોઈ બહેનની ચૂડી-ચાંદલો નષ્ટ થાય. એને એ છાન્દતું ન હોધાથી જ જીવતો રાખું છું.’

એને છોડી, ગભરાયેલી સખીએને કહેવા લાગી કે— ‘ એમો ડરો છો શું ? એ કોઈ રાક્ષસ તો નથી કે આપણા બધાને ખાઈ જત ! આજે પાણી પાવાનો હૂકમ કરે છે એને બીજી વખતે પગચેણી કરવાની અધ્યા છેઝસે. ’ કેમ જ્વાલે આપણે પુરુષ જતિની દુંછા ગ્રંથાં

નાયનાર પુતણીએ ! ’ ગ્રેમબાવે આંભનાર માટે આપણે પ્રાણુ પણ ન્યોછાવર કરી દઈએ, તો પાણીનો પ્રશ્ન હેઠો ! પણ બ્યાં અધિકાર હિબરાતો હોય અને અપમાન જળવાનું હોય ત્યાં આપણે પ્રથળતાથી પંડકાર કરવો જોઈએ. પારણું જુલાવવાની તાકાતવાળા આપણું હાથોમાં જગતને હિલાવી દેવાની સ્ક્રિત ભરી પડી છે. આપણું એ વાતનું ભાન જાગત હોવું જોઈએ. આપણું જ ખોળામાં ઉછેલા— અરે રમેલા પુરો આપણું ઉપર રવાય કરી શકે ? આપણે અવતાર તો સ્ક્રિતનો. એક વાર પરચો બતાવાય તો સૌ સારા વાના સમજવા. ધર કરી બેઠેલી નથળાઈ ખંખેરી નાંખીએ તો કોની જગ્ઘાર છે ન આપણી સામે ફૂડી નજર પણ કરે ? આપણું નિશ્ચય થતાં આના જેવા સુંખ્યાયં ધરતરાંએ. તો આપણું ધરના વામાં છૂંદાઈ જય ! ’

માંડ કળ વળતાં ઉભો થયેલ સૈનિક આ લાવા સમી ધંધગતી વાણી સાંભળા અને રમણીનું અદૃષ્ટ પરાક્રમ જોઈ એવો તો ઉધાઈ જયો. થી નમેલું માયું ઉચ્ચું જ ન કરી શક્યો. ત્યાં તો વિલંબ બવાથી અકળાયેલ એનો સરદાર પણ આવી પહોંચ્યો. ધારિણીના છેલ્લા શષ્ઠો. એણે સાંભળ્યા હતા. નજર સામેનું દસ્ય જોનાં પરિસ્થિતિનો એણે ખ્યાલ આવ્યો, જાણે કંઈ બન્યું જ ન હોય એમ એ ખોલ્યો—

અહેન ! જરી પાણી તો પાતા જા.

નાયહના મૃદુ શષ્ઠો સાંભળતાં જ ખીલ હોઈ લલના આગળ આવે તે પૂર્વે ધારિણીએ હોડી જઈ પોતાની રૂપાની જાગરમાંથી પાણી આ પ્યું. પૂર્વની ઓનસ્ટિતા સહ સૌન્દર્ય અને નાગતાનો આવો સુંદર જ યાગ જોઈ નાયહને ધારિણી જોડે વાત કરવાનું મન થયું. કોની દિકરી છે એ જાણુનાની તાલાવેલી હિબરી. પણ સંધ્યાનો અંધકાર ડેક્કિયાં કરી રહો હોવાથી અને પાણુચારીએ જવાની હિતાનગમાં

હતી એ જોઈ છેણા મનમાં સમાવી, ખાલે એક વાર પુનઃ ખરી જળ
બેચાના મિશે ધારિણીના ચંહેસ પ્રતિ નજર નાખી લીધી. નારીષું દ તો
હું સગતિએ ગામ પ્રતિ આગળ વધી રહ્યું હતું. આ તરફ જણને
ચેટમાં પદ્ધરાની ઉલાયે ઢોડા પ્રલાઘ્યા, અને અશ્વેને ધોરી માર્ગે
ચાળી, તરતજ કૌશામ્યીની દિશામાં દોડાની મૂક્યા.

માર્ગે, સૈનિક મુખે શાંખાતમાં બનેલો વ્યતિકર જણી, સરદારના
મુખમાંથી એકાએક ઉદ્ગાર નીકળી પડ્યા.

‘એ ઇપવતી રમણીનો ધમંડ તો અહુ ભારી ! એમાં તો તારા
અપમાન સાથે માં-અરે કૌશામ્યીના અગ્રગણ્ય નાયકનું’ પણ હડ-
હડતું અપમાન ગણ્યાય !

એ તો તમો સમજે એ ! માં તો રૂપણ માનવું છે કે એ ડોધ
સામાન્ય નારી નર્થી. તાકાતવાળી ને શરી ક્ષત્રિયાણી છે. લાગે છે
કુમારિકા, પણ જ્યાં જશે ત્યાં અજ્ઞવાળાં પાથરશે. સીધી ઉત્તરશે તો
ગુણવંતી ગૃહિણી અને વિશ્રી તો સાક્ષાત વાધણું સમજું લ્યો.

દિક્રિ નહિ. ઓષ્ઠું જ એક રાતે વહાણું વાયું છે. આ માર્ગ તો
આપણે માટે છાસવાર નેવો છે. કરીથી અહીં આવતાં એનો મેળાપ
જરૂર કરવો ને અપમાનનો અદ્દો લેવો.

ગામ તરફ નજર કરતાં, પેણું ત્રિયાવણું તો લાગેલ વટાની ગામમાં
પેણું જણ્યાય છે. ગામ નજીક પહોંચતાં જ નિઝ શષ્ઠો સંભળાયા
હુાથ, હવે કણ વળી ! આજના અનાવથી મારી છાતીમાં તો જખરી
ગભરામણ જિડી હતી.

વ્યવહારી ધનહેતની પુત્રવધુ મંગાના ઉપરના શષ્ઠેને જણે
સમર્થન ન કરતી હોય એમ મહિલકાએ ઉમેયું કે હોવે પહેન, એ એના
વિકરાળ ચહેરા જોતાં આરા તો ટાંટીયા ગળવા માર્ગેલા. કંઈક છેડતી
તેમના તરફથી જરૂર શવાની એવીં ભય પણ લાગેલો ! આપણું અધ-
િનું નેર પણ કેટલું ? આબદ્દેનો પણ વિચાર ખરોજ ને !

જ્યાં આ વેવલાઈ સૂચ્યક વાત આગળ વધે ત્યાં તો વારણી આગળ આવી ફરી ઉડી.

સાખી ! ધારિણીના શૌર્ય પૂર્ણ વર્તાવને જેયા છતાં અને શિખા-મલ્લના શાખાઓ સાંભળ્યા છતાં, તમારામાં ફેર ન પડ્યો ! સાવ વેવલીએ ! એ તે શું કરી નાખવાના હતા ?

હં, હં, ધારિણીએ ન હતે તો ખબર પડતે એરત તે એરત અને મરદ તે મરદ ! ઉભયના ઘડતરમાં ફેર ખરોઝ.

ધારિણીએ હસતાં હસતાં કહ્યું. “ આખરે કુળ તો વણિકનું ને ! પેવાને ધૂળ ચાટતો આંખે દીઢા છતાં તમારી ભડક ન ગઈ ! નારી જાતિ એટલે નથળાઈનો અવતાર; એમ માનવું જ ભૂખ ભર્યું છે. શિયળપતનું રક્ષણું કરવાનો આપણે ધર્મ મુખ્ય, પણ તેથી ગલરાવાની

‘ જરૂર શી ? વાતવાતમાં ભીતિ ધરનાર એ ધર્મ સાચવી શકે કે ? ભર જંગલમાં સતી ક્રીએ કોના ખણે જરૂરી હતી ? વિચાર તો કરો ? ’

“ શિયળપતના રક્ષણુની સાચી તમજા ધરનાર પ્રમદાએ હિંમત ધરવીજ જોઈએ. માતૃત્વ જેવું ઉમદાપદ બોગવનાર રમણીમાં, વીક્રે ત્યારે વાધણુનો જુરસો આવે છે. સૌ પ્રથમ તેણીએ ભયને ખંખેરી નાખવો જોઈએ. મરણના જેવો જ આત્મા પોતાનામાં છે એવી દ્વારા ધરવી જોઈએ. આટલું કરનાર મહામાયા ધતિહાસના પાને અનેરી વિલક્ષણતા નોંધાવે છે. સતીત્વના રક્ષણ અર્થે જરૂરમનાર એ રામાનો જેરું ખુદ ભગવાન હોય છે. એના અંતરમાં એ કાળે ડોર્ઝ અનોખી તેજસ્વીતાનો દીપક બળતો હોય છે. ”

“ ક્યાતો જીવનની પવિત્રતાની જ્યોતિ વિસ્તારે અને ક્યાતો જીવન ફૂના કરી, અમરત્વ પ્રાપ્ત કરે. સતી જી માટેના એ બે માર્ગ. નથળાઈ એનામાં નજ હોય. ”

ઓહો બહેન ! તમોએ તાલીમ લીધી છે ને. જુદી જુદી કળાઓ શીખ્યા છો એટલે આવી હિંમત રાખી ખાચું પાર ઉતારી શકો છો. અમારા જેવાનો જ્યાં હાથ જ ન ઉપડે ત્યાં બીજું તે કયું પરાક્રમ દાખવીએ ?

આવા કાયરતાના વેણુને દેશવટો દઈ દ્વો. અલયત, કળાનું શિક્ષણ લાભકારી છે અને તાલીમ લેવાની ના નથીજ. છોકરાઓની માફક છોકરીએને પણ દ્રેક જાતના શિક્ષણની જરૂર છેજ. યૌવન પ્રાપ્ત થયા પછીજ ઉભયના કાર્ય પ્રદેશ જુદા થાય છે. આમ છતાં મહત્વની વાત તો નિર્ભયતા ડેળવવાની જ છે. નિરૂતા એજ સાચી તાલીમ છે.

ઓદી વરસુનો કે અવર્મ યુક્તા પ્રવેશનોનો સામનો કરવાની ટેવ નાનપણમાંથી જ પડવી જોઈએ. એ સંસ્કારોના પાયા ઉપર જ યુતા-વસ્થાના ચણુતર થાય છે. અધોાર જ ગંગામાં અડગપણે ઉલ્લનાર સંતીએ આપણી નારીનિતિમાંની જ હતી ને ! શિયળ રક્ષાર્થે ઝૂઝનાર યુવતિમાં અનોખી વીરતા ઉદ્ઘાટને છે. એની આંખોમાં જે તેજ પેદા થાય છે તેની આગળ અત્યાચારીની ચક્કુએ આંખળી ભીત બની જય છે. ‘એક મરણિયુએ સેને ભારી’ એ ઉક્તિ પાછળ રહસ્ય છેજ. એકજ પાછ ગોખરી રાખો—‘હિંમતે મર્દા તો મદ્દે ઝુદા.’

જંગા—કુંવરીએ, તમારી વાત તદ્દન સાચી છે. ખાળપણથી જ નિર્ભયતા ડેળવવાનું શિક્ષણ મળતું હોય તો ગભરાટનું કારણ રહેવાન ન પામે. તમારે નારી જલિના એય અર્થે એ પ્રશ્ન ઉપાડી લેવો ધરો. એમ થતાં અદ્ય કાળમાં જ અમારા જેવીએની શિક્ષણ બદલાઈ જરો. મેં કૌશઅભીમાં અને ચંપાખુરીમાં આ પ્રકારની પ્રવૃત્તિએ ચલાવતી જોઈ છે. વણિક કુળમાં પરણેલી હું એનો જાતે અનુભવ કરવા ગઈ નથી; છતાં સખીએ કારા મળેલી માહિતીના જોરે કહી શકું હું કે ત્યાં સુમધુરો ઉપયોગી વણ્ણું રીખવાસ છે અને ક્ષત્રિયબ્રહ્માઓ સ્પરા પ્રમાણમાં ભાગ લે છે

તો, અંગા બહેન, તમો આ જામના રહીશ નથી જણ્યાતા.

ના, ના, સખી ધારિણી, એમનું સાસરં તો અહીં જ છે. તેમનું ધર અમારા ધરની સામેના વડલાના વૃક્ષની પાસેના બળહેવમંદિરથી પાંચમું જ છે. અમારા બન્નેના પિયર કૌશભ્યિમાં. અમો બાળ સખીઓ છીએ. નાગદા રેઠ એના સસરા થાય. શેઠના મોટા દિકરા ધર્મદાત તો અહીં જ ધંધો કરે છે પણ નાના પશપાલ—એના પતિ-દ્વિનાહન ભૂપના ખાનગી મંત્રી છે. પિતાની નરમ તથિઅતના કારણે અહીં આવેલા છે. અંગા તો મારા આગ્રહથી ગાગર લઈ કુવા કાંડે આવી છે. ચંપામાં તે આવી રીતે ન જઈ શકે.

પ્રકરણ ૨ નં ભાગીના વાસનાં

આવો, આવો, કુંવરીએ ! તમ સરિખા છો રતનાં પગલાં થવાથી આ ધર પાવન થયું. તમારી ઓળખાણ એ તો જીવનને યાદગાર પ્રસંગ.

સખી જંબા ! આ વધારે પડતા વિવેકની આપણા વચ્ચે કંઈ જ જરૂર નથી. પેલી સંઘાએ છૂટા પડ્યા પછી તો દિવસો ધણા વહી જયા ! મેં ધારેલું કે તમો અવકાશ મેળવી દરબારગઢમાં આવશો, અને એ આશામાં હું હજૂ થોડા દિન વિતાવત પણ ખરી; ત્યાં અચ્યાનક જઈ કાલે મહિકાના મુખેથી તહારા શ્વસુરના અવસાન સમાચારની જાણ થઈ એટલે એ નિભિત્ત આખળ ખરી હું આશ્વાસન આપવા હોડી આવી છું.

માંદગી જાડી લાંઘાઈ હોય એમ જણ્ણાં નથી.

ધારિણી બા, તમારી વાત સાચી છે અને અનુમાન પણ ખરું છે. અમો દંખતીના અહીં આવ્યા પછી તેમની તણિઅત સુધારા પર

આવી હતી, અને અમો અહીંથી ચંપા પાછા ફરવાના વિચારમાં જ હતા. જ્યાં પહેલાં એક વાર મેં તમોને મળવાનો વિચાર પણ રાખેલો અને એ સંબંધમાં ભલ્લિકાને વાત પણ કરી હતી, પણ બન્યું જુદું જ ! માણુસની ધારણાઓ કામ આવતી જ નથી. દૈવના દાવ જ સાચા પડે છે ! અમારા જીવનેનાં મંતવ્યમાં અને વડિલશ્રીનાં વચનમાં મોટો વિરોધ જણ્ણાતો. કષૂલતું જોઈએ હે તેમનો અનુભવ સાચો હતો. મારા થયુર ભાર મૂકી કહેતા હતા કે—

‘આ વેળા પોતે પથારીમાંથી ઉઠવાના નથી. અમારી નજરે ને સુધારો જણ્ણાતો, તેને તેએ હોલવાઈ જવા માંડેલા દીપકની આગાઢી લેખતા. મરવાની આગણી રાત્રિયે અમો સૌને-નેઠ, નેહાણી, મારા પતિ તેમજ મને-પથારી પાસે બોલાવ્યા અને તકિયાને અહેલી ને વાતો કરી, એ હજુ મારા કાનમાં રમી રહી છે. જુઓ ! મારે તમોને ધન મિલકત સંબંધમાં ખાસ કંઈ કહેવાનું નથી. જે છે તે તમારી જાણ બહાર નથી. એ બધું હું અત્યારે વોસરાવી દઉં છું. એ ઉપરના મમત્વનો ત્યાગ કરું છું. જંદુગીમાં મારાથી બન્યું તે મુજબ અર્થ, કામ સાથે ધર્મ પુરુષાર્થ સાખવા યત્ન સેવ્યો છે. મરણની લીતિ મને જરાપણ નથી. હું તો એના આગમનની રાહ જોઈ રહ્યો છું. મને આભાસ થાય છે તે મુજબ એ અહું દૂર નથી. આત્મા તો અમર છે. ઓળણીયું જલ્દું થાય એટલે એ બદલાય જ. પુદ્ગળનો એ તો સ્વભાવ રહ્યો. ભગવાન પાર્શ્વનાથના અનુયાયી ને એમાં દુઃખ માનવાનું ન જ હોય. નેવી કરણી એવી પાર ઉત્તરણી. હર્ષ શોક ધરવાની મૂર્ખાઈ ન જ કરવી. કર્મ બાંધતાં વિચાર કરવો જરૂરી છે. ઉદ્ઘ આવે ત્યારે તો સમતાથી વેદવા એ સમજું આત્માનો ધર્મ.

તમો સર્વ સંશોને, આ પૃથ્વી પર ને થોડાં ધણું વધો ગાળવાના હોય તે ગાળશો તો માનવભવ પાભ્યાની સંઝણતા ગણ્ણાશો. માત્ર બ્યવસાયી જીવન ગાળવામાં હે લક્ષ્મીનો. અતિ સંચય કરવામાં, અભવા.

તો મન માન્યા વિલાસો લુંટવામાં જંગીની સંશોષણ નથી સમાતી; એ વાત રખે ધ્યાન બહાર થવા હેતા. આત્મરોક્ષન અને એ દ્વારા કૃપાય ચોક્કી ઉપર કાખૂન્ઝેવા મૂળભૂત મુદ્દાને સહેવ ચક્ષુ સામે રાખ્યો.

જન્મસમય આનંદકારી મનાય છે અને મરણ હુઃખ કર્તી લેખાય છે. એ વહેવાર દશ્ચિયે; આવતું સૌને જમે પણ જતું ન પોષાય એ વહેવાર છે માટે. પણ સમજુ માટે એ માર્ગ નથી. એ તો ઉલ્લભ સ્થિતિમાં સમભાવ ધારણુ કરે. અરત ને ઉદ્ઘય, ચડતી અને પડતી; કિંના જન્મસ અને મૃત્યુ એ તો કાખેવના ચક્કાનાં એ પાસાં. ઉપર નીચે થયા વિના ગતિ સંભવે જ નહોં. તો પછી હર્ષ શોક ધરવાપણું કેમ હોય? કર્મરાજની હાકલ થતાં હસ્તે મુખડે વધાવી લેનાર જ સાચો સુલટ. એ જ સમજુ આત્મા.

મારી પાછળ શક્તિ અનુસાર ધર્મ કરણી કર્યો. રોકણ કે શોકના ઠોરા જરા માત્ર ન કરતા. અજ્ઞાનતાના એવા ચાળા સમક્ષિને ન જ શોલે.

કુંવરી ખા, આવી ડાહી ડાહી શિખાંમણુ આપનાર હજ જોતે જોતામાં જ કુપાઈ જરે એવો ધ્યાલ અમોને ન જ હોય! પણ જઈ પરમ દિને સવારમાં તો અહીંના રટણુમાં એકતાર એવા વડિલથી અમારી વચ્ચેથી સીધાવી ગયા. અમારી જાંખો અશ્રુ પ્રવાહમાં વહી રહી.

સંસારી હદ્દોએ એકદમ રમૃતિ. કેમ ભૂલી થકે? આમ છતાં મજબૂત મન કરી, આમ જનસમૂહનો વિરોધ સહી, વડિલની સૂચનાને અમલ કરી રહ્યા છીએ. એ કારણે તો ઘડીપૂર્વે વડિલની યાદ ભૂલવા બંધુ ચુગલ હાટે જયું છે. અને મારા જેઠાણી તેમના પિયર ઓદો હેવા જ્યા છે જ્યારે હું મારા કર્મરામાં જરા ઉચ્ચાંનીચું કરવામાં લાગી છું. અહીં મરણ થયું છે એવો ધ્યાલ સરખો આજાંતુકને ન આવે, એવો વતીન રાખ્યો છે.

મારા ગામના જ એક ભાઈના તમેં પતિનિ અને વળી મારાથી વયમાં પણ કંઈક મોટા; તો તમેને ભાષી કહીને સંખેધું તો ખોટું નહીં લાગેને ! ધારિણીએ હસતાં હસતાં ગંગાને ઉદેશી પ્રક્રિયા કર્યો.

ના રે, ના, ખેણ ! તમારી ધ્યાનમાં આવે તેવા સંખેધને ઓલાવો. કુંવરીબાના વચ્ચેનો તો મધ્ય સમ ગળ્યા લાગે છે.

એમાં પણ કુવા કંઈનો બનાવ યાદ આવતાં અને એ વેળા દ્વારા વેલી વીરતા વિચારતાં મને તરત જ મારી બાળ સખી જ્યાંતી સમૃતિમાં તાજુ થાય છે. વીરત્વમાં તો સાચેજ તમે પદ્માવતી જેવા છો.

ભાષી ! તમારા એ જ્યાંતી-પદ્માવતી પાત્રો છે ડોણું ? કયાં વસે છે ? આ ગ્રામ્યબાળાના કણે હજુ પહેલીજ વાર તે નામે અથડાય છે અને તે પણ તમારા મુખે જ !

કૌરાખ્યાપતિ શતાનિક રાજનું નામ તો સાંભળ્યું જ હશે. એની ખેણ તે જ મારી સખી જ્યાંતી. મારું પિયેર એ નગરીમાં જ છે. વળી અમારો વણિકવાસ રાજભીઠી અધી ઘટિકાના રસ્તે આવેલ છે. મારા પિતાશી રાજ્યના કર્મચારી, અને રાજ્યની તેમજ અમો સૌ, નિર્ગંધ ધર્મના અનુયાયી એટલે અમારા વચ્ચે સંખ્યાંધ પણ ગાડો જ છે. માતુશ્રીની સાથે રાણીવાસમાં હું ધણી વાર જતી; તે રાણી સાહેબા-મુગાવતી પાસે એસી વાતે વળગે, ત્યારે હું તથા જ્યાંતી ત્યાંથી રમતાં રમતાં નજીકના કરમરામાં જતાં; અને બાળકીડાના આ પ્રસંગો વય વૃદ્ધિ સાથે સહીપણું પરિણય્યાં. પછી તો ભલુવામાં અને પર્વિણ્યે ધર્મકરણીમાં પણ જેડીદાર બન્યા. આમ પ્રીતિનો અંકુર મજબૂત થએ રૂપે વધવા માંડ્યો.

સખી જ્યાંતી, રૂાન મેળવવામાં અને ક્ષત્રિયોચિત ધરવીરતાના ધારણું ધારવવામાં મને કચાયે રૂપી જય તેવી નહીં; છતાં એથી અમારી વચ્ચેની પ્રીતને કંઈ અગ્રવળ ન પહોંચતી. પોતે રાજકુંવરી છે એવો

ભાવ હોધવાર દેખાડતી નહિ, એનો હસસુખો ચહેરો અને મળતાવડો સ્વભાવ હરકોઈને પોતાના અનાવવા પર્યાપ્ત છે એમ કહેવામાં અતિ-શયોક્તિ નથીજ.

યૌવનના આંગણે ઉલટાં જ લસની વાતો થવા માંડી. મારા સરખી વણિકતનયા માટે તો માંબાપે શોધ કરી લીધી અને હું તમારા ગામની વહુ અની. જ્યાંતી તો ક્ષત્રિય ભાગા. વરને જાતે શોધનારી; એ કંઈ જટ ફેરા કરી ન જય. એના વિચાર જેતાં તો જ મભર કુંવારી રહે. એમ જણાય છે.

ભાલી, તું યે જરૂરી નસિબદાર ! કૌશામ્ભીમાં ભાળપણ—આ ગામની સાસરી અને ઘરસંસાર જર્દ માંડ્યો ચંપામાં ! ‘ દીકરી ને ગાય દોરે ત્યાં જય ’ એમાં નસિબની શી વાત ભલા ? જ્યાં ધણી ત્યાં ધણિઓણી. આને તો ચંપામાં વાસ છે પણ કાલે રાજવી દધિવાહનના હૂકમં ધ્રૂવે ને કહે, જાવ કંચનપુર; તો ઓછી જ ના કહેવાય બહેન ! રાજ્યની નોકરી, લોક અધિકાર માને; છતાં પરાધિનતા તો અરી જ ને !

વણિકભાગના ભાળપણમાં—અરે. જ્યાંતી જેવી ભાગના સખીપણમાં—કંઈ જાણુના જેવી પરાક્રમ કથા હોય તો, ભાલી મહારા, એ કહેને. નારીનિતિના રોદણાં શું રડો છો ?

મારું માનવું છે કે વણિક કે દ્વિજ કુળોત્પલ લક્ષનાઓ કરતાં ક્ષત્રિય વંશની રમણીઓમાં હિંમત અને પરાક્રમની માત્રા વહુ હોય છે. એ વસ્તુઓના પ્રદર્શનની તક સાંપડ્યા વિના, એના સાચા મૂલ્યાંકન જો કે કરી ન શકાય, છતાં ભાળજીવનમાં કંઈ પ્રસંગ જ ન આવ્યા હોય તેવું તો ન જ બને. મેળવેલું શિક્ષણ પોપીયા કે પુસ્તકિયા રહ્યું કે કોઈ વાર અખતરાનો પ્રસંગ લાધ્યો હતો ?

સખી, હવે હું એજ સુદ્ધા ઉપર આવું છું. સુવર્ણની પરીક્ષા

કસોઈ પર કસાય, તો જ થઈ બણાય. માનવ અમૃતના દર્શન પણ આદરમાત્રિક આપત્તિ ટાળે જ થાય. પરીક્ષાની પણ સાંપડ્યા વિના ક્રમણ અહારુરીના બણુગાં ફૂંકવાથી કે એની પ્રશનિત લલકારવાથી કંઈ જ અર્થ સરતો નથી. મારી સખી જયંતી તો અથી પરીક્ષામાંથી ‘તરી’ પાર કરી ગઈ છે.

કૌશાંખી પતિની ભગીની એટલે દરખારી દદરો ને માનપાન તો ખરા; એની સામે મીટ માંડવાની જન્મલે જ કોઈને હિંમત થાય. તેણુંએ ભાલો કેરવવાની, પટા ખેલવાની, તલવાર ચલાવવાની, લાડીના દાવ ખેલવાની, અથ્વ દોડાવવાની અને દોડતા બોડા ઉપરથી ફૂરી પડવાની કળાઓમાં એવી નિષ્ણુતતા પ્રાપ્ત કરી છે કે અમારા નારી વુંદમાં તો અથપદે લેખાય પણ એ ઉપરાંત રાજપૂત કુમારો અને અન્ય બ્યવહારી પુત્રો કે જેએ એ જતના શિક્ષણમાં જોડાયેલા છે અને વરસોથી તાલીમ લે છે એમાંના મોટા ભાગના તો તેણુંના કૌશલ્ય આગળ એકડા ઘૂંટનારા નવા નિશાળાચા જ ગણાય.

કુંવરીણા, મને લંખાણ વર્ણન કરતાં તો ન આવડે. પણ તમારી જ્ઞાસા તૃપ્ત કરવા એકાદ એ પ્રસંગો સંભળાવું.

એક વાર ઉસ્તાદજીએ હરિદ્રાઇ ગોહવી. વે વેળાના પક્ષમાં નિદ્રાથીએની સાથે નિદ્રાથીનીએને સ્થાન આપવામાં આવેલ. અં રીતે દરેક પક્ષમાં ક્ષત્રિય તથા વણિક યુવાનો અને એ એ કુમારીએનો હતી. સૌ કોઈને લાભતું કે જયંતી અને વણિક તનયા લીલાનીવાળો પણ ટક્કર ઝીલશે પણ આખરે ફાવશે તો સામો થાંને વહુ ક્ષત્રિય કુમારોનાળો પક્ષ જ. પણ જૂદા જૂદા દાવોના સરવાળે ને પરિણામ આવ્યું એ જોઈ બધા આશ્ર્ય પામ્યા. ખુદ ઉસ્તાદજીને કહેવું પડ્યું કે જયંતીએ આઠલી હંદે કાર્યક્ષતા મેળવી છે એ પોતે પણ આજેજ જાણે છે. દરેક રમતમાં પ્રથમ નંબર, માત્ર એકમાં જ થીજે નંબર.

નારી જાત માટે આ કંઈ જેવું તેવું જૌરવ ન લેખાય. પક્ષને વિજય અપાવનાર જ્યાંતિને પ્રેક્ષક સમુદ્દરના ધન્યવાહ મળ્યા અને એ વાત કૌશાભ્યીના હાટમાં પણ ચમકી રહી. એ અનાર પણી તેણી એકાદ એ ક્ષત્રિય ચુવાનેલું લક્ષ્ય બની રહી. તેણીના પ્રત્યે તેચો જેહની નજર ડેરવા લાગ્યા અને પ્રસંગ શાધી પ્રેમની લિક્ષા માંગવાને નિરવાર પણ કરી ચુક્યા. એ કારણે પાછળ ભામવા પણ લાગ્યા.

મધ્યાહ્ન પણી રોજ અમો સાધીણી વસ્તીમાં ધર્મનો અભ્યાસ કરવા જતા. એ દારા જાન પ્રાપ્તિ થતી તેમજ સહિયરોને પરસ્પર મળવાનું પણ થતું.

એક દિવસ હું તેમજ મારા મહોદ્યાની એ બાળાઓ કંઈક મોડાં પડ્યા. વસ્તીમાં પહોંચ્યા ત્યારે ખખર પડી કે ઉદ્ઘાનમાં ઢેઈ સુરિ મહારાજનું આગમન થયેલું હોવાથી ગુરુણી મહારાજ પોતાની શિષ્યાઓને લઈ વંદન કરવા ગયા છે. આજ અધ્યયનનો વર્જ બંધ રહેનાર છે. એ જણી જ્યાં પાછા ઝર્ણેએ છીએ ત્યાં જ્યાંતી અહેનને સામે આવતા દીડા.

હું તરતજ બોલી ઉઠી.

ચલો અહેની, પાછા વળો. આજે રણ પડી.

શાનાર્જનમાં રણ ડેવી? એ બોલ્યા.

સાધીણના ઉદ્ઘાનમાં જવા સંખ્યા વાત કરતાં જ તે સહજ બોલી ઉદ્ઘાયા.

ચલો ઉદ્ઘાનમાં આપણું દર્શનનો લાભ થશો અને મહારાજાની પાસેથી નખું નથુવાનું મળશો. શાનાર્જન વિના હિન ફેંગટ નસુમાથાય. મારી સખીઓને આ વાત તરત જ જમી ગઈ, એટલે તેમણે ટાપશી. શુરતા જણ્ણાધ્યું કે—

ગંગા! જ્યાંતીએન ઈક કણે છે. ચાલવા માડો.

ક્યા ઉદ્ઘાતમાં જવાનું છે એ અમો જાણતા નહોતા અને આજળથી આવેલ જરૂરીઓને પણ જાણતા નહોતા. એમણે માની કીદું કે મહારાજાની જ્યાં ઉત્તર્યા છે એ તરફ જ અમો પગલાં ભરી રહ્યા છીએ. કૌશલ્યા કરતાં ત્રણ ઉદ્ઘાત હતાં. વળી એના રહ્યા ભાગોળ વટાવી ચેલું આગળ વખતાં જૂદા પડતા હતા. વાતોના રસમાં માર્ગ કાપી રહેલા અમો, પાછળ કોણ આવે છે કિંवા એ શી ચેષ્ટા કરે છે એ નેમ જાણતા નહોતા, તેમ ક્યા ઉદ્ઘાતે જઈ રહ્યા છીએ તે પણ જાણતા નહોતા.

અનેલું એમ કે એક ગરાસુદારના દિકરાને હરિદ્વારના પ્રસંગથી જરૂરી એનની લગની લગેલી. એ મળવા સાર તક શોધા કરે પણ યોગ સાંપુદ્યો નહીં. વાત એણે પોતાના એક વણિક ભિત્રને કહી. એ ભાઈની સાંખ્યીક્યાળી વસતી નજીક રહેતા હોવાથી અમારું ત્યાંના આગમનથી માહિતગાર હતા. અમોને પાછા કરતા જોઈને એ સમાચાર તેમણે પેલા રાજ્યપુત્રભિત્રને પહોંચાડિલી. મેળાપનો આ સારો યોગ છે એમ માની લઈ ઉલ્લય ભિત્રોએ અમારી પૂંડ પકડી હતી. પાછળનું અંતર ઓછું કરતાં ને ટોળ ટચ્ચાં ઉડાવતાં તેઓ જ્યાં ભાગોળ મૂકી નેળમાં પગ મેલીએ છીએ ત્યાં આવી પહોંચી લગોલગ થઈ ગયા. હસતાં હસતાં ઓદ્યા—

શિકાર જડપાંચો ! આખરે પકડી પાડીને ! આમ ક્યાં જવ છો ? કાઢ રસિકની શોધમાં તો નથી નિકલ્યા ને ! કઠારો પણ અહું ભારી ! એણાણખાણું—પરિચય વગરના ચા શાંદો કાને, અથડાતાં જ અમો વણિક આળાએં. ઉચાઈ ગઈ.

ત્યાં તો જરૂરી એનનો પડકર સંભળાયો—

નમો કાલું છો ? ઝાની મજાક ઉડાવો છો ? અમારી પ્રખૃતિ જાણ્યાનું નમોને શું પ્રયોજન છે ? શો અધિકાર છે ?

એહા ! શું દમામ ? નારી જતિને વળી આ ધમંડ ! !

મિત્રના ઉપકા શહેરો સાથે મેળ સાંધતો હોય એમ વણિક ચુવક હાસ્ય કરતો એવ્યો—

જેરસિંહ, કવિઓતો નારી જતિને કોમળાંગી અને મૃદુભાષિણી વણુંને છે જ્યારે અહીં તો ઉદ્દો જ અનુભવ મળે છે.

જ્યાંતી-ભાઈએ આવા અણુણાન્તરાં ચેન ચાળા કરવાના છેડી દ્વારા તમારે માર્ગે જવ. ગૃહરથોના સંતાનોને આવી આછકલાઈ ન શોલેં.

જેરસિંહ—લલના, આમ ગુર્સો ન કરો. અમો કોઈ લક્ષ્યના આનન્દીએ નથી. પેલી હરિકાઈના પ્રસંગથી જ મારું દિલ. તમારી તરફ સહજ આકર્ષણું છે. હું કેટલાય સમયથી મળવાની તક શોધતો હતો પણ રાજસ્વસા ઓછા જ રસ્તામાં રઝળતા હોય તે હાથ ચઢી જાય ! આને મિત્રની રહાયથી અચાનક યોગ થયો છે. હું તમારી સાથે કેટલીક વાત કરવા મંજું છું.

ને તમારી આ સાચા અંતરની અભિલાષા હોય તો પ્રથમ મારી અનુકૂળતા પૂછાવી મળવું જોઈએ. તમારા આ મિત્રને નળદમયંતીના હંસ માઝક સંદેશવાહક બનાવવો હતો. એ ભાગ મજાવવાની યોગ્યતા તેમનામાં છે. હાલ તો અમો ઉતાવળમાં છીએ. હા, એટલું યાદ રાખજો કે હું માત્ર શતાનિકની બહેન જ નથી પણ સાથેસાથ ક્ષત્રિય આળાપણ છું જ.

જણે મંત્રથી આકર્ષણ સાપ દરમાં પેસે તેમ સખીની ઓન્સ્ટી વાળી શ્રવણ કરતાં જ ઉભય મિત્રો પાછા ઈચ્છા. અમારા હૃત્યમાં ટાંક વળી. હાંશ ! ઉચ્ચાર સહજ થયો. સાથમાં જ્યાંતીએતનું હોત તો પેલાએ. તરફથી જરૂર આજે કંઈ છેડતી થાત. મજાક ઉડાવત. આટલા સાર નિભન્તા સાથ વિના અમો બહાર જ ન નીકળીએ !

સખીઓ, આવી ઉર્ફોકતા આપડિય કહેવાય. મરદના હર્ષન એ કંઈ આવાની કે ગભરાવાની ચીજ નથી. ઓરતનો અવતાર એટલે હગલે પગલે લાજ, શરમ કે ધાર્થી ધરવાપણું એવું કોણે કહ્યું? પોતાની જતને મરદ્યી ઉત્તરતી ગણી આપળે આપળી જતને વણી હાનિ કરી છે. રનેહના ઓછા નીચે હદ વગરની ગુલાભી વહેરી લીધી છે. એમાં વૈદિક સ્ત્રીના કેટલાક શ્લેષ્ણાંશે સાથ પ્રોયોં છે. બાકી પતિતાપણાના તેજ પર મુસ્તાક રહી, ભર જંગલ વચ્ચે મહધારી માંધાતાઓનો સામનો કરી પરાભવ પમાડનાર સતીઓનાં ઉદાહરણ શોધવાં પડે તેમ નથી જ. હદ્યની નથળાઈ ખંઘેરી નાંઝો એટલે કાઢની તાકાત નથી કે તમારા સામે રાતી આંખ કરે.

અહેન, પેલા યુવાનને આશ્વાસન આપ્યું તે એના પ્રતિ કંઈ રનેહ છે કે કેવલ જૂઝું! અમારા તો સંબંધ માતા-પિતાની પસંદગી પર નિર્ભર એટલે આવું કંઈ કહેવાય જ નહીં.

આલણુ-વણ્ણિકની પ્રથા કરતાં અમારા રાજપૂત સમાજનો શિરસ્તો નિરાણો છે. રાજકુમારીઓ મોટા ભાગે સ્વયંવરાજ હોય છે. સ્વામીની પસંદગીમાં અમારો અવાજ અગ્રસ્થાન ભોગવે છે.

મારા ભાબી-રાણી મૃગાવતીના પિતા ચેટકરાને પોતાની પુત્રીઓ ઉપર જ વર પસંદગી છોડી દીધી છે. લગભગ દરેક પોતાનો જીવન-સાથી જાતે જ શોધ્યો છે. એકાદ એ બાકી છે તે પણું એ રતિ જ પ્રેમપાત્ર શોધી લેશો. પદ્માવતીનો કિરસો તો મરાહૂર છે. તેણીએ પોતાના ઉપર અન્ય રાણી ન આખુંવાની શરતે જ દ્વિવાહનના કંડમાં માળ નાંખી છે. એ ભાય્યાળો તો ખરી જ.

નેરસિંહ જેવા ધણુ અમરો—સૌન્દર્ય પાછળ ભમતાં પતંગિઓ—એ—મારી પાછળ ભમ્યા કરે. પાકી પરીક્ષા વિના હું પગદુર્ની ન ભર્યાં. સરખે સરખાના યોગ વિના હું પ્રભુતામાં પગલાં ન પાડું.

આહે ! શું બોલતાં હશે ? નારી કુંવારી રહી સાંભળી છે ખરી ?

આહુલી ચમકે છે શાસાડ ? આત્મા તો અમર છે અને આ હેઠું તો કર્મરાજે પહેરાવેલા વાધાં સદશ છે; ત્યાં પછી કુંવારા રહેવું કે પરણું એ તો વ્યક્તિગત પ્રશ્ન લેખાય. ખુગાંધીશની પુત્રીએ આહુલી અને સુંદરી કેને પરણી હતી ? લગ્નગ્રંથીથી જોડાવું એ પ્રશ્ન જી. જ્યાં અંતરનો છે ત્યાં સમાજના બંધન ડેવા !

દ્યો ઉદ્ઘાન આવી ગયું. સમેટો રામાયણ; પેલું આશાપૂર્વ યક્ષતું મંદિર. બાળુમાં આવેલ મણાન એ જ અતિથિ ગૃહ. અવર જવર કંઈ લાગતી નથી. ઉદ્ઘાન ભૂલ્યા. યમુનાની વાત તો સાચી જણ્યાય છે. વાતના રસમાં જ્યાંતીએન, આપણે ભળતી જગ્યાએ આવી ચઢ્યા. અમણો તો વણું ખરં છેડા ઉપર આવેલ તિહુંક ઉદ્ઘાનમાં જ ઉત્તરે છે. વચ્ચા માર્ગે ફંટાયા હોત તો સીધા ત્યાં નીકળાત.

જ્યાંતી—અગડી શું ગયું ? આવ્યા છીએ તો યક્ષમંદિરમાં જઈએ. જઈએ અને પાકી આતરી મેળવીએ. વળો આવ્યા છીએ તો ઉદ્ઘાન-માંના કુસુમોની સુવાસ પણ માણીએ. સુવાસિત વૃદ્ધો અને રંગ—એરંગી કુલોથી સભર મનોહર સ્થાન તો—વિશ્રામ તો દેહને તાજગી આપનાર છે.

પૂજારી મુખે મહારાજશ્રીને ઉતારો તિંદુકવનમાં સાંભળી મંદિર પાછળ વિસ્તરેલી હરિયાળામાં ફરવા લાગ્યા. રમ્ય લતાઙુંને ને કળામય વિથિકાએ નિરખતાં—મનગમતી મનક કરતાં, છેડાના ભાગ પર આવી પહેંચ્યા અને એકાદા વિરામાસન પર ગોઢવાવાનો વિચાર કરીએ છીએ ત્યાં તો સામેના લતામંડપમાંથી કોઈ અભિનાનો આત્મ સ્વર—

‘આ દુષ્ટના પંનમાંથી બચાવો. મારા સ્વીધર્મનું રક્ષણ કરો’ સંભળાયા.

એ શ્વરણુ કરતાં જ જ્યંતીએને દોટ મેલી. અચાનક આવેલા નાડે અમારામાં ભીતિ અને આશ્રમ જન્માવ્યાં. અમે પણ સખીની ખાંચળ જેંચાયા. લતામંડપના એકાંત ભાગમાં પહેંચતાં જ જે દસ્ત નિષ્ઠાળ્યું એથી રિથર થઈ અથડ.

એક તરણી આજા થરથર પ્રસ્તુતી બાળુમાં ઉલ્લિ છે જ્યારે જ્યંતી-એના ધક્કાથી ધૂળ ચાટ્ટો અનેલ માનવી, જાળ પંપાળતો જમીન પરથી ઉડવા પ્રયત્ન કરી રહેલ છે. ઉલ્લયની સામે રણુયંડી સમી ઉલેલી જ્યંતીએન એલી રહી છે—

સખીઓ ! આપણું માર્ગ ચૂકવામાં કુદરતનો કંઈક સાડેત જ છે. મારી હાજરીથી જ આ નરાધમને હાથે આ તરણીની આધ્યાત્મનું લીલામ થતું અન્યું છે. આવી ત્યારે તો આ નરપિશાચ બળાતકાર કરવાની તૈયારીમાં હતો. પ્રભુ દુખ્યારાને એલી છે એ નાત ભૂલી ગયો. હતો.

દુરાચારી ! આજ તો જતો કરું છું. ધારું તો રાજ્યની દેવડીએ ઘસડી ઝાંડરાં પહેરાવી દેવરાવું. ચતાનિકની બહેન આવે. દુરાચાર ઘરીભર ચલાવી લેવા તૈયાર નથી. ઇક્તા તારા કાલાવાતાથી જ હૃદ્ય કૂમળ ફેને છે. આવા કામ મારે ઉપવનમાં આવે છે ?

અભ્યાસ—કુંવારાંશા, તમારા ઓવારણાં લઉ છું. તમે મારી રહણે ન આવ્યા હોત તો જરૂર માટે કિયળ લુંટાયું હોત અને આપધાત કરી રહેં સંતાઉં ફડત.

આ તો અહીના માણણો ભાઈ છે. એની લાલા મારા મહોદ્યાના નાડે રહેતી ક્રેત્કી માલસુની દિક્રી થાય. મંદ્રે આવી હતી એટલે અહીં મળવા આવનો વિચાર થયો. એ મારી સાંથ ધર બતાવવાના નિષે આવ્યો અને અહીં એકાંતમાં લાલી ઇસાતી.

ત્યારે તો આજે જ નોકરીમાંથી ઇખસટ અપાવી હઉં. આવા જાહેર ર્થાનમાં હવકી વૃત્તિવાળા માનવીએ ન જ રાખી શકાય. . .

એ સાંભળતાંજ માળાનો ભાઇ દોડી આવી, જ્યાંતીએનના પગમાં પડ્યો અને કરગરી કહેવા લાગ્યો.

કુંવરીએ, મારી ભૂલ માદ કરો. રાજ્યી રજ દેશે તો અમાડં આવી અનરો. રોટલો અને ઓટલો બન્ને જરો. મારા વાંકે મારા સાઈનું કુદુંબ રઝળતું થઈ જરો. મારો ગુનો માદ કરો. આશાપૂરક જક્ષને સામે રાખી શપથ લડું છું કે, ‘હવેથી આવું હીણું કામ નહીં કરું.’

ત્યાંથી પાછા ફરી વિરામાસન પર બેસતાં જ જ્યાંતીએને પેલી અખળાને પ્રશ્ન કર્યો.

યક્ષપૂજનનો સમય તો સામાન્ય રીતે સવાર કે સાંજનો હોય છે. તમો આ ઉત્તરતા મધ્યાન્હે કયાંથી આવી ચઢ્યા? સાથે કોઈને લાવ્યા પણ નથી!

કુંવરીએ, તમો મારા રક્ષણહાર. તમારા આગળ પાપ ધૂટી વાત કરું. પરણ્યા છ વરસ થવાં આન્યાં છતાં હંડાડો ન ચઢ્યો. એ વિધ્ય મારી સાસરીમાં ચિંતાનો બન્યો. ધલ્લીને બીજુ કરવાની ખૂણે ખાંચેરેથી સદ્ગુરૂ મળવા લાગી. દરમિયાન જોખનો બેઠો થયો. એણે સદ્ગુરૂ આપી કે એકાદશીની મધ્યાન્હ પછી પૂજાપો લઈ આશાપૂરક યક્ષની પૂજા કરી, ‘સંતાન મુખ દેખાડો’ એવી માગણી કરવી. એવી રીતે પ્રત્યેક માસે શુક્લ એકાદશી-કુલ અગ્નિઅદ આરાધની-જડિર આશા ફળશે. અને સંતાન પ્રાપ્તિની આશાથી મૂઢ બનેલી મેં આ સમય સાધ્યો. પણ આવ્યું વિધન; પેલો બોલ્યો હતો કે ‘યસ તો સંતાન આપે ત્યારે ખરા, પણ લે હું તણે આપું. તહારી આશા પૂર્ણ’. મારી એકાંતની પ્રાર્થના એણે સાંભળ્યા લાખે છે.તેથી જ ફોસલાગી એ મને લઈ ગયો.

નામ, આવા તો કંઈ કંઈ વહેમેનું આપણુમાં સાત્રાણ્ય
પ્રવર્તે છે. જેવિના સાચા પડતા હોય તો કોઈ વાજથી રહેવા ન ન
પામે, સંતાનપ્રાપ્તિમાં તો ખૂર્દ ભવને ઋણુનુંધે જરાયો હોય છે.
પવિત્ર તપ કરણી દ્વારા ન અંતરાન કર્મો નારી પામે છે. બાકી આવી
હાસ્યારપદ ચેષ્ટાઓ તો કોઈ વાર શવનને અકાળે કરમાણી હે છે.

વાતો કરતાં અમો સૌ નગરીમાં પાછા ફર્યો.

ધારણથી અહેન, તમારી નિરજાસા ધીપાવવા હીક લંબાણ કર્યું ને?

અંણ, પણુ પદ્માવતી પ્રભાંધનું તો નામ પણ ન સંભળાયું?

એ જાણુવાતો આ નાનકદી નોંધનું પારાયણ કરવું વટે.



મફકરણું તું જું પગાવતીનો સહિતાસુ



ઓહો ! રાજકુમાર તમારાં દર્શન તો બહુ મોધાં થઈ ગયાં છે !
તમારી રાજ્ય ચિંતા ડાઈ અનોખી જણાય છે !

રાજકુંવરી, એવું કંઈ જ નથી. વૈશાલી છોડતાં પૂર્વે એકવાર હું
તમને મળવાનો હતો જ. જે કાર્ય સાર્થક આવવું જવું થાય છે એનો
ઉકેલ તો સૌ પ્રથમ આણુવો જ વિદે ને ?

સાંભળ્યા પ્રમાણે, એ કાર્ય તો નિશ્ચિત થઈ ગયું છે.

નારે ! ના, વૈશાલી અને ચંપા આજે પણ નિરાળા તંત્રમાં ઉભાં
છે. આમાં દેશની પરિસ્થિતિ, પ્રણ માનસની વિચિત્રતા, અને રાજ્ય
કર્તાની બિન્ન બિન્ન વિચાર સરણી અભ્રસ્થાન ભજવે છે. આમ છતાં
પરરપરનાં દાખિબિન્દુ સમજવાની જે તંત્ર પ્રાત થઈ છે એ કંઈ જેવો
તવો લાભ નથી થયો.

તમારા પિતાશ્રીની નિર્દેશાબદૃતિ અને દ્વષતા તેમજ હૃદયની
નિર્મણતા એકાદ રાજ્યની કરતાં એકાદ સંતને વધુ મળતી આવે છે.

તેથી જ એ ગણુરાજ્યના આગેવાન અને લિંગધની-મલ્લકીઓના હૃદય સ્તાની છે એટલું જ નહીં પણ એમાં આગેવાન તરિકે અનોખું જોરવ ધરાવે છે. પણ મારી કે આસપાસના મગંવ-કૌશામ્યી આદિ રાજ્યોની વાત જ જુદી છે. જમીન લોબ, અને સત્તાનો શોખ વત્તાં હોવાથી અમારા વચ્ચે સંભળનાં ચૂનો ગંધાય એવો સંભવ જ નથી ! વારે ક્રવારે તલવારો ઘઘડે છે અને દુઃમનાવટ પણ ચાલુ જ છે. ભડકો થાય તેવી સામની તૈયાર પરી હોય છે, ઇક્તા એકાદ અંગારો પડવો જોઈએ.

• ગણુરાજ્ય યાંને પ્રણસત્તાએ એવું આ વૈશાલીનું રાજ્ય કયાં ! અને સાંબ્રાન્યના અભિલાષ ધરતાં અમારા વ્યક્તિ સત્તાના મદમાં વેરાયેલાં રાજ્યો કયાં ! જમીન આસમાન જેટલું અંતર ! ઉલ્લય વચ્ચે મેળની ભૂમિકા નથી સર્જાએ શકી ત્યાં મારા પ્રયાસને ઇન્ન ઐસવાની વાત કયાંથી સંભવે ?

એટકરાજના સહવાસ સમાગમથી મારા અંતરમાં એમના પવિત્ર જીવન સંખંધમાં જે છાપ ઉડી છે તે હવે ભૂસાય તેમ નથી જ. મારા અંગત જીવનમાં પલ્ટો આણુવાનો મેં નિશ્ચય કર્યો છે. અંગદેશ પોતાની પ્રગતિ વૈશાલીને નજર સામે રાખીને જ કરશે.

જવા હો તમારી એ રાજ્ય ખટપટો. રામરાજ્યની ભાવના જ્યાં ભૂલાતી હોય અને પ્રજાનો પાલક રાજ પોતાની જતને માલિક ગણુ-વાના મોહમાં તણુતો હોય ત્યાં લડાઈ ટંટા અનિવાર્ય ગણ્યાય જ. અનેડા-અંડ વારે ક્રવારે ફૂટી નીકળે જ. સ્વાર્થવૃત્તિ રાજમાંથી પ્રણમાં ઉતરે એટલે સત-અસત નેવાની શક્તિ ઓછી થાય અને પાડોશી ધર્મ પણ ભૂલાય ઉલ્લય વચ્ચે આંતરિક કલેરના ધીણરોપણું થાય. એથી લાભ ત્રીજને મળે. પણ સત્તાનો મફ આ નિતરં સત્ત્ય જે. ઉત્તરવા ન હે. પરિણામે સર્વ નાથ આવવાનો જ.

વીર આળા, તમારી વાત શુદ્ધ કુંદન જેવી છે. પણ આવું હિએક સમ નિર્મણ સત્ય સમજય છે કેને? માનવા કોણ તૈયાર છે? અને તો સૌ અણુભ હિંદુના હેઠમાં મશ્વરું થયેલા છે. નગારખાનામાં તત્ત્વીના નાદ જેવી દરશા!

રાજુ! કાળખળ એ વાત કાન પડીને સમજશો. પિતાશીની દીર્ઘ દશ્ચિ ભલે આને તમો માંધાતાઓ ન સમજો, પણ ભારતવર્ષને શારે આવી રહેલ આફમણુંની આગાહી થઈ રહી છે એ વાતમાં મીનમેખ નથી જ. એ વેળા સંગડનની સાચી કિંમત પરખાશો. સંગકિત હશે તેજ ગનઘત રહી શકશે; અને જીવશે પણ તે જ; આકીના પાયમાલ થવાના.

એર ! ભાવિલાખ હશે તે અનશે. પેદી વાતનો શો વિચાર કર્યો ?

અરે, હા. રાજ્યચિનામાં એ તો મને યાદ જ નથી રહી ?

આપણે શ્રી મુનિસુગ્રત સ્વામીના રત્નપ દર્શને પ્રથમ મળ્યા હતા અને પ્રીતિને પ્રથમ પાડ પઢ્યા હતા. એ પદ્ધી અહીં આવવાના પ્રસંગો ગ્રામ ઘનાં એ સ્નેહ અંકુર વૃદ્ધિ પામ્યો. પરસ્પરના દિલ વાંચવાના યોગ પણ સ્વાંપદ્યા અને કાયમી રૂપે પરિણમાવવાનો પ્રશ્ન પણ તમે રજુ કરેલો. એ વાતનેજ તમો યાદ કરી રહ્યા છો ને?

ચંપાપતિ ! તમો પણ અન્યમ જાહુગર છો ! આટલી લાંખી સાંકળ ગોછી, છતાં મુદ્દાની વાત આવી ત્યાં યાદદારત ઝાંખી કરી દીધી ! વાહ, તમારી ચતુરાઈ ! કુંવારાને લમની જ વાત યાદ આવે ને ! નારી હલ્ય તો પ્રણયંતી જ શોધમાં હોય ને ! ચઢોરી ચંદ્રની પાછળ ભરે—એ કાળ જૂનો રવૈયો ! પિતૃગૃહ એ તો એને વિસામા જેવું.

રાજકુમારી, મને તમો ગમી ગયા છો. એટલું જ નહિ પણ મારી સાથે જોડાઈ એક અંગરૂપ બનો. એવી મારી હાંદિક છચ્છા પણ છેજ. વૈશાલીની દ્રશ્ય કુંવરની હાથ પ્રાપ્ત થાય એ તો જીવનની એક હાણુ

લેખાય. પણ ચેડા રાજના પ્રતાપ ને ગૌરવ જોતાં, એમની સમક્ષા એ વાત કરવાની-તેમની દર્શા જાણવાની, હજુ મેં હિંમત કરી નથી.

તમો પણ કોથળામાંથી બિલાડું કહાડવા જેવું કરો છો ! ક્ષત્રિય થઈને આ વણિક કણાનો શા સારુ સધિયારો શોધો છો ? એમાં પિતા-જીની અનુમતિનો પ્રશ્ન કર્યાં ? ક્ષત્રિય તનયાએ પોતાના જીવન-સાથી શોધવામાં સ્વતંત્ર હોય છે. મારી કોઈ પણ પણ બહેનના જગ્ન જોડવામાં એમણે ભાગ લીધો જ નથી. એમાં આ તો વૈશાલી. આ રથાની દરેક વ્યક્તિ, જન્મથી જ સ્વતંત્રતાના મેંબેરા પાછ પઢેલી. જીવાય તો તમારે આપવાનો રહે છે. મારી પેલી વાત યાહ છે ને ?

કૃદાય ભૂલી ગયા હો તો તાજ કરાવું કે જરૂર કર્યાના ઉંડેલ થઈ રહે. કેટલાક રાજનોં કરી રહ્યાં છે એવું જનાના મંણ મારી હાથ અણ્ણા પછી નહિ કરી શકાય. મુંબું જોતાંજ જેમ ભ્રમર રસ ચારતો ભટક્યા કરે એવું જીવન જીવવાના મને કોડ નથી. મારા ભરથારતું એ રીતનું ભટકું મને પસંદ પણ નથી. મારા બનેવી ચંડપ્રથોતનું જીવન એવું જ છે. બહેન શારશ્રી બલે એ સાંખી શરૂ પણ આ પણ તો ઘડીભર નહિ ચવાવી હે. એવા જીવનમાં પ્રેમનું ખીટ સરણું ન ગોણાય. જ્યાં ચંતરનો પ્રેમ નથી-દાર્દી ઉમળ્યો નથી-પરરપરનું આકર્ષણી નથી-ત્યાં મારું મન માનતુંન નથી. આપણા વર્ચ્યે સાચો. પ્રેમ હોય નોંધ જગ્ન છાટ લેખાય અને નોંધ સંસારનો કંસાર માડો લાગે.

ઓલો, તમારો એ સંઅધમાં શો જીવાય છે ?

કુંવરી, તમારી એ વાત, અરે શરત કહો તો શરત, મને સોએ સો ટકા મંજૂર છે. તમારા સરખી જુદ્ધિમતા પ્રમાણને મેળવી અન્યત્ર ભટકવા જનાર એ કોઈ રસીક તો નજ હોય પણ જમાર જ સંભવે. પ્રેમની વ્યાખ્યા હું પણ જાણું છું. અનુભવજ એની પ્રતીતિ કરારી શકે. લૂધાં વચ્ચેનો વદ્વાનો કંઈજુ અર્થ ન લેખાય.

ગમે ત્યાં ભમતા કુરવું કિંબા રૂપવતી રમણીએને નિરખી રેહના ચેનવાળા કુરવા અથવા તો કામિક વિલાસમાં જ જીવન ખર્ચી નાખવું એ શુદ્ધ પ્રેમનાં લક્ષણ નથી. એ તો ઉધારી કામી દરાના ચિનહે છે. એવી ધૂતિ મારી હોત તો ચંપાના ધર્ષણી તરીકે ફેટદોયે લાભ લેવાયો હોત. અહીં એડા તમારા કાને પણ એ જીવનના પડધા પડયા હોત.

મને આપતા જવાખ્યી સંતોષ થયો છે. આપથી ઉતાવળ કરી જવાશે નહિ. ત્રણ દિનમાં લગ્ન કાર્ય પતાવીને આપણે હવે સાથે જ ચંપા મારે ગ્રયાણ કરીશું.

આટલી અધી ઉતાવળનું શું પ્રયોગન છે? એકાંત મારી વાતનું તોલન કરો. આ તો જંગળના સોદા કહેવાય.

મન જ્યાં સાક્ષી પૂરનાર હોય ત્યાં વિલંબ નજ હોઈ શકે.

જેવી તમારી મરજ. પ્રેયસનો આગ્રહ હું પાછો શા સારુ હેલું? આ તો ‘જોઈતું હતું ને વૈદે કહ્યું’ એવો ધાર.

હું વિધિવિધાન અંગેનો પ્રથમ માતુશ્રીને કહી કરાવું છું. હુદ્દયના તાર સંધાયા છતાં વ્યવહારની એ મર્યાદા જળવવી જોઈએ.

પદ્માવતી રાણી તરીકે આવ્યા પણી રાજમહાલયની રિથનિ પલટાઈ જાય એ તો સ્વાભાવિક છે. પણ સૂર્યિયે ચંપાનગરીની રોનક કરી ગાઈ છે. જ્યાં ત્યાં તાજગી અને ઉલ્લાસ બન્યું વાતાવરણ અર્જન્યું છે. વૈશાલીના અનુભવ ધ્યાનમાં રાખી, પદ્માવતીએ ધર્ષણી ખર્ચી આખતમાં દર્શિયાહન ભૂપના સલાહકાર મંત્રી રૂપ બની, અતનનતના સુધારાઓ કરાવ્યા છે. પ્રણમાં સ્વતંત્રતાની ઉધા પ્રકરણી છે. પિંજરનું પક્ષી અને વનવગડામાં વિહરતું પક્ષી—આમ રૂપરંગમાં તેમજ વાણી વિહારમાં સરંખાં ઉત્તરતાં ડોાવાં છતાં ઉભયની રહેણી—કરણીમાં જે વિનનતા દશ્ઠિગોચર થાય છે એ ઉપરથી બંધિયાર જીવન અને સૈર જીવન વચ્ચેની તરતમતા ઉડાને આંખે વળગે છે. એ ઉપરથી બન્ને

જીવનમાં ને ક્રિકેટ રહેલો છે તે સહજ જોઈ શકાય છે. એ જિતનું ચિત્ર પાઠનગરની પ્રણના અદ્ભુતેલા માનસમાં રૂપષ્ટ જોવામાં આવતું હતું. એ સર્વના નિમિત્ત ભૂત વૈશાળીના સ્વતંત્ર વાતાવરણમાંથી આવેલી રાણી પદ્માવતી હતી. આ રીતે એકાંત સુખમાં ભૂપ દ્વિવાહનનાં વર્ષો વ્યતીત થવાં માંડયાં.

નીતિકારના દોકમાં ગુહિણીના ને ગુણો વણું વેલા છે. ‘દ્વાર્યેષુ
મંત્રાને કરણેષુ રાસા’ કિંવા ‘બોજનેષુ માતા ને શયનેષુ રંભા’ જેવાં
ને વિશેષણો અપાયેલાં છે તે સાક્ષાત્કાર કરવાનો રાજની દ્વિવાહન
માટે તો રોજનો ક્રમ થઈ પડ્યો છે.

રાજકાજનો પરિશ્રમ અંતઃપુરમાં પગ મુક્કાં જ રૂપ ભૂલી જય
છે. દાંપત્યછુવનના નવનવા આનંદમાં ને એકત્ર અનુભવાય છે તે
અન્યત્ર ભાગ્યેજ જોવા મળે તેમ છે. ખીલ અંતઃપુરો માઝું અહીં
શોક્યાની ખડકો કે ધિગાણુંનું નામ પણ નથી સંભળાયું. પ્રાતઃ-
કાળના કિમતી સમય ઉદ્ઘાનમાં આવેલ શ્રીવાસુપૂર્ણ સ્વામીના રતૂપના
પૂજન-રત્વનમાં અને પદ્ધીથી રાજ્યના કામકાજમાં વ્યતીત થાય છે.
સંધ્યાકાળ તો નમરીના જુદા જુદા ભાગોમાં પરિશ્રમણ કરવામાં અને
પ્રણના સુખદુઃખ જાણવામાં પસાર કરાય છે.

ન્યાં પલ્યોપમ અને સાગરોપમ નેદ્રા કાળના વહાણાં વહી ગયાં
ત્યાં ચંપાના સ્વામીના-હરકોઈને છર્ણો ઉપનવે તેવાં થોડાં વર્ષો વહી
જય એમાં આશ્રમ્ય પણ શું !

પ્રણનાં કલ્યાણમાં સહેલ રત રહેનાર, અહીની પ્રણના મૌન
આશાવાદનું ભાજન અનનાર આ દંપતી પર જનસમૃહની તો નજર
ન એહી, પણ વિચિત્ર રીતે વિશ્વનું સંચાલન કરનાર વિધાતાની તો
કરડી આંખ થઈ.

અંભેદકારી જનતા રાણી પદ્માવતી સગભી થયાના સમાચાર

સાંભળી આનંદ-પ્રમોહથી નાચી ઉડી, ભાવિ વારસના મુખદર્શનને પ્રસંગ હવે હાથવેંતમાં છે એ જાણી અશાલીમાં ગરડાવ અની.

જાની ભગવંત સિવાય કોણ જાણી શકે કે આ પાછળ દૈવની કોઈ અતોભી લીલા વિસ્તરથા માંડી હતી. દ્વિવાહન જૃપ સામે કોઈ અગમ્ય સંકટના આગમનની આગાહી થઈ રહી હતી. પ્રાકૃત માનવને એ જીબ નથી એ પણ ડીકન છે.

મહિના વૃદ્ધિ સાથે રાખીને દોહલા ઉત્પન્ન થવા માંડયા, ગર્ભમાં આવનાર જીવ પુન્યશાળી હોય છે તો માતાને સારાં કાર્યો કરવાના વિચારો. ઉદ્ભવે છે—ભાવનાએ જણે છે. એથી ઉદ્દું, ઉત્પન્ન થનાર જીવ હીનપુનીયો હોય છે તો માતાના વિચારો પણ એને લઈ વિચિત્ર વલણ લે છે. સુંદર દોહલા ગર્ભદસ્થામાં ઉત્પન્ન ત્યારે જ થાય છેકે જ્યારે ભાગ્યની અધિકાઈથી કોઈ પુન્યશાળી જીવ ગર્ભમાં આવે છે. વર્તમાનકાળમાં ગર્ભવતી સ્ત્રીએને ઉત્તમ પ્રકારના ભાવો નથી ઉદ્ભવતા એજ પંચમકાળના જ્વોની પુન્યાધ કેટલી એણી છે એ અતાવે છે.

જાની પુરુષોનું કથન છે કે કોઈ પુણુ જાતના પરિચય વિના માત્ર પ્રથમ દર્શને જ ને વ્યક્તિને જોતાં સ્નેહ ઉપને તો એની સાથે પૂર્વભવતો રાગ છે એમ માનવું એને તિરસ્કાર ઉપને તો સમજવું કે પૂર્વભવતો દૈપ છે. કર્મોની ગતિ ભાહન છે. પુત્ર તરિકે કુક્ષિમાં આવનાર કંઈ શત્રુ તરિકેનો ભાગ ભજવે છે. કંસ અને ફૂણિકના દૃષ્ટાંત એ માટે જીવતાં જાગતાં છે. કાન્નિં વધારનાર પુત્ર તરિકે અભયકુમારનો દ્વારાલો મોણુદ છે. ગર્ભમાં આવતાં જ માતુશ્રી નંદને સુર્વત્ર જીવદ્યા દેખાવવાનો ભનો઱થ થયો હતો. દોહલા એક પ્રકારતા. ઉત્પન્ન થનાર આત્માના લક્ષણું સંદેનો જ છે.

પદ્માવતીના ઉદ્દરમાં અનાવનાર આત્મા પ્રથમ પુન્યશાળી હતો. સંરસ્કારી માધ્યાપના આચારની છાયા એમાં ઉતરી હતી. એના જેરે

પદ્માવતીને મોટા ઉત્સવપૂર્વક પ્રભુપૂજન કરવાના, દીન દુઃખને ઉદ્ધરવાના-વિપુળ પ્રમાણુમાં દાન-દેવાના મનોરથ ઉપજતા. રાજવી એ પૂરવામાં જરાપણું ઉણુપ ન દાખવતો કે વિલંબ ન થવા હેતો.

એકદા રાણીને વિચાર છૂટબયો. કે ચોતે હાથીની અંખાડીમાં એસે. જોડમાં પતિહેવ એસે. પાછળ અનુચર ઉભી અમારા મસ્તકે છત ધરી રાખે અને એ રીતે નગરના ધોરી માર્ગે થઈ, ઉદ્ઘાનમાં જઈએ. એ વેળા હું એ હાથે ખુટથી દાન હેતી સૌ કોઈનું દુઃખ હરં.

ભૂપતિએ આ વિચાર જણુતાં જ સર્વ પ્રકારની તૈયારી કરાવી. મુક્તર કરેલા દ્વિને ગણુનીના રક્ષકો સાથે દંપતી ગજ ઉપર એસી નીકલ્યાં. ચંપાપુરીના રાજમાર્ગે થઈ લોકોની સલામો ઝીલતાં-ભાતજનતના જથુન્યકાર સાંભળતાં આગળ વધ્યા. સોનારુપાના સિક્કાના દાનથી દીન દુઃખીના દુઃખ ટલ્યાં અને મૂડ આશીર્વાદ મળ્યા. ઉભયના આનંદને સીમા ન રહી.

હાથી નગરનો દ્વરવાળે વટાવી ઉદ્ઘાનની દિશામાં વળ્યો. એડે જતાં એકાએક તેનામાં ગાંડપણું આવ્યું. ઉન્માદથી એકધારો હોડવા લાગ્યો. ઉદ્ઘાન બાણુ પર રહ્યું અને એ વનના માર્ગે વળ્યો !



પ્રકરણ ૪ થું ગ્રેયલીનો વિરહ



મુદ્રણના માર્ગે ગજરાને ગતિનો વેગ અતિશય વધારી દીવિા,
જાણે એ ધરતી પર નથી હોડતો પણ આકાશમાં ઉડી રહ્યો છે એમ જ
થાગે. પાછળ આવતી અશારોહી સંરક્ષક દણની ટુકડી એ વેગ સાથે
હરિદ્રાઇન કરી શકી. આ રીતે રાજવી અને સૈનિકો વચ્ચે અંતર
અહુ જ વધી ગયું.

આનંદ માણવનો ઉલ્લાસ ઓસરી ગયો. કોઈ પણ રીતે આ
ગાંડા બનેલ હાથીને કાખૂમાં લેવાના વિચારમાં રાજવીનું મન રોકાધ
પડ્યું. મહાવતના પ્રયત્નો એક પછી એક નિષ્ઠળ જવા લાગ્યા. જાણે
રાજ વક્ષાદારીથી વત્તાં આ ગજરાજ બદલાઈ જ ન અયો હોય !
અને પણ કંઈક ગુસ્સો આવ્યો. અને અંકુશનો ઉપયોગ જોરપૂર્વક કર્યો.

પણ એથી તો બળતામાં ધી હોમવા જેવું પરિણામ આવ્યું. એ
મહોન્મત પ્રાણી વધુ સતે જ બની એવું તો ઉછાળો. મારતું હોડયું કે
પીડ પરથી મહાવત ગખડી નીચે પડી ગયો. હોદામાં એઠેલા રાજ
રાણી પણ કૂળ ઉઠ્યાં.

રાજ્યની સીમાનો અંત આવી રહ્યી હતો. હાથી પરરાજ્યની હટમાં પ્રવેશી ચૂક્યો હતો. અનુચર કે રક્ષકમાંથી કોઈ હાજર નહોતું. છત્રધરને તો ઉધાનના માર્ગથી ગજરાજ આડો ઇંટાયો. કે તરત જ છત્ર સંક્લેષી લઘ સૈનિકોની મહદ્દ્યી ઉતારી દેવાયો હતો. એ દીર્ઘ નજર ભૂપે ન વાપરી હોત તો આ ગાંડુ બનેલ પ્રાણી વનમાર્ગના વૃક્ષોની ડાળોઓમાં કયાંક છત્રને ભેરવી મારી અકરમાત કરી નાખત. આમ છતાં ભાવિ ભયંકર જણ્ણાતું. પદ્માવતી તો લગભગ શુનમૂન અની ગોઠ હતી. આમ બનવાનો એણે સ્વપ્ને પણ ખ્યાલ નહોતો. જંગલનો માર્ગ ગાઢ ને ધીય થતો હોઠ વિકાળ જનવરનો ભય ડોકિયાં કરી રહ્યો હતો. સંધ્યા નજીક આવી રહી હતી. કોઈપણ ઉપાયે હાથી થોલે. એમ ન જણ્ણાતાં, દ્વિવાહને હાથીનો લ્યાં કરી દેવાનો. નિશ્ચય કર્યો. 'પણ એ અર આણુવાનું રહેલું નહોતું'. સંયોગો વિપરીત હતો. ઉતરીને ભર જંગલમાં-રિડારી વન પણુંઓની વચ્ચમાં, રહેવાનો જેટલો ભય નહોતો. એથી અધિક, દંપતીએ કેવી રીતે અંભાડી છોડી ઉતરી પડવું એ પ્રશ્ન મૂંઝવી રહ્યો હતો.

ત્યાં એકાએક હાથીના માર્ગમાં એક મોટા વજની વડવાઠાઓ લટકતી નજરે પડી. પળમાં એનો ઉપયોગ કરી લેવાની યોજના ભૂપના મનપ્રહેશમાં વડાઈ ગઈ. એ બોલી ઉઠ્યો.

જ્લાદી ! જે પેદું વટવૃક્ષ અને એની લાંબી વડવાઠાઓ. હાથી નીચે આવતાંજ આપણે ઉભયે છલંબ મારી એ પકડી લઘ લટકી પડવાનું અને આ અંભાડીની બેઠક તજ દેવાની. હાથીના ખસાર થઈ ગયા પણી વડવાઈ ઉપરથી વડનો સખિયારો લઘ ઉતરી પડવામાં જાડી ઝુંકેલી નહીં નડે.

વર્તમાન અવસ્થામાં રહારાથી છલંબ મારી વડવાઈ પકડી રાકાસે ?

સ્વામીનાથ ! ત્યાં અન્ય માર્ગ નથી ત્યાં એ સાહસ કર્યેં છુટકો.

વડવાઈ હેઠળ આવતાંજ દ્વિવાહને તો ધાર્યો ઉપાય અજમાયો। અને એક ડાળને જોરથી લટકી પડ્યો, પણ પડ્યાવતી તેમ ન કરી શકી, પ્રયત્ન કરવા છતાં, ભવિતવ્યતાના કારણે કહેલ કે સગર્ભાવરસ્થાને લઈને કહેલ, ગમે તે હો પણ તેણીના હાથ વડવાઈને ન પહોંચ્યા. દ્વાઢતા હાથીની પીઠ પર એ એકાકી ક્ષિતિજમાં દેખાતી અદશ્ય થઈ. ઉપર આલ અને હેઠળ ધરતી. ભર જંગલ અને રાની પશુઓની લીધણું રાડો વર્ચ્યે એકલી અટુલી—જેને એકાકી પગ સરખે. ધરતી પર મૂક્યો. નથી અને રાજમહાલયની બહારની દુનિયા જોઈ નથી એવી—પ્રહેશમાં ખેંચાઈ રહી. સ્નેહઅંથીથી ગંધારેલ અને એક બીજાના અજણ્યા પ્રેમમાં આકંદ ખૂદેલ રાજરાણી કલ્પનામાં ઉતરે નહીં એવા સંયોગોમાં વિખૂટા પડ્યા. વિધાતાએ જોતજોતામાં તેમના સુખમાં આગ લગાડી દીધી.

‘વિધિરેવ બલીયસી’ એ નચન ટંકશાળી ગણ્યાય છે તે આવી શક્તિને કારણે જ.

દિષ્ટિમર્યાદા બહાર થતી પ્રેયસીને જોયા છતાં ભૂપ દ્વિવાહન કંઈજ કરી શક્યો નહીં. વૃક્ષનો. આશ્રય લઈ એ ધરતી ઉપર ઉતરી આવ્યો. પણ આજના બનાવે અને પ્રગટેલી નિરાશાએ એના હૃદ્ય પર એવે રો કંઘને કર્યો હતો કે કેટલાક સમય પર્યાંત એ ઝાડ હેઠળ બેભાન દ્વારામાં પડી રહ્યો. સંરક્ષક દુકેડિના નાયકે આવી, પ્રથ્યામ કરી, રાણીમાતા અંગે પ્રશ્ન કર્યો ત્યારેજ જાણે લાંખી જાખમાંથી એકાએક જન્મત થતો હોય એમ એ ભાગુકી ઉદ્ઘ્યો!—માંડ બોલ્યો—

સર્વનાશ !

અરે મહારાજ ! શું થયું એતો કહેલ. હતાશ ન બનો. રાણીજ કૃતાં જયા ? અને જાંડા હાથીનું શું થયું ? અમે આવી જયા છીએ તો સત્ત્વર કઢી નાંખ્યો. કે નથી તપાસ આરંભાય. માર્ગે અમે માત્ર

મહાવતને બેબાન પડેલો જોયો એટલે એને નગરમાં પહોંચાડવાનો ગ્રંથંદ્વ કરી આ તરફ દોડતા આવ્યા છીએ.

નાયક, આ હૈવની કૂર મસ્કરી છે. આનંદ-ગ્રમોદ અર્થે ગોઠવેલ પ્રસંગનો આવો કરુણ અંભ આવશે એવો સ્વર્ણે પણ ખ્યાલ ન હતો, એમ કરી બનેલી હકીકત દૂંકમાં કષી સંભળાવી.

પ્રાંતભાગે નિસાસાપૂર્વક દુઃખી હદ્દે જણાવ્યું કે—પ્રાણુવલદભા પદ્ધાને એ ગાંડો હાથી ક્યાં લઈ જશો, ક્યા મુલકમાં કેંકરો અથવા તો એની પીંડ પરજ બિચારીના રામ રમી જશો એ કંદ્પના કરતાં પણ બ્રૂજ જવાય છે.

મહારાજ ! ડિંમત હારવાનો જરૂર નથો. સંખ્યાના એણા પથરાદ રહ્યા છે. આપને આરામની જરૂર છે એટલે જરૂરી નગરમાં પાછા કરવું જોઈએ. હાથીની બેલંછા પાછળ મને તો કોઈ દેવી શક્તિનો હાથ જણાય છે. એ સંધંગમાં મહા અમાત્ય સાથે વિચારણા કરી, આવતી કાલના પ્રાતઃકાળથી રાણીમાતાની શોધ સાડ ઉપાયો હાથ ધરવાના. “પુરુષાર્થને કંઈજ અશક્ય નથી.” રાત્રિના થોડા કલાકોમાં એ પ્રાણી કેટલી ધરતી ખૂંદી વળશે ?

નાયક ! મને પણ રહારી વાતમાં તથ જણાય છે. દેવમાયા વિના હાથીમાં આવું બ્રહ્મ ન સંભવે. હું પ્રેયસીની સાથમાં હોત તો હીક થઈ પડે. એવી ચિંતા હદ્દ્ય ઢોરે છે.

રાજ્યી, સંરક્ષક દુકડી સહિત ચંપામાં પાછા ક્યો તારે નિશા-દેવીના આગમનની લેરી બ્રહ્મ રહી હતી. દેનમંદ્રોમાં [સંખ્યાકાળની] આરતીના ઘંટાનાંદો વાગી રહ્યા હતા. દરથારગટમાં મહા અમાત્ય, પ્રધાન, સેનાપતિ આદિ અધિકારી વર્ગ મહારાજના આગમનની રાહ ચાતક નયને જોઈ રહ્યો હતો.

હસ્તીપ્રીકને ખદ્દે એકાદ સામાન્ય અથ ઉપર ઐસી ભૂપતે આરતાં

નિરખી સાથમાં રાણીજીને ન જેતાં દીર્ઘ દષ્ટ મહામંત્રીના હૃદયમાં શાંકાના વમળો ઉઠવાં શર થયાં. અને નૃપતિએ આવી, હુલાતા હૃદયે સર્વ વ્યતિકર કહી બતાવ્યો ત્યારે માત્ર મહા અમાત્યને જ નહીં પણ હાજર રહેલા સર્વને ભારી હુંઘ થયું. વૃત્તાંત પાછળના તાણા વાણા મેળવતાં એના મનમાં એક જ છાપ પડી કે હાથીની આ ધેલછા પાછળ હોઢ અદ્દસ્ય શક્તિનો દોરી સંચાર છે અને તેથી જ રાણી પદ્માવતીના દર્શન પુનઃસુલભ નથી જણ્ણાતા.

સૌ એકાએક બોલી ઉઠ્યા.

મહારાજ ! સંકટ તો ભારી આવી પડ્યું છે. સુદ્ધક ને સુંશીલ રાણીજીનો વિરહ જરૂર શલ્યની પોડા આપે તેવો છે, છતાં જે બન્ધું છે એનો તાળો મેળવતાં તેમના જીવને હાની પહેંચે તેવું કંઈ થવાનો સંભવ નથી. પૂર્વ જવના વૈરી કોઈ દેવ કે વિદ્યાધરનું આ કાર્ય છે. બન્ધું તે ન બન્ધું થનાર નથી. હવે તો હિંમત રાખી ચારે દિશામાં ખાસ કરી હાથી જે દિશામાં ગયો છે એમાં આવતી કાલ સવારથી જ શીધગામી અશ્વરોહિએ. અને બારીકાઈથી અવલોકન કરતારાચરેને રવાના કરો. એ ગ્રાણી રાત્રિના કલાકોમાં કેટલું ફૂર જવાનું છે ? આપ નિશ્ચિંત બની આરામ લ્યો.

સૌ વિભરાયા. અને રાજવીએ પણ ધીર્ય ધારણ કર્યું. પ્રેયસીના વિરહે-પદ્માવતી જેવી ગુણવંતી સહયરીના અભાવે ચંપાપતિની રાત ડેવી વિષાદમય વીતી હતી એ તો ખીજ દિવસના પ્રાતઃકાલે તેમનો બહેરો જેતાં હરકોઈને સમન્ય તેવું હતું. મહામંત્રીએ સેનાનાયક જોડે મસ્લાત ચલાવી વ્રહેલી સવારમાં જ માણસો દોડાવ્યા હતા. ચારોએ ત્લિ સૌ કોઈની નજર એમના આગમન પ્રતિ ખેંચાઈ રહી હતી. પણ સંધ્યાકાળ પર્યાત કોઈના પણ પગલાં ન સંભળતાં રાજવીની જીરાશા અતિશય વધી પડી. ત્યાં એકાએક ગઢના નાકે ધોડાના

દાખલા સંભળાયા. કંઈક મુહાસર સમાચારની આશામાં સૌ એ તરફ
મીટ માંડી રહ્યા. સલામ ભરી જ્યાં એક પઢી એક અનુભવના અંતે
આલી હાથે ફરવાની વાત કરવા લાગ્યા; ‘અરે ન તો હાથી જોવામાં
આન્યો કે ન તો રાણીજીનો કંઈ પત્તો મળ્યો’ એમ ઉદ્ગાર કાઢતા
કથન પૂર્ણ કરવા માંડયું ત્યાં ભૂપતિની રહીસહી આશાનો પણ લોાય
થયો. અને એકાએક તેઓ બેભાન બની ગયા.

શીતળ જળના છાંટકાવ અને પવનના વીંઝણુથી માંડ ઘટિકા
પઢી મૂર્છા વળી. છતાં મગજ દારુલુ પીડાથી છલકાઈ ગયું. મુખારવિંદ
પર કાળિમા પથરાઈ ગઈ.

આશ્ર્ય પણ જેવું તેવું ન લેખાય. એક રાતમાં કેવો ફેરફાર.
ગ્રાણી કે પતિનિ કોઈનિા પત્તો જ નહીં. કોઈનિા કંઈ ચિન્હેં પણ ન
મળ્યાં! જીવતાં છે કે યમહેવના ભક્ષય બન્યાં છે એના પણ કંઈ સમા-
ચાર નહીં! કુદરત આગળ માનવ, અરે મેટો રાજવી પણ કેવો
પામર છે! ખરેખર વિધાતા તહારી લીલા અપાર છે! પહેલી-માઝીક
ખીલ રાત્રિ પણ સુંવાળા બિધાનામાં કાયાના પાસા ફેરવતાં પસાર
થઈ. રોધના પ્રયાસ ચાલુ રહ્યા પણ ઉત્સાહ જનક ખખર ન મળી.
એક નિષ્ણુલ જણાતા પગીએ જણાયું કે અરણ્યના ઊંડાણુમાં એક
નાના સરોવર પાસે હાથી પાણી પીવા થોબ્યો હોય તેવાં ચિન્હેં છે.
પણ પઢી આગળ પગનાં જણ્ણાતાં નથી.

મહારાજ ! આ છે તો સાતું કાચા સુતરનો તાંતણો, પણ એ
આશા તંતુ પર ભાર ભૂતી તપાસ ચાલુ રાખવાથી કંઈને કંઈ વહુ
આતમી મળસે.

આમ આશામાં દિવસ પઢી દિવસ વીતવા માંડયા. પણ નવી
ભાળ ન જ મળી. જનાન જણે ચમત્કાર રૂપ થઈ ગયો. દુઃખ વિસારે
જરૂર ભયું છતાં રાખીમાં સૂર્તિં ન આવી. રાજનતા મગજની

અસ્થિરતા વધી પડી. રાજકાળમાં ચિત્ત ચોટું જ નહીં. ધણો ખરો સમય તે એકાંતમાં જાળતા અને સહા ગમગીન રહેતા. આસપાસના પ્રદેશમાં આની માડી અસર થવા માંડી. ખંડીયા ભાયાતોમાંના કોઈ આ તકનો લાલ લેવા તૈયાર પણ થયા.

પડોશની કૌશામ્ભીમાં તો આ બનાવ અંગે જીત જતની ગુલ આંગો દિ' ઉઘ્યે ઉડવા લાગી. એ પાછળ મન ગમતા વળ ચઢવા લાગ્યા. સગપણુના નાતે સાહુ થયેદા, છતાં શતાનિક અને દ્વિવાહન વચ્ચે ખટરાગ તો વર્ષો જૂનો ચાલુ હતો. એમાં પદ્માવતી વાળા બનાવે ઉમેરે! કર્યો. મૃગાવતી જેવી દૃક રાખીને પણ પોતાની ભગીરિના આ અદ્દસ્ય થવાના બનાવમાં કંધ જુદી જ રંધ આવી. ચંપાપતિના નામે શંકા-કુશંકા અને આક્ષેપોની હવાઈઓ જૂદી રહી.



પ્રકરણ પ મું ધારિજીનું સ્વરૂપ



ગંગા ભાલી ! આમ હણુ કયાં સુધી ચાલ્યા કરવું છે ?

કાં, કુંવરીબા ! આટલામાં જ ચાકી જયાં ?

અરે ! ચાકવાની વાત કેવી ! ક્ષત્રિય બાળાને શરીર વાપરવાનો
જેમ કંટાળો નથી, તેમ ચાલવા કે હોડવામાં ચાક નથી જ.

તો પછી ! આમ ઉતાવળા કેમ થયા ?

ભાલી, અધુરી વાત જાણી લેવાની તાલાવેલી લાગી છે. કુંવરીબા,
તમારી ઈચ્છા સંતોષવા ખાતર તો આ એકાંત પ્રહેઠ પસ્સં દ કર્યો છે.

જુવો, આ સામે દેખાણું-સ્વસ્તિકની નિરાનીવાળા ઘણથી
શોભતું જે શિખરથંધી દેવાલય દેખાય છે એ સુચિની આદિમાં
થયેલા-એ વેળાના માનવીઓને નીતિ-ધર્મના પાઠ પદાવી સાચી
માનવતા શિખવાડી, જુન પ્રમાણિકપણે ગાળવાણું દર્શાવનાર-પ્રથમ
તીર્થંકર શ્રી નાથજીનું છે. એમાં પ્રભુતી મોટી ઝૂર્તિ વિરાજમાન
છે. અમારા જૈન ધર્મના સાહિત્ય મુજબ ચાલુ કાળ યાને આ

અવસર્પિણી કાળના ત્રીજા આરામાં તેમનો જન્મ ભારતવર્ષની અયોધ્યા નગરીમાં થયો હતો. માતાનું નામ મહેના અને પિતાનું નામ નાલિરાજન હતું. તેમને ભરત ખાડુષલિ આદિ સો પુત્રો અને ખાલી સુંદરી નામા એ પુત્રીએ હતી. તેમની એ પતિની નામે સુમંજલા અને સુનંદા હતી. જીવનના ગ્રાંટ ભાગે રાજ્ય, વૈજ્ઞાનિક અને સંસારની સર્વ માયા, સાપ કંચલી ઉતારી નાંખે તેમ છોડી દઈ, જ્ઞાનપ્રાપ્તિ અર્થે તેઓશ્રી નીકળી પડેલા-તીવ્ર તપશ્ચર્યા દારા કર્મ સમૂહને બાળી નાંખી અપૂર્વ એવા ક્રેચલજ્ઞાનની પ્રાપ્તિ કરી. એ રીતે આત્મસાક્ષાત્કાર કરનાર અને જનસમૂહના ઉદ્ધારક એ પ્રથમ દેવ છે.

ભાલી, હેં તો બહુ લંખાણુ કર્યું ! હું કંઈ તહારી માફક ચંપા-વાસી નથી. આ ગામમાં વસનારી હું આ પ્રાસાદમાં પ્રતિષ્ઠિત દેવ સંબંધમાં સાવ અલિજી હૃદશ એમ તું માને છે ? અમારા કુળમાં શૈવમતની ભાન્યતા છે છતાં દેરેક ધર્મને માન આપવાની રસમ પણ છે જ. અહીં ભરાતા મેળામાં હું આવેલી છું. એટલું જ નહીં પણ મેં ભગવંત મૂર્તિની ચંદ્રનપૂજા પણ કરી છે.

હું, ત્યારે મારું આ વર્ષનું તો મા આગળ મોસાળ જેવું જ લેખાય. તમારી આગળ ચંપાનું વર્ષનું કરું તો નહું ગણ્યાય. અલી ઓન, મારે ચંપાનું શું કામ છે ?

એ તો તમારી વાત પરથી જ સમજાય છે. પણ મને એની કંઈ ઉતાવળ નથી.

ભાલી, ક્યાં એસવું છે ? પેલી દિશાને કુંવાકાંડો જેમ ભારાથી અજાણ્યો નહોતો તેમ આ ખાળુનો સરિતાતટ પણ અજાણ્યો નથીજ. પ્રાસાદના પાછલા ભાગમાં બગિયો છે અને એની હેઠળ નદીનમ પાણી મંદ્રમંદ વહે છે. ઉપરના પગથારે ગોઠેલાં વિરામાસન પર બેસી સામેનું દસ્ય નિરખવાની મોજ અનોખી છે. એ આનંદથી હું તો વચ્ચિત નથી રહી.

સખી, આપણે ત્યાં એસીને જ વાર્તાલાપ કરવાનો છે. અત્યારના સમયે ત્યાં ડોઝ જવલ્યે જ બેઠું હોય છે અને શાંતિ તો અતિ ધણી હોય છે. અલખતા સંધ્યાના આગમન ટાળે ભીડ વધવા માંડે છે પણ તે થતાં પૂર્વે તો આપણે પાછા ફરવું છે. આ વાસના કુમરાને બદલે આ સ્થળ પસંદ કરવા પાછળ હેતુ છે.

આપરે તો વખ્ટિકની જતિ ને ! કંઈક લીલતા તો હોય જ. આપણી વાત એવી તે કેવી છે કે જેમાં આટલી હૃદે ગભરાવાનું હોય ! શું રાજી-રાણીની વાત જ ન થાય ? બીકનું કારણ નથી. છતાં જ્ઞાનગીપણું તો છે જ. ડીક, તું કહે તે ખડું. ગાતાં ગાતાં જામ આવ્યું. આ તારો એકાંત પ્રદેશ. બિરાંજે આસન ઉપર અને ભાબીશી, ઘોલી નાંખો. તમારી આ નોંધપોથી આવી અધૂરી કેમ છે ? માત્ર એ પ્રકરણો ! એ લખવામાં શું આશય છે ? લખનાર તો તમારા પતિહેવ જલ્દું થએ.

નણુંદી થયા તો ભલે, પણ આવી પ્રશ્નોની ઝડી ન વરસાવાય. તું કંઈક તમારી માઝક કળાઓની જાણ નથી કે જી જવાઓ આપવાની મને સુજ પડે. જરા ધીરજ રાખી એક પછી એક સવાલ કરો તો ઉત્તર આપવાનું પણ સુઝમ પડે. આ અધું જાણુવાની આટલી હૃદે ઉલટ તમને કેમ થધ ?

તમો પરણ્યા એટલે કુંવારી અવસ્થા સાવ ભૂલી જયા લાગો છો. ભાબી ! યૌવનને આંગળે રમતી બાળાઓને તો દરેક વાત જાણુવાની અજાસા સંભવે જ. આમાં ભારી ઉલટ સકારણ છે.

કુંવરીબા ! મને રામની રામાયણ ન આવડે. વાત એમ છે કે આ નોંધ સકારણ લખાઈ છે. માઝં પિયેર કૌશમ્ભીમાં છે એ તો તમો જાણો છો. જ્યારથી પદ્માવતી ગુમ થધ છે ત્યારથી અમારા રાજવી વિશ્વદ ત્યાં કંઈક કંઈક જાતના તુઙ્ગા ઉદ્ઘાવાય છે. ડોઝથી હિસાબે રાજવી

દ્વિવાહને ઉતારી પાડવાના પેંતરા રચાય છે. મારા માતાપિતાને ભળવાના નિમિત્તે જઈ, જાણીતા સુખીએને મળા, ચંપાની પરિસ્થિતિનો ખ્યાલ આપવાનું કામ મારા સ્વામીને આપવામાં આવ્યું અને તેથી તેમણે આ નોંધ તૈયાર કરી છે. સાચી પરિસ્થિતિ જણાવવાનું એ દારા સુગમ પડે.

જે કંઈબન્યું છે એ અતિશય હુઃખડર છે, પણ એમાં ચંપાપતિ દ્વિવાહનો કંઈ પણ હોય નથી. ગર્ભિણી પદ્માવતીના ગુમ થવા પાછળ રાજીવીએ શોધ કરવવામાં જરા પણ કચાશ રાખી નથી. અરે, મહિનાઓ વીતવા છતાં, રાજ્ય કાર્યમાં રાણીની જરૂર ઉગલે પગલે રહેતી હોવા છતાં, અન્ય રાજીવીએના અંતઃપુરમાં એકથી વધુ રાણીએ નજરે જોવા છતાં, રાજી માટેની આવી પ્રચ્છિત રૂસમ છતાં, અને અધિકારી વર્ગ તરફથી એ માટે આગહ ચાલુ છતાં, જેણે અંતરનો શોક નથી તો એછો કચોં કે જેણે કુરીથી લગ્ન કરવાની હા પણ ભણી નથી અને પ્રેયસી પાછળ જેની ઝુરામણું જરા પણ ઓછી નથી એવા શુદ્ધ પ્રેમી નૃપ પાછળ મનગમતા ગપગોળા ગણડાવવા, અરે કલ્પિત તહેમત ખડા કરવા, એ મારા પિયરવાસી પ્રલજનોમાં રવૈયો થધ પડ્યો છે ! એ પાછળ કૌશામ્ભીપતિ આંખમિચામણું કરી રહ્યા છે. મંત્રીમંડળને એ પાછળ કંઈક જુદી જ ગંધ આવે છે. આ લીલા આગળ વધતી રહે તો રાજ્ય પર જઘં જોખમ આવે એમ તેમનું મંત્ર્ય હોવાથી, કૌશામ્ભી જઈ, વાતાવરણું નિર્મણ કરશા—અને સાચી પરિસ્થિતિનો ખ્યાલ આપવા—ના કાર્યમાં મારા પતિદેવને મુખ્ય ભાગ ભજવવાનો છે. સાથેસાથ ચંપાના દરખારને શોભાવે, રાજીવી દ્વિવાહનો શોક એછો કરાવી રાણી પદ્માવતીની જોટ ભૂલાવે, એવી ડોઈ રમણીની શોધ કરતાં આવવાની જ્વાખદારી પણ તેમના શરીરે નાખવામાં આવી છે. વચ્ચમાં વડીલની માંદળીને પ્રસંગ આવી પડવાથી એમાં ઢીલ થઈ છે.

એટબા સારુ તો અહીંથી પ્રયાણુ સત્તવર કરવાને। નિશ્ચય થઈ ગયો છે. આજે તમો શોધતા નોંધાયા હતે, તો મારે તમને મળવા તમારી અઠીના પગથીઓં ડેકવા પડત.

સખી, વાતના અંડોડા ખરાખર સંધાઈ ગયા. નોંધ વાંચતાં જ મારા મનમાં ઉદ્દ્દેશ્યનું કે પદ્ધાવતીનું ગુમ થવું એક અહન કોષ્ટકા ૩૫. છે; છતાં એમાં ભૂપ દ્વિવાહનની જરા પણ કસ્તુર નથી.

અમર જેવું સ્વચ્છંદી જીવન જીવતા અને પરાગ રસ લુંટવા સારુ અહીં તહીં ભટકતા અસ્થિર મનના રાજાએમાં તમારા ચંપાપતિની દફ્તા પ્રશંસાપાત્ર છે. અડગ વૃત્તિના ભૂપાળ તરિકે એ જુદા પડી આવે છે અને તેથી એમનું રથાન અનોડ છે. હરકોઈ સમજુને તેમના પ્રતિ માન છૂટે તેમ છે.

હરકોઈની વાત બાળુ પર રાખો. કુંવરી ! તમને એમનું વર્તન ઝેવું જણાય છે. તમો કેવી નજરે નિહાળો છો ?

એમાં મારા મતની શા કિમત છે, ભાલી ? હું તો એમની આ વૃત્તિને કુલડે વધાવું છું. આવો સ્વામી પદ્ધાવતી જેવી કોઈ સતી જીવીના ભાગ્યમાં જ હોય !

અરે હીક કલ્યું, પદ્ધાવતી જેવી હોઈ ખોટ પૂરનાર રમણી શોધી આપોને ! કુંવરીએ ? સ્વામીના શરીર આવેલ એ જવાબદારીને। ઉકેલ મારે કરવાનો છે.

હું, હું, લારે તો ભાલી, તમો પણ મારા ભાઈની માંડક રાણ્ય અંગેની ખાસ ફરજના સહેશવાહક થયા છો !

ક્ષત્રિયવટ લલેને દાખવી ન શકાય, પણ તેથી શરવીરતાની પિણાન ન કરી શકાય એવું હોણે કલ્યું ? રાણીની જગ્યા સાચવે એવી લલના મેં તો શોધી પણ રાખી છે.

તો તો ભાલી ! તું પણ પાકી વાણિયણ લેખાય.

બાકી પદ્માવતી જેવાં કી રત્નો એઓંાં જ હાલતાં ચાલતાં હાથ આવે. ઉચ્ચ સંસ્કૃતિમાં માતાપિતાના સંસ્કાર નિમિત્ત ભૂત છે પણ એ ઉપરાંત પૂર્વના ભાગ્યની રેખા ઝણકતી હોવી જોઈએ.

એવી કોઈ રમણી મળે તોજ ભૂપતિનું દુઃખ ભાંગે. કુંવરીબા, મને આ કાર્યમાં મહદું ન કરો ?

અરે, કહો તો સાથે આવું અને માગો. તેવી સહાય કરે. બાકી ચંપા પાણી કરો. ત્યારે મને ખખર જરૂર આપજો. પદ્માવતીને જોઈ નથી, પણ દ્વિવાહન નરેશને એક વાર નજરે જેવાનો અથળાખો છે.

તો તો બહેન ! મારા ઉપર મોટો ઉપકાર. અમારા આંગણે તમ સરખાનાં પગલાં થાય એ તો અહોભાગ્ય ગણ્યાય. હવે મને બીજી મહદુંની જરૂર પણ નથી. મારા મનમાં કુવાકાંહાના અનાવથી સહજ વિચાર ઉદ્ભબ્યો હતો કે એક વાર તમો ભૂપની નજરે ચઢો, કિંવા એ તમારી દૃષ્ટિએ પડે એવો પ્રસંગ ગોઠવવો. પણ તમારા બાપુ અંમારે ત્યાં તમને મોકલશે ખરા ?

શા સાર ન મોકલે ? તમારું ધર પારકું કચાં છે ? કદાય એ ના પાડે તો પણ ક્ષત્રિય લલના અંધનને ગણ્યકારે ખરી ? મેં ધરથી જ કહ્યું છે કે સ્વતંત્રતા એ તો અમારા ધાવણુમાં પવાય છે. નિરતા એ તો અમારો વારસાગત ધર્મ.

કુંવરીબા ! તો હું પણ હિંમત ધરી કહું છું કે મારી શોધમાં તમોજ પ્રથમ નંખરે છો. દ્વિવાહનને તમારા જેવી સહયરીની જરૂર ગણ્યાય. પદ્માના અનાવથી જે મગ્નીનીએ તેમના મગજનો કબજો લીધો છે એ તમારા સરખી દક્ષ દ્વિતાના ચોગ વિના હુદે તેમ નથી.

ભાલી, તમો પણ મશ્કરીની હુદ એણંગો છો ! કયાં આંગ

હેઠનો મહારાજા અને કૃયાં એકાદા નાનકડા ગામનો હરનામસિંહ ઢાકોર ! એની આભિષુ દીકરીને ચંપાના મહાલયમાં સ્થાન મળે ઘરં ?

કોણે કહ્યું ન મળે ? ખ્રી રત્ન તો હુષ્કુળમાંથી લેવાય એવું નીતિ-કારેનું કથન છે. અહીં તો કુળ ને યોગ્યતાનો પૂરો મેળ છે. મારી આ મળાક નથી. રાજનું શ્રેય જોવું એ ધર્મ કહેવાય અને એમાં પણ પોતાના જ જીબમાંથી ખ્રી રત્ન મળે એ તો સોનામાં સુગંધ ભલ્યા જેવું. ઉલય પ્રકારે લાભકારી. મન ભલ્યા છે તો આજે વાત કહું છું.

ન્યારથી મારા પતિહેવે કુવાકંહેની તમારી વીરતાની વાત સાંભળી છે ત્યારથી તે તો કહી ચૂક્યા છે કે આપણા ગામખણીની પુત્રી, ચંપાના મહાલયને શોભાવે તેમ છે. મને પ્રયાસ કરવા પણ કહેલું.

પણ નશુદ્ધી, માંડ થોડા દિનતા આપણા વચ્ચેના સહીપણુમાં એ વાત ઉપાડતાં મારી જીબ જ ન ઉપડી. આ એકાંત સ્થળની પસંદગી પણ એ સંખ્યામાં તમારી છંદ્ધા જાણી લેવા સાર જ કરેલી; છતાં તમારા પ્રભાવ સામે એ પ્રશ્ન કરી જ ન શકી.

ભાલી ! તમો ક્ષત્રિયાણીના સહવાસમાં આવ્યા છતાં રદ્ધા તો એવા ને એવા ! આવી નથળાઈ ધરવાનું શું કારણ ? વળી આમાં કઈ મોટી ગફન વાત પણ છે ?

હોવે, તમો તો શું એલતાં હશો ? જાંદગીને સવાલ !

પણ, એ તો પસંદગી કરનારે વિચારવાનો ને !

એક સહિયર તરિકે મારો અભિપ્રાય મેળવવાનો તહેને હુક્ક છે અને મારી છંદ્ધા વ્યક્તા કરવાનો. મને પણ એટલો જ હુક્ક છે.

તો કંઈ જ બગડ્યું નથી. છંદ્ધા જણ્યાવે તોં ગોર ઘનવા તૈયાર હું.

ભાલી સાહેબ તો સંભળનો. છે તો સ્વમની વાત; પણ જેમ ખખાં સ્વભન્સાચાં નથી હોતાં, તેમ કોઈ એવાં પણ હોય છે કે જે સાચાં પડી પણ જાય છે.

મને વાત જાણુવાની તાકાવેલી એટલા સાર લાગેલી કે ગઠ રાત્રિના પાછલા પહેરે સ્વભન્માં મેં મારી જતને રાજમહેલમાં ફરતી જોઈ. ચંપાનરેશ જોડે વાત કરતી હોય એમ લાગ્યું. નોંધપોથીના ખનાવ પછી ચંપાપતિના અંતરમાં જે દાઢણું હુઃખ જન્મ્યું હતું અને એથી કરીને સારાએ રાજમહાલયમાં જે વિષાદ્ધાં વાતાવરણ પેદા થયું હતું, એ નિવારવામાં હું કારણ ભૂત બની. એથી રાજવી મારા ખલે હાથ મૂકી કંધ કહેવા જાય છે અને હું શરમથી જરા આધી ખસવા જઈ છું ત્યાં તો મારી આંખ ખુલી ગઠ.

કુબિએ ખરં જાયું છે કે—‘સ્વભનાની સુખલડી ભૂખ ભાંગે નહીં’ સામાન્યતઃ સ્વભન મને આવતું જ નથી. તેમાં આ આવ્યું અને જેમને નજરે દીઠા પણ નથી એમની સાથે નિકટનો ભાગ ભજવ્યો એ જેતાં, એની પાછળ કંધક હૈવી સંકેત સંભવે છે. તેથીજ મેં સામે આવી ચંપામાં આવવાનું નોતરં માગી લીધું છે.

કુંવરીઆ, શા સાર સખી કે નખુદી, તરીકે આવો. ખાસા સામૈયા પૂર્વક જ આવો ને ! હા પાડો એટલી જ વાર છે.

અંગાના મુખ પર હાથ ધરતી ધારિણી ભોલી—ચૂપ, આખળ હરદેન કાઢતી. ક્ષત્રિયનિતિમાં એ રીતે કંદુમાં પાણી ન પડે. ક્ષત્રિયાધ્યાનના હાથ રેઢા નથી હોતા !

ચાલ સમય થયો છે, હવે ઉડીશું ને ?

હા, હવે તો તમો જરૂર ઉતાવળ કરવાના જ. ગરજ સરી ગઠ.

આવ્યા છીએ તો દેવાલયમાં દર્શન કરીને જ પાછા કરીએ.

પ્રકરણ ઇ હું મસ્તિષ્કભૂષના કમરામાં

હું મહા અમાત્ય ! તમારી સલાહ સાચી છે. હું પણ સમજું હું કે વ્યવહારિક અને ધ્યાનિક કાર્યોમાં ઉગલે ને પગલે રાજ સાથે રાખીની જરૂર રહે છે, એથી જ તમો અને અધિકારીઓ લગ્ન કરવાની સલાહ આપી રહ્યા છો.

પણ સુરખ્યી, એક તો મેં પડ્યાનો હાથ ગ્રહણ કરતાં તોણીને વચ્ચન આપેલ કે હું એક પત્નિપત્રનો ઉપાસક રહીશ. એ વચ્ચન મારે શું તોડવું ?

મહારાજ ! પ્રતિજ્ઞાભંગ કરવાની વાત મારાથી નજ ઉચ્ચારાય. એવી સલાહ હું આપું જ નહિ. પણ જ્યાં રાખીનુંનો પત્રો જ નથી ત્યાં એ પ્રથ્યે કેવી રીતે સંભવે ? મૂળ નથી ત્યાં શાખા કંચાં શોધવી ? ને કંઈ કરવું પડે છે એ પણ આપણી સામે—ચંપાન્દેશ સામે વ્યાધ રહી નેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે માટે જ.

શું સેનાપતિએ મોકલેલા બધાયે અનુચરો પાછા કરી જયા ? મૂળા જીવતાની કંઈજ ભાળ ન મળો ! આ પણ એક અચ્છેદું જ ને !

સેનાપતિ આવી ચૂક્યા છે. એમના મહોદેથી જ જવાબ સાંભળવે ડીક છે. મારી આ જરૂરી વયમાં આ જાતનું હરણ અને તે પણ એક મહારાણીનું, એ તો પહેલો જ પ્રસંગ છે અને એથી ઓછી અજયણી નથી થતી. પણ જ્યાં વિધિ આડો હોય ત્યાં માનવ પ્રયત્ન હેડા પડે. ખરું જ કર્યું છે કે ‘લિખિતં અપિ લલાટે પ્રોજિતું ક: સમર્થ:’

ઓલો અરિદ્ધમનજી ! રાણીજ સંબંધમાં તપારી તપાસ કર્યાં સુધી પહેંચ્યો છે ? મહાયમાત્યજી તો હાથ ધોંઘ નાખે છે. તમો શી આશા આપો છો ?

‘કંઈ લાખો નિરાશામાં અમર આશા દૂધપાઠ છે’ એ કવિ ઉક્તિ અહો તો બંધ બેસતી થાય તેમ જણ્ણાતું નથી.

મહારાજ ! મારા સૈનિકોએ પ્રેયાસ તો ધણુા ધણુા કર્યા છતાં મહેં હુસતું થાય તેવા સમાચાર સાંપડ્યાં નથી. આપણા રાજ્યની મર્યાદા ઓળંગી પર રાજ્યમાં પણ તેઓ ગુપ્ત વેશે પહેંચ્યો જયા અને ખૂણે ખાંગરે પણ ભ્રમણું કરી આવ્યા. કંચનપુરના પ્રદેશને ખૂંદી વખ્યા. દંતપુરના સ્વામી જોડે આપણને બરાબર મેળ ન હોવા છતાં ત્યાં પણ ભળતી રીતે ધૂમી આવ્યા ! વિરહની જે ધરીએ આપે જણ્ણાવી એ સમયમાં ગર્ભાવરથના આંગણે ઉભેલા રાણીમાતા આ સ્થળથી વધુ દૂર જાય એવો સંભવ જ નથી. આમ ચોતરકીની સ્થિતિનો કંચાસ કંહાડતાં હું એવા અનુમાન પર આવ્યો છું કે તેઓ કરાળ કાળનું ભક્ષ્ય બન્યા છે. એ ભયંકર કાર્ય કોઈ જંગલી વાધ કે ચિત્તા દારા ચયું છે. શિકાર કરી ધીય જાડીમાં તેઓ ભરાઈ જતાં હોવાથી શિકાર બનનાર વ્યક્તિનો કંઈજ મુદ્દો હાથમાં આવતો નથી.

આ સાંભળતાં જ રાજવીના મુખમાંથી નિભન ઉદ્ગાર સરી પડ્યા.

વહાલી પ્રિયતમા ! અરે વંશ વર્ધક કુમળી વેલ ! તારું આવું કુરેણ મોત ! અરે હૈવ ! તે આ શું કર્યું ?

સેનાપતિના શષ્ઠોથી અધિકારી વર્ગના મહેંડા ઉપર શોકની ઘેરી છાયા પથરાઈ. અશુદ્ધી ચક્ષુઓ લીની થની.

સૌને મૂક જોઈ, જાણે ડેડા વિચાર પછી મેં ઉધાડતાં હોય એમ રાજપુરોહિત રામશર્માળ ધીમા અવાજે બોલ્યા—

આશા તો અમર છે. સેનાપતિલું અનુમાન ગળે ઉત્તરે તેવું છતાં સમાચારમાં એક એવું પણ વત્તાંત મળ્યું છે કે અટવીના અમુક સરોવર પર્યાત હાથીનાં પગલાં જણ્ણાય છે. તો પછી ત્યાંજ કેમ કંઈ ચમટકાર ન થન્યો હોય ! કોઈ દેવ કે વિદ્યાધરના હાથે રાણીઓનો ઉદ્ધાર થાય એ સંભવિત ન ગણ્ણાય ? એમની આકૃતિ જોતાંજ, હરકોઈને તેમના પ્રતિ બંધુમાન ઉપને તેમ છે. પદ્માવતી નામ પ્રમાણે સૌને કમળની માઝક પ્રિય થઈ પડે તેમ છે. સરોવરનું પાણી પી ગજરાજ નજીકની જાડીમાં ચાલ્યો ગયો હોય તો ઉભયમાંથી એકનું પણ કંઈ ચિન્હ હાથ ન આવે એ બનવા જોગ છે. આ પણ અનુમાન અસ્થાને નથી. મારં જ્યોતિષ રાજવીના ભાગ્યમાં ત્રણ રાણીનો યોગ અતાવે છે. એમાં આંતરાં પણ પડે છે.

ગમગીનીભર્યા ચહેરે એ સાંભળી એકએક ચંપાપતિ એલી ઉદ્ઘાટા—ત્રણ રાણીઓ ? મારા જેવા પ્રતિશા અધ્યને ?

હા, મહારાજ ! ભાવિના રાહ નિરાળા જ હોય છે. આંતરાં પડે એટલે પ્રતિશાને આધ ન આવે. પામર માનવીથી વિધિનાં માપ કહાડી શકાતાં નથી. તેથી તો નીતિકારોને હાથ ધોધ નાંખી વદ્વાં પડ્યું છે કે—

વિધિરેવ તાનિ ઘટયતિ યાનિ પુમાન નૈવ ચિંતયતિ ।

એ વિધિએ જ વસિષ્ઠ જેવા વિદ્યાન ગુરુના રાજ્યારોહણ મૂર્ખતામાં શ્રીરામને વનવાસ મોકલ્યા અને મહોદરી જેવી સતી ધરમાં હોવા છતાં રાવણુને સીતાનું હરણ કરવાની અભિલાષા પ્રગટાવી.

મારી તો સલાહ છે કે મદ ગૂજરી ભૂલી જઈ, મહા અમાત્યની

સલાહ મુજબથી આજની અગત્ય વિચારો. કાળ પાકતાં જ સહુ સારાં વાનાં થશે. હુઃખ પાછળ સુખ કિંવા વિષેગ પણી સંયોગ અવસ્થ્ય આવશે જ.

તાં તો અનુચ્ચરે આવી ખખર આપ્યા કે યશપાળજી મુસાફરીએથી આવી ગયા છે. તેઓ મળવા માંગે છે.

જ, જ, તેમને જલ્દીથી અંહર મોકલ જોઈએ. તેઓ કંઈ શુભ ખખર આપે છે.

ભીજ તે શું ખખર લાવવાના ! કૌશામ્ભીનું કંઈક હશે.

આવો યશપાળજી, હીક સમય તમારે લેવો પડ્યો. વડિલ તો ખરલોકના પંથે પ્રયાણ કરી ગયા. તમારા માથેથી છત જતાં જવાબદારી વધી. એ સમાચાર મણ્યા હતા અને એ પણ જણ્યું હતું કે તમો ટૂંક સમયમાં કૌશામ્ભી તરફ જણ્ણે પાછા ફરશો. અહીં તો રાજવીના જદ્યમાંથી કેમે કરી પ્રિય રાણીઓનો વિરહ ભૂંસાતો નથી.

મહા અમાત્યજી ! અહીંની આ પુરિસ્થિતિ છે ત્યારે કૌશામ્ભી-માં તો જુદી જ હવાઈએ ધૂઢી રહી છે. આપણા પ્રજાવત્તસલ રાજવીના શરીરે જાતજ્ઞતના આળ ઓરાદાય છે. કોઈ કહે રાજન્ જાણીથુંજીને તપાસમાં ઢીલ રાખે છે તો કોઈ કહે જેને ભટકતું જવન જવવું હોય. તેને ચેટક તનયાની પ્રીતનું બંધન પાલવે જ નહીં. એટલે આ રીતે ધૂટકારો શોધ્યો. આવી મોં માથા વગરની વાતોમાં આપણા વચ્ચે ચાલ્યો આવતો કલહ, સંભાર ભરવામાં બળતણુંની ગરજ સારે છે. ચોક-ચૌટે એવું ઘોલનારા પણ છે કે હવે ચંપાપતિને:કોઈ દેનાર મળવાનો જ નહીં. કોઈ સૌન્દર્યવતી ને કુલિન કાન્તા હાથ ગ્રહણ કરવાની હા પાડવાની જ નહીં. દોરંગી હુનિયા ! એખું જ એના મોઢે જળણું છે. મારા શ્વશુરની લાગવગથી હું કેઠ શતાનિક રાજવી ચૂધી પહોંચી ગયો હતો અને સાચી સ્થિતિથી તેમને વાંદે કર્યા હતા.

એ જ પ્રમાણે અથથી ઈતિ વૃત્તાન્ત રાણી મૃગાવતીના કાને નાંખવામાં માર્દી પતિનિએ એની સખી જયન્તિ દ્વારા કામ લીધું હતું. આમ કરવાથી ઘરણી ગેરસમજ દૂર થઈ છે. હાલ તો પરસ્પર શાલો ખખડે એમ લાગતું નથી. બાકી રાન્યુ પ્રણાલિની ભિન્નતા અને વર્ષોનું જુનો ચાલ્યો આવતો વિરોધ, એકવાર ઉલ્લય રાન્યો વચ્ચે જખરી અથડામણુ ઉભી કર્યા વિના રહેનાર નથી જ. પશ્યાળના છેલ્કા શખ્દોને પકડી લઈ દધિવાહન ભૂપ ભૂલ્યો. ઊચી ફરતાં એલી ઉટ્યા—

અથડામણુ આને કાં ઉભી નથી થતી? કૌશામ્ભીને લડવું જ હશે તો હું કાંઈ ચૂહીએ. પહેરીને નથી બેડો. એક વાર એના સીમાડા એભરા કરી આવ્યો. હતો એ વાત શું આઠલી જલ્દીથી ભૂલાઈ ગઈ છે! સગપણુનો નાતો યાદ ન આવ્યો. હોત તો એ વેળા જ હિસાબ ચૂકતે કરી દીધો હોત !

ઐર ! હજુ કંઈ જ બગડી નથી જયું. અંતરનું દુઃખ મને અંતરમાં શમાવતાં આવડે છે. સાચને આંચ આવતી જ નથી. અહા અમાત્ય ! રાન્યને અંગે ને કંઈ કરવું ધટે તે હું કરવા કખૂલ છું. જગત એકવાર જેશે કે દધિવાહનમાં બ્રમરધૃતિ છે કે હાર્દિક પ્રેમ છે? કાયરતા છે કે સાચી વીરતા છે એ સમજવવા જવાની જરૂર નથી. માર કાર્ય જ એની સાબિતી આપશે.

સેનાપતિજ ! તમો સૈન્યમાં ભરતી કરવા માંડો. સંગ્રામ એ તો ક્ષત્રિયો માટે પવ હિન જેવો અણુય.

ઓલ, ભીજું શું બાકી રહે છે ?

રામશર્મા, એકજ વાત—રાણી આણવાની.

એ પણ અંજૂર છે. કોઈ પણા જેવી શોધી લાવજે. જમે તેમ હાથ ન મિલાવાય. નેવું પદ તેવું પાત્ર જોઈએ.

મહારાજ ! મને બોલવાની રજ હોય તો એ સંખ્યમાં મારી અનુભવેલી વાત કહું.

યશપાળ ! તમારે રજ માગવાની ન હોય. તમો મારા રહસ્ય મંત્રી છો. જે કહેવાનું હોય તે સત્ત્વર કહી નાંખો. પડોશી રાજ્યો મારા સાચા પ્રેમને નથ્યાએ અણે કે મને અર્થીલ માને એ વાત હું ધરીબર ચલાવી લેવા તૈયાર નથી.

સંમતિ મળતાં જ ધારિણીવાળો કુવાકંહાનો પ્રસંગ યશપાળ દ્વારા કમાં વણ્ણવી બતાવ્યો. અને ઉમેયું કે—

ચંપાના મહાલથને શોભાવે તેવું આ પણ એક સ્વીરત્ન છે. ચેડા મહારાજની પુત્રી જેવી અન્ય ન સંભવે, છતાં એની સમૃતિ ભૂલાવે. અને ભલભલાને પડકારે એવી આ જોગમાયા છે. ગણુનાપાત્ર નારી છે.

રામશર્મા—યશપાલજી, જરાં નામ તો ફરીથી કહો.

હરનામસિંહ હાડોરની એકની એક પુત્રી. એનું નામ ધારિણી.

રામશર્માએ આંગળાના ટેરવાં હેરહેર કરી થોડો સમય કંઈ વિચારી જોયું અને પછી બોલ્યા—રાશિ અને ચંદ્રમાના યોગ તો અતિ સરસ છે. રાજ્યવીનો ગૃહસૌસાર દીપાવે તેવો અહું છે વળી સંતાન યોગ પણ જોવાય છે. કરો, શુલ્ષુર શીધમ શુલ્ષુર શીધમ.

સારા કામમાં વિધન ધણું એ જન ઉક્તિ લક્ષ્યમાં લઈ કંદુમાં પાણી જલ્દી નાંખવું સારું.

સૌની નજર ભૂપતિ સામે વળી. તેઓ શું જવાબ આપે છે એ સાંભળવા સૌ આતુર બન્યા.

તેઓ ઓાત્યા—મારે નવું કંઈ જ ઉમેરવાતું નથી. યશપાળની પસંદગી પર મને પૂરો ભરોસો છે. એમાં વળી પુરોહિતજીની હા મળો. છે. એ અંગે જેણું કરવું જોઈએ તે મહા અમાત્યને કરવાની પૂરી ઝટ છે. હવે રહે છે કંઈ અધૂરું ?



પ્રકરણ નું રમણી તા એ જ

વડીલ : આપણે સહેજ મોડા થયા. સામે દેખાય છે એ રમણીય દેવમંદિર છે. એને કૃતું વિવિધ પ્રકારના કુલ-ઇળના વૃક્ષોથી ભરવક બનેલું, મીઠી સુવાસ અને શીળા છાયા આપતું મનોહર ઉદ્ઘાન છે. હમણાં આપણી નજર આગળથી ને ગાડી પસાર થઈ એમાં એટેલ દંપતીએજ અમારા રાજીવીના આ બીજ લગ્નમાં મુખ્ય ભાગ ભજવ્યો છે.

એ સાંભળતાં જ વાત કરતી ત્રિપુરીમાં જેની જિચાઈ અધિક હતી અને જેનો પહેરવેશ એકાદા રાક્ષણના નાયક સરખો હતો એ પોતાના સાથીદારને ઉદેશીને બોલી ઉછ્યો—

કંડરીક ! આપણું ફેરો ફેઅટ નહીં જય. કૌશામ્ભીમાં ને સમાચાર આપણું કણે અથબા છે એ સાવ નિર્મણ નથી જ.

હં, માય ! તારે આ કણુંસિંહને-ભાણુઅને માત્ર ભળવા અહીં ચંપામાં-નથી પથામી ? એ પાછળ બીજે પણ કંદ ગુપ્ત હેતુ લઈને આવ્યા લાગે છો ?

કંડરીક-ભાઈ, સ્વાર્થ વિના મુસાફરીના કષ્ટ વેકવાનું અને શત્રુ જણાતા રાજ્યવીના મુલકમાં પગલાં ભાંડવાનું લોખમ ડોણું એડે ?

એમાં પણ તારા મામા તો પૂરા વિચાર વિના ડગલું ભરેજ નહિ, સાથીદારની વાત ઉચ્ચકી લેતા નાયકે ચલાવ્યું —

કરણ ! તારાથી કંધ વાત દ્રુપાવવાનું જરા પણ પ્રયોગન છેજ નહિ. અવકાશે એ અધું હું જણાવીશ. ગાડીમાં હમણું જે દંપતી ગયા તેની વાત પણ બાળું એ રાખ. કૌશામ્યીમાં એમના લગ્ન થયા છે અને થોડા સમય પૂર્વે એ મહાશય સાસરીમાં આવી પણ ગયા છે. ચહેરે જોતાં જ મને પરખ આવી ગઈ છે. મૂળ વાત જે તે એ છે કે તારા રાણીજને આવતાં ડેટલેા વિલંબ થશે ?

એ સીધા મંદિરમાં જય છે કે ઉદ્ઘાનમાં ફરવાનું કાર્ય પણ કરે છે ? અહીં ડેટલેા વખત આજે છે ? સાથમાં રાજ્યવી હોય છે કે એકલા આવે છે ?

માસુ ! મને લાગે છે કે તમો ડોધ વિચારમાં તદ્દાકાર બન્યા જણાયો છો. તમે ને પ્રશ્ન પરંપરા જન્માવી એની જરૂર જ ક્યાં છે ? આવતા વેંત મેં કંદી તો દીધું કે આપણે જરા મોડા પડ્યા રાજ-રાણી અંગ રક્ષકની દુકડી સહિત ઉદ્ઘાનમાં પહેંચી પણ ગયા. જે ગાડી આપણે જોઈ એ રાજ્યવીના રહસ્ય મંત્રો અને અંગત મિત્ર જેવા યશપાળની હતી સંરક્ષક દુકડીની પાછળ એ રહે છે. મંત્રીના પતિનિ, તમારા કથન મુજબ કૌશામ્યીના શેહની દીકરી, નરા રાણીજના ખાસ સહિત છે. લઘુતો યોગ મેળવી દેવામાં ઉલસ્યે જયરો ભાગ ભજવ્યો છે. એમના સંગીત પ્રયત્ન ન હોત તો અમારા રાજ્યનું લઘુ કરતે જ નહોં ને !

ભાષ્યા ! તારી વાત સંભળતાં ભારી સંકળનોં એંકોડા મળીબા લાગ્યા છે. મને એ કહે કે રાણી નજરે હવે ક્યારે પડરો !

લગભગ ત્રણું કલાક તો થશે જ. દર્શન, પૂજન-સ્તવન, ભક્તિ, તેમનું કોઈ સંત ઉદ્ઘાનમાં આવ્યા હશે ને। તેમના ઉપદેશનું શ્રવણું કરશે. એ નહીં હોય તો ઉદ્ઘાનમાં થોડું કુરશે પણ ખરા જ. ચંપાપતિને ખાસ ચિંતા જેવું તો છે જ નહીં અને એમાં પણ આ નવા રાણીનાં સમાગમ પછી તો એવા આનંદ અને ઉત્સાહમાં મહાલે છે કે જ્ઞાને નવા અવતારે આવ્યા.

ઉતાવળ હોય તો મંદિરમાં જલ્દી જઈ પહોંચીએ, તો એ દર્શન કરતાં આપણી નજરે જરૂર ચઢી જશે.

ભાઈ, એમાં મળ ન આવે. બરાબર મુખ ન જોવાય. અન્યની દુષ્પિત્તમાં આપણે અવિવેકી અણુાઈએ.

શીકર નહીં, તથું કલાક ગાળવાનો રસ્તો કહાડીશું, ને હેતુએ આવ્યો છું તે સિદ્ધ કર્યા વિના પાછા નથી કરવું. તારા ધ્યાનમાં કોઈ નજીકનું સ્થાન હોય તો બતાવ. ત્યાં જઈ નિરાંતે થોડી વાતો કરીશું એટલે સમય પસાર થઈ જશે.

મામા ! આ ઉદ્ઘાનના મુખ્ય દરવાજાની બરાબર સામે ને આંખા વૌડીશું છે એ અનુકૂળ સ્થાન છે. અત્યારે અહીં ધમાલ રહેતી હોવાથી લાં કોઈ ચલિયું પણ કરવાનું નહિ. વળી આપણી નજર પણ સ્ત્રામીજ રહેશે.

હા, હા, એ ડિક છે ચાલો એ તરફ.

આંખાવાડીયામાં પગ મૂકતાં જ નાયક બોલી ઉઠ્યો.

અહા ! અહીં તો અપૂર્વ શાંતિ પ્રસરેદી છે, નિરવતા પણ પ્રશંસનીય. કડંરીક ! ચંપાનગરી રિદ્ધિ સિદ્ધિમાં અને કણ્ણુપતામાં કોશાખીને ટપી જાય તેવી છે. અંગ દેશ સાચે જ સમૃદ્ધ છે.

માસુ ! મારી જ-મભોમના વર્ણનનું કરવાનું કામ કોઈ કવિ, કે સેખકના શીરે સોંપી, મૂળ વાત ઉપર આવો. એકાંત છે એ સાચું

પણ, “ લીંતને પણ કાન હોય છે ” એ જન ઉકિત સાવ વીસારી ન દેતા. ખ્રી પૂરતું બોલવામાં જ લાલ છે. પોતાની કૃજ અહી કરવામાં જ સૈનિક-જીવનની રોભા છે. એમાં પણ તમો રહ્યા નાયક થાને સરદાર. તમારો ધર્મ શણ્ઠો તોલીને બોલવાનો.

કરણ ! તારી વાત સો એ સો ટકા સાચી છે. કોઈ કોઈવાર હું ઉતાવળમાં એ વીસરી જડી છું. અમારા આગમનનું કારણ હું દૂંકમાં જણ્ણાવું —

દધિવાહન અને શતાનિક સાહુ થાય એ તો ઉધાડી વાત છે. જ્યારથી પદ્ધાવતી ગુમ થયાના સમાચાર કૌશામ્ભીમાં આવ્યા, ત્યારથી એની બહેન મૃગાવતીના મનમાં કોઈ જુદી જ શાંકાએ ધર કર્યું છે. ઉલ્લય રાજ્ય વર્ચ્યે મેળ તો નથી જ. એમાં આ બનાવે બળતામાં ધી હોમવાની જરૂર સારી છે. રાજ-રાણી પાછળ પ્રજાએ પણ મન ગમતાં અનુમાનો એ પાછળ વહેતાં કર્યાં છે.

મામા ! એ વાત તો જૂની થઈ ગઈ. વળી સાચી હકીકિત તમારા રાણીને કાને નાંખવા સારું તો અમારા પેલા યશપાળ ત્યાં આવી પણ ગયા. તમો કૌશામ્ભી વાળા પણ અજ્ય છે. અન્ય કંઈ કામ નહીં જડતું હોય, તે વિના આવી પારકી પંચાતમાં સમય જાળો ખરા ?

કરણ ! ઉતાવળો ન થા. તમારા મંત્રી આવી ગયા એટલે તો અથડામણ થવાના દિન દૂર ડેલાયાં.

એક પતિના હિમાયતી અને વધુ રાણીઓના અંતઃપુર રાખનારા અન્ય રાજવીઓની ટીકા કરનાર, તમારા ભૂપ દધિવાહન એકએક કેમ માણીમાં એસી જયા ! થા સારું જલ્દીથી પરણી બેકા ? શું શોધખોળનો અંત આવી બયો ? પદ્ધાવતીનો પત્તો નહીં જ મળે એવી પ્રતિતી થઈ ગઈ ? પ્રજાના માનસમાં આ નિમિત્તે શાંકા કુશંકાએ જરૂરે એ સુરૂ છે.

વળી અંગ દેશના સ્વામીને કન્યા આપનારા રજવાડાં ક્યાં ઓછાં હતાં કે એકાદા-સામાન્ય કક્ષાના—મરાસદારની દીકરી પસંદ કરી ? લઘુકાર્ય પણ એટલું જલ્દીથી આટોપાયું કે પડોશી રાજ્યમાં એ પછી લગભગ છ મહિને એની જાણ થઈ.

તું જ કહે છે કે નવા રાણીએ રાજ્યીના જીવનમાં જરૂરો પદ્દો આસ્થો છે. લોકો એવું સાંભળોને ઉદ્દ્દા વધારે શાંકાના વમળમાં અથડાય છે. એથી તો પદ્દા પાછળનો શોક એક ઝારસર્પ બની જાય છે.

કહે છે કે રાણીમાં પણ ક્ષાત્રવૃત્તિ એટલી બધી સરોજ છે કે એની સામે ભલ ભલા સરદારો પણ ખૂલ ઉઠે. રાજ્યના પ્રત્યેક કાર્યમાં રાણીની સલાહના એંધાણ હોય છે જ. આ સર્વ સાચું છે કે કેમ ? એ જાણવા હું આવ્યો હું.

મામા ! એ બધું સાચું છે. એમાં મીનમેખ નથી જ. પણ એટલા કારણે તમો આ સાહસ ન કરો. અમારે ત્યાં લોકવાયકા પર જાળું વજન મૂકવામાં નથી આવતું. તમારા આગમન પાછળ અને રાણી સંબંધી આટલી જોંજ કરી રહ્યા છો તેથી, જરૂર કંઈ ગુપ્ત હેતુ તો છે જ.

અમારા નવા રાણી ભલે સામાન્ય ભાયાતના ધરમાં જન્મથા હોય, ભલે એમની પાછળ વંશ પરંપરાની કુલીનતાના વાધા ન સંજયા હોય, છ્ટાં તે એક રમણી રતન છે. સૌન્દર્ય અને ઇપની નજરે એ કોઈ પણ નારીને ટક્કર મારે તેમ તો છે જ; પણ ગુણો અને તેમાં પણ જ્ઞાહળતી થરવીરતા અને ઉભરાઈ જતી ક્ષાત્રવૃત્તિ જેતાં, હર કોઈના ખન્યવાદ તેમો તરફ સહજ વર્ષો જાય છે.

તમારી કૌશાળીના નગરની પુત્રી કહો કે અમારા નૃપતના રહસ્ય અંત્રોની પલિન કહો, અમર રાણીજીના જામની પુત્રવધુ કહો; તેણું જેતાની અજૂએ સામે રાણી ખારિણીમાં ને વીરતા ભરેલી છે તેનો

પરયો જેયો છે. ઓજરવી વાણીને ધોખ વહેતો નિહાલ્યો છે. ભાયાત હરનામસિંહની બહાદુરી આપણા સૈનિક સમૃદ્ધયમાં અનણી નથી. એના સરખો એક પતિનિત્રત ધારી અને પ્રમાણિક ગરાસદાર ભારા જણુવા મુજબ આપણા પ્રદેશમાં અન્ય નથી. એવા ચારિનું સંપન્ન ધરમાં જેનો ઉછેર થયો હોય એવી લલના, રમણીરતન તરિકેની ઘ્યાતિને વરે એમાં નવાધ પણ શી?

મરદ કરતાં ખી જાતિમાં રનેહના અંકોડા જઈ સંધાય છે, અને ગૃહ્ણ પામતી રેશમની ગાંધની ઉપમાને વરે છે. સખીપણુના નાતાથી ભાયાતપુત્રી ધારણી, અહીં ચંપામાં મંત્રીપતિને મળવા આવેલ. એક વેળા ઉલય સહિયરો ઉદ્ઘાનમાં ને પ્રાસાદ આપણે જેયો ત્યાં દર્શને આવેલ. અચાનક પધારેલ રાજ્યની દધિવાહનની દસ્તિયે એ રમણી રતન ચઢ્યું. ચાર નેત્રો સામ સામે મળતાં જ હટ્યના તાર ઝણ ઝણી રહ્યા.

આ પ્રાસાદ પાછળ તો લાંખી ચૈતિહાસિક શૃંખલા! રચાયેલી છે. એની ચમત્કૃતિના ઘ્યાન પણ કંઈ કંઈ જનતાના અંતરમાં નોંધાયેલી પડ્યા છે. એમાં વધ્યોની સાક્ષી પણ સાંપડે છે. વારાણસી નગરીના સ્વામી અશ્વસેનના પુત્ર પાર્થકુમારે કમક જેગીની અળતી ધૂણીમાંથી લાકડું એંચી એમાંથી ઝળતા સર્વને બચાવી, સાચો ધર્મ જીવદ્યામાં છે એ વાતનો વિજય વાવટો કરકાવ્યો અને પાછળથી તેઓ સંસાર ત્યજ દર્ઢ સાધુ બન્યા. એકાકી વિચરતા એ સંત ઉપર ઉપસર્ગોની ઝડી વરસી. એ સર્વ સમતાભાવે સહન કરી તેઓ સર્વરૂ બન્યા. આમ જનસમૂહમાં પુરુષાદાની પાર્થનાથ તરિકે ગ્રસિદ્ધ થયા. એમના પગલાં અહીં થયેલા. એમના ઉપરેશથી જનતાનો મોટો ભાગ અરિહંત ધર્મનો ઉપાસક થયો છે. એમના આગમન ખાદ જ્ઞા ઉદ્ઘાન તથા એમાં આવેલ પ્રાસાદ, તીર્થધામ ઇપ બનેલ છે. ચાલુ અવસર્પણી કાળમાં થયેલ એ ત્રૈવીરભા તીર્થકર છે. ખૂર્ચાખી

ચોવીશ તેમના સરખા જ જ્ઞાનવાન અને પ્રભાવશાળી સર્વજી થયા છે. એમાં પ્રથમનો અંક પ્રાપ્ત કરતાર શ્રી આદ્વિનાથ-યુગલિક કાળની સમાધિ વેળા થયેલ. એમણે જ જનતાને સંસારમાં ઉપયોગી સર્વ વ્યવહારનું ભાન કરાયું. એમનું જન્મ સ્થાન અયોધ્યા નગરીમાં. વર્ષોના અસંખ્યાતા થોડડાએ એ વાતને વીતી ગયા. એ પછી જે આરમા તીર્થુંકર તરિકે ચોળખાય છે એ રાજવી વસુપુણ્યના તંદના શ્રી વાસુપુણ્ય નામે આ નગરીમાં જ થયા. જન્મયા-મોટા થયા. રાજ્ય ભોગયું. પાછળથી દીક્ષા લીધી. અને કૈવલ્ય મેળવ્યું. આયુધ પૂર્ખ થતાં મુક્તિ પણ પામ્યા. એ સર્વ અહીં જ બનેલું. એ વાતની સ્મૃતિમાં આ પ્રાસાદની સ્થાપના. દરેક તીર્થુંકર દેશ કાળ પ્રતિ નજર રાખી પોતાની ઉપહેશ પદ્ધતિ નક્કી કરે છે; છતાં સર્વજી હોવાથી દરેકના કહેવામાં સરખાઈ જ હોય છે. લક્ષ્ય મિંહુ એક જ. કષાયો ઉપર વિજય મેળવો, કર્મનો. જડભૂળથી નાશ કરો. અને આત્માના મૂળ ગુણો-જ્ઞાન, દર્શન અને ચારિત્ર નિર્મળ અનાવો. આપણે ચોવીશ અવતાર માનીએ છીએ તેમ જૈતો. ચોવીશ તીર્થુંકર માને છે. જો કે માન્યતાને અંક સરખો છતાં એમાં તરતમતાએ તો ધરણી ધરણી છે. હજુ ચોવીશમા તીર્થુંકર થવાના આકી છે.

અરે હું પણ વાતના વર્ણનમાં કયાં પહોંચી ગયો? કહેવાનો મુહી તો એ હતો કે શ્રી વાસુપુણ્ય તીર્થપતિ થયાને વર્ષોનાં વહાણાં વાયા છતાં, સ્મૃતિ ચિન્હ સરખો પ્રાસાદ તો હજુ ઉભો છે. કાળ ચક્કના ધસારામાં અને પરિવર્તનીમાં આ નગર સાથે એ પણ પસાર થયો. છે. દધિવાહન ભૂપ વારસમાં મળેલી લક્ષ્ણ એ પ્રતિ દાખતો; પણ પદ્માવતિને પરણી આવ્યા પછી તો એમાં સારા પ્રમાણમાં ઉમેરો થયો. છે. ચેટકરાજની તનયાના સંસ્કારે એ ઉપર સજજડ છાપ મારી છે. તેમનું અવન ધર્માત્મા તરીકે વિશેષ ઉજ્વળ બન્યું છે. રાજવીએ ગ્રન પાદનમાં અને જન કલ્યાણમાં જે ઉત્સુકતા દાખવી છે અને એ

દારા પ્રણનો ગ્રેમ સંપાદન કર્યો છે એમાં નિમિત્ત ઇથી સંસ્કારી પદ્માવતીનો યોગ છે. ઉલ્લય રોજ દર્શાને આવતા. એ નિયમ રાણીના વિરહકાળે—ગંભીર ગમગીનીમાં પણ અફ્ર રહ્યો; એ નિમિત્તે એક સંધ્યાએ પૂર્વે કહ્યું તેમ હરનામસિંહની પુત્રી નજરે ચઠી. પ્રાસાદમાં મંજુલ સ્વરે ગવાતાં ગીતે રાજ્યાતું મન આકર્ષિયું. સામાન્ય વાર્તાલાપથી ઓળખાણ થયું. અવારનવારના પરિચય પછી ઉલ્લયના દ્વિતી મહ્યા અને એ ઉપર આખરે લગ્ન અંથીતી મહોર મરાઈ. અમારા નવા રાણીનો આ વૃત્તાન્ત.

હવે, તમારે ગુપ્ત હેતુ કહી નાંઝો કેમકે સમય થવા આવ્યો છે.

કરણુ ! કહેવાતું બધું તેં કહી નાંખ્યું. તમારા રાણી એ માર્દ ગ્રેમપાત્ર છે. કુવા કાંદાનો બનાવ કિંવા યશપાળની પતિનો. પરચો એના મુખ્ય પાત્ર અમો—હું અને મારો આં સાથીદાર કંડરીક. વાતના તાણા વાણા ધણા તો મળતા આવી ગયા છે. એ રમણીને નજરે જોયા વિના પાકી ખાતરી ન અપાય.

કંડરીક—સરદાર ! માનો યા ન માનો પણ રમણી તો એ જ જણાય છે. એનું નામ ધારિણી આપણે સાંભળેલું. માર્દ મન સાક્ષી પૂરે છે કે તમારી આશા ધૂળમાં મળો છે. એલ ખલાસ થયો છે.

કરણુસિંહ—મામા ! એની સાથે શું તમારે પૂર્વે કંઈ પરિચય હતો ? ગુપ્તપણે સ્નેહ તંતુ સંધાયા હતા ?

ના, ના, એવું તો કંઈ જ નહોતું. પણ કુવાકાંદાના બનાવ પછી મેં એનો ઇવાખ જોઈ મનમાં ગાંઠ વાળેલી કે ડોઢ બી હિસાબે એને પરણી લાવી, જર્વ ઉતારવો. આ નાયકે ભલભલાના પાણી ઉતારી નાંખ્યા છે તે એકાદ નારીના ધમંડને નહીં સાંખી શકે ?

મામાશ્રી ! તક જઈ એ તો હવે પાછી ન આવે. રાધના પહાડ રાતે વઢી અથા. હવે એ પરરમણી અને તેમાં પણ અંગદેશના નહારાણી !

ધમંડ ઉતારવાની વાતથી હાથ ખંખેરી વાળો. જેઠે એ પણ કંદું કે તમે મરદ જાતિના ગૌરવનો. ગજ લાંબાં રાખ્યો છે. કારણ વિના એ રમણીએ ધમંડ દાખ્યો તો નહીં હોય ને !

અરે કરણ ! તું પણ પૂર્ણ જાણ્યા વિના શું હાંક્યે રાખે છે ? આ કંડરીકના પાણી ભાંગવા ઇપ સામાન્ય પ્રશ્ન પરથી તેણીએ યુવાનીના મદમાં છકી જઈ રજનું ગજ કરી મેલ્યું. એ તો અમારે કૌશામ્ભી પહેંચવામાં વિલંબ થતો હતો, નહીં તો એ વેળા જ એની ઓખરી બંધ કરી, હાથ અતાવી દીધો હોત. કેમ કંડરીક ! મારી વાત ખરી છે ને ! ‘શેડ કહે સાગરનું પાણી મીઠું છે તો હાજ હા’ જેવા સાથીદારે નાયકની વાતમાં ડોરા પાને મહું માર્યું.

નાયકનો ભાણેજ પણ પાડો બેલાડી હતો. એ ઓલી ઉદ્ઘ્યો—

મામાજી ! એવા ગર્વમાં કંઈ જ દમનથી. અહંકાર તો રાતણ જેવા નિખંડાધિપતિનો નથી રહ્યો. કૃત્રિમ રમણીના તેજ જુદા જ હોય છે. તેણીની પવિત્રતા પર કંઈ પડકાર થયા વિના એ ભાંયે જ છંછેડાય છે; અને એકવાર વિક્રી એટલે ડસીલી નાગણ્ય જ જોઈ લ્યો.

નાયક-ભાઈ ! ત્હારાથી તો થાક્યા. દ્વીપ, દ્વીપ અને દ્વીપ. જ્યારથી તમારા રાજવી ગણરાજ ચેટક મહારાજના તંત્રની લતે ચઢ્યા છે જ્યારથી તમારા લોકોના વિચાર જ કોઈ જુદી રીતે વહે છે. મરદ જાતિના માન-અપમાનની તમને કંઈ ખેવના જ નથી. ‘ઓની શુદ્ધિ પગની પાનીએ’ જેવા સનાતન વાક્ય પર નિશાસ નથી. પુરુષ તે પુરુષ અને નારી તો એના પગની મોજડી જેવી ! ધર્મમાં જ્યાં પુરુષનું પ્રધાનત્વ છે ત્યાં વહેવારમાંએ હોય જ. એમાં નવાઈ જેવું શું છે ?

‘પ્રધાનત્વ’ ના નામે થેટાં ન ચરાવો. એ પાછળનું ૨૬૨૫

સમજે, અર્થનો અનર્થ ન કરો. સંસાર રથના, ક્રી પુરુષ રૂપ એ ચકો; ઉલયના સહદારથી જ રથની ગતિ અરખલિત રીતે ચાલુ રહે. એકમાં જરાપણું બગાડો થતાં જ રથ થંલી જાય. એમાંના એક પણ ચકની અવગણુના ન નથી શકે. ધર બહારના વ્યવહારમાં પુરુષ કરતો કારવતો લેખાય જ્યારે ધરતી આંતરિક વ્યવસ્થા ક્રીને આવિન છે. ક્રી કાંઈ દાસી કે ગુલામડી નથી અને નથી વારે ધડીયે સ્વચ્છાપણે બદલવાનું જૂતું. ભાવિ વારસની એ છે જનેતા—એ છે સહયરી. આવી સરલ ને સાદી વાત જે ન સમજે તેને કહેવું શું?

જવા હે એ મતદેર. માન્યતાએ કંઈ બદલી નાંખવી સહેલ નથી. આવા કારણોથી અમારી કૌશાખીને તમારી ચંપાના રાહ ન્યારા છે.

જુઓ, સમય થવા આવ્યો છે. માંડો ચાલવા. રાણીજને નજરે જોવા છે તો જોઈ લ્યો. એ સાથે મારી લાલ બતી સમી ચેતવણી પણ સાંભળી રાખો કે—

‘સતીની છેડમાં પડરો નહીં. પ્રીતના પલ્લે બંધાયેલી એ રમણી હવે તો પરનારી છે માટે સન્માનને પાત્ર છે. એના પ્રત્યેની નાની સરખી પણ કુદાણી સત્યાનાશ વાળરો. મોહનો અંશ રહ્યો હોય તો પણ હવે એને તિલાંજલી દેણે.’ નાયકે ફેરવી તોળતાં હંચ્યાર્યું કે—

ગામમાં પેસવાના ફાંઝાં, ત્યાં પટેલને ધેર ઉના પાણી જેવી આપણી આ વાતો. રમણી એજ છે કે બીજી એ તો હજુ નજરે પડે ત્યારે જ સમજય ને!

કરણું! માંહિર તો આવ્યું. કયા દરવાજેથી પ્રવેશવાનું છે? કયાં જિભા રહેવાતું છે? સ્થાન એવું શોધને કે કોઈને વહેમ ન આવે.

મામા! એ હિકર રહેલા. મારી પાછળ ચાલ્યા આવે. સામેના લતા મંડપમાં ઉલયાથી બરાબર મુખ દર્શનનો લાભ મળશે. જુઓ, પેલી ઘાણું અવાજ સંભળાય છે.. હમણા રાણીજને છેલ્લા દિવસો જાય છે-

એટલે પ્રભુ ભક્તિમાંથી પરવાર્યાં આદ તેઓ પોતાના હાથે અરીએને અન્ન તથા વણનું દાન હે છે. એ કેમ શરૂ થયા પછી ચંપામાં ફાઈ પણ માનવીને ભૂખ્યા પેટે સુવાવારો આવતો નથી. અરીબ અને રાંક જનતા તે ધારિણી રાણીને અન્નપૂર્ણાનો અવતાર માને છે. એમના પ્રત્યે અહુમાન દાખવવાના આ અવાજ સંભળાઈ રહ્યા છે.

ત્યાં તો ભૂપ દ્વિવાહન અને દ્રુટા હાથે દાન દેતી ધારિણી લતા-કુંજ પાસે થઈ પસાર થયા. તેમની પાછળ યશપાળ અને જંગાતું સુગલ હતું. પછી સંરક્ષક દળની કુકડી આવી રહી હતી.

નાયક તો એકાશ દાખિથી જોઈ જ રહ્યો. ધારિણીનો ચહેરો અરો-ભર ધ્યાન પૂર્વક જોઈ લીધો. સગર્ભાવરથા હોવાથી દેહયાણની સુંદરતા અને અંગોપાંગની પ્રકૃત્યાતા અતિસિય ખીલી ઉદ્દી હતી. મુખારવિંદ પર ગુલાબી છવાઈ હતી અને આણું રિમત રેખાતું હતું.

એ સૌના પસાર થઈ જયા પછી આ ત્રિપુરી ઉલાનમાં ચક્કર લગાની વરના પંથે પડી. કયાં સુધી તો સૌ મૌનપણે ચાલ્યા. આખરે પોતાનું અનુમાન પોઢું તો નથી એ ચકાસી જોવા નાયકે કંદીકને ઉદેશી પ્રશ્ન કર્યો—

‘કેમ ભાઈ ! તું શું ધારે છે ?

સરદાર-ધારવાનું છે જ કયાં ? જો કે કુવાકાંહાના દીદારમાં આજે તો આભ જમીનતું અંતર પડ્યું છે. સ્વર્ગની અપ્સરા પણ શરમાઈ જાય એવું સૌન્દર્ય અડકાઈ જયું છે. ચહેરો કંઈ દાંક્યો રહે !

ખડું કહ્યું. રમણી તો એજ. ‘ડ્રિપ દ્રૂપે નહીં ભખૂત લભાયો.’



પ્રકરણ ८ મુ

આગિકા વસ્તુમતી

ચુંપાપુરીનો આ ભાગ સામાન્ય રીતે આધી વસ્તીવાળો હતો. નગરીના દરવાજને મુહૂરી આગળ વધતાં છૂટાછવાયાં ઝુંપડાં અને એ પછી તરત જ વિશાળ ઉઘાન આવ્યું હતું. વચ્ચમાં ભૂપ દખિવાહનનો શ્રીમનિત્રાસ ત્રણુ મજલાથી શોભતો ખડો હતો. વિવિધ વૃક્ષોથી ભરપૂર અને પરિમિતના પમરાઠથી સાંદ્રાં સુવાસિત બનેલ આ સ્થળ સાચે જ શાંતિદાયક હતું. ભર ઉનાળાના તાતાભર જેવા લક્ષ્મરાશિના ઉક્ખાટની અહો કંઈ જ અસર નહેંતી. ધાણું ખડું ઉનાળાના દિવસોમાં રાજવી પોતાના પરિવાર સહિત અહો જ રહેતા.

એ સામે નજર પડતાં જ ઝડ્ભામાં એ રમણીઓ પરસપર વાર્તાલાપ કરી રહેલી દાખિ ગોચર થાય છે. પ્રાસાદની ખુલ્લી બારીઓ મારફત નજર હોડાવતાં સહજ જણ્ણાય છે કે કે ડાઈ પુરુષ વર્ગ હાજર નથી. લેખકને રાજમહાલયના પહેરેગીરો પણ રોકી શકતા ન હોવાથી સીધા ઝડ્ભામાં પહેંચી જઈ, થતી વાતમાં મન પરોવવું વ્યાજપી કાગે છે કે જેથી વાર્તા પ્રવાહમાં આગળ વધી શકાય.

એક વાતની ચોખવટ જરૂરી છે. જત પ્રકરણુમાં જેયેલ રાણી ધારિણી અને સખી જાંગા અહીં એસી વાત કરી રહેલાં પ્રત્યક્ષ થાય છે છતાં ઉભયની સ્થિતિમાં ધર્શા ફેર છે. છેલ્લા પ્રસંગને તો લગ્ભગ ખારેક વર્ષનાં વણાણું વાયાં છે. દરમિયાન વિશ્વનું કાળ ચક તો અરખલિતપણે વહેતું રહ્યું છે. અરતોધ્યના સપાટામાં ધર્ણી ધર્ણી આસમાની-સુલતાની નોંધાઈ ગઈ છે. એના વધુ ઊડાણુમાં ન જઈએ તો પણ ખુલ્પ પૂરતી વાતો ઉપર નજર નાંખી જવી પડે જ.

રાણીપદને પામેલી ધારિણીએ દ્વિવાહન રાજવીના શુવનમાં કોઈ અનેઝં જેમ ઉભરાવી દીધું છે. પદ્માવતી ગુમાનતાં જે નિરાશા પ્રગટેલી એનું નામ નિશાન પણ રહેવા નથી દીધું. ક્ષાત્ર તેજે એવા તો માડાં પાણી પાયાં છે કે આસપાસના પ્રદેશમાં એની હાક વાગી રહી છે. કૌશામ્ભીપતિના વારે ક્વારે થયેલા ચાર-પાંચ દુમલા એણે એવી રીતે પાછા ડેલી દીધા કે ત્યાર પણી શતાનિક રાજ તો ચૂપ જ એસી ગયો છે. છેલ્લા પીછામાં તો ડેડ કૌશામ્ભીની ભાગેણે ચંપાપતિ પહોંચ્યો હતો. ચેટકરાજના પરિચય પણી નવી ધરતી મેળવવાનો લોભ ન હોવાના કારણે જ, વળી સાઢુપણાના નાતાથી જ, એ છાપો ભાર્યાં વિના સખત હાર આપો પાછો ઇર્યો હતો. મગધરાજ ભંભાસારની માઝક એણે રાજ્યવૃદ્ધિનો લોભ હોત તો એના હાથમાં એ વેળા કૌશામ્ભી આવેલું જ હતું. આમ છતાં પોતાના રાજ્યમાં કોઈની પણ દાદાગીરી એ ચ્યાની લેતો નહીં. કોઈ પણ દાદા ભાયાતે માથું છચ્યક્યાનું એ સાંભળતો કે તરત જ જતે ત્યાં દોડી જતો. સમજૂતીથી માને તો દીક, નહીં તો સ્વઅાહુના પરાક્રમનો પરચ્ચો ખતાવતો. એકવાર સપાટામાં આવી ગયા પણી કોઈની પણ ઊંચી મૂંડી કરવાની હિંમત રહેતી નહીં. સર્વ પ્રકારના દુમલામાં-કરવા પડતાં ચુદ્ધમાં-એના પાસા પોખાર પડતા હતા એટલે એને ‘છતશર્નુ’ નું ઉપનામ મળ્યું હતું.

આ સર્વમાં એ ધારિણીના પગલાને નિભિત્તભૂત લેખતો. પદ્ધાવતીનો વિરહ ગર્ભવતી હતી ત્યારે જ થયેલો અને પછીના બનાવ અંગે કંઈ જ માહિતી સાંપડેલી નહીં. એટલે ધારિણીએ બાળિકાને જન્મ આપ્યો ત્યારે એના હૃદયમાં તો રાન્યનો વારસદાર ચુવરાજ ન જન્મ્યો હોય એટલો બધો હર્ષ ઉપન્યાસો હતો. કુંવરીનો જન્મ પ્રસંગ ધણી ધામધુમપૂર્વક સારાયે અંગ દેશમાં ઉજવાયો હતો. અગ્રીચાર દિન સુધી પ્રજનને જોઈતી પ્રત્યેક વરતુ વિના મૂલ્યે મળતી હતી. એના દામ રાજભંડારમાંથી ચૂકવવામાં આવતાં હતાં અને જન્મભરતના ડેઢીએને પણ મુક્તિ આપવામાં આવી હતી. જન્મભૂર્વેણી રાન્યની લક્ષ્મી-સાંપત્તિ-વૃદ્ધિ પામવા માંડેલી હોવાથી કુંવરીનું નામ ‘વસુમતી’ રાખવામાં આવ્યું.

ગુણું સંપન્ન બાળા, વયના વધવા સાથે આજે તો તારુણ્યનાં બાગને દરવાજે આવી લાગી હતી. સૌનંદ્ય^૧ અને નિડરતા તો એની માતા તરફથી વારસામાં મણ્યાં હતાં. એની ઉમર જોતાં જે સમજણું અને જ્ઞાન એનામાં જણાતાં એ જરૂર વધારે ગણ્યાય. પૂર્વ ભવના ક્ષયોપશમથી આમ બનવું શક્ય છે. સરખી વયની બાળાએ સાથેની રમતમાં ધણ્યોભરો કાળ નિર્ગમન એ કરતી હોવા છતાં આવડત-અભ્યાસમાં એ સૌના મોખરે હતી. માતાપિતાના સંસ્કારની સુદૃઢ છાપ એનામાં ઉતરી હતી. આ વયથી જ એ ધાર્મિક બાયતમાં શક્ષા ધરાવતી, શક્તિ અનુસાર વ્રત-નિયમ પણ પાળતી, અને ઓછું એલિવાની ટેવવાળી છતાં જ્યારે કોઈપણ વિષય પર બોલતી ત્યારે એની વાણીમાં કુલ ગરતાં હોય એવી રીતે શખ્દો વહી જતાં અને સાંભળનારનાં હૃદય સોંસરા ઉત્તરતાં. ટૂકમાં કહીયે તો ચંપાના મહાલયને આ બાળાએ ઠનગનતો અન્યાંવી દીધો હતો. બાળકીડાની વિવિધ રમતોથી એ સભર લાગતો. અંગદેશની અસ્મિતાનો સૂર્ય અત્યારે મધ્યાહ્ન તપતો હતો. પ્રજની સુખાકારી હરકોઈ પડોરી રાન્યને ધર્ષો ઉપનલવતી.

હાર્યો જુગારી અમણું રમે એ જનવાયકા પ્રમાણે ઉપરા ઉપરી હાર પામવા છતાં શતાનિકને અદલો લેવાની વૃત્તિ ઘર કરી રહી હતી. સીધી રીતે ન ફાવવાથી એ ડેઢ ફાવપેચ અજમાવવાના વિચાર કરતો. ચંપામાં બનતા બનાવેની એ પોતાના વિશ્વાસુ ચર મારકણ તપાસુ રાખતો. આ કાર્યમાં પૂર્વે જોઈ ગયા તે નાયકનો સાથ ખાસ હતો. ધણી ભરી બાખતો રાજ આ નાયક સાથે જ ચર્ચતા—કેટલીક વાતો તો અમાત્યથી પણ ખાનગી રહેતી. રાજવીનો પૂર્ણ વિશ્વાસ નાયકે પોતાની ચાલાકીથી મેળવ્યો હતો. ધારિણી હાથમાંથી ગઠ એ ચોક્કસ થયા પછી એને પોતાની કરવાની આશા, નિરાશામાં ફેરવાઈ ગઠ હતી. ઘમંડ ઉતારવાની વાત સરી ગઠ હતી. છતાં દૂઅતો આદમી તણખલાને પણ બચવા સાડ પકડે એમ એણે ધારિણીનું હરણુ કરવાનો મનસુષ્પો રાખ્યો હતો. એટલા સાડ તો વારંવાર શતાનિકને અદલો દેવા ઉસ્કેરતો. એક પથરે એ પદ્ધી મારવાની એની ધારણું હતી.

એનું અંતર જોરથી પોકારતું કે આ મનોરથ બર આવવાનો સંભવ નથી, ફેમકે ક્ષત્રિય રમણી એક વાર જેને છદ્ય સોંપે છે તેને જીવનભર વિદ્ધાદર રહે છે; અને એ સાડ પ્રાણુ કુરખાન કરવા સુંધીના કષ્ટો સહન કરે છે. અરે પ્રાણુ જવા હે છે પણ પોતાની પવિત્રતામાં જરા પણ ડાખ લાગવા હેતી નથી. આમ છતાં કોણું જણે ક્યા હેતુથી એ ધારિણીને વીસરી શક્યો નહોતો. બળજખરીથી પણ એક વાર તેણીને હાથ કરવાનાં સ્વખાં સેવતો હતો. એ હેતુ પાર પાડવા સાડ, સાહસોમાં આગળ પડતો ભાગ લઈ, એ રાજવી શતાનિકનું પ્રીતિ-ભાજન બન્યો હતો. શતાનિકને જમે તે રીતે દધિવાહન ઉપર વિજય પ્રાપ્ત કરી બર દરિયે ડોલાયમાન થઈ રહેલી ક્રીતિને કાંઠે વાળવાના હોડ હતા અને એમના આ સલાહકારને એમાં સાથ પૂરી, ચંપાના આવાસમાંથી રાણી ધારિણીને ઉપાડી આણ્ણી, એક વાર બળજખરીથી ધરમાં બેદાડવાના અભિલાષ હતા.

આમ ઉપરની શાંતિ હેઠળ ખુદ પડોશના રાજ્યમાં જ જ્વાળા-
મુખી ફાટી ઉઠવાના સંઘેગે ખડકાઈ રહ્યા હતા. ભાણેજ સાથેના
પત્રવ્યવહારથી નાયક કૌશામ્ભીમાં એઠા એઠા ચંપાના રલેરજ વૃત્તાંત
મેળવતો અને ત્યાં બનતા બનાવથી માહિતગાર રહેતો.

‘રજમાંથી ગજ’ થયાના કે એકાદી નાનકડી ભૂલમાંથી ભયંકર
પરિણામ આવ્યાના બનાવે. કચાં ધતિહાસનાં પાને ઓછાં નોંધાયાં
છે? અદ્ય કિંવા નહિ જેવા પ્રમાણથી જીતી બાળ ધૂળમાં મલ્યાના
અથવા તો જીત હારમાં પરિણમવાનાં ઉદાહરણે સંઘાખંધ પ્રાપ્ત પણ
થાય છે.

પથારીમાં આગ વા લીતરનો અભિન એ પહેલી તકે નજરે ન ચઢે
છતાં ઉધાધના ઢેર જેવો છે. નાના સરખા ઉધાધના લીંટા નીચે
હળરો જંતુએ ખદખતાં હોય છે એટલું જ નહિ પણ એ નહિ જેવા
લીટાએ અંદરનો પ્રદેશ એવી રીતે ખલાસ કરી નાંખેલો હોય છે કે એ
ઉપર અંગુલી મૂકૃતાં જ જડી ઉતરી જય. આ નાનકડા જંતુનાં
ભક્ષ્યમાં માત્ર પુરત્રો જ સ્વાહા થાય છે એમ નથી; એ તો મોટી
મોટી ધમારતોને પણ કકડભૂસ કરી વાળે છે. પડોશનો શત્રુ એ
લીતરના અભિનુભ્ય હોઈ ઉધાધના વળગાડ જેવો છે. ચડોર માનવી
પણ એમાં ભૂલનો લોગ બને છે.

કૌશામ્ભી હવે શાંત એહું છે એમ માની ભૂપ દ્વિવાહન એ
તરફના સમાચારે માટે સાવ બેદરકાર હતો. હજુ પાંચ દિવસ પૂર્વ
કુચનપુરના સીમાડા ઉપર થયેલ રમભાણ સાંભળો એ જતે જ શમા-
વવા ઉપડી ગયો હતો. એ વેળા સચિવે, એ કામે હોઈ બીજને મોડલન
વાની દરખાસ્ત કરેલી. જીતથતું તરફેની એકધારી જ્યાતિ વરનાસ
જુપને એ ગમ્ભી નહિ! એ સામે મળાક કરતાં એ એલ્યા હતા કે—

પ્રધાનજી, મારી નાડીમાં દોહી એટલી હુદે ધર્મકારા મારે છે હુદે
મને હોથમાંથી તલવાર છેડવી મમતી જ નથી. જતે ખુલ્લ માણવાની

મોજ જૂદી જ છે. એ તો અનુભવનો વિષય ગણ્યાય. વળી સૈનિકોને બેસાડી મૂડી નિષ્ઠિ અને આળસુ ખનાવવા કરતાં, જુદા જુદા પ્રદેશ-માં કૂચ કરાવી સતત કાર્યત્વત રાખવા એ ઓછું લાભદાયી નથી. અહીં તો શાંતિ છે. વળી તમો સર્વ અહીં બેઠેલા છો. હું પખવાડીયું આશ્વા જયો એથી શું દાટ વળી જવાનો છે? રાજ્યની તો ધુમતો જ સારો.

ચંપાનગરીના અને આસપાસના વાતાવરણની ઝાંખી કરી હવે ઝડપામાં ચાલતા વાર્તાલાપ તરફ વળીએ.

ગંગા—કહો ન કહો પણ રાણીજ! તમો આજ, રોજના સરખા પ્રકૃષ્ટ નથી જણ્યાતા. તમારો ચહેરો જ એ વાત દર્શાવી આપે છે.

સખી જંગા! હજુ તું રાણીજનું સંઘેધન ચાલુ રાખ્યા કરીશ? ચંપાની જનતા માટે હું રાણી તરીકે ઓળખાઉં પણ તારા માટે તો ધારિએહું જ છું. હવેથી એ વિશેષણ આગળ આણુવાની ભૂત ન કરતી.

મન પ્રકૃત્યા નથી અને અંતરમાં જ્ઞાની ઉદ્ભવી છે. એ કહેવા સારુ તો તને આ ધીકતા તાપમાં તેડાની છે.

તો પછી શરી રમણી એ વાત જટપટ કહી નાખોને કે જેથી લેવા જોઈતા જ્ઞાનજ હાથ ધરાય અને એનું નિવારણ સત્તર કરી દેવાય.

રાજમહાલખના સુખો, પાણી માંગતાં દુધ હાજર કરનાર દાસ દાસીએં, કાલુંબેલું વદી સદૈવ આનંદ આપનાર તનયા વસુમતી અને વેણુ મુખમાંથી અહાર પડે. તે પૂર્વે એને ઉચ્ચકી અમલી ખનાવનાર ધારા પ્રત્યુત્પત્તિ વર્ચ્યે વસનાર તમને, થાં કારણે જ્ઞાની જન્મવી જોઈએ?

સંસારવાસી લખનાએં આ કરતાં કયા વધુ સુખનાં સોષુલાં સેવે? કદાચ પુત્ર વિદ્યાએ અંક મિત્તા કરનારતો હોય તો એ પણ આશા

પૂરાવાને સંભવ છે. હજુ વય કંધ પાકી ગઈ નથી. વસુમતી જેવી ખાલિકા બાધ વિહૂણી નથીજ રહેવાની.

ભાબી ! તેં પણ આજે તો ભારે હોય. કલ્પના રૂપી તુરંગ ને તરંગે મારફતે ખૂબ ખૂબ હોડાવી મેલ્યો. તું ધારે છે એ જાતની ચિંતા મને છેજ નહીં. વળી ભાષ્યાંથીન વરતુ મારે હાયવેય કરવાવાળી હું નથીજ. દીકરા-દીકરી વચ્ચે મને ભેદ દેખતો જ નથી. એમાં તો પૂર્વનભને ઝડપાનુંધ નિમિત્તાઙ્ક છે એનો. તે હર્ષ શોક હોય અરે !

તો પછી હું ખનું નામ જણાવ્યા વિના શી ખખર પડે ? વાત એમ છે કે, રાજવીના ગયા પછી મને છેલ્ખા એ દિનથી માછાં સ્વભાવાં આવ્યાં કરે છે. જણે હું આ સ્થિતિમાંથી ગણડી પડી અને ડોઢ અંધારી ખીણુભાં પહેંચી ગઈ એમ લાગે છે. ડોઢએ મારી દીકરી ઝૂંટાવી લીધી. આ નગરી પર એકાએક હલ્લો આવી પડ્યો. અને ઉપર કર્યું એવું જોત જોતામાં બની ગયું.

પણ ઝબકોને જગતાં જ મને પદંગ ચોઠેલી જોઉં છું. સ્વભાવી કંધપણ નિશાની જણાતી નથી. પણ એ સયનનક સ્વભાવે મારી ચિંદ આરામ અને આનંદ હરી લીધાં છે.

હજુ ગઈ પાછલી રાતની વાત છે. માંડ ચાર ઘટિકા પ્રાતઃકાળને ખાકી હશે ત્યાં તો મારા કમરામાં એકાદા સૈનિકને ધરી આવતો જોયો. મેં પહેરેગીરને ખૂબ મારી પણ તેના આકસ્તાં પૂર્વે તો પેલો. સૈનિક ઘડઘડ હસતાં બોલ્યો—ચોઝીદાર તો ભાગી ગયા અને તમારો પ્રીતમ નગરીમાં છે જ નહીં—તમારી ન્હારે ડોઢ આવે તેવું રહ્યું નથી. મૂંગા મૂંગા મારી સાથે ચાલી નીકળો.

હું કંધ સવાદ કરું તે પૂર્વે તો પેલાએ મને ચિચકી લઈ ભાગવા શાંદયું અને હું એના હાથમાંથી છુટવા યત્ન કરવા લાગી ત્યાં નેત્રો ખુલ્લી ગયા અને મારી જાતને પદંગની ધર પર બોઈ.

માર્દ મન આ બ્રમણ પાછળ અહૃજ વિવશ અની ગયું છે. કશામાં ચિત્ત ચોટતું જ નથી.

‘સખી! પતિના વિરહથી નારી જતિને એકલા પડતાં એવાં સોણવાં આવે. એમાં તમારો ગ્રેમ તો ચ્યકવાકોના યુગલ કેવો. કહો તો રાજવી જલ્દી પાછા ફરે એવો સંદેશ મોકલવાનો પ્રખાંધ કરાવું. બાકી સ્વખા જવલ્લે જ સાચાં પડે છે. તેથી તો કવિએ રહ્યું છે કે—‘સ્વખાની સુખલડી ભૂખ ભાગે નહીં.’

અંગા! તું તે શી વાત કરતી હુદશ. ભૂપથી આ કંઈ જુદા પડવાનો અને એકલા રહેવાનો પહેલો ગ્રેસંગ નથી. પતિ પાસે હોય એ હર કોઈ નારીને ગમતી વાત ગણ્યાય. પણ કારણું વસાત એ દૂર જય એથી આ ક્ષત્રિયાણી ન ગભરાય. ગ્રેમ એ કંઈ આજકાલનો ગ્રેસંગ નથી. હવે તો એ પાછળ દશકા કરતાં વધુ સમય વીત્યો છે. હું કંઈ અભિસારિકા હે નવ યૌવના નથી. સંદેશો મોકલવાની કંઈ જ જરૂર નથી. હું તો જણ્યા છન્યું છું કે આવા તરંગો પાછળ કંઈ તથ્ય સંભવે અરું?

અંગા જવાબ આપે તે દરમિઆન વસુમતી અને એની તણું ખાળ સખીઓ રક્જક કરતી આવી પહોંચી અને એમાંની એક કહેવા લાગી-રાખીમાતા! તમારી વસુને સમજાવો. અમારી દરેક વાતને એ ઉતારી પાડે છે. એ ને કંઈ કરે તે સાચું અને અમારું બધું ખોએનું. રમતમાં એવો વર્તાવ હેમ ચાલે?

પણ વાત શું છે એ તો વીમું! પહેલા કહી સંભળાવ. જુઓને અમો બધાં રમતાં રમતાં બાગના કુવારા નજુક પહોંચ્યાં. પાણીમાં કુંડળાં કરવા મેં એમાં કાંકરો હેંક્યો. એ જોઈ આ જયા અને રમાએ પણ કાકરા હેંકવા માંડ્યા. ત્યાં વસુખા ડાલ્યા થઈ ખોલ્યાં-

વીમુડી, આ તું શું કરી રહી છે? આ રમતથી પાણીમાં રહેલાં માછલાં વિગેરે નાના જ્વોને પીડા થાય. તેઓ બાપડા મરી જાય!

આવી રમત આપણાથી ન રમાય. કુંવરીઓની શિખામણુ માની લઈ અમોએ રમત બંધ કરી, અને સર્વ જ્યાં ચોગાનમાં છોડરાએ. ગેડી દ્વારાથી રમતા હતા ત્યાં પહોંચ્યા. અમને જોઈ પેદા ઇતેહસિંહ ખાપુનોં દિલીપ મારી પાસે આવ્યો. અને મારો કાન પકડી બોલી ઉઠ્યો—

વીમુ ! અરે લુચચી બાળા, તું ક્યાં રમતી હતી ? તને હું સારાયે અગોચામાં શોધી વલ્યો. તેં તો આજે મને ખૂબ થકવી નાંખ્યો.

હું જવાબ આપવા વાંકી વળી ત્યાં કાન પરથી એના આંગળાં છૂટી જયાં.

અરે, તું તો ભારે જઘરી થઈ ગઈ ! એમ બોલતાં એણે મને ગાલ પર ટપ્લી મારી. જો કે આ બધું દિલીપે સામાન્ય મળક કરતાં સરળ ભાવે જ કર્યું હતું. વળી ટપકીથી મને ખાસ કંધ વાગ્યું પણ નહોતું. પૂર્વે કુટલીયે વાર અમો સાથે રમેલાં છીએ. દિવસમાં એકાદ વાર ન મળોએ તો એક ખીજને ગમે પણ નહીં.

પણ રાણીમાતા ! અમારો આ વતૌવ જોતાં જ વસુમતી તો રાતી પીળી થઈ ગઈ. અને હું કંધ કહું તે પૂર્વેતો ટપલીના બદલે દિલીપને તમારો લગાવી દીધો.

વિશેષમાં ઝવાબ ભેર કુંવરીઓ બોલ્યાં કે—

નાદાન છોકરા ! તું સમજે છે શું ? બાળાઓ સમજ ગમે તેમ ચેન ચાળા કરે છે ? તહારાથી ગાદ ઉપર આંગળી અડકાડી શકાય જ કરમ ? સ્વી પુરુષની મર્યાદાનું ભાન તું શું છેક જ ભૂલી ગયો ? જરૂર ચામારી આંખથી દૂર થઈ જ.

હસતામાંથી ખસવું થવા ડ્રપ આ નાનકડી વાતમાંથી આવું ગંભીર ઝપાનત જોતાં જ દિલીપ તો શરમિંદો બની ગયો. બિચારો ઊથાઈ જ ગયો. ખીજ છોકરાએ. પણ રમત બંધ કરી એક ખીજ સામું

જેવા લાભ્યા. એ સમયનો દેખાવ જોતાં હર કોઈને લાગે કે વસુમતીના વાક્યોએ કાતીલ ધા નેવી અસર કરી છે. એ મૂંગો મંતર બની ત્યાંથી ચાલી ગયો. એના સાથીદારો પણ એક હરક ઉચ્ચાર્યો વિના એની પાછળ ઉપડ્યા.

રાજની લાડીલી દીકરી સામે કોઈ કંઈ જ ઉચ્ચારી શક્યું નહીં. પાછા ઇરતાં મેં કહ્યું, સખી વસુ ! તેં આજે કાચું કાપી નાંખ્યું. ધાખું જ અવિચારી પગલું ભર્યું. માછલાંની દ્વા ખાનારી તું, આજે નિર્દીષ દિલીપને અપમાની મહા કષ્ટ હેનારી બની જઈ ? તેં આજે રજનું જજ બનાવી ડેવલ કલ્પનાના જોરે રેતી પર મહેલ ચસ્થી નાંખ્યો. કંંકરા ઝેંકવાની રમત જે પરને પીડા કારી જણાય તો, વિના કારણ કોઈનું દિલ દુભાવવું એ વધુ હુઃખારી ન લેખાય ? આમ કરવામાં તું દ્વાખિત છે.

પણ ‘દોષ’ શાખદ સાંભળી એ તો છંછેડાઈ જઈ અને કહેવા લાગી કુદેલી વીમુ ! આવાં અડપદાં નારીનિતિએ પળભર પણ ચલાવી ન લેવા જોઈએ. આપણે ખાળાઓ કંઈ પુરુષ જત નાટે રમવાની ઢીંગલીએ તો નથી જ. આપણા અંગ-ઉપાંગ સાથે ચેડા કાટવાને અધિકાર કોઈ પણ મરદને છેજ નહિ. સ્વી સન્માન કોઈ અનેરી ચીજ છે. મૈત્રી કે પરિયય પરસ્પર ગમે તેટલો હોય પણ વર્તન તો ભર્યાંદા યુક્તા જ જોઈએ. એજ શોલો.

આ તો ચોર કોટવાલને દંડવા જેવી વાત કરી. પોતાની ભૂલ કુખૂલવાની વાત તો દૂર રહી પણ સામેથી અમને બોંઢા પડ્યે છે.

રાણીમાતા ! તમોજ ન્યાય કરો.

આ સાંભળતાં જ ધારિણી અને ગંગા ખડખડ હસી પડ્યા. એમને હસતાં જોઈ વીમુ સિવાયની ખાળાઓ પણ હસવા લાગી. વસુમતી તો નાંસી નજરે છેવળ જોઈ જ રહી.

ગંગા—સખી ! કુવાકંડો યાદ આવે એવી વાત છે. મા તેવી દીકરી.

જરૂર એ યાદ સંધરવાળેવી ગણ્યાય, કારણું દેશ—કાળના એંધાણું
નેતાં નારીજલતાં ને અથળા મટી પ્રથળા થવાની અગલ અતિ ધણી
છે. એમ કહી ધારિણીએ ધીમેથી કહ્યું.

વીસુ ! તમો માનો છો. એ રીતે જરૂર વસુમતીએ ભૂલ કરી ગણ્યાય.
તમારી વાત સાંભળતાં દિલીપનો વર્તાવ ખાસ ગંભીર ન લેખાય.
તમો સૌ હજુ બાળવયના પ્રાંગણુમાં રમો છો. એટલે એ પાછળ કોઈ
મહિન હેતુ નથી, પણ માત્ર નિર્દેષિતા જ છે.

એ સાથે એટલું ઉમેઝં છું ડે—આવો વર્તાવ યુવાવસ્થામાં આવેલા
તરણુ—તરણીઓ વચ્ચે ન જ શાબે. કેટલાક પુરુષોમાં એવો સ્વભાવ ધર
કરી ગયો હોય છે કે ‘રમણી એતો રમવાની ઢીગલો’ એની સાથે ગમે
તેમ અડપલાં કરી શકાય. એ ભૂલ ભાંગવા સાર નારીજલતાએ સામનો
કરવો રહ્યો. નિર્દેષ જીવજંતુએને કે માનવોને વિના કારણ દુઃખ
આપવું એ તો અધર્મ ગણ્યાય. આકૃ અપરાધી સામે તો જરૂર પડ્યે
સંસારવાસીને શર્ખો પણ વાપરવાં પડે. એ એની ફરજ લેખાય.
એથી પીડા તો થવાની. એ દોષ વહેરાને પણ અપરાધ ટાળવો જ
પડું.

પ્રકરણ દે મું

અરણ્યના એકાંત પ્રહેશભાં



રમણી ! ભૂતકાળ ભૂલી જ. ચંપાના રાણીપદ્ધને વીસારી મુદ્દ
અને રાજ્યભૂષિથી મારી માંગણીને સ્વીકાર-કુવાકાંડે જ્યારથી તું મારી
નજરે પડી ત્યારથી જ હું તારા સ્નેહમાં લેપાયો છું. એ દિનથી તને
મારી કરવાની જે આશા સેવેલી તે આજે મોંધા પ્રયાસો પછી ક્રણ છે.

નાયક ! સૈનિકોના સ્વામીને આવા કણ્ણુંકઢુ વચ્ચે એક પરણે
સ્ત્રી સન્મુખ ઉચ્ચારવા એ શું છાને છે ? એક પક્ષી રનેહ કદી પણ
સક્રણ થયો સાંભળ્યો છે ખરો ? નારી જતને ફ્યાવવામાં નથી તો
સાચી માનવતા કે નથી તો સાચી શરવીરતા. એની નિરાધારતાને
લાભ લેવામાં ક્ષાત્રવટ નથી પણ એવા પ્રસંગે રક્ષણ કરવામાં જરૂર
એ દીપી નોકળે છે. માટે બીજી તીજી વાતો મૂકી દઈ, અમ મા-
દીકરીને પોતાના ધર્મિત માર્ગ જવા હે. હૃદયમાં કરુણભાવ હોય તો
ચંપાના માર્ગ બેળા કરી હે.

વાહ ! શી સુશીયાણી સલાહ ? એ સાંભળવા અર્થે મેં કંધ આ

લેખમ નથી ખેડું ! હાથમાં આવેલ શિકાર છાડી દું એવો હું
મુર્ખ નથી. રમણી ! તને ખરર ન હોય તો જાણી લ્યે કે—

તારી પાછળ મેં લોહીનું ધાણી કર્યું છે. કેટલીયે રાતોના
ઉનભરા સેવ્યા છે. તારી શોધ પાછળ બ્રમણ કરવામાં આ ટાંઠીયા
દીલા કરી દીધા છે. કૌશામ્ભી અને ચંપા વર્ચ્યેના આંટાફેરા કરવામાં
કુચાશ નથી રાખી. પૈસા તો પાણી માઝક ખરવ્યાં છે. મારી
ચીરકાલિન આશાને જ્યારે આજે ઇણ એહું છે ત્યારે તું શા સાંદ માન
માગે છે ? શું આ બધું મેં સાચા સ્નેહ વિના કર્યું છે ? જે પ્રેમ તું
અત્યાર સુધી જોઈ છું તે કરતાં અધિક પ્રેમ તને મારા ગરીબ
ખૌનામાં મળશે. બાલ્ય નજરે રાજમહાલયના સુખે. જરૂર હરકોઈને
મોહાવે—એકાદ મારા સરખા નાયકના આવાસની સામાન્ય સામગ્રીથી
ચઢી પણ જય; પણ આંતર ઉલેચતાં સાચા માપે માપતાં—ને સડા
ત્યાં પ્રવર્તે છે, ધ્રૂવી હાયે ઉઠે છે અને નિરંતર ખટપટો વર્ચ્યે જીવન
વીતાવવાનું હોય છે એ સર્વનો વિચાર કરતાં હૃદ્ય ધૂળ ઉઠે છે; સહજ
તિરસ્કાર જન્મે છે. એ જોતાં સાચા ગ્રેમીની નાનકડી ઝૂંપડીની
સ્વાધીનતા ધણી રીતે ચઢીયાતી છે. સુખનો સાચો ખ્યાલ એ ઝૂંપડી
જ આપે છે.

ઉપરનો વાર્તાલાપ અરણ્યના એકાંત ભાગમાં ચંપાપતિની રાણી
ખારિણી અને કોશામ્ભીના પેલા નામચીન નાયક વર્ચ્યે ચાલી રહ્યો છે.

એ ડુપુરુધ નાયકે પોતાની ધર્યા બર આણવા સાંડ સોગણાં
ગોઠવવાનાં શર કરી દીધાની વાત આપણે જોઈ ગયા છીએ. દધિવાહન
ઝૂપની ગેરહાજરીના સમાચાર એના કાને આવતાં જ એનાં ચઢો
જતિમાન બન્યાં. તરત જ એ રાજ્યી શનાનિક પાસે પહોંચ્યો અને
દધિવાહનઝૂપ સીમાડા ઉપર રોકાયેલ છે અને ચંપા ઉપર અચાનક
જાપો મારવાનો આ સમય અતુલૂળ છે એમ જલ્દાવી જિમેર્યું હે—

મહારાજ ! આ તક જરૂરી લેવા જેવીં છે એક કરતાં વધુ વાર હું ચંપા નગરીમાં જઈ આવ્યો હું. ભૂપના ફરીથી લગત થયા અને આજે નવી રાણીની કુંવરી લગ્નભગ ચૌદ વર્ષની થઈ છે. એ વર્ષોના જાળમાં પ્રાણે જે શાંતિ-સુખ લોગવ્યાં છે, બ્યાપારની એકધારી પ્રગતિ સાધી છે અને સંપત્તિની વૃદ્ધિ થવાથી જે વૈભવ-વિલાસમય જીવન જીવવા માંડ્યું છે એથી જનતાનો મોટો ભાગ ‘અંગરેશ તરફ કોઈ નજર નાંખે એવો માડીન્યો જન્મ્યો જ નથી’ એવું માની ઉધાડાં આરણે સૂચે છે. જાણે પાટનગરને કોઈ તરફનો ભય નથી એમ માની રક્ષકો ને દરવાનો પણ એદિકરા અન્યા છે. રાન્યના અધિકારી વર્ગમાં પણ હુદ્દ ઉપરાંતની નિશ્ચિતતા વર્તે છે. દ્વિવાહન ભૂપ ‘જીત-શત્રુ’ તરફની ખ્યાતિ પામ્યો છે એટલે તેઓ એમ માનતા થઈ ગયા છે કે જાણે ચંપાનો કોઈ શત્રુ જ નથી રહ્યો.

કૌશાભ્યાના માલિક ! આ રામાયણ પાછળ મારો હેતુ એકવારની બગરેલી બાજુ સુધારી લેવાનો છે. પરાજીત થવા ૩૫ જે છાપ પડી છે તે સુધારી વાળવાનો છે. હેઠળીયે વાર આપણું એપરવાઈનો લાલ લઈ દ્વિવાહન ભૂપે અહો હસ્તા લાની જે તુકશાની કરી છે અને પોતાના પરાક્રમની જે ઢોંઢ પોટાવા પડોશી રાન્યમાં યશગાથા વિસ્તારી છે અનો અદ્દેલા લેવાનો મારો છરાદો છે; યોગ સાંપડ્યો છે. ઇક્તા આપની સંમતિ-મહોર મૂકવાની ઢીક છે. ખાનગી તપાસના અંતે મને માલૂમ પડ્યું છે કે ચંપાનો સ્વામી પોતાના ચુનંદા લસ્કર સાથે સીમાડાના બજેડાને શમાવવા ગયેલ છે અને નગર સંરક્ષણને અર્થે જે સન્ય રાખવામાં આવેલ છે એ ધણું થોડું છે તેમ કંઈક અંશે મોજલું હોનાથી ઇરજ બળવવામાં એદરકાર પણ છે. આપણે સત્તર છૂપી રેખારી કરી ચંપા ઉપર અચાનક હસ્તો લઈ જવો. રાત્રિના કલાકોમાં અંધારાનો લાલ લઈ છાપો મારવો. કર્મચારીઓની અસાવધતાનો અને તેટલો લાલ ઉદ્ઘાવવો. ભયનું વાતાવરણ સર્જવવું અને હો-

કાટતાં પાછા ફરી જવું. આ રીતે કરવાથી નહિ જેવી હાનીએ આપણે ચંપા ઉપર વિજય મેળવ્યો જણ્ણારો.

ધણુા પરાજય સામેની આ જીત નિશ્ચિત છે એટલું જ નહીં પણ મૃગાવતીની ભગ્નિની પડ્ગાવતી સંબંધે એક સંબંધીજન તરફે દધિવાહનની શુદ્ધ ડેકાણે આણુવા કંઈ ક્યું" પણ કહેવારો.

જમાદાર ! હારી વાત ગળે ઉત્તરી જય તેવી તો છે જ, છતાં આપણે પરિસ્થિતિનો પૂર્ણ વિચાર કરી પગલું ભરવું જોઈએ. આપણી પાસેનું સૈન્ય મજબૂત નથી. પરાભવો વેહવાથી જુસ્સો પણ દખાઈ અયેલો છે. છાપો મારી સર્તો વિજય મેળવવાની વાત જેટલી મનોરંજક છે એથી હલ્દું રક્ષણો જાગૃત હોય તો આ ચઢાઈ ડેટલી ભારે પડી જાય અને કેવી ખુબારી વેહવી પડે એનો વિચાર પણ કરવો રહ્યો. વળો એક સથળ રાજ્યની સાથે શાંત પડેલ કલહને નવેસરથી જગાડવાનો આ પ્રયાસ સ્ફુતા સિંહને છંછેડવા જેવો જણ્ણાય. અંધકાર અને અન્જણુપણુનો સધિયારો લઈ હંદો કરવો એ ક્ષાત્રવટને શોલે તેવું કામ ન ગણ્ણાય; એમાં પરાક્રમનો દાવો ન કરી શકાય.

મહારાજ ! દાવ આવે સોગઠી નું મારી જણે એ ખરો રજપુત બચ્ચોનીં. સમય એટલો એછો છે કે જાઓ વિચાર કરવા "પરવડે તેમ નથી. મેં તો આનગી સમાચાર મેળવ્યા. મારા હૃદયને જરૂરા-તે કહી બતાવ્યા. આપ માલિક છો. બાકી રાજ્ય નીતિમાં દાવપેચથી વિજય નોંધાયાના સંખ્યાઅંધ દાખલા રજુ કરી શક્ય તેમ છે.

મારા જેવાતું થોડું સૈન્ય આપો અને પછી જોઈ લ્યો કે મારી ગણુની અરાખર છે કે નહીં. આપને જાતે તસ્દી લેવાની જરૂર નથી. મને તો જેણે પાકી ખાતરી છે કે આ પ્રયાસમાં હું જરૂર કૌશામ્ભીના કુપાળ વિજય તિલક કરાવીશ; છતાં ધારો કે એમ ન ખન્યું તો આપ જવાબદારી ખંખેરો કહાડજો. વાગ્યું તો તીર નહિં તો તુઝો ! તક ગુમાવીશું તો પાછળથી પરતાવાનું થશે.

શતાનિકે નાયકને સેનાપતિ ઉપર ઇઝો મોકલી અમુક હુકડીઓ અપાવી, પણ છાપો મારવા સંખંધી ખાનગી ગોઠવણુંની ગંધ સરખી કોઈને આવવા દીધી નહીં. બ્યાં કુશાભ્યાનો અધિકારી વર્ગ અને જનતા આટલા અંધારામાં રહ્યાં ત્યાં એ સંખંધી સહેજ પણ જાંખી, ચંપાના સીમાડે થવા ન પામે એમાં આશ્ર્ય પણ શું ! નાયકની આ હીલચાલનો રન સરખો ઢાક્ખના કાને ન પહેંચ્યો.

આખીયે રમત પાંછળ નાયકની કડક સંભાળ અને પાકી દેખરેખ હતી. છાપો સંકળ અને તોંક એની લાંબા કાળની સુરાદ ખર આવે બેમ હતું. એના હૃદયમાં ધારિશ્ચાયે એવું સ્થિર આસન જમાવ્યું હતું કે તેણુંને ડોધપણ હિસાયે હસ્તગત કરવાની વાત સતત ચક્ષુ સામે રમતી હતી. એ અંગેની તમના એને હરકોઈ સાહસમાં ઝૂકવાની પ્રેરણા પાછ રહી હતી. નીતિકારોએ કહ્યું છે કે—

‘ સાહસે શ્રી પ્રતિવસતિ ’ અર્થાત સાહસિકોના ભાગ્યમાં જ અક્ષમનો યોગ હોય છે એ બોધું નથી જ.

નિશ્ચિત કરાયેલા સમયે નાયકે પોતાની હુકડી સાથે ચંપાપર આકમણ કર્યું ત્યારે ડોધપણ જાતની શીતિ વિના પ્રજા નિદ્રાના ખોલે નિશ્ચિંતાથી પોઢતી હતી. શ્રીષ્ટ નિવાસ તરફ હથો લઈ જવામાં નાયકને પાઠનગરના ડોધ જાહેર માર્ગો વટાવવાના નહોતા. મધરાતના ટકોરા થયા પછી પ્રસરેલા અંધકારમાં એકાએક બંદુકોના ધડાકા થવા માંડયા અને શબ્દોના ચમકારા સાથે મહાલયના રક્ષકો સાથે આગંતુકાની અથડામણ આરંભાધ. આ અપાઙ્ગી જાઓ સમય ચાલી નહીં. સંખ્યામાં રક્ષકો વધુ ન હતા. વળી આ મહાલય નગરીના પ્રાંત ભાગે આવ્યો હતો અને બનાવ આકર્ષિક હતો એટલે એના સમાચાર અધિકારી વર્ગમાં પહેંચ્યા અને સૈનિકોની હુકડી સજા થઈ આવી એમાં ધર્ષી ધર્ટિકાઓ વીતી મધ્ય.

नायकनी सूचना मुजब्ब अनेना साथीदारे महालयमां अने आस-पासना प्रदेशमां हाहाकार फेलावी धृ, हाथमां आच्युं ते लूंटी लध, निर्णित समये पाछा झरी गया. .

गभराट शम्भा पृष्ठी ज्यां सविता-नारायणुनां आछां किरण्णो. आ पृथ्वीतળ पर पथरावां भाँड्यां त्यारे रात्रिना अंधकारमां थयेली खानाखराभीने ख्याल चंपानी प्रज्ञने आव्यो. अधिकारी वर्गे ज्ञेयुं के शत्रुओनी दानत सीधी लडत आपवानी नडोती पैणु भयनुं वातावरलु प्रसरावी लूंट यलाववानो हती. मरणु प्रभाषु नश्युं हुं अने धवायेलानी संभ्या पैणु अंगणीना टेरवे रमे तेटली ९ हती. अलयत महालयमां भांडे झैऽ अने लूंटकाट वधु जणुआ. अति हुःअनुं कारणु तो ए थध चंच्युं के लूंटाराओ. राणील अने कुंवरी वसुभतीने उठावी गया हता. जे कमरामां तेओ सूता हता त्यां पलंगो आली पडया हता. त्यां अन्य भांडझोड न होवाथी उभय मा दीकरीने धरादा पूर्वक उच्यकवानो भाग भञ्ज्वायेल नज्जरे याव्यो.

કौशाभ्याना सैनिको आ रीते सस्तो विजय भेणवी, पाटनगर चंपानी भागोणथी धध्ये हूर एक निर्जन स्थानमां नायकनी वाट जेता थोभ्या हता. ज्यारे नायक तो पोताना विश्वासु साथीदार कंउरीक्ते लध, लांचा काणनी कामनानी सिद्धि अर्थे राणीना कमरामां पहोंच्यो हतो. मा-दीकरी भाडी निदामां गोढया हता. उभये अतिशय चूपक्षीदीथी तेओ जगे नहीं ए रीते अभा उपर उपाउया अने पाछा क्यां. आसपास झेाध पैणु जग्याए थोभ्या विना तेओ सीधा दूँका रस्ते घेला नियत स्थले आव्या. ए वेळा ९ सैनिकोंए जास्युं के नायक चंपानी राणीलने उठावी लाव्या छे. आभाये दान एवी रीते घेलायो हतो. के एक कंउरीक सिनाय हृत्तानी पाण्डणो आ आशय क्लाईपैणु पारभी शक्युं नहेतु. .

આવતાં બેર નાયડે, સૈનિકોને કંડરીકની સરદારી હેઠળ જલ્દીથી ક્રીશાભ્યી પાછા ફરજાની આજા ફરમાવી, અને પોતે પાછળથી આવી પહોંચશે એમ જણાવ્યું. કુકઢી નજરથી દૂર થતાં જ નાયક ઉભય લવનાઓને કે ને ડુંગે જગૃત થઈ ચૂકી હતી અને આસપાસના દસ્યથી પોતે કોઈ લૂટારાના હાથમાં ફસાઈ પડી છે એ પણ સમજ ગઈ હતી—પોતાની પાછળ ચાલ્યા આવવાનું કહી અરણ્યના નિર્જન પ્રદેશમાં આગળ વધ્યો. આમ ધારિણીને આવતાં મીંહાં સ્વર્ણાં આખરે સત્ય રૂપે પરિણાયાં. વસુમતી તો મા પાછળ ચાલતી હતી પણ ધારિણીને તો રૂપણ ભાસ થવા માંડ્યો. હતો કે પોતાના સુખના દ્વિસો પૂરા થઈ ગયા છે અને ભાવિકાળની ભયંકરતા નેત્રો સામે ડોકિયાં કરતી ખડી થઈ છે.

પ્રદરણના આરંભમાં વાર્તાલાપનો જે પ્રસંગ જોઈ ગયા, તે નાયક અને ધારિણી વચ્ચેનો જ છે. પુનઃ એ તરફ મીઠ માંડીએ.

લવના ! શા સાર આ આશાને વધુ તટવાવે છે ? કુવાકાંહાના તહારા નેત્ર આણે મારી છાતી વીધી નાખી છે. ત્યારથી હું શુષ્ણ-શુષ્ણ ભૂલી ગયો છું. ફરત તહારા નામની જ રટણા કરું છું. ભાગ્યોએ તહારી પ્રાપ્તિ થઈ છે તો રાજ થઈ મારા હૃદયની ખ્યાસ બૂજાવ.

ભાઈ ! કુવાકાંહાની રમૃતિ પણી તહારા અંતરનો પડ્યો ઉચ્ચકાઈ ગયો છે. એ પાછળ પ્રેમ નથી પણ કામતી આગ ભડભડતી મને જણાય છે. અલઘત મને ઉચ્ચકી લાવવામાં એકજ તમના તહારી છે અને તે મને પતિન અનાવવાની. પણ હવે એ કળવાના જ્યાં સંયોગ નથી રહ્યા. ધાર કે તહારા કામને હું પ્રેમ રૂપે જોઉં તો પણ તે એક પક્ષી છે. હું એક રાજીવીની અંગના છું. મેં પ્રેમપૂર્વક એ છેડો પદડેલો છે. સંસારી જીવનના ફળ સ્વરૂપે આજે હું એક આળાની માતા પણ અની ચૂકી છું. એક આર્ય રમણી યાચકની માંગણી અંતોષ્ઠવા ખાતર એક ભવમાં એ જવ ન જ કરે. પોતાના માતૃ-પિતૃ

કે શશુર કુળને ભસીને। કૂચડો ન લાગવા હે. આ નિતિં સત્ય સમજ લઈ, અમને દ્શટા કર. અમારા માર્ગે જવા હે.

ધારણી ! હું જેમ જેમ નભતાથી, સમજવટથી માર્ગ કહાડવા કહું છું તેમ તેમ તું મોંઢી બનતી જય છે. ઉચ્ચા તત્ત્વજ્ઞાનની વાતો કરે છે. ધસ્ક તો આંખણો છે અને અનંગનો આતપ ખૂઝાવવા શખ્દો કામ નથી લાગતા પણ અંગના લેટણું જરૂરી છે.

બહાલી રમણી ! હું સૈનિક છું. મારો વ્યવસાય ખાંડાના દાવ ઘેલવાનો છે. અક્ષરોની ગૂંથણી મને ન આવડે. સૌન્દર્યની મને પિછાન છે અને નારી છુદ્ધની આકંક્ષાએ હું ઓળખી શકું છું. છતાં એની લાંખી પહેણી વ્યાખ્યાએ કરવાતું પસંદ નથી. જેના પ્રત્યે આકર્ષણું જન્મ્યું એને મેળાપ કરવો અને એની સાથે માનવ ઉચ્ચિત જીવન જવું એ મારો સુશ્રાવેખ છે. ચાહે તો એને પ્રેમ, સ્નેહ, પ્રીતિ, વિગેર શખ્દોથી ઓળખો, કે ચાહે તો એને કામ કે વિલાસનું નામ આપો. મને નામ સાથે કામ નથી પણ એ પાછળના ભાવ સાથે કામ છે.

તાયક ! મારાં અનુમાન સાચું હ્યું છે. જ્યાં દૈહિક લાલસાએ પોપવાની વૃત્તિ જગતી બેદી હોય ત્યાં ‘પ્રેમ’ જેવો દૈવી શખ્દ સંભવતો જ નથી. એનાં ઉદ્ભૂત તો અંતરના ઊડાણુંમાં થાય છે. એનાં આતિમિક આકર્ષણું અને પૂર્વભવનો ઝડણાનુંંં હોય છે. ઉપરછલ્લા કામિક બોગો. ત્યાં ગૌણું ભાગ ભજવે છે.

ઘેર, નોંધી દે. આ ભવમાં તહારી આશા ઇણનાર નથી. સ્વી જાતિને મન શિયળવતનું પાલન એ મોટામાં મોટી અને અમૂલ્ય વસ્તુ છે. ચંપાના માલિક સાથેના મારા સ્નેહ બંધન કાચા તાંતરે નથી બંધાયાં. ભાઈ ! માને તો હજુ પણ એક ઝેણ પોતાના ભાઈ પ્રત્યે જેવો સ્નેહ રાખે તેવો સ્નેહ તહારી સાથે બાંધવા તેથાર છું. ભૂતકાળની અન્ય સમૃતિને વિસારી મૂકી આ નવો સંબંધ બાંધવા ઉત્સુકતા જાખવ. અમને માન પુરસ્સર અમારા નગર ભેગા કરી

પરોપકાર સાથે માન અકરામનું ભાજન બન. તહારો એ ઉપકાર મારી છાતીમાં જડાઈ જશે. સાચી માનવતા અતાવવાની આ તક ન ગુમાવ. એમાં જ આત્મશ્રેષ્ઠ છે.

ધારિણી! મને ખાતરી જ હતી કે તું તહારી હણ નહીં હોય. મારી વાત રહેલાધ્યા નહીં માને. મારી ઢીલાશ જોઈ તું જીચી ચઢતી જાય છે. મેં સેવેલી ચિંતા અને વેઠેલા ઉજગરા એ કાંઈ ઘેણના હેત માટે નથી. એનો બદલો તો ગ્રેયસીના આલિંગનથી વાળવાનો છે. પતિ-પતિન તરીકે જોડાઈ સંસારી વિલાસ માણુવાના કંઈ કંઈ અભિવાષ છે: એ પૂરવાના છે.

શિયલવત અને પતિપતિનાપણું જેવા શષ્ટદતો રસ વિહૃણું માનવીએ- એ નિપળવેલા પ્રવાપ માત્ર છે. સરએ સરખાનેં યોગ મળ્યા છતાં ઈદ્રિયોની ભૂખ ન ભાંગવી એ મીહા પાણુના સરવરતે જોયા છતાં તરસ્યા રહેના બરાબર છે. અત્રીશ વાનીઓથી ભરેલ થાળ સામે છતાં ભૂખ્યા મરવા તુલ્ય છે. એવી ભૂખ તો કોઈ ભૂરખ કરે. આ નાયક તો નહીં જ કરે. માનુની ! વિલંબ ન કર. આનાકાનો તજ હે.

તું નહીં જ માને તો હું બળાત્કાર કરીને પણ મારો છંચણ પૂરીથ.

પામર આદમી ! તેણે પ્રેમની વાત વહેતી મૂકી, એટલે જ મેં આટલું સંભાપણ ચલાયું. મૂર્ખ ! ‘પ્રેમ’ની કિંમત તું આ ભવનમાં આંકડી શક્વાનો નથી જ. તહારા કાભી જીવનની લોકુપતા પૂર્ણ કરે એવી આ એવી નથી. ક્ષાત્રજટને ગળથૂથીમાં પીનાર આ રમણુને કુવાણીઠી જેવા છતાં એના એજસનો ખ્યાલ નથી આવ્યો. શરા પિતાની પુત્રી અને વીર પતિની પતિન તહારા સરખા માસુકી અને પણ લાંસસા વાળા માનવીના હાથમાં પોતાની કાયાને મૂકવા કરતાં મરણુની લેટ કરવામાં વધુ આનંદ લેખે છે. આથે રમણું પોતાના પવિત્ર જીવન માટે પ્રાણું પાથરવામાં પાણી પાની નથી કરતી. મોતને હુણેલીમાં રાખીને જ એ જીવન્ત હોય છે.

રાંકડા ! મારા જેવીના ચરણ ચૂમવા પણ તહારા ભાગ્યમાં નથી. સરળયા. ત્યાં તું કયા મોહે સહીવાસ કરવાના સોણુથાં સેવે છે ? કહું

શક્તિના જેરે બોગ વિલાસ માણુવાની વાતો કરે છે? બળાત્કારની ધમકી આપનાર એ નરાધમ! જણી લે કે જીવતી ધારિણી એ તો ઊરી નાગણું જેવી છે. એની લેટ જીવતા કરવાનું ભાગ્ય એકલા ચંપાના માલીકનું જ છે. આત્માવિહૂણું કલેવરને લેટવાથી જે તહેને સંતોષ મળતો હોય તો લે.

એમ કહેતાં જ ધારિણીએ મનમાં પુરુષાદાની પાર્શ્વનાથનું ધ્યાન કરી, સર્વ સંઅધેને વોસરાવી, પોતાની આંગળા પરનો હીરો જેરથી ચૂસ્યો.

શિયળ રક્ષણાર્થી આપધાત કર્યો. આ કાર્ય એટલી ઝડપથી બની ગયું કે બિચારો નાયક તો એ જોઈ આલો જ બતી જયો. વાત આટલી હુદે વણુસી જરો એવું તે ધારતો જ નહોતો, એકાંત પ્રહેઠનો લાભ લુંટવાની ધારણામાં એ અંધ બન્યો હતો. પવિત્રતા પાછળ જીવતની આહૃતિ દેનાર પ્રમદાઓની વાતો એણે સાંભળી હતી પણ આજે નજરે જેતાં જ એ હરી ગયો.

એનો કામણી હરી ગયો. મનમાં ભીતિ લાગી કે માનું અનુકરણ આ વસુમતી કરી ન એસે. આંશિકાર પણ હાથમાંથી સરી ન જય એમ વિચારી ઓલી ઉઠ્યો—

દીકરી વસુ! તું આવું કોઈ પગલું ન ભરતી. એક ખાપ પોતાની એટી પ્રત્યે જેવો વર્તાવ રાખે તેવું હું તહારા પ્રત્યે રાખીશ. હું સમજ્ઞ છું કે તું મારી પાસે રહેવાનું નહીં કણૂલું કરે. મારો એ માટે આગ્રહ પણ નથી. તહેને હું કોઈ ગૃહસ્થના હાથમાં સેંપીશ. તહાં ભાવી જીવન ઉજ્વલ બને એવો માર્ગ ગ્રહણ કરીશ. મારો નરો તહારી માતાના સમર્પણથી ઉત્તરી ગયો છે. ખરેજ એ રમણી રતન હતું. જે વાત એના જીવતાં હું ન સમજ શક્યો એ એના મૃત ચહેરા પર રમતી પવિત્રતાએ મને સમજાવી છે.

પુત્રી! સત્ત્વર ચારા, કૌશામ્ભીના માર્ગ અંગળ વધવાનું છે. ત્યાં વસતા સદગૃહસ્થેની મને માંહિતી છે.



પ્રકરણ ૧૦ મું શું ધારિલું ચાલી ગાઇ !

મુને અન્યથી તો એ થાય છે કે મારા હાથે વારંવાર પરાલય પામનાર કૌશાળીપતિ આમ એકાએક છાપો મારી જયો. અને તમો બધા સૂતા રહ્યા ! એની એ હિંમત સંભવતી નથી. વળી તમો જાણુંને એદ્વકાર રહેં. એમ પણ માની શકાય તેવું નથી. એ પાછળ જડ્ઝ કંઈ બેદ છે.

મહારાજ ! આપશ્રીને જેમાં બેદનો જંધ આવે છે તે વાત અમેને પણ ઓછી ગૂંઘવી નથી રહી. ચંપાનગરી કંઈ સાવ સાધન કે સૈન્ય વિદ્ધાલી નહેઠા. 'શત્રુની હીલયાલ રાત્રિના અંધકારમાં એટલી ગુપ્ત રીતે થઈ છે કે ભલભલા મહારથાને પણ આશ્ર્ય પેદા થાય. આ તો રામના વનવાસ પ્રસંગની રમૃતિ કરાવે છે. આગલી સાંજે અયોધ્યાની પ્રજન સારી રીતે જણી ચૂકી હતી કે આવતી કાલે શ્રીરામનો રાજ્યાભિપેક થવાનો છે. પણ થીજી સવારે નિકામાંથી જગતાં જ કોઈ જુદું જ દસ્ય નિહાયું. શ્રીરામ તો સત્તી સીતા. અને અતુજ બંધુ લક્ષ્મણ સાથે વનવાસ સીધાવી રહ્યા હતા. અમો રાત્રિના દ્વારા પણ તાં લગી

શત्रुની હીલયાલનો રવ સરખો સંભળાયો નહોતો. સવારે તો ધામધૂમ પૂર્વક રાણીજી-વસુમતી આદિ ખીમંડળ ઉદ્ઘાનમાં શ્રી વાસુપૂજન્ય-સ્વામિના ચૈલ્યમાં મહોત્સવ જિજવવાનું હતું. પણ આંખ ખુલતાં જ મહાલયમાં રાણી કે કુંવરી કોઈ નથી એવા સમાચાર મળ્યા. રાજબની તરફ પગલાં પાડયાં તો જાણુવામાં આવ્યું હે નિશાકાળની ગણુત્તીની ધટિકાચોમાં શ્રીષ્ટમ નિવાસમાં જબરી જિથેલપાથે મચી ગઈ છે. દરમિયાન સેનાપતિએ સામનો કરવાનો ઉચ્ચિત પ્રભંધ પણ કરી શીધેલો. પણ એ પૂર્વે તો છાપો મારનાર પદ્ધાયન કરી ગયા હતા. સામી છાતીએ લડનાર કોઈ યોધો દશ્ઠિજોલ્લાર ન થયેટ સંરક્ષક દુક્કિએ પડકાર જીલવામાં કચાણ નહોતી રાખી, ખણું આ નિશાયરોનો છરાદો આંડાના દાવ ખેલવાનો હે પરાક્રમ શ્વોરવવાનો નહિ પણ લૂંટ અને હૃહાવભિરનો જ જાણ્યો. ભાંગઝોડ, લૂંટ અને રાણીજી તથા કુંવરીનું હરણ એ વાતના જ્યંત પુરાવા છે. એ લોકોની પૂંહ પકડતાં અને પગલાં જોતાં ખાતરી તો પાકી છે કે આ કામ કૌશામણીના સૈનિકોનું જ હતું.

પ્રધાનજ ! તો આમ કરી શતાનિહે મારી આખર ઉપર હુાથ નાંખ્યો છે.

ના,ના, મહારાજ ! એમ અનુમાનવામાં પણ ઉતાવળ જેવું કહેવાયું યશપાળ ! તમો આમ ક્યા આખારે કહો છો ? અંતઃપુર પરનો હુમદ્રો સામાન્ય ક્ષત્રિય પણ ન સાંખી થકે તો હું અતથતુ...

મહારાજ ! મારા ચરપુરુષ આરક્ષતે જાણુવા મળ્યું છે કે રાજવી શતાનિક તો આમાં હાથાડ્ય બનેલ છે. ચંપા પર સર્તા વિજયની અધ્યાલાળ આપનાર એને એક નાયક મળ્યો. એનાથી હા પડાઈ નઈ. આકી નાયકના હૃદ્યમાં ને દ્રુપી રમત રમાઈ રહી હતી એથી એ તદ્દી અનાથું હતો. મારા ચ્યાશુરપક્ષના સંખ્યાખ્યા મને કે જાણુવા મળ્યું છે

તે ઉપરથી હું હિમતપૂર્વક કંડી શકું છું રાણી મૃગાવતીના પ્રેમને તરણોડી કે એની ઉપરવટ જઈ બીજુ કોઈ નારી પર આંખ વાળવાની શક્તિ શતાનિકમાં નથીજ.

તો પછી આ બનાવ પાછળ શી રમત છે ? સેનાપતિ ! તમો કેમ મૌન છો ?

મહારાજ ! હું મારા ખાસ સૈનિકોના આગમનની રાહ જોઈ રહ્યો છું. આપણું સૈનિકોએ એ ભાગેકુએના ધણું ખરાને યમના અતિથિ બનાવ્યા છે. બહુ થોડાકે જુ દૌશામ્ભીને સીમાડો જેયો હશે.

ત્યાં તો પહેરેગીરે આવી ખખર આપી કે, બહાર એક સૈનિક ઉલ્લો છે જે જે અંદર આવવાની આજ્ઞા માગે છે. સેનાપતિને ખાસ મળવું છે એમ કહે છે.

જા, જા, એને જલ્દી અહીં મોકલી આપ.

સૈનિક આવી, નીચા નમી સવામ કરી, સેનાપતિનો છથારો થતાં કહેવા માંડયું—

રાજધિરાજ ! અમારા નાયકના હૃકમ પ્રમાણે અમારી દરાની દુકદી, પગીની સ્ફુરણા અતુસાર અરણના ઊડાણુંમાં આગળ વધી રહી લગભગ એ ધટિકા પર્યાત એ રીતે ખાર્ઝ કાપ્યા પછી જે દશ્ય અમારી નજરે ચઢ્યું તેથી અમો સર્વ દ્રુજ ઊઠ્યાં. સમરાંગણુંમાં મારકાપ કરનારાં અમારાં હૃદયો પણું ધડીલર કરુણુતાથી હાલી ઊઠ્યાં અને આંખોમાંથી અશ્રુપ્રવાહ વહી રહ્યો. મહારાણી ધારિણીદી જમીન ઉપર પડ્યા હતા. ચહેરાની કાનિતમાં જરા પણ ફેર નહોંતો પડ્યો. અચેતન દ્વારા જોઈ લાગ્યું કે તે એભાન દશામાં હશે. પણ બારીક તપાસના અંતે જણાયું કે એમનું પ્રાણુપદ્ધેર દેહરૂપી પિંજરમાંથી ઊડી ગયેલાં છે. કોઈ પિશાચના પંજમાં સપડાયેલ રાણીઓ પોતાના શિયલપ્રતના રમણ અર્થે આંગળી પરની વીઠીને હીરા ચૂસી જાતે આપદાત કરેલો છે.

अमात्राभांधी यारेक जणु आसपास तपासमां ઇरी વખ्या. હુરહુર સુધી ધરતી ખૂંદી વખ्या પણ ગુનહેગાર વ્યક્તિનો પતો મળ્યો નહિં. તેમ કુંવરીઓનાં કંઈ ચિનહ હાથ આવ્યાં નહિ. અમોએ સૌ પ્રથમ રાણીજના શાય સાથે પાછા ફરવાનો વિચાર કર્યો અને હું તેઓથી છુટો પડી હોડતે ધોડે આ વાત જણાવવાં આગળ આવ્યો છું.

ત્યાં તો દારપાલના પગલાં પુનઃ થયાં. પ્રધાનજી તરફથી કૌશામ્ભી ગયેલ હુત પ્રવેશની આજા માગે છે એમ એણે સલામ ભરી જણાવ્યું.

‘અહીં એને પણ મોકલી આપ’ એવો રાજ્વીનો હૂકમ મળતાં જ દારપાણ પાછો ફર્યો અને હુતે આવી નમન કર્યું.

પ્રધાનજી હુતને ઉદેશી બોલ્યા—

નંદન ! મેં જે સંદેશ પાડવ્યો હતો એના જવાયમાં કૌશામ્ભી-પતિએ જે કંદું હોય તે મુદ્દાસર સત્તવર કહી નાંખ.

આપની સૂચના અનુસાર મેં કૌશામ્ભીના દરખારે જઘ, રાજ્વી શતાનિકને ભારા આગમનનો હેતુ કહી સંભળાવ્યો. તેમની આજા થતાં જણાવ્યું કે—

મહારાજ ! આપ જેવા ક્ષત્રિય કુલાવતંસને અને સંસાર-વ્યવહાર-ની નજરે એક નજીકના સંખ્યાને ચંપા પર રાત્રિના અંધકારનો લાભ લઈ છ્યો હુમલો કરવો બિલકુલ છાજતો નથી. એમાં પણ ચંપાપતિની ગેરહાજરીમાં સીધી લડત ન માંડતાં રાણીવાસના કમરા પર હુલ્લો લઈ જવો એ ધણું હીધું ને હલકટ કર્યું છે. આપ જેવાને વધુ શરમાવનાડું પણ છેજ.

આટલા શખ્ષ સાંભળતાં જ સલામાં અન્યથી પ્રસરતી મેં જોઈ. પ્રધાન આદિ મુખ્ય અધિકારીએ રાજ્વી પ્રતિ મીટ માંડી રદ્દ પરિસ્થિતિનો લાભ લઈ મેં કડકાઈથી આગળ ચલાવ્યું.

એર, તમેને ખાંડાના એક એલવા નહોતા ગમતા અને આમ પીઠ પાછળના ધા કરવા દ્વારા વિજયના ઢોલ વગડાવવા હતા તો તેમ ભલે કર્યું. પણ એમાં રાણીજ તથા કુંવરીઓનું અપહરણ કરવાની શી જરૂર હતી ? એમ કરવાથી આપની કષ્ટ પરાક્રમ ગાયા નોંધવાની હતી ? એક રીતે ધારિણી રાણી એ પદ્માવતી રાણીના શોક્ય ગણ્યાએ, અને આપના રાણી મૃગાવતી અને અમારા પદ્માવતી તો બહેનો રહી, એ જેતાં ધારિણીરાણી પણ મૃગાવતીના બહેન જ લેખાય. એમના જિપર કુદ્દિટ કરવી એ શું કૌશાખ્યીના રવામીને છાંજે છે ? મૃગાવતી જેવા આર્ય રમણી એવું આચરણ નભાવી લેશે ખરું ?

મહારાજ ! મારા સ્વામીની ભુજાએ શૌર્યના દાવ એલવા અને શખોના ચમકારા બતાવવા સહા તૈયાર જ હોય છે. વૈશાલી પતિ ચેટકરાજના સંપર્કમાં આવ્યા પછી એમણે રાજ્યલોભ રાખ્યો નથી. એટલે પોતાનું સાચવવામાં જ તેઓ જૌરવ માને છે. એનો અર્થ જેએ જિધે કરી એમની નખળાઈ માનતા હોય તેઓ સમજ રાખે કે એમની નાડીમાં એજ શ્વરાતન વહી રહ્યું છે. નકામો રક્તપાત એ ચાહતા નથી, પણ કોઈને ચુદ્ધ માણવાના કોડ હોય અને વિજય વરવાની લાલસા હોય તો સામે મુખે આવવાનું તેમનું એને આર્ધાન છે.

તેમની વીરતા જગમશહૂર છે. દ્શ્વપા દાવ ધાવ એમને ગમતા જ નથી. એ તો નીતિપૂર્વ કના ચુદ્ધમાં માને છે. નામ ધિવાહન છતાં જીતશત્રુનું બિરદ પ્રાપ્ત થવામાં એમની ચુદ્ધ વિશારદતા કારણભૂત છે.

વારંવાર પરાભવ પામ્યા છતાં, જીતશત્રુના પ્રરાક્રમ નજરે નિહાણવાના અભિવાષ હોય તો સમય અને રથાન નક્કી કરેા. ભલે સમરક્ષેત્રમાં એકવાર ક્ષાત્રતેજના દર્શન થઈ જય. વિના કારણ લોહીની નહીંએ ન વહેવડાવવી હોય તો, મારી સાથે માન પુરસ્કર રાણીજ એ કુંવરીઓને વિદ્યાય આપો. ક્ષાત્રતેજની શોભા એમાં સમાયેલી છે.

રહી સહી એ વટ—એ આયર્ડ—કૌશામ્ભીપતિ ન ગુમાવે એવી અંતરની કામના હોવાથી મને પ્રધાનજીએ આપની પાસે મોકલ્યો છે.

રાજધિરાજ ! આટલું કલ્યા પછી હું મૌનપણે અધિકારી વર્ગના ચહેરા તરફ મારી આંખ ફેરવી રહ્યો. સર્વના મહોાં મને ઠીલાં પડી જયેલાં જણ્યાયાં. મને એ ઉપરથી લાગ્યું કે તેઓને અંધારામાં રાખી આ તરકીબ રાજવીએ પોતે ગોદવેલી છે.

ત્યાં તો ખુદ રાજવીએ મોં ખોલ્યું અને જે વાત રજુ કરી એ સાંભળતાં મારું અનુમાન સાચ્યું હતું એમ પુરવાર થાય છે. કૌશામ્ભી પતિએ કહ્યું કે—

દૂત ન દન ! સૌ પ્રથમ મારે કખૂલવું જોઈએ કે અહીં એઠેલાં મારા એક પણ અધિકારીને। આ કાર્યમાં હાથ નથી. અરે એમની સલાહ સરખી પુછવામાં આવી નથી. સાથેસાથ એ પણ તું જણી લે કે, મારી ધર્માચાર્ય કરી નકામો રક્તાપાત કરવાની નથી, અને કુદરતે સાંઘેલા સંખંધને તોડી અને વિકૃત કરવાતું મારું મન પણ નથી જ.

અંતઃપુરના હુમલાથી હું સાવ અભણ્ય છું. જે નાયકની સલાહથી હું ચંપા ઉપર વિજય મેળવવાની લાલચમાં ઇસાયો. એણે મને પણ કુટલીક વાતથી અંધારામાં રાખ્યો છે. તારી વાત પરથી ૨૫૦૮ જણ્યાય છે કે એની મુરાદ કોઈથી હિસાએ રાણીજીને ઉપાડી જવાની હેઠી જોઈએ અને એ એણે આ રીતે ખર પણ આણી છે. મને વિજયની લાલચે ભોળવી એણે એ કાર્યમાં જરાપણ નહતર ન થાય એ અર્થે મારી સૈનિક દુકદીઓનો સહકાર મેળવ્યો છે. મૃગાવતી જેવી સતી રમણી મારા અંતઃપુરમાં છે એ મારું જેવું તેવું સૌભાગ્ય નથી. ગ્રણની વહુ-દીકરી જ્યાં મારા મનથી પોતાની પુત્રી સરખી છે ત્યાં ખર રાજ્યની રમણી પ્રત્યે મારી નજર બગડે એ શક્ય જ નથી. હોઠ માને પણ નહીં અને એમાં પણ પદ્માવતીની શોક્ય પર ! એ આકાશ

કુશમવત् અશક્ય ! સૈન્યનો જે ભાગ પાછો ફર્યો છે એના દારા માત્ર એટલા જ સમાચાર મળ્યા છે કે નાયક પાછળ રોકાયા છે. હજુ એ મૂર્તિના અહીં પગલાં થયાં નથી. તારી વાત પરથી દાળમાં કંઈ કાળું જણ્યાય છે. એ નાયકે ધરાદા પૂર્વક જ રાણીજ તથા કુંવરીનું હરણું કશ્યું હરો અને એ પાછળની પોતાની મલિન વાસના બર આણુવા સાડ પાછળ રોકાયો હરો. કદાચ અહીં હવે આવશે પણ નહીં. નોતિ અને ચારિય માટેના મારા વિચારો હેવા કડક છે એ કોઈથી દ્યુપું નથી. એ જણ્યા છતાં અહીં પગ મૂકવાની હિંમત એ કરવાનો જ નહીં.

છતાં નંદન ! હું ખાતરી આપું છું કે એ નાયક મારા હાથમાં આવ્યા પછી પુનઃ છટકવા નહીં પામે. એના આ પિશાચી કાર્ય માટે જરૂર એને યોગ્ય નશિયત થશે જ. એ વેળા એનો હોદ્દો કે પૂર્વકાળની સેવા આડા નહીં જ આવી શકે.

આજથી હું એની તપાસ કરાવું છું. તમો પણ તપાસ કરાવો. કૌશાખ્યીમાં એ આવશે તો પહેલી તક હું રાણીજ તથા કુંવરીને માન, પુરરસર ચંપા મોકલી આપીશ. જે કંઈ બન્યું છે એમાં તારા માલીક જટલું જ મને પણ હુઃખ થયું છે એમ મારી તરફથી તું જણાવને.

ભૂલનો લોગ કોણ નથી બનતું ?

માલીક ! કૌશાખ્યીપતિએ ઉપરનાં. કથન પછી મને સતકારપૂર્વક વિદ્યા આપી. હું પણ બનતી ઉતાવળે ત્યાંથી દોડતો આવું છું.

આ સર્વ સાંભળ્યા પછી યશપાળે વાતના અંકોડા જોડતાં જણ્યાયું કે—

મહારાજ ! શતાનિક ભૂપ, નાયકની વાગ્નણમાં ફરી પડ્યા છે. એટલું જ; બાકી બીજી વાતમાં જરૂર અનણ છે. આ કાવતઙું કરનાર જે નાયક છે એ રાણીજના પ્રસંગમાં—મારા માદર વતનમાં—એકવાર આવેલ છે. એમ કઢી કુવાડિ પાણી માંગતાં અનેક બનાવ દૂંકમાં અહીં સંભળાવ્યો.

વળી ઉમેયુંકે મારા ચર મારકૃત તપાસ કરાવતાં જે ને આદ્ભીઓ શાંકા પડતા જણ્યા તેમના ધરની જડતી લેવામાં આવતાં એક કરણુસિંહ નામે દારપાળના ધરમાંથી જે પત્રો મળ્યા એ ઉપરથી વાતનું ચોકડું બરાબર બેસેંછે. ચંપામાં ડોઢ ફૂટેલ આદમી ન હોય તો અહીંની રજે ૨૯ બાતમી કૌશામણી જવાનો સંભવ ઓછો ગણ્ય. છાપો મારનારે બધી ગણ્યત્રીથી કામ લીધું છે અને નહીં જેવા સામનાએ ધૂપિસત કાર્ય પાર પાડ્યું એ પેલી બાતમીના આધારે જ.

પત્રનો કંઈજે લઘુ, એ કરણુસિંહને દ્યાવતાં જ એણે બધું સાચે સાચું કહી દીધું છે. નાયક અને મામો થાય છે. અહીંથી બાતમી આપવાનું કાર્ય એ જ કરતો હતો. પોતાને પાળા પોષી મોટો કરનાર આ મામાના આભાર હેઠળ આવવાથી અને આ કાર્ય કરવાની કરજ પડી હતી. રાણીજીના અહીં આવ્યા પછી એકવાર પેલો નાયક દ્યુપી રીતે આવી તેમને જોઇ ગયો હતો.

તો તો એમ જ કહોને કે બાળપણના પરાક્રમે રાણીજીનો લોગ કીધો. એકાદ નાનકડી ભૂલનું આવું કરણું પરિણામ !

એમ કેમ મનાય ! આમાં તો ક્ષત્રિય રમણીના હૃદયની સાચી અળક દાષ્ટ ગોચર થાય છે. નારી જત માટેની ગૌરવ જાથા આદેખ્યાય છે. સ્વમાનના રક્ષણ અર્થે અખળા પણ પ્રથળા બની શકે છે એનો જીવંત પુરાવો મળે છે.

શબદની જે હાલત સૈનિક વર્ણની એ પરથી સહજ કળી શકાય છે કે સ્વ શિયલના રક્ષણ અર્થે પ્રાણુની કુરખાની આપીને પણ પેલા નાયક સામે પોતાની મહત્તમાને-ક્ષત્રવટને-અખંડ રાખી છે.

સ્વને પણ નહીં કદમ્બું હોય એવું રાણીજીનું ચા પરાક્રમ જોતાં જ પેલો નાયક આભો બની ગયો હુશો. કદમ્બ અને લાઘું હશો કે ‘મા’

ના પગલે દીકરી પણું જય. એટલે તરત જ ત્યાંથી કુંવરીને લઈ જ ગલના આડા માર્ગે તે પલાયન કરી ગયો હશે.

મિત્ર યથમાલ ! મને તારું અનુમાન વારતવિક જણાય છે. હું સરહદના અખેડાને દાખવા સારું પ્રયાણું કરવા તૈયાર થયો. ત્યારે આટલા વર્ષોના સહવાસમાં કોઈવાર નહીં સાંભળેલું એવું વચ્ચન ધારણીના મુખમાંથી સાંભળ્યું. તેણુંએ જાણે ગમગીન થતાં ન કહું હોય એમ જણાયું કે—

તમો જતે ન જતાં, કોઈ સેનાપતિને મોકલેા તો ન ચાલે ? એ સાંભળી મને પ્રથમ તો ભારી અજયથી ઉપજી. હું એકાએક પોકારી ઉઠ્યો—

આ કોણું હરનામસિંહની તનયા બોલે છે ? જેની પ્રેરણું અને પ્રોત્સાહનથી હું પત્તિના વિરહદૃઢાખને વીસારી સાચા ક્ષણિયને છાને એવું જીવન જીવતો થયો. અને શત્રુગણ ઉપર રવપરાઈમની પ્રતિષ્ઠા સ્થાપન કરી ‘જાતશત્રુ’ કહેવાયો, એ શરીર રમણીના મુખમાંથી આવા નિરાશા સૂચક ઉદ્ઘાર નીકળે છે ?

‘આપ સમાન બળ નહીં અને મેધ સમાન જળ નહીં એ લોકાક્રિત જોઈ નથી જ. ક્ષત્રિયવટના નૂર તો સમરભૂમિમાં જ પરખાય. ધર આંગણે બંધનમાં પડવાનું હે કૃત્યાંક વિલાસમાં રવ્યા પર્વ્યા રહેવાનું એને ન પોસાય. તારી સલાહ પાછળ કંઈ ખાસ કારણ હોય તો હું મારો કાર્યક્રમ ફેરવવા તૈયાર હું.’

ખાસ કે મહત્વતું કારણ તો કંઈ નથી જ. મને કેટલીક વાર અમંગળ થવાના ભણુકારા વાગ્યા કરે છે. આ બધી સંપત્તિમાંથી હું એકાએક ગણી પડીશ એવા વિચાર અચાનક આવી જય છે. તમો જીબીપ હો તો એ વાત ભૂલાઈ જવાય એ જ માત્ર હેતુ છે.

હું, એવી કુશાંકાએ ધરવાનું કામ વખ્યિક વર્ગની નારીઓને માટે ભલે અનામત રહે. આ જાતના વહેમ એ તો એક પ્રકારની નથળાઈ સૂચક છે. ક્ષત્રિયાણીના અંતરમાં એનો કણું સરખો ન સંભવે. તું એ કિંદર રહે, હું જલ્દી પાછો ફરીશ.

આજે એ દિનની વાત પાછળનું તથ્ય સમજય છે. અમારી એ છેલ્દ્વી મુલાકાત જ નીવરીને ! ધારિણી તો ગઈ જ ને ! એતું મૃત્યુ તો શરીર ક્ષત્રિયાણીને છાજે તેવું. મારી દશા તો પાછી ફરીવાર એકલવાયી બની ગઈ. હા, હૈવ ! તેં આ શું કરી નાંખ્યું ! અરે વિધાતા ! મારા સિવાય તહેને કોઈ અન્ય પાત્ર જડતું નથી!

હજુ એક પ્રાણું વલ્લભાનો. પત્તો મળતો નથી. એ જીવતી છે કે પરલોક પ્રયાણું કરી ગઈ એના કંઈ સમાચાર સાંપડતા નથી ત્યાં ગલરૂ ભાગા વસુમતીના અપહરણના ધા !

પુરોહિત-રાજ્ઞ ! રાણીમાતાની અમર પ્રેરણા શું આપ આગકી જલ્દીથી ભૂલી જવા માંગો છો ? કર્મરાજે કોને કોને નચાબ્યા નથી ! જ્યાં એના વિલક્ષણું સપાઠામાં ભલ ભલા શંભુ, સ્વયંશુ અને હરિ વા દ્યંક જેવા બત્રીશ લક્ષણુંએ આવ્યા છે ત્યાં આપ જેવાને આ જાતની નાશીપાશી શોભતી નથી. ધારિણી રાણીનું નામ તો સાહિત્યના પાને અમર બન્યું. એથી તો હજરો રમણીઓને તાકાત ફરખવાની અજખ પ્રેરણા મળવાની. એ નામ તો સતીઓની હારમાળા માં શોભવાનું. જે જીવતા છે એનો કોઈને કોઈ દિ' અવશ્ય મેળાપ થશે જ. મારું જ્યોતિષ કરીબંધ ખરું પડતું આવે છે. એ દિનની વાત આપ જ વિચારી જુવો. આ શોકના ટાણે એતું પુનરાવર્તન છું નથી એટલે એટલું જ કહું છું કે ક્ષાત્રવટને શોભે એવી રીતે ભૂતકાળને ભૂલી, વર્ત્તમાનમાં વર્તો.

સાચું છે તમારું વક્તવ્ય ભૂહેવ ! આ વેળા હું કંઈ વિરહના નાસે

જરાપણું હતાશ બનનાર નથી. બમણું જોરથી કાર્યરત બની, મારી પ્રિયાના અકાલ અવસાનમાં નિમિત્ત ભૂત થનાર એ નાયકને-મારી શુદ્ધ કુલવાડીમાં અંગારો ચાંપનાર એ નરપિચાચને દુનિયાના પડ-માંથી શોધી કહાડીશ. બદલો લીધા વિના હું જંપનાર નથી જ.

ત્યાં તો દારપાળે આવી નજરીની ભાગોળે રાણીજીને મૃતહેઠ આવી જયાના સમાચાર આય્યા.

તરત જ સૌ જિફ્યા. પોતપોતાના સ્થાનકે જઈ શોકસૂચક વખ્તો પરિધાન કરી, સત્ત્વર સૌ દરખારગદમાં એકઠા થયા. જિચિત દૃષ્ટયા સહિત ચંપાનગરીના મહારાણીને છાને એવી રીતે મૃતહેઠને અભિન સંસ્કાર કરવાના કાર્યમાં લીન થયા.



મફકરણું ૧૧ મું લીલામના અજારમાં વસુમતી

અરરર ! નર્સીબ ચાર ઉગલા આગળનું આગળ જ આવ્યું !
 ‘ ભાગ્ય વિના નર કોડી ન પાવે ’ એ જન વાયકા મારા માટે તો
 સાચીજ નીવડી. હાથ આવેલ રમણી રતન ચાલ્યું ગયું. મારા તક-
 દીરમાં ગૃહિણીનું સુખ નથી જણાતું. હતી તેની જોડે મેળ નહોતે.
 એ મરતાં મનમાં આશા જન્મી કે કોઈ મારા સ્વભાવને અતુર્પ જોડે
 છેડા ગાંડીશ. ધારિણીને કુવાકાંડે જોતાં જ સ્નેહનો અંકુર ઉદ્ભબ્યો.
 પણ એ વેળા મરદાધના ધમંડમાં હું તણ્યાયો. સ્નેહનો પ્રચલિત રાહ
 ચૂકી કોઈ જુદીજ દિશામાં વલ્યો.

કેવી મોહક આકૃતિ ! કેવો નમણે. ચહેરો ! હસતું સુખ ! એ પુલ-
 કિત વદન તો હજુ પણ ચક્ષુ સામેથી ઘસતું પણ નથી.

રાજમહાલયના વિલાસ માણુનારી એ પ્રમદ્દાએ મને બંધવ તરફે
 લેખવા હાથ લંબાવ્યો, પણ મેં મૂરખે હંડ ન છોડી.

શિયળત્રતનો મહિમા જેની શિરાઓમાં સતત વઢી રહ્યો છે એવી
 એ રમણી શું મારા અજાતકારને તાખે થાય ? એષે તો પ્રાણ ન્યોધા-

વર કરી ત્રણ કુળની કીતિં અજવાળી. મારં જીવન તો ત્રિશાંકુની દ્વારામાં આવી પડ્યું. નીરાત-તીરાત બ્રહ્મ જેવી જતિ થઈ. અખાં-ગના મળી નહીં અને નાયકનો અધિકાર હતો તે પણ જયો. ધારિ-એનિના મૃત્યુ પાછળનો સારોથે વૃત્તાંત જાહેર થઈ જયો. હશે. મારા માટે ક્રાશાભ્રી અને ચંપા સંસ્થાઓનાં દાર વસાઈ ગયાં. હવે તો આ ધરતીને રામરામ કરી કોઈ અગમ લોમ પ્રતિં પમલાં સત્તવર ભરવાં રહ્યાં. નાયકનો સ્વાંગ ઉતારી નાંખી, જીવન રક્ષાથે કોઈ આવા-જોગીના વાધા ધારણું કરવા રહ્યા.

જીવન જલ્દી નિશ્ચય હુપર આવી જા. વાપિદા પર સ્નાનશુદ્ધિના નિમિત્ત ગયેલી વસુમતી પાછી ઝરે તે પૂર્વે માર્ગ નિરધારી લે. પુત્રી તરફે આશ્વાસન આપ્યું છે તો હવે એ ધર્મ બરાબર બજાવવો. ગ્રેટ એવા ગૃહરથના હાથમાં સેંપવી કે લેથી માતાના ચહેરા ને અનુરૂપ છિતરેલી એ આળા પવિત્ર પણે જીવી શકે.

સામાન્ય મૂલ્યનો ખરીદનાર હાલતા ચાલતા ભળે પણ લાખ જોનેયા આપનાર થોડા ! પારખ કરીને લેનાર કિંવા કરુણા ભાવનાથી જીભરાઈ જનાર-વ્યક્તિ જ એ દામ આપશે. ભાવિ જીવનમાં એ રક્મથી મને સધિયારો ભળશે અને હેતુ બર આપશે.

ત્યાં જળ ભરેલા કુંભ સહિત આવતી વસુમતી દેખાણી. માતાના આપધાતરી જે દુઃખ લાગ્યું હતું તે ચહેરો જેતાં જ દીસી આપતું. એમાં છેલ્લા ત્રણ દ્વિત્સમાં માર્ગ કાપતાની હાડમારીએ ઓછી નહોતી અનુભવી. રાજ મહાલયમાં ઉછરેલી ખાળાને આ અનુભવ તહેન નવો હતો. નાયકના હોર્ચા એને ચાલ્યા વિના અને ગાઠ જંબલમાંથી બહાર નિકળ્યા વિના દ્શ્વટકોઝ ન હોતો. વયમાં પાકટ ન ગણ્ય છતાં શુદ્ધિમાં વસુમતી એની ઉમરની ખાળાએને ટપી જય તેવી હતી. અમીર તો માતાપિતાનું વારસામાં જિતરી આવ્યું હતું. સાચે જ અદ્ભુત ખાળા હતી.

કોઈ શહેર કે જામ નજરે પડતાં જ આ નાયકના હાથમાંથી ચુક્કિતી-પ્રયુક્તિ કરી છૃદ્વાનો એનો સંહલ્પ દઢ થયો હતો. ઉપર જેથું તેમ નાયક પણ જલ્દીથી એનો નિકય કરી આ ભૂમિને છેલ્લી સવામ કરવા માંગતો હતો.

કુંભના જળથી સત્તવર એણે મુખ પ્રક્ષાલન કરી, આગળ વધવાની તૈયારી કરી લીધી. કોશમણીના ઘોરી માર્ગથી ગણેક ગાડ દૂર આવેલ એક નાનકડા છતાં કૃયવિક્રિયના ફેન્ડ ગણ્ણાતા ગામે આવી પહેંચ્યા ત્યારેજ ઉભયે પોતાના ગતિમાન બનેલા પગોંતે આરામ આપ્યો. એકાદ વિશાળ વૃક્ષની છાયામાં ઉભય બેઠા અને સામેના ચોગાનમાં દર શુફ્ટવારે ભરાતી ગુજરીની રાષ્ટ્ર જોવા લાગ્યા.

આસપાસના પ્રહેણમાંથી સવાર થતાં જ માનવીઓ કૃયવિક્રિયની ચીજેનાં પોટનાં બાંધી ચાલી નીકળતા લગભગ મધ્યાહ્ન પૂર્વે તો ચોગાન વિવિધ વસ્તુઓના કામ ચલાડી હાટથી ભરાઈ નેતું. જુદાં જુદાં શાક પાન ઇણ તેમજ ધાન્ય ઉપરાંત માટીનાં રમકડાં તથા જત જતનાં વાસળો, ગાય, બળદ, બેટાં, બકરાં, ધોડા જેવાં ગ્રાણીઓ પણ લાવવામાં આવતાં. ધરકાર્યને ઉપરોગી દાસ દાસીઓના સોદા પણ અહીં થતાં. ગુલામો પણ અહીંથી જ ખરીદાતા. આ રીતે વિક્રિય કરાયેલાં માનવીઓ ખરીદનારની પાછળ રાજુ ખુશીથી જતાં. પંચેંદ્રિય પશુઓની જેમ માનવના વેચાણ થતાં. એમાં કોઈ પ્રકારનો દોષ ન દેખાતો. એ કાળે ઉપર વર્ણવેલ પ્રથા ઉપરાંત કંઈ કંઈ ધતિંગો ગ્રવર્તાં હતાં. અજ્ઞાનતાનું સાઓન્ય પૂર બહારમાં ખીલી જોઈતું હતું. અને એમાં અંધશ્રદ્ધ રૂપી ડક્કિનીએ એનો વો અંબારમટ વિસ્તારોં હતો કે ભલભલા સમજુ ગણ્ણાતા માનવીઓ પણ મૌનપણે એમાં સાથ પૂરતા. આ પ્રકારનું વાતાવરણું સર્જવામાં અચ ભાગ ભજવનારા ભૂદેવો હતા. ધર્મના એહા હેડળ એમણે ફેલ્લીક એવી કુરસીઓ જેલી કરી હતી હેઠેમાં અહિંસા જેવા પરમ ધર્મનું છે-

ચોક લીલામ બોલાતું હતું, એટલું જ નહીં પણ ખુદ્ધિના કંઈ ચદાનતાં જે ઘડીભર ટકી શકે તેમ હતું જ નહીં.

આમ છતાં વર્ણોમાં અમો ગુરુપદે છીએ અને સ્વર્ગ કે નર્કના પરવાના કહાડી આપવાની સત્તા અમારા જ હાથમાં છે એવું વિના રોકટોકે વહનારા દ્વિજ વર્ગનું જેર પ્રવર્તતું હોય અને એ સામે ક્ષત્રિય એવા રાજવીએ પણ હુંકારો ન જોડાવી શકતા હોય, ત્યાં એ જાતની ભયંકર લીલા ચાલુ હોય એમાં આશ્રય્ પણ શું ?

ચક્ષુ સામે કૂર રીતે કાળને કોળાયો બનતાં પણું મરણ સમયની અરેરાડી સંભળાતી હોય, અરે શરીરમાંથી રક્તની ધારા જોડતી હોય, આમ જોડાડી હિંસાના તાંડવ નૃત્ય ભજવાતાં હોય, છતાં યજમાં થતી હિંસા એ દોષપૂર્ણ નથી પણ ધર્મ છે એવા પંડિત મન્યોના પ્રલાપો, સૌંનીચી મૂંડીએ કખૂન રાખતા. જે પ્રાણીની આ રીતે આહૃતિ અપાય છે એ મરીને સ્વર્ગ જય છે એવું પ્રમાણુપત્ર આપનાર યજો કરવનાર વિપ્ર મહાશયનું વાક્ય ‘બાબા વચન પ્રમાણુમ’ માઝક સ્વીકારી લેવાતું. એ સામે ચાંગળી ચીંધ્યા સિવાય ‘સાગરતુ’ પાણી મીડું છે તો હાજ હા’ કહેનારામાં યોદ્ધાએ, વ્યાપારીએ અને રાજએ પણ હતા જ. ચાર વર્ણોમાં શુદ્ધોનો નંબર સાવ જીતરતી છાટિનો. સેવા કરવાનું તેઓ સર્જિયા છે એમ બાપોકાર જહેર કરતું. જીવન ભરની ગુલામી તેમના કપાલે જરી દેવામાં આવી હતી. પવિત્રતાના ધામ લેખાતા—અધમ ઉદ્ધારણ અને પતિત પાવન કરવાના બિંદુને વરેલાં દેવસ્થાનોનાં દ્વાર તેમને માટે અંધ હતાં. અરે એ વર્ણની ગણુના પણ કરતાં પણ નીચી પાયરીએ ખસેડી દેવામાં આવી હતી. આવા વિચિત્ર સંયોગોમાં માનવના વેચાણ થતાં હોય એમાં કંઈ નવાઈ જેવું ન લેખાય.

નાયક તરફથી વસુમતીને વિકયના પદાર્થઢ્યે ખડી કરવામાં આવી. અવનત મસ્તકે તે જોભી રડી. લિન્ન રચી ધારી સંખ્યાઅંધ

મનુષ્યો એની આસપાસ કરી વણ્ણા. તેણીના હેખાવ સંખંધી કે ચહેરાની રમ્યતા વિષે અથવા તો ગુલામ તરીકે એ કેવા પ્રકારનું કામ આપી શક્યો અગર તો એ કયા કયા ઉપયોગમાં આવી શક્યો તે સંખંધી મનમાનતા અભિપ્રાયો પ્રગટ કરવા લાગ્યા. બીજની શરદ્યાત તો જોરપૂર્વક થઈ અને આંક જોતજોતામાં સૈકા વટાવી હજનરે ઉપર પહોંચ્યો. લીલામ કરનારે નાયક સામે જોયું. પણ માથું હવાની નકાર ભણ્યાયો.

ટોળું ઓસરવા માંડયું. સામાન્ય નોકરી તરીકે લઈ જવાની. ધારણાવાળા બીજી તરફ કદમ ભરવા લાગ્યા. સંસારી ધ્રચ્છાયોને માણુષાના કોડ સેવતા રસિકો પણ આંક શતકોને વટાવતો નિહાળી મ્હાં મચ્યકોડતાં વંને માપવા લાગ્યા. કોણ દીકે પણ કરતાં કે દશ હજનર સેનૈયા ! અરે પાંચ હજનરમાં તો દાડમકળી જેવી, રંભાને શરમાવે લેવી, કયાં નથી મળતી ! આમ છતાં ધંધાદારી જરવનિતાઓ તો વધુ નજીક આવી. વસ્તુમતીના ગાત્રોને ધ્યાનપૂર્વક નિરખી, મનમાં કંઈ કંઈ ગણુન્નીએ મૂકી, બીજને આગળ ધપાવતી હતી. શિછામણીનું જેર તેમની હરિદ્રાઇને આભારી હતું. સૌ કાઈને રૂપણ હેખાતું કે આ કુમનીય બાળા જરૂર કુદ્દણુખાનામાં જવાની.

નીચી મૂંડીએ જલેલી વસ્તુમતી પણ એ વાત સારી રીતે સમજ ગઈ હતી. પોતાની આસપાસ ભજવાઈ રહેલા નાટકને એ મૂકપણે નિહાળી રહી હતી. કર્મી કેવા નાચ નચવે છે એ જે અનુભવી રહી હતી. રાજમહાલયમાં જીછરનાર અને સખીઓની કીડામાં મોખરે રહેનાર પોતે આજે કુલી ઘ્રતરનાક દશામાં મૂકાઈ છે એ જોતાં હૃદ્ય રૂટનું; પણ ધ્વાજ નહોંતો. ભગવાન પર ભરોસો રાખી ધીરજથી એ સહી રહી હતી. સારી રીતે મનને મનાવતી કેને કંઈ બની રહ્યું છે એમાં આ સર્વ તો નિમિત્ત માત્ર છે. બાકી તો મારા પૂર્વ જન્મની કુરણીના વિપાક હું લણી રહી છું. હરિશ્ચંદ જેવા સત્યવાદી ભૂપાલને

ચંડાળને ધેર વેચાવું પડયું ત્યાં મારા જેવી કુંવરીને નાનમ શી ? આત્મા તો અનંત રાક્ષિતનો ધણી છે અને એનો પરચો ખતાવવાનો અધિકાર તો મારા હાથમાં જ છે. શા માટે અત્યારથી અભરાવું. નાયકે પુત્રી તરિકે અણવાના અને ડોર્ચ કુલીનના હાથમાં સોંપવાના જે વેદ્યો કહાડુંચાં છે એનું પારખું તો જોઈં. મનમાં આ જતના તરંગોના હીલોને હીંચોલાતી વસુમતી નાયક પ્રતિ એક આડી નજર કરી, પુનઃ નીચું જોઈ ગઈ.

ત્યાં તો લીલામંડારે પચીશ હજર સોનૈયાની જહેરાત કરી. ઘૌબનના આંગણે જિબેલી આ-મુગધાના એટલા દામ ઓછા ન ગણ્ય ! નાયક હા ભણે એની રાહ જોવાઈ. ધણુને લાગ્યું કે હવે સોદો થવો જ જોઈએ.

ત્યાં તો નાયકનું મુખ જિધડયું અને એમાંથી જે શાખેનો ખહાર આવ્યા, એ સાંભળો સૌ અચરજ પામ્યા.

‘ એક લાખ સોનૈયા વિના વેચાણું શક્ય જ નથી.’ જમાના ખાદેલી અલિકાએ મેં મયકોડતી ચાલી નીકળો. સાથે કેટલાક રસિકો ખણું નાયકની હઠ પર મળક જિડાવતાં, લગભગ ખજરમાં ફરી વળી, અહોં આવેલા હેવાથી નગરના સરિયામ માર્ગ તરફ રિધાવ્યા. યાર, લડકી રૂપ રંગમેં તો ખહેતા ખૂઅસુરત, નાંજની સરખી હે. પાંચ પંદરકા મામલા હેતા તો, હમ જરૂર દાવ લગાતે. ઉસીઠું ધર લાડે અંધી બનાલી દેતે.

હાં, બડે ભાઈ, ટેઝોને લાખ અશરફીયાં ? ક્યા ખાત ! બોલનેવાલા અમકો તો દીવાના દીસતા હ્ય ! રંદીકા છતના મૂક્ષ ! છતની રકમ સુપનેમેંબી નહીં દેખી જતી, તો ખીસામેં ક્યા હોવેગી !

દોસ્તો, વાત તો સચ્ચી ને. દિન કહાં કે મીયાં કે પાવમેં જૂતી ! જને હો એ ખાત, છસુકી પૂછે જુગર દુઃખાને સે ક્યા લાભ !

ગુજરીમાંથી નમર માર્ગે પાછા ફરતાં આ લહેરી લાલાયોની વાત પાછળ આવતાં કૌશામ્ભીના રોડ ધનાવહના કાને પડી. તરતજ વણ્ણિક સુલભ બુદ્ધિમત્તાના જેરે અનુમાની લીધું કે લીલામના ચોકમાં જરૂર કોઈ કુલીન લવના ખરી થઈ હશે. સામાન્ય ખીના લાખ સોનેયા સંભવે નહીં.

સામાન્ય રીતે અહીં પગ ન મૂકનાર શેષિ, આડા કંટાઈ સત્તર ગુજરીના સ્થાને આવી પહોંચ્યા. નીચી મૂર્ડીએ ઉભેદી આળાને જોતાં જ પોતાનું અનુમાન ખોડું નથી એવી અતીતિ થઈ. નાયક જોડે એક ઝુદી નાયકને પચાશ હજારથી વધી ડેઠ, પંચોતેર સુધી પહોંચી સોદો કરી લેવાની રકજક કરતી સાંભળી. ત્યાં તો પેલો નાયક પોકારી ઉફ્ફો—

આ કોઈ સામાન્ય બાળા નથી. એ તો રાજકન્યા છે. મારી માંગણીમાં એક દોકડો પણ ઓછો નહીં થાય. જ્યાં એનાં પગલાં પડશે ત્યાં ધનના દ્રઘલા થશે જ થશે. એમાં જરાપણું મીનમેખ નથી. માથે પળીએં આવ્યાં છતાં ડોશીમા, ચા સાહ લોલ કરો છો. યોડા દિન નૃત્યકળાની તાલીમ આપી કે એડો પાર સમજો. તમારા ધરાકો કોઈ માસુલી માણુસો નથી.

વસુમતી નાયકના વેણુ સાંભળતાં થીજુ અધ. તેણું લાગ્યું કે આ ડોકરીના પનારે પડી એટલે સર્વનાથ. અણ્ણિકાના ધંધામાં અલ્યાચ્યર્ય —રક્ષા કે શિયદવતના પાવન સંભવે જ શી રીતે? તરત જ કોઈ ચીજ યાદ આવતાં હાથ અંબોડા પ્રતિ કળ્યો.

ધનાવહ રોડની નજરથી આ છૂપું ન રહ્યું. એ નાયકને કહેવા લાગ્યા અને હરઙું ઊચ્ચયારે છે ત્યાંતો પેલો ડોકરી વચ્ચમાં ઓલી ઉડી.

તું પણ ખરે લોલોએ છે ભાઈ! મારી જંદગીમાં આટલો ચીકણો સોદો કરનાર તું આજે અખ્યો. આવક થશે એ સાચું પણ એ પાંછળ મહેનત ઓછી નહીં પડે. જવાદે એ વાત. તારું રહ્યું અને મારું રહ્યું. ચાલુ મારી સાથે અને મણીલે નેતું હજાર સોનેયા.

દશ હન્જર એઓછા ? માં વેણુ ન ફરે. એદો શેહ તમો શું કહો છો. પસીનાથી અને પરિઅમથી હું હવે થાક્યો છું. મારે જલ્દી સોહો પતાવવો જોઈએ.

મારે કહેવાનું કંધજ નથી. રહારા લીલામકારને પૂછ એટલે સમજશે. એક વચ્ચનીના બોલને અવગણુવાનું કામ અમ શાહ સોદાગરનું ન હોય. આવી કુલોન ભાળાના મૂલ્યાંકન કરાયજ નહીં.

લીલામકારે નાયકને હુંડી ખતાવી. પેલી ડોકરી નાયકનો હાથ પકડી ચોતાને હુક્ક કખુંનવા આગછ કરી રહી. લાખ સુનૈયા આખવા તૈયાર થઈ.

હુવે નહીં અને—સોહો થઈ જયો છે એમ કહી, વસુમતી તરફ વળી નાયક બોલ્યો.

તહારી માતાના મરણ વેળાના ભારાં વેણુ યાદ કર. ભરોસો રાખી, દીકરી ! આ શેહની જોડે જા.

ધનાવહ શેહ આગળ અને વસુમતી પાછળ મૂકપણે ચાલતાં ચાલતાં કૌશામ્ભીના પ્રવેશ દ્વાર સમીપ આવી પહોંચ્યા. ભાળાને આટલો ભાર્ગ કાપતાં થાક લાગ્યો હશે એમ વિચારી, સમીપના એક પાકી બાંધણીના વિશ્રામ સ્થાન આગળ થોક્યા. સ્થાન રમણિય હતું અને જુદા જુદા વૃક્ષો પાછળના ભાગમાં હોવાથી સારા પ્રમાણમાં એની છાયા એ ઉપર વિસ્તરેલી હતી એટલે હુંડક પણ એઓછી નહોતી.

ભાળા, આપણે જરા અહીં વિશ્રામ લઈ નગરમાં પ્રવેશ કરીએ. હુવે કંધ જાડું ચાલવું પડે તેમ નથી.

એમ કહી ધનાવહશેડો પિછોડીથી ચોતરાની એદક જ્ઞાન કરી એક ખાળું એદક લીધી અને બોલ્યા—

ભાળા, અહીં ખાળુમાં ઐસ. આજથી તું મને તહારા પિતાને સ્થાને જ લેખજે અને એક દીકરી પોતાના પિતાની સાથે દ્રાઇ પણ

જાતનો સંક્રાંતિ સેવ્યા વિના વર્તે એમ વર્તને. તહેને કહેવામાં વાંધો નહોય તો આ કેમ જુનવા પાણ્યું તે કૃતાન્ત મને ટૂંકમ હી સંભળાય.

પિતાશ્રી ! નાયકના રાજ્યકન્યા શખ્દથી જ આપ અનુમાની શક્યા હશો કે હું કોઈ ખાનહાન કુળની બાલિકા છું. કેટલાંક કારણ-સર મારા માતા પિતાનાં નામોલ્લેખ કરવાનો મારી મરજ નથી. એમ કરવામાં આપનો અણુવિશ્વાસ છે એમ નહીં, પણ એ પાછળ ખીજ્યું કારણ છે. નાયકના હાથમાં અમે મા દીકરી સપડાયા. મારી માતાને જ્યાં એણે અણુધટતી માંગળીદારા પોતાની પતિન જુનવાની વાત કરી કે તરતજ એ સામે તિરસ્કાર દાખવતાં એણે આપધાત કર્યો. હું ખડીભર આની બની ગઈ. એણે લીધેલા માર્ગ જવામાં મને વિલંબ થાય તેમ નહોતું. ગળથૂથીમાંથી જ નારી જુવનની પવિત્રતાને ઝાંમતી ગણુવાના પાઠ મને મળ્યા છે. શિયળીત કરતાં કોઈ મોટો મર્મ છીનતિ માટે નથી એ મારા હટ્યમાં લોખંડના ટાંકેણે ક્રાતરાયેલ છે, એટલે એના રક્ષણકાળે જુવનને ફ્ના કરતાં પાણી પાની કરું કે લીઢતા દાખવું એમ હતું જ નહીં. મારા અંખોડામાં તીવ્ય અસરકારક સોમદ ગુટિકા હતી. પણ ગમે તે કારણે માતાના મૃત્યુથી નાયકનો આ વેગ ઓસરી જયો. મને પુત્રી તરીકે લેખ્યી, કોઈ ચોગ્યના હાથમાં સાંપ્રવાની વાત એણે જીવ્યારી. ‘જુવો નર ભરા પાએ’ એ નીતિકારના વચનને ધ્યાનમાં રાખી મેં આપધાત ન કરતાં તૈની વાતપર વજન મૂકી અહીં આવવાતું અને લીલામના સ્થળે શિબવાનું મૌનપણે સ્વીકાર્યું. તમારા સરખા ભર પુરુષના સમાગમે મારા જુવનની હોણા થતી બચી ગઈ.

વડિલશ્રી ! મારા જુવનની આ ટૂંકી કહાણી આપશીને સંતોષ આપશો.

પુત્રી ! તહાં દ્વિલિ દુલ્ભવી મને વધુ જાણવાની જરાપણ છયછા નથી. તહારા જેવી શાળી બાળાના પિતા અનવામાં મને કુદરતનો સંકેત જાણ્યા છે. એક તો સર્વ પ્રકારની રિષ્ટિસિષ્ટિમાં જે એક જીણુપ-સંતાનના અભાવની હતી તે આજે દૂર થઈ છે અને વધારામાં એક બાળાનો જીવન દીપક અફાળે હોલવાઈ જાત, તે ન અનવા પામ્યુઃ એનો આનંદ છે. તહારી મારી-શેરડીના રસ જેવી કે આવના ચંદનના લેપ જેવી ઠંડકારી-વાણી શ્રવણ કરતાં મને જે આહાદ ઉદ્ભબ્યો છે એ કલ્યો જાય તેમ નથી. તહાં મૂળ નામ વસુમતી ભલે હોય પણ હું તો તહે 'ચંદના' જ કહીશ.

સૂરજ મધ્યાન્હે પહેંચવા આવ્યો છે એટલે ચાલ દીકરી ! જલ્દી ધર બેગા થઈએ.

બિભય નભરીના માર્ગો વટાવતાં થોડા સ મયમાં પોતાના આવાસમ આવી પહેંચ્યા.

કુલીન વંશપરંપરામાં જિતરી આવેલ આ ધનાવહ શેહને ત્યાં લક્ષ્મીદેવીની પૂર્ણ મહેરબાની પ્રવર્તતી હતી. માર્ગનુસારીના ગુણોને વળગી, એનો ચીવટાધ્યપૂર્વક અમલ કરનાર શેહના પૂર્વનેતી છાપ કૌશામ્ભીમાં સારી હોનાથી લેવડેવડના વ્યવસાયમાં શેહને ઓછા પરિશ્રમે સારો લાલ રહેતો. વડવાઓની માઝક તેમની પ્રમાણિકતા માટે પણ એ મત જેવું નહોંનું. ધરમાં ગાડી ધોડા અને દાસદાસી હોના છતાં, શેડ જતમહેનતમાં માનતા હોનાથી પરિશ્રમ કરવામાં પીછેહું ન કરતા. ખાસ દૂર જવું હોય તો જ વાહનનો ઉપયોગ કરતા નોકર-ચાકર અને મૂંગા પ્રાણી પ્રત્યેનો વર્તીવ પ્રશંસા પાત્ર હતો.

શાંતજીવન, ધર્મનિધા અને પરોપકાર વૃત્તિઃપ ગુણુ ત્રિવેણીમાં જ્ઞાન કરતાં શેડ-શેડાણીએ લગભગ યુવાવરથા વટાવી પ્રૌદ્યતાના

ગ્રાંગણુમાં પગ મૂક્યે હતો. સર્વ્ય પ્રકારની સહેલીમાં જે કંઈ પણ જીણુપ દાણ્ણોચર થતી હોય તો માત્ર સંતાનની હતી.

નિશ્ચિય ધર્મના ઉપાસક અને પર્વતિથિના વત-નિયમમાં ૬૬ અદ્ધાવંત રેઠ એ માટે પોતાના પૂર્વભવના કર્મને કારણભૂત લેખી મનમાં ઓછું આણુતા નહિ; પણ મૂળાશોહાણી સ્વીજાતિ સુલભ ચંચળતાવાળા હોવાથી કર્મમાં માનતા છતાં, પોતાના ખોળામાં ખાળક રમતો ન થવા બદ્ધલ ફુઃખ ધરતા. એ વિચારથી ધણીવાર ઉહુવિઘ્ન થતા. પિયરમાં લાડકોડથી ઊછરેલા મૂળા શોહાણીમાં રિસાળ વૃત્તિ અને વહેભીપણું મૂળથીજ હતું. વળી અસ્સુયા જેવો અવગુણ પણ ધર કરી ગયો હતો. કોઈક વાર આ દુર્ગુંણોના વંટોળમાં ચડી, સંતાન સુખના અભાવથી એટલી હુદે ફુઃખી જતાં કે ધરના શાંત વાતા-વરણુમાં ખળભળાટ મચ્છી જતો. પ્રકૃતિના પારખુ એવા રેઠ ધીરજ રાખી, પૂર્વકુળના ઉદાહરણો ટાંકી કર્મે સર્જવેલ આ કાર્ય શાંતિથી સહન કરવું એજ સમજુ પુરુષોનો ધર્મ છે એમ જેણે જિતારતા અને પુનઃ શાંતિ પાથરતા. શોહાણીની આવી વિલક્ષણ પ્રકૃતિ સૌ નોકર-ચાકરના ધ્યાનમાં હોવાથી એમના હુકમ સામે કોઈ કાંઈજ અવાજ કહાડતું નહિ. મૂળાશોહાણીને જેમ ઇચ્છાનું તેમ થતું.

આમ છતાં સમાજમાં અને બ્યવહારી તરીકેના વટવહેવારમાં આ ધરનો મોખો જરા પણ જિતરતો નહોતો. ધનતાવહ શેઠની પ્રતિષ્ઠા તો સારાયે નગરમાં વંશ ઉતાર ચાલી આવી હતી તેવીને તેવીજ જળવાઈ રહી હતી.

નીતિકાર કહે છે કે જે ધરમાં મેલાંધેલાં અંગોપાંગવાળાં અને કાલુંધેલું શોલનારાં બાળકો મરતી કરતાં દેખાતાં નથી એ ધરને અરદ્ધની ઉપમાજ ધેટે છે. નારીના ખોળાની શોભા એમાં રમતાં ધાવણું બાળકથી અંકાય છે અને વંશની શોભા ભાવિ વારસના પરજ અવલંબે છે. વંધ્યા સ્વીનો અવતાર નિષ્ઠળ જ ગણુાય છે.

આવું સાંભળનાર મૂળાશોહાણી ધણી વાર પડોશના ઘૈરાંએમાં પેતાના અવતારને નિંદા અને ધણીવાર ઓલી પણ જરતાં હે શેહ મારા પર બીજી શોકચ લાવે તોપણું મને દુઃખ થવાનું નથી. ધરમાં આળક રમતાં થાય એ આનંદ ન્યેવો તેવો ન લેખાય.

આ વાત ડિડતી ડિડતી શેહના કાને પણું પહોંચતી. અરે એક એ વારતો ખુદ શોહાણીએ સ્વભુષે શેહને ફરીવાર પરણુવા કહેલું. પણ કર્મસ્વરૂપ સમજનાર શેહ છોઠ ડિગતી આળાનો ભવ આળવા તૈયાર નહોતા, એટલે ધસીને ના પાડતા.



પ્રકરણ ૧૨ શું ઉપવનમાં મેળાપ

પંડિતા—રાજકુંવરી ! આજે તમારા શરીરે કંઈ ભેગેની જેવું જણાય છે. તે વિના આમ મૂગાં મૂગાં ફરો નહિ. રોજ તો તમે હસતાં રમતાં અને વાતોમાંથી ખરવારતાં પણ નહિ. હું કંઈ કહેવા જતી તે પૂર્વે તમે જ રામની રામાયણ કરી મૂક્તાં.

કુંવરી—સખી, તારી વાત સાચીજ છે. આજે હું આ ઉપવનમાં કહું છું ખરી છતાં મનના ઉમળકા વિનાજ.

પંડિતા—એનું કારણ શું ?

જુઓને, આ તડવરનાં પણો અને પુષ્પો તો જણે નાચી રહ્યાં છે. વર્ષાકાળનું સ્વાગત કરવા જાણ્યું એકતાર ન થઈ બેઠાં હોય તેમ જણાય છે. મનોહર અને રંગબેરંગી કુસુમોની સુવાસ હરકોઈ તપેલા મગજ-વાળાને ઠંડુ પાડી હે તેવી પ્રસરી રહી છે. આવા રમ્ય કદલીગૃહમાં પગલાં પાડયાં પછી અને મનમોહક કુલોના દર્શન પછી એવી તે શી ચિંતા છે કે જે તમારો પત્ને છોડતી નથી ?

કુંવરી—મને પણ એ સમજતું નથી ! રોજ તો અહીં પગ મૂકૃતાં જ જે આનંદનો ઉદ્ઘિ ઉલ્લભરાતો એમાંનું આજે કંઈ થતું નથી. નણે અહીંનું આ ભીલેલું વાતાવરણું મારા અંગમાં દાહ પેદા કરી ન રહ્યું હોય એમ લાગે છે !

પંડિતા, કુંવરીની વાત સાંભળતાં જ પોકારી બિડીઃ—

આ તો આશ્ર્યની અવધિ ! શું આ વાત અભયાકુંવરી વહી રહ્યા છે ? ‘ચંદનનો લેપ અભિન પેદા કરે છે’ એ કહેવું જે સાચું હોય તેઓ કુંવરોથા, તમાડં કથન સત્ય મનાય. આવી અસંઅધ વાત કોઈ સામાન્ય શુદ્ધિમાનના ગળે ન જિતરી રહે વાસથી ભરી દેતાં અને દંડથી પ્રદુલ્લિત “નાનતાં કુસુમો તાપ પેદા કરે ખરા? હરગીજ નહિ. તમારા ઉકળાટનું” કારણું મને તો કંઈ જુદું જ જણાય છે.

તો ખણ ઝટ બોલી દેને સખી !

આ તો ચોર કોટવાળને દંડે તેવો ધાટ. મનહુઃખ તમને થાય અને એનું કારણ હું જણું ?

તહારી ચતુરાધ હું ન જણ્ણતી હોઉ ત્યારે ને ! તું તો એકાદ ઈટ ઉપરથી ઈભારત ચણી કહાડે તેવી શક્તિશાળા છે. તો પછી એમ શાને કહેતાં નથી કે એ જુદું કારણું તમારે ભારે મોઢે બોકાવવું છે ?

શ ! મારે ! બિચારા કુસુમોને હોય દઈ રહ્યાં છે ?

યૌવનના આંગણે જીબેદી તરણીનો તનમનાટ અનેરો જ હોય છે. એના અંગો પાંગતી ભીવવણી રોજઅરોજ નવો. સ્વાંગ સજતી હોય છે. એથી મનોપ્રદેશમાં અવનવા ઉલ્લભાસ પાંગરતા હોય છે. તરણતા પર ફૂટતી નવનવી કુસુમ કળાએં માઝક, એ અવસ્થામાં પગ સંચાર કરતી તરણીએં અવનવી આશાના ઝુલે ઝુલતી હોય છે. ભાવિકણ સંઅંધી મનોહર સોખલાં સેવતી હોય છે. એના કંદ્રસ્થાને સનાન ક્ષાના સાથીદારની શોધ હોય છે. અસુએં એ પાછળ ભમતી જ હોય

છે. કોઈ નજરે યઠી જય અને એનું આકર્ષણું થાય તો અંતરમાં ચોટ લાગે છે. માસુલી કણ્ણુનો એ અનંદ અવર્ણનીય હોય છે. પણ પણી એની પ્રાપ્તિનો પ્રશ્ન મુંજવણું જન્માવે છે. એ સામે, વ્યવહાર-જાતિના જે અવરોધો ખડકાયા હોય છે એ તરફ દાખિ જતાં, યોગ થવા અંગે કુશાંકાએ ઉહ્લબવે છે. આ મનહૃદય એવું જેર પડ્યે છે કે ખાવાપીવા કે પહેરવા એવાનું કાર્ય ચાલુ રહેવા છતાં એ પાછળનો ઉત્ક્ષાસ શોધાઈ જય છે. કિયાએ યાંત્રિક બની જય છે. કશી વાતમાં દિલ ચોટતું જ નથી, છતાં આ! અંતરકથની ઉકેલાતી પણ નથી જ.

તમો પણ આવા જ કોઈ દરદના બોગ બન્યા જણાવ છો. આ તો મારું અનુમાન છે.

પંડિતા, તહારા નામ પ્રમાણે તું ખરેખર પંડિતાધ્યી ભરેલી છું. નામ મુજબ તહારામાં ગુણું પણ છે. તહાઁં અનુમાન સાચું છે.

કુંવરીભા, દાયણું આગળ પેટ છૂપાવી શકાયજ નહું. ભલે હું ભાલ વિધવા છું છતાં એક કાળે તમારી માઝક હું પણ યૌવનીના ખગીયામાં રમતી તરણી હતી. તમો નાથનગરના જમીનદારની પુત્રી છો. એટલે માગતાંજ સર્વ કંઈ હાજર થઈ જય છે જ્યારે હું જોકે તેવા સંયોગમાં જિછરી નહોતો તોપણું દ્રિજકુળ સુલભ ખાનપાન અને વસ્ત્રાદિની ઘેટ ન હોતી જ. બણી સહેવ જ્યાં જ્ઞાનની પર્યુપાસના ચાલતી હોય ત્યાં જણુવા સમજવાનું ધણું બનતું. એ જોરે મેં જે અભ્યાસ સાધ્યો છે એનો અદ્દલો ધનના દગ્ધાથી ન તોલી શકાય. સ્વદેશો પૂજ્યતે-રાજા વિદ્વાન-સર્વત્ર પૂજ્યતે=રાજની પૂજા પોતાના મુલકમાંજ થાય છે અને જ્ઞાનવાન વિદ્વાન તો જ્યાં જય તાં પૂજાય છે. એટલેજ જ્ઞાનળ શ્રેષ્ઠ કહેવાય છે. ‘Knowledge is power’ એ આંગંડ ઉકિત સાચીજ છે.

આને તમો જે લાગણીઓ અનુભવી રહ્યા છો. એથી અધિક પ્રમાણમાં તે કાળે હું અનુભવતી હતી. નારીજાતિના ખડતર જ એવી.

અજાય રીતે થાય છે કે એનામાં રનેહના અંકુરને વિકસર થતાં વિલંબ નથી થતો. વર્ષોના વહન સાચે એની શરીરકૃતિ પણ વિવિધ પહ્યા દે છે. હેહની એ ભીલવણી જાત જતની ચંચળતા જન્માવે છે. તમારી સમક્ષ મારે મારું પૂર્વ જીવન કે પ્રેમ વાર્તા વર્ણવાની ન હોવાથી હું એટલું જ કહું છું કે અન્ય આખોમાં ભલે મને તમો રૂપી જાવ, પણ આ ગ્રીતિના વિષયમાં તો હજુ એકડો ધુંટતા નવા નિશાળીઓ સમ છો. તમો વૈભૂવની ટોચે વિરાજતા અભ્યાકુમારી મારા માલિક છો. અને હું સેવા કરવાના નિમિત્તે તમારા સંસર્ગમાં આવેલી એક સામાન્ય દાસી છું. એ વાત સો ટકા સાચી છતાં, મારા અનુભવની સરખામણીમાં તમારું જીન તોલામાં રતિભર જેટલું જ ગણ્યાય.

પંડિતા ! હું તહે સેવિકા રૂપે લેખતી જ નથી. તહારી સાથેનો મારો વર્તાવ એક અંતરની સખી તુલ્ય છે. ભલે નાથનગરની પ્રજામાં હું વિન્યસિંહની પુત્રી હોવાથી અભ્યાસુંદરી કે રાજકુમારી તરીકે લેખાતી હોઈ, છતાં તહારી આગળતો એકાદી નાની બહેન જ છું. તેં કોઈ દિવસ મારા વર્તાવમાં કડકાણ જોઈ છે? આટલા સમયના સહવાસમાં મેં કોઈ વાર અધિકાર કે જીવાચ દાખલ્યો છે? ઘણીવાર તું જતે મારી સાથના વર્તાવમાં સેનક-માલિક જેવો ભાવ દાખલે છે, બાકી મેં તો પ્રથમ ભિલાપથી જ તહે મારી અંતરની સખી માની છે એટલું જ નહીં પણ એથી આગળ જઈ ગુરુસ્થાને બેસાડી છે. મારે હોઠ બહેન છે નહીં એટલે તહે મોટી બહેન માની તહારી હોરવણીએ જ મારું નાખ હુંકારું છું.

તો પછી આજે આમ ડેમ વર્તો છો? શા સારુ વાત છુપાવો છો?

‘ જેહ શું આંદે પ્રીતદીલ, તેહ શું રહે પ્રતિકુળ;
મેલ ન છુંકે મન તણોલ, એ માયાનું મૂળ. ’

એ કવિ વચન મુજબ મને તમારું આજતું વર્તમન જણાય છે. હૃદય અરામર ખોલી નાંખો તો વાત સમજાય દરદ જાણ્યા વિના ઓપથ કર્યાંથી શોધાય ?

પંડિતા ! તું કદ્વે છે એવું ગંભીર દરદ નથી, તેમ એવી આનગી વાત પણ નથી. મારી નજરે એ નહી છે. એટલે કેવી રીતે એનો આરંભ કરવો તેના વિચારમાં હું મૌનપણે ઉગ ભરતી હતી હું ન કહેત તો પણ ત્હારા કાને એ આવ્યા વિના રહેત નહીં જે કે હું તો રહેને એ કહેના સારુ તો વિરામાસન પર રોજની માઝક ન ઘેસતાં આ કદલીગૃહ તરફ એંચી લાંબી છું.

આને મારા વિવાહ સંખ્યમાં માતપિતાને વાતો કરતાં અચ્યાનક મેં સાંભળ્યા. આટલા વર્ષમાં કોઈ વાર નહીં ને આજેજ તેમની આનગી વાત સાંભળાવા હું બાળુના કમરામાં છૂપાઈ રહી.

પિતાશ્રી કહે કે ચંદ્રપાત્ર જીતશત્રુની છાવણી આપણા નગરની ભાગોળે જ પડી છે. કૌશામ્ભીપતિના છેલ્લા અણધાર્યા હુમકામાં રાજવી ફરીથી રાણી વગરના બન્યા છે. જે કે એ અન્યું ત્યારે મહારાજા તો સીમાડાના ભાયાતોને વશ કરવા નીકળ્યા હતા. ચંદ્રપાત્રાને એ બનાવ તો પીઠ પાછળના ઘા જેવો હતો. એ હાજર હોય ને કોઈ અન્ય રાજવી જીત મેળવે એ હજુ પર્યાત તો અન્યું નથી જ. એ કારણે નામ દખિવાહન હોવા છતાં ‘જીતશત્રુ’ તરીકેની જ્યાતિ ચાંચ્યા છે. હારી સંમતિ હોય તો આપણી પુત્રીના સગપણુની વત્ત તેમના કાને નાંખવાનું મારું મન છે. રાજયના કાર્યોમાં રાણીની જરૂર તો ઉગલે ને પખલે પડે. મારા મિત્ર મારશ્શત જણુવામાં આવ્યું છે કે પદ્માવતીના વિરહ વેળા એ જેમ થોડો સમય સુધી કિંકર્તાવ્ય મૂઢ અની ભયા હતા એમ આ વેળા નથી બન્યા. ઉચિત શોક પાળી, તરતજ પેંતાના દેશમાં પર્યાટન કરવા નીકળી પડ્યા છે એને યોગ્ય રમણી મળે તો એ સ્વીકારે પણ ખરા જ. પુરુષભાગ્ય હોય તો જ આવો સંખ્યંધ સંખ્યા.

માતુશ્રીએ કહું કે—તમારી વાત જોગ આના ને રતિ ઉપર જેવી છે. તેઓ હા પાડે તો દીક્ષરી બધી રિતિ સુખમાં જય. પૂર્વે જેણે પૂરાભાવે ભગવાન પૂજ્યા હોય તેના નસીબમાં જ આવું સુખ અને આટલી સાદ્યાખી સંભવે. હા, એક વાત ખૂંચે તેવી તો ખરી. આ જેડું સરખી વયનું ન ગણ્યાય. અખ્યા અને રાજવીની વય વચ્ચેનું અંતર વધુ દેખાય. એ સિવાય વિચારયાનું એ રહે છે કે તેમની પ્રથમ રાણીનો પત્તો નથી પણ એ ગલ્બિણી હતી અને બીજી ધારિણીને તો વસુમતી નામે પુત્રી પણ હતી. એ બધાનો હાજ પત્તો નથી પણ ધારો કે પુનઃયોગે સાંપડે તો મારી પુત્રીનાં ફરજદનું શું ?

અરે તું પણ ક્યાં સુંદી પહેંચી ગઈ ? ગામમાં પેસવાના હજુ ફાંઝાં ત્યાં પટેલના વેર જેના પાણી જેવી તહેં વાત કરી. સારા સારા રજવાડાની કુંવરીએ દોડતી આવે તેમ છે. ત્યાં આપણા સરખા સામાન્ય ભાયાનો ગજ વાગશે કે કેમ તે હજુ અચોક્સ છે. આ તો મારા મિત્રના લાગવગ પહેંચે છે અને આંગણે આવ્યા છે તો મેળ ઐસાડવાના પ્રયત્ન છે. શાંકરની કૃપા હોય તો એ ઐસી જય. ભાવિના વિચાર તો નકામા છે. રજવાડામાં વયના અંતરપર વજન ન મૂકાય. આકી રાણીપદ ભોગવનારના સંતાનો રાજ્યના હક્કદાર ગણ્યાવાના જ. એ કંઈ રજળતા ભિખારી નથી થવાના. ચાલી આવતી પ્રણાલિકા મુજબ હિસ્સેદાર ગણ્યાય. આટલા વર્ષોમાં જેની ભાળ મળી નથી એ ક્યાંથી એકએક દૂરી નીકળશે ?

તો, પધારો જરૂરી શુભસ્ય શીଘ્રમ મારી તો હા છે જ.

આટલી વાતે મારા અંતરમાં અકૃથ્ય ભાવેં જન્માવ્યા છે ? જેને દાઢિ મર્યાદામાં એકવાર પણ લાવવાનો પ્રસંગ લાઘ્યો નથી, જેની સાથે સંભાપણ દૂર રહ્યું; અરે પરસ્પરના સ્વભાવનો મેળ ઐસે છે કે કેમ એ નિયુારનાં પણ દૂર રહ્યું; કેવળ નેત્રોના મેળાપનો યોગ પણ મળ્યો

નથી; એવા અજ્ઞાતના હાથમાં ફું સેંપાવાની અને એની સાથે અજાણ્યા સ્થાનમાં ધકેલાવાનું ! સાડે યે જીવન ત્યાં વીતાવવાનું ! આ વિચારતાં જ મારી મુંજવણું વધી પડી છે. એ કારણે જ મારી સર્વ કરણી યાંત્રિક પુતળી સમ થઈ પડી છે.

કુમારી ! એમાં મુંજવાની કંધ જ જરૂર નથી. નારીનાટિને શિરે એ બ્યંહાર કંધ આજકાલને નથી. અનંત કાળથી ચાલ્યો આવતો એ તો રવ્યો. માતા પિતાના ખોલે ઉછરેલ બાળા, યૌવન વયમાં આવતાં તદ્દન અપરિચિત ગૃહે જય અને ત્યાં નવી સૃષ્ટિ જન્માવે. ‘ દીકરી ને ગાય, જ્યાં દોરે ત્યાં જય ’ એ જનઉક્તિ શું તમે જાણુતા નથી ? લગ્ન નથી થયાં અને એક વાર નાવલીયાનો પ્રસંગ નથી પડ્યો ત્યાં સુધી જ તમને એ નવું લાગવાનું ! પછી તો સૌને ભૂલી જવાના !

જીતશત્રુ જેવા પ્રતાપી રાજ્યીના રાણી જનતાં અને ચંપાના મહાલયમાં મહાલવાનું મળતાં અમને યાદ પણ નહીં કરવાના !

પંડિતા ! તું એ રાજ્યીને ઓળખતી લાગે છે.

ના, ના, ખાસ ઓળખાણું તો નથી જ. એમની છાવણી આપણું નગરમાં પડ્યા પછી એ ચાર વાર તેમને નજરે જેવાના પ્રસંગ લાધ્યા છે. બાકી એમના જીવનની કથની તો એકાદી નવલિકા જેવી છે. પ્રણનજોના કર્ણોપકર્ણું વહી રહેકી એ કથા મારા સાંભળવામાં પણ આવી છે. જે એ તમને સ્વીકારે તો તમે પૂર્ણ ભાગ્યશાળી ગણ્યાવ. એક વાર નજરે જેશો કે તરત જ લલચાઈ જશો. પણ વયના અતરનો ગ્રશ તો ખરો જ ને ?

એ વાત ફેંકી દેવા જેવી ન લેખાય, પણ પરાંકમશાળી નરના શરીર બાંધા આગળ અને નારી દેખ કે રીતે સંયોગો મળતાં પાંઅરે છે એ જેતાં એ પર જાણું મહત્વ આપવું મને યોગ્ય નથી લાગતું. સર્વદીશીય સમાનતા સૌ કોઈના ભાગ્યમાં આદેખાઈ હેતી નથી.

વાડ, તહારી એ વાત કણૂલ રાખીએ તો પણ જેનો હાથ પકડવો હોય એને એક વાર નજરે જેવો તો જોઈએ ને? નહીં તો પાણી પીધા પઢી ધર પૂછવા જેવું કે હજમત કરાવ્યા પઢી વાર જાણવા જેવું હાસ્યારપદ આચરણ કરવાનો અર્થ શે?

હાં, ત્યારે એમ ચોક્કું કહી હોને કે નૃપ જુતશરૂના દર્શન કરવા જ છે. એમાં કાંઈ ભારી હિકમત અજમાવવાની અગત્ય નથી.

સાંભળો, એ રાજ્યી, અહનીંશ આ તરફ સંધ્યાકાળે પોતાના સલાહકારો સાથે કરવા આવે છે. જેવા સામેના કુવારાની પાછળના લતાદુંજમાં એ મંડળી ગોહવાય છે. લગભગ ઘટિકા ઉપરાંતનો કાળ ત્યાં વાર્તાલાપમાં વ્યતીત થાય છે. આપણે રોજના સમય કરતાં અધીં ઘટિકા મોડું કરીએ તો પાછા કરતાં એમને જેવવાની તક સાંપડે.

સખી! તો આજે એમ જ કરીશું. અંતરનો ઉકળાઈ એ નિના શમવાનો નથી.

જેવી કુંવરીભાની આજા. પંડિતાની કરજ તો એ જીલવાની જ જણાય.

અંહ, પણ ધારો કે તમો રાણીપદે ગોહવાયા તો પઢી મારા જેવીને યાદ કરવાના કે સાવ ભૂલી જવાના?

યાદ કરવાની અગત્ય ન રહે, એ સાંદું ફું તો તહે સાથે જ તેડી જવાની. તહારા વિના મને પળવાર પણ ચેત ન પડે. દેહની છાપા. એઓછી જ જુદી રહે. આપણે સ્નેહ પણ એવો જ સમજ.

વાત તો ખુશી થવા જેવી છે. પણ મોલ્યું પાળો ર્યારે સાચું.

અરે! વિશ્વાસ ન પડતો હોય તો વચ્ચન આપું.

ત્યાં તો પંડિતા એલી છી—

કુંવરી! તમારો સિતારો જરૂર ચમકે છે. જુનો, જુનો, વતુ

થોભવાની જરૂર નથી. પેલા આવતા જણાય છે એજ ચંપાપતિ દ્વિવાહન ઉર્ફે રાજીવી જુતશરૂ.

આને તો સાથમાં માત્ર એક પરિચારક જ છે.

ચાલો, ઝટ કરો, એ દિશામાં પગલાં માડો એટલે સામે આવી રહેલ તેમના દિદાર-દર્શન સુલભતાથી સંપૂર્ણપણે થઈ શકશે.

કદાચ શખ્ષેદોની આપ લે કરવી હશે તો એ પણ અની રાકશે. ખ્યુપુરુષ વચ્ચે આકર્ષણું એ ડેઢ નવું તત્ત્વ નથી. એમાં સમાન વૃત્તિને યોગ હોય ત્યાં જાણાં વાણી વિલાસની જરૂર ન રહે. આંદો મળે અને એમાં ડેટલાએ દ્યુપાદ્માવોની આપ લે થાય. જાનીપુરુષો એ મારે સ્પષ્ટ કહે છે કે પૂર્વભવતો સંબંધ એમાં અગ્રભાગ ભજવે છે. કર્મની વિચિત્રતાને માનતાર તેમનું એની અચિત્ય શક્તિને જણનાર સારું એ આશ્રયને વિષય નથી જ.

સામસામે થઈ પસાર થતાં મૂકવૃત્તિએ ઘણું થઈ ગયું. એમાં અંગ-ઉપાંગના હાવભાગ અને નેત્રના કટાક્ષ પણ ખરાં. નીરીજતિ સુલભ લંજણથી કુમારી ઓલી ન શકી, પણ રાજીવીને એ સંકેચ નડ્યો નહીં. ચાલી જતી રમણીએ પાછળ પરિચારકને નામ જણનું મોકલ્યો.

નોકરે આવી પંડિતાને પ્રશ્ન કર્યો અને દક્ષ સખીએ એ તકનો પૂરેપુરો ઉપયોગ કર્યો.

એ મહોં મલકાવતાં મોટે સ્વરે ઓલી હે—

નરેશ, મારા કુંવરીભાનું ઓળખાણ ધર્યે છે તો તે આ પ્રમાણે છે.

એમનું નામ સુંદરી અભયા, આ. નાથનગરના જમીનદારની એકની એક માત્ર લાડીલી કન્યા. સર્વષ્ઠામાં સંપૂર્ણ. આપનું નામ જ્ઞાંભલ્યા પછી આપના પ્રતિ પ્રીતિવાળી પણ બની છે.

ઉપવનના આ પ્રસંગ પછી અત્યક્તાળમાં જ સગપણુંનો સંખ્યાંથી સંખ્યાંથી અનુભૂતિ જોડાયેલી કુંવરી અભયાચે થોડા દ્વિસ પિયેરમાં વધુ રોકાઠ ભૂપ સાથે ચંપાપ્રતિ પ્રયાણુ પણ કર્યું. પંડિતાને કુલ આખ્યા પ્રમાણે પોતાની જોડે લાવી. રાજમહાલય ફરીથી એક-વાર રાણીના આગમનથી ભર્યો ભર્યો થઈ ગયો.

નવી રમણી અને સર્વ પ્રકારની સાનુદૂળતા પછી શું કમી રહે ? અતશ્ચતુ રાજ્યી સંસારી વિલાસમાં લીન રહેવા લાગ્યો. ‘દુઃખનું એસડ દહાડા’ એ કહેતી સુજય વખતના વધવા સાથે ભૂતકાળિન અનાવો વિસ્મૃતિના વિષય બન્યા.

આમ બનવામાં રાણી અભયાની આવડત અને આડર્થણુ પણ ખરાં જ. ચોસડ કળામાં પારંભત એવી આ રમણીએ સખી પંડિતાની સલાહથી સ્વામીને નવનવી રીતે આનંદ પ્રમોદમાં કાગ વ્યતીત કરાવવા માંડયો કે, જેથી ભૂલાયેલી વાતો તાજ થવાના પ્રસંગ જ ન કાઢ્યો. પદ્મા અને ધારિણી કરતાં અભયાના સહવાસમાં વર્પના આંકડા વધુ આગળ વધ્યા. ચંપા નગરીમાં આબાદી અને સુખાકારી તો હતાં જ. પ્રણતી આંખ ભાવિ વારસના દર્શન પ્રતિ મીટ માંડી રહી હતી. અભયાના સુખોમાં માત્ર એ એકજ ઉણ્યપ નજરે ચટતી. -



પ્રકરણ ૧૩ મુ દર્મનિષ્ઠ દાપત્રી

શ્રી વાસુપૂજય સ્વામીના રમણીય પ્રાસાદમાં આને સખત લીડ
જામી હતી. નિર્બાણ કલ્યાણુંનો પવિત્ર દિવસ અને એ સાથે ગુણ
સંપન્ન સુદર્શન શેહ તરફનો ઉત્સવ સંકળાયેલો; એટલે સોનું ને સુગંધ
મળ્યા જેવો પ્રસંગ. આ મહોત્સવમાં એ નવી વાતો જરૂરિને આંખે વળગે
તેવી તરી આવતી. એક તો અભિજીવન્ય સુદર્શન તીર્થપતિના જવન વિષે
વિવેચન કરવાના હતા અને મહારાજા દ્વિવિધાધન પોતાના અંતઃપુર
સહિત દર્શને પખારેવાના હતા. સામાન્ય રીતે જગવણી તો વિવિધ
પ્રકારી ભક્તિના ગીત ગાનમાં પર્યાપ્ત થતી. આને ઉપરની એ નવી
કાર્યવાહીના ઉમેરાએ પણ વધુ આકર્ષણ્ય જનસમૂહમાં પેદા કર્યું હતું.

રંગમંડપ, દેવાલ્યનો બહિરભાગ અને ફરતા અગ્રીયાની તણે
દિશાએ નર નારી અને ભાગવંદના સમૂહથી ભરાઈ જાયાં હતાં. અજ
પ્રકારી પૂજા વિવિધ વાન્નિત્રોના કણ્ઠપ્રિય સ્વરે સહ મેળ સાખતી
આંભાઈ ચૂકી હતી. સંગીતના ગ્રનાહમાં એક તાર બનેલા સમૂહને
વહી જતી ધાર્ટિકાઓનો અધ્યાલ સરખો પણ નહોંતે. નાદને પાંચમો

‘વેદ’ કહેવામાં આવે છે એ ખાડું નથી. સુંદર રાગે અને મધુર કુઠે જવાતા પદમાં જમે તેવા ભારી ડોળાહળને શમાવી દેવાની અને ઓક્ખારી શાંતિ પાથરી દ્વારાયે સમૃહનું આકર્ષણું કરવાની અજબ શક્તિ છે.

આ રીતે જળ, ચંદ્રન, કુસુમ, દીપ અને ધૂપ ઇપ પાંચ પ્રકારની પૂર્ણાહૃતિ થતાં ભાડણામાં વિરાન્નેલા રોઠ સુદર્શન પોતાની ગૃહિણી મનોરમા સાથે જિલ્લા થયા. તીર્થપતિ સામે ગોઠવેલા સુવર્ણ જડિત બાજુઠ ઉપર ગાયના દૂધ સરખા ક્રવેત વર્ણવાળા—અખાડિત ખારવાળા ઉત્તમ જલતિના—અક્ષતોથી ઉભયે નંદાવર્ત સાથીયા આલેખ્યા. એ ઉપર જુદી જુદી જલતના નૈવેદ અને સુંદર ઇલો મૂક્યા. પ્રભુની દાખિમાં પોતાની દાખિને જોડી, હસ્તની અંજલી કરી, રોઠ બોલ્યા—

“ હે ત્રિલોકના નાથ ! નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ ઇપ જતિ ચારના—આ સંસાર બ્રમણુમાંથી જિગરવા અર્થે આ સ્વસ્તિકની રચના કરી છે. એ ઉપરની ત્રણ દ્વારા દ્વારા દર્શન—જ્ઞાન—ચારિત્ર ઇપ ત્રણ મહા-મૂળા રત્નોનો પ્રકાશ સંપૂર્ણપણે અમારા આત્મામાં પ્રસરે એવી અંતરની ભાવના છે. આપ સરખા તીર્થપતિના અવલંબન વિના એ થવું મુશ્કેલ છે માટે આપ નિમિત્ત ઇપ ચાવ એવી પ્રાર્થના છે. એ નિર્મલતા લાધ્યા પછી આત્માનું અંતિમ ધ્યેય સિક્ષશિક્ષાનો દાસ; એ તો સહજ સિક્ષ છે એ સૂચક ચિનહ્બ, અષ્ટમીના ચંદ્ર સસું આલેખ્યું છે. નૈવેદ અને કળ દાંકવા પાછળ, આત્મ સમર્પણું કરવાની દદ મનો કામના છે.”

“ પ્રભો ! આ રીતે દ્વય પૂજન કરી ભાવ પૂજનમાં આપશીની સ્તવના કરવા હું યત્કિંચિત પ્રયત્ન સેવું છું.”

ગૃહિણી મનોરમાએ નારીવદમાં બેદક લીધી અને બ્રેષ્ટિવર્યે માનવ-અખુ સાંભળે એ રીતે મધુર વાણીમાં બોલવાનો આરંભ કર્યો.

ચાલુ અવસર્પિણી કાળના ચોથા આરામાં જંખુદીપના આ ભરતમાં જુદા જુદા રથાને, અનુકૂળે શ્રી ઋપલહેવથી માંડી, ટીક ટીક સમયના અંતરાળો અગિયાર તીર્થકરો થઈ ગયા. ત્યારપછી આપણી આ પવિત્ર ચંપા નગરીમાં રાજ્યની વાસુપૂજય અને રાણી જ્યાદ્વીના પુત્ર તરીકે આરમા વાસુપૂજય સ્વામીનો જન્મ થયો. તીર્થકર. નામ કર્મના પ્રભાવથી સર્વ પ્રકારના ઉત્તમોત્તમ સંયોગો વચ્ચે ઉછરતા તેઓ લાયક ઉમ્મરે પહોંચ્યા. યોગ પ્રાપ્ત થતાં સાધુ બન્યા. પરિષહ અને ઉપસર્ગોની ઝડીને સમતા ભાવે વેદી, અપૂર્વ એવા કૈવલ્યને સાધ્યું. તીર્થકર શ્રી વાસુપૂજય સ્વામીની કાયાની ઊંચાઈ ૭૦ ધનુષ્ય^૧ અને આયુષ્ય ૭૨ લક્ષ પૂર્વ.^૨ દીક્ષા લેતી વેળા સાથમાં ૬૦૦ માનવીનો સમૂહ હતો. એમનું લંઘન મહિષનું હતું. નિર્વાણ સમય પૂર્વે તેઓની સંપત્તિમાં^૩ ગળુધર^૪ ૬૬, ચૌદ પૂર્વીમાં^૫ ૧૨૦૦ સાધુઓ, જ્યારે અવધિજ્ઞાતી^૬ ૫૪૦૦ અને મન: પર્યવ જાની^૭ ૬૧૦૦ તથા કૈવળજ્ઞાતી આત્માઓની સંખ્યા ૬૦૦૦ ની હતી. વૈક્રિય લખિંધ^૮ વાળા ૧૦૦૦૦ અને વાદી ૪૭૦૦ હતા. શાવક સંખ્યા ૨ લાખને ૧૫ હજાર અને શાવિકાની સંખ્યા ૪ લાખ ૩૬ હજારની હતી. ગણધરોમાં મુખ્ય શ્રી સુક્ષમ નામે હતા. યક્ષ કુમાર નામે અને યક્ષણી ચંદ્ર નામે હતા. આપણી આ ચંપાપુરીમાં જ તેઓશ્રીનું નિર્વાણ આપ્નાં સુદ ૧૪ એટલે આજના હિને થયું હતું. એ વેળા તેઓ એકાકી ન હતા, પણ સાથમાં ૬૦૦નો પરિવાર હતો. અન્ય તીર્થકરોની નિર્વાણ ભૂમિ થવાનું ભાગ્ય, જન્મભૂમિને નહીં પણ કોઈ નવી નમરી કિંના પાર્વતીય પ્રહેશને મહિયું છે જ્યારે આપણી આ ચંપાપુરી એકલીજ

(૧) વણુ દૃષ્ટ (૨) ચોર્યાસી લાખ ને ચોર્યાસી લાખે ગુંણીએ તો કે આંક સંખ્યા આવે તેને એક પૂર્વ કઢેવાય છે ને તેવાં બહેંતેર લાખ પૂર્વ વર્ષ (૩) ચિન્હ (૪) પરિવાર (૫) સમુજ્ઞના નાથક (૬) ચંપણી વિવાના પારગામી (૭) ભર્યાદાવાળું જ્ઞાન (૮) મનોના પર્યથિને લાણી શકે તેવું (૯) ધર્માણે વરસુ અનાવી શકે તેવું જ્ઞાન (શક્તિ).

નસીબદ્વાર છે કે જેના ભાગ્યમાં ખારમા તીર્થપતિના પાંચે કલ્યાણુહો પોતાના આંગણે થના ઇપ અનેરો લાભ નેંધાયો છે.

અરિહંત વાસુપૂજય સ્વામીને થઈ ગગા પક્ષી તો સંખ્યાખંડ વર્ષોના વાયરા આ ભૂમિ ઉપર વાયા છે, એ દરમ્યાન આ ભારતવર્ષમાં જુદા જુદા નગરોમાં ખીઝ અગિઆર તીર્થકરો થયા છે. ચોવીસમા યાને છેલ્લા તીર્થપતિ તરિકે ક્ષત્રીય કુંડ નગરના રાજવી સિદ્ધાર્થ અને રાણી ત્રિશક્તાદેવીના તનુજ શ્રી વર્ધમાન થવાના છે. તેઓએ રાજમહાલયના સુખોને સાપ જેમ કાંચલીને છોડી હે તેમ ત્યલ દ્ધ, સંયમનો વિકટ પંથ સ્વીકાર્યો છે એ આપણી સર્વની જાણુમાં છે. હાલતો તેઓ શ્રી પરિપહો અને ઉપસર્ગોનો સામનો ઉધારી છાતીએ અને એકાઢી પણે કરતા ભિન્ન ભિન્ન પ્રદેશમાં વિચરે છે એ સમાચાર પણ આપણે માટે નવા નથી. તીર્થની સ્થાપના દરેક તીર્થકર કરે છે ત્યારે સાધુ સાધ્વી આવક આનિકા ઇપ ચતુર્વિધ સંઘમાં ને વ્યક્તિ યોગ્ય જાણ્ય છે તેને મુખ્ય પદે સ્થાપે છે. સંપર્દા દરેકને હોય છે પણ એમાં સંખ્યાની સરખાઈ નથી હોતી. તત્ત્વતી દશ્ટિયે દરેકના ઉપદેશમાં સાખ્ય હોય છે પણ પ્રદૃપણાની રીતીમાં ભિન્નતા સંભવે છે અને એમાં દેશ કાળના સંયોગો કરાણું ઇપ અને છે. પોતાના સમયના વિશાળ જન સમૂહનું માનસ અવધારી લઈ તીર્થપતિ પોતાની ઉભેદન પદ્ધતિ નક્કી કરે છે.

આપણે સૌ અહીં પ્રભુશ્રી વાસુપૂજય સ્વામીની વિધિપૂર્વક પૂજા તેમજ સ્તવના કરી રહ્યા છીએ એ પાછળ આશય માત્ર એક જ છે કે આપણે પણ ને ધર્મરિપુએને તેમણે મારી હડાય્યા તેઓને મારી હડાવી તેમના સરખા વીતરાજ અનીએ કહ્યું છે—

ઇલિકા ભ્રમરીધ્યાનાતુ ભ્રમરીત્વમદ્દુતે ।

અર્થાત્ ધર્યળ જેમ ભમરીનું ધ્યાન ધરતી પોતે ભમરીઇપ અની જાય છે તેમ આત્માએ પરમાત્માના ધ્યાનમાં તદાકાર અનતાં રવ્યં પરમાત્મા

હેઠે થઈ જાય છે. આત્માની સામ્યતા અને અનંત શક્તિ માટે એ ભત છેજ નહીં. આત્મા જે શુલ્ક કરણીમાં ચિત્ત લગાવી પ્રયાસ આરંભે તો મહાત્મા થવું કે પરમાત્માપણું પ્રાપ્ત કરવું જરાપણું મુશ્કેલ નથી જ.

આ ભગવંતના જીવે સર્વ કર્માને ખંઘેરી નાંખી પોતાના આત્માના મૂળ ગુણો જ્ઞાન-દર્શન અને ચારિત્રને સ્થાનિક રત્નસમ નિર્મણ બનાવી દીધા એટલે તે કૃતકૃત્ય થયા. એક કાળે તે પણ આપણી માફક આરાધક દશામાં હતા પણ વીર્ય ફેરબ્યું તો આરાધ્ય બન્યા. એમના જીવન ને નજર સામે રાખી, તેમના ચીધેલા માર્ગ પ્રયાણું કરીએ તો આપણું માટે એ પદે દૂર નથી તેમ નથી દૂર એ સિદ્ધશિક્ષા !

પ્રભુ મૂર્તિનું અવલંબન સંસાર ભ્રમણુમાં આપણુને મહાસાગર-માં ફરતાં વહાણો. અને જહાનેને જેમ દીવાઢાંડી સહાયક બને છે તેમ સુક્રિતના માર્ગ લઈ જવામાં મદ્દદ કર્તાં છે. કર્મરિપુએ કર્યાં કયાં ધામા નાખી પડ્યા છે અને જીવોને ડેવી રીતે ભૂલથાપ ખવડાવે છે, અરે જીતની બાળ હારમાં ફેરવી નાએ છે. એ જાણવા સારુ તીર્થી કર દેવના ચરિત્રો નિર્મણ દર્પણુની ગરજ સારે છે. આપણે એનો શ્રદ્ધાપૂર્વક ઉપયોગ કરી આપણે માર્ગ નિષ્કારક બનાવવાના પ્રયત્નો હાથ ધરવાના છે. જીંચા પ્રકારના પદાર્થો-વિવિધ જાતનાં દ્રસ્યો-એમની સંમુખ ધરી માંગણી તો એ કરવાની છે કે—

હે પ્રભુ ! અમારામાં એ સર્વ ત્યજ દેવાનો ભાવ પેદા થાવ. એ પદાર્થો પાછળની લાલસા નષ્ટ થાવ.

અષ્ટપ્રકારી પૂજા પાછળનું રહસ્ય એજ છે. ૫૦૪ અને ભાવ પૂજાએ દ્વારા આખરી ધ્યેય તો પ્રભુ જેવા આપણે પણ પૂજય બનીએ એજ છે.

આમ જ્યાં એજ વિવેચનની પૂર્ણાદૂતિ કરે છે ત્યાં ભૂપતિના પગલાં ચ્યાં. શેઠના છેલ્લા શબ્દો તેમણે પણ સંભષ્યા. રાજ-રાણી પ્રભુ-

બિંભ-૧ દર્શન-વંદન વિધિ કરી જમેલી મંડળામાં જાચિત સ્થાને
જોડવાયા. સંગીત પણ પૂર અહારમાં પ્રસરી રહ્યું. ટૂંક સમયમાં જ
આરામ મળવાનો છે એવા જ્યાલથી વાંચિત્રો પર વગાડનારાની
અંગળાએ અજાય ગતિથી ફરવા માંડી. એ પ્રેરણા જીલી ગાયકો પણ
પૂર્ણ રંગમાં આવી ગયા. વધાઈ અને આરતી- મંગળદીપની નિધિ
પૂર્ણ થતાં જ સૌ વીખરાવા માંડ્યા.

- શેડની વિનંતીથી રાજવી પરિવહું સહિત બગીચામાં એક 'આજુ
ભિભા કરેલા મંડપમાં પધાર્યા, તેમની સન્મુખ શેડંપતીએ પોતાના છ
પુત્રો સહિત આવી નજરાણું ધર્યું' અને પોતાના પિતાશ્રીના અવસાન
અંગે કરેલ ઉત્સવમાં આમંત્રણું માન આપી પધારવા અદદ આભાર
માન્યો.

આ કાર્યની પૂર્ણોહતિ થતાં રાજ-રાણી રથમાં એસી દરખારગઢન
માર્ગ પરિવાર સહિત પંડ્યા.

અભ્યાના સવાલથો દ્વિવાહને કહ્યું કે—

શેડ સુદર્શન એ તો ચંપાનગરીનો આગેવાન વહેપારી છે. એની
પ્રમાણિકતા અને શુદ્ધ ચરિત્ર માટે એ મત ન હોવાથી, વ્યાપારી
મહાબ્લનમાં એ વડો છે અને નગરીનું એક અણુમોદ રતન છે. 'હીરો
ને કુંદને જખો' એ ઉક્તિ અનુસાર એની પતિન મનોરમા પણ કુળવાન
ધરનું રમણી રતન છે અને સતી નારીઓમાં અથવે આવે છે.

કુવિવયન મુજબ 'કલાગરા છે દીકરા, અને કુલવંતી છે નાર' અહો તો સાક્ષાત જોવા મળે છે. ઇપ-વિનય અને નભ્રતામાં પુત્રો પણ
એક ધીજાની ફરિકાધમાં જિતરે તેવા છે. વળી લક્ષ્મીહેવાની પણ મહેર
એ કુદુંબમાં પૂર્વજોના વારસાડ્યે જિતરી છે.

'ખરેખર, સુખ તો એવું છે કે હરકોઠને છર્યાં ઉપને—'

આટલું ખોલતાં અભયારાણી એકાએક ડાંડા વિચારમાં પડી ગયાં. મન તરંગોના હિંડોળે ચદ્રયું. પરણીને આવ્યા પછી વર્ષોનાં વહાણું વીતી ગયાં, છતાં સંતાન સુખદર્શનને. પ્રસંગ આવ્યો નહિ. કાલીયેલી વાણીમાં ખોલતા એકાદ ખાગડથી પોતાનો જોળો ભરાયો નહિ; અથવા તો ‘મા’ એવા સંભોધને ખોલાવનાર એકાદ અર્બંક નજર સામે રમતું જોવાયું નહિ. એ ઉણુપ મોટા વિરાટ સ્વરૂપે સ્પૃહી નાચી રહી.

માતૃપદની લાવસા અજખ છે. એ માટેની નારીજલિમાં તીવ્ર વાસના સહજ હોય છે. એ પદ પ્રાપ્તિ વેળા પાછળ તોકિયા કરી રહેલ મરણુંત કષ્ટની પણ ભીતિ પર વિચાર સરખે જતો નથી. એ વરસના અન્ય સુખોની તેણીને મન જાઝી કિંમત નથી. એટલે તો વાંઝીયાપણું ટાળવા એ ગમે તેવા સાહસ વહેરે છે.

અભયારાણી આખરે તો એ જલિમાંનું જ એક પાત્રને ! રાણીપદ એ જરૂર સુખ-વૈભવની ટોચ સમું. પણ આજના બનાવે-મનોરમા જેવી પ્રૌઢાના દર્શને અંતરમાં દ્શપાયેલ માતૃત્વની વાસના એકદમ સતેજ કરી દીધી. મન તરંગોની આવલિઓથી જિલ્લારાધ રહ્યું.

રાજમહાલયના વિલાસો, દાસદારીઓની હારમાળા, પાણી માગતાં પૂર્વે દૂધ મળે તેવો સાહેણી, રાજવીનો એકધારો સ્નેહ, અને અંગહેશનું મહારાણીપદ, સંતાનના અભાવમાં તેણીને બાળી નાખવા લાગ્યાં. અરે ડોડીની કિંમતના પણ ન જણાયાં. આંખો સામે સતી મનોરમા વૈભવના શિખરે બેઠેલી હેખાઈ. મન પોકારી જિદ્યું. અહા, ડેવી ભાગ્યશાળી એ અછિ પ્રિયા ! એક એ નહિ પણ છ તો છોકરા !

વળી રૂપ-રંગ અને કાંતિમાં અનંગ હેવનાજ અવતાર સમા ! નારીજીવનની સફળતા માતૃજીવનમાં સમાયેલી છે. વંધ્યત્વ તો અભાગી-પણુંતી જળતી ચિરાગ છે. અરે પૂર્વજનમના મહાપાત્રકનું મૂર્તિમંત

સ્વરૂપ છે. જો મારા નર્સાબમાં એ કંદું રેખા જ અંકયેદી હોય તો,
આ મહાલયના સુખોની કંદજ કિંમત ન જણાય !

ત્યાં તો સાથમાં રહેલા સ્વામીના હાથના જેંચાણે અને ઉચ્ચ્યરયેદા
નિઝન શાખાઓ, આગળ વધતી વિચારમાળાને અટકાવી.

પ્રિયે ! એકદમ મૌન કેમ અની ગાંધી, કે હેંશલેર આપણે દર્શને
આભ્યા હતા અને એ દેણા તારા ચહેરા પર ઉમંગની ને લાલાશ
દષ્ટિગોયર થતી હતી, તે આમ પાછાં કૃતાં એકાએક વિષાફની કાલિ-
મામાં કથા કારણે બહુલાઇ ગાઈ ? એવી તે કદ ગડન ચિંતાએ એકાએક
તને ઘેરી લીધી.

નાથ ! મનોરમાના પ્રસંગમાં આભ્યા પછી મારી સંતાનભૂભ
એકદમ ઉત્ત્ર બની છે. નારીજલતિ માટે વંધ્યત્વ જેવું અન્ય કોઈ હુઃખ
નથી. એના અભાવમાં આપણી આ રિદ્ધિસિદ્ધિ સર્પડંશ સમ ડંખે છે.

વહુલે ! તહારી વાત સાચી છે. મને પણ ગાડી વારસની ચિંતા
ઓછી નથી સુંજવતી. એકના વિયોગ પછી કંદ ભાળ જ ન મળો.
અને બીજુના સંતાનનું શું થયું એની પણ ખખર નથી. એ મારા
જેવા ને ઓછું ડંખ્યતું નહીં હોય. વધના અંક તરફ નજર નાંખતા
હુદ્ધય નિરાશા અનુભવે છે. મિત્ર યશપાલની સલાહથી ‘લાખો
નિરાશામાં અમર આશા ધૂપાઈ છે.’ એ કંવિ વચ્ચનનો સધિયારો
લઈ સંતોષ પઢું છું. તું પણ આશાવંત અન; તહારી સખ્ખી પંડિતા
હેંશિયાર છે. એની સલાહથી કોઈ વ્રત-આખડી કર, કારણું કે ધરમ
કરણીથી પૂર્વના અંતરાય કર્મો ત્રુટે છે. પૂર્વજન્મના દુષ્કર્મોને ટાળવા
સારુ પ્રભુભક્તિ અને તપ-આચરણ એ રામભાષ્ય ધ્લાંજ છે. આશા
દીવડા પર આધાર ન રાખે તો માનવ બીજું કરી પણ શું રહે ?

ત્યાંતો રથ, પ્રાસાદ આવતાં થોષ્યો. એમાંથી શિતરી રાજ-રાણી
મહાલયના પગથીઓ ચઢી પોતપોતાના કભરામાં ગયા.

કમરામાં પ્રવેશ્યા છતાં, અને ચ્યક્ષુ સામે સહેદ ચાદરથી આચ્છાદિત
પદંગ અને એ ઉપર મશરૂતાં ઓશિકાં જેવા છતાં રાણીને એમાં
પડી આરામ લેવાનું મન ન થયું. મનમાં પુત્ર પ્રાપ્તિની અદ્ભુત ભૂખ
ભલકૃતી હતી. વારંવાર વિચાર પણ એ અંગે જ આવતા હતા.
ઉદાહરણું પણ અને અનુદ્રાગ જરૂતાં ધનસ્પતિ જેવી એકદિની જાતિમાં
પણ રૂપ આપવાનો—નવ પલ્લવિત થવાનો—સ્વભાવ છે અને હું એથી
વંચીત ! કેરીઓથી લચી રહેલ આખ વૃક્ષ મંગલિક ટાણે યાદ કરાય,
અરે મૂખ્ય દાર પર એના પર્ણોનું તોરણ બંધાય. કારણું એક જ અને
તે ફળવાપણું !

તિર્યંત્ર ડેટિમાં લેખાતાં પણુપંખીએ પણ પોતાના પરવશ
જણ્ણાતા જીવનમાં બન્યાં—કંચ્ચાં સહ એસી કલ્લોાં કરવાની વરીએ।
મેળવે છે જ્યારે હું જ કેવળ એકલવાયી ! દંપતી જીવનની સફળતા
વંશ વેલની વિકસનરતામાં છે. ગૃહસ્થ જીવનની એકરસતા—પૂર્ણલય
લીનતામાંથી જ સાંતાનરૂપ પાકનો ઉદ્ભવ થાય છે. ઉભયના પ્રતિબિંબ
રૂપ અર્ભાંક એ ગુણહર્ષક આરિસો કે વળગાડે જાંદું તો અતૂટ ધારે !
જ્યાં એ નથી ત્યાં કંઈજ નથી.

ડાચભી રીતે, અમે તેવા સાહસે મારં વાંઝીયાપણું તો યાળવું
જ જોઈએ.

હા, હા, એ વાત સો ટકા સાચી. પણ— ..

અરે પંડિતા, હું કયારની અહીં આવી છો ?

તમો રહ્યા મહારાણી, ડોલુ કયારથી આવ્યું છે અગર કયાં જિલ્લાં
છે ? એની પરવા આપ સરખાને કયાંથી હોય ?

સખી, પારાયણ કરવાનું મુક્કી ને હોય તે જટ કહી નાંખ.

ડોને કહું ? રસોઈએ ભાણું પીરસીને દાસીઓને હોડાવે.
મહારાજા, વાટ જેતાં ભાણુપર એમી રહે. અને આપ તો અહીં

સંતાનપ્રાપ્તિના સોણુલાં સેવતા હો. એ દશામાં પેલી બિચારીએ તો અવાજ માર્યે જાય ને આખરે ફરમાન છુટે આ પંડિતા ઉપર ! પિયરની ફાસી એટલે એના ઉપર બેવડો દાવો. અમે તે કામ કરતી હોય છતાં આજા થતાં દોડતાં આવવું જ પડે !

પધારો, મહારાણીજ ! જીતશક્તિ મહારાજ ઉપર આપે અન્યથા જાણું કર્યું છે; આપની હાજરીની એ માર્ગ પ્રતીક્ષા કરી રહ્યા છે.

સત્ત્વર ચાલો, પહેલા પેટની અભિન બુઝાવો પછી નિરાંતે દેહની ભૂખ ભાંગવાનાં રવનાં સેવનો.

જ, તેમને કહે કે મારા શરીરે અસુખ હોવાથી તેઓ એકલા જન્મા લે. કષીને અહીં સત્ત્વર પાછી આવને. તારી સલાહ વિના અભયાંશી કંઈજ થવાનું નથી.

પંડિતા રસોડામાં સંહેરો પહોંચાડી આવી, અને એ સાથે ભૂપતિના મુખેથી બગીચામાં બનેલ પ્રસંગ અને એ ઉપરથી રાણીને ઉપજેલ સંતાનભૂખની વાત પણ જાણુંતી આવી. ખુદ રાજવીએ એ સંબંધમાં ઉપાય યોજવાની તેણીને તાકીદ કરી.

એણે અભયાને ઘાલવવા, આવતાં ભેરજ, મેં મહાકાળી કહેવા કહેવા માડ્યું—

રાણીજ ! તમારી પોતા પદ્માંદી ગાઈ છે. આહારભૂખ તો સમજાય પણ તમારી ભૂખ તો અન્યથા છે ! સંતાન એમ રસ્તામાં નથી પડચાં. એ તો કર્માધિન વાત. સોણુલાં સેવવાથી ઓછો જ ખાણો ભરાવવાનો છે ! એ પાછળ તરંગો વહેતા મૂડવા કે વલોપાતા કરવા તે જાંઝવાના જળ જોઈ હરણો પાણી પીવાની ફૂવાંગો મારે તે સરખું નિરર્થક છે. પાતળી પહેલી રેતની કૃત્રિમતા દૂરથી જળનો ભાસ કરાવે તેથી ઓછી જ ત્યાં જવાથી પાણુની તૃપા છીપે ! સંતાનપ્રાપ્તિમાં સૌ પ્રથમ તો પૂર્વનો જણાનુભંગ જોઈએ છે. એ ઉપરાંત અન્ય કારણોની સાનુકૂળતા પણ જેવાની હોય છે. ધણ્યાખરા દાખલામાં જેમ ઉખરભૂમિમાં પાક ન સંભવે તેમ અમુક ખીઓના બંધારણું જ એવાં હોય છે કે તેમને

ગર્ભ રહેતો જ નથી ! એટલે નાસીનાનિનેં એ હોષ ગળુાય છે. પણ કુદુરું વેળા એથી ઊલદું પણ બને છે. પુરુષના દોષેને લદું નાસીનાનિને ઝરણ્યાત વાંઝણી દરશાને અનુભવ કરવો પડે છે. ચિંતાથી કાયા શોષાય અને આહાર ઉપર અર્દચી જન્મે એ વધારામાં ગળુાય. પણ પતિવ્રતા સ્વીના શિરે એ ધર્મ અનાદિકાળનો ચાલ્યો આવતો છે. એ સામે અંગળી ચીધવાથી કંઈ જલાતી નથી. વંધ્યાને સ્વામી પુનઃ લગ્નથ્રી દારા પિતૃત્વ પામી શકે, પણ હીનપુરુષાર્થી કે વંડની ભાર્યા માતૃપદ ન જ મેળવી શકે !

સખી, મારે ત્હારાં આ નીતિવચ્ચને સંભળવાં નથી. મારા અંતરમાં કે ભૂખ ઊધડી છે અને એનાથી કે અજિન પેદા થઈ છે એને શાંત પાહવાનો ઉપાય શોષવો એ ત્હારો ધર્મ છે. મેં રહે ગુરુપદે સ્થાપી છે એટલે ઝરણ પણ છે. તું અદ્ધ કરવા માંગે છે કે કેમ ?

કહાય અહા ન કરું તો શું શિક્ષા કરશો ?

રહે શિક્ષા કરવી એ મારી શક્તિ બહારની વતા છે. બાકી એમ ચવામાં વધું નિલંઘ થશે તો તો ત્હારી અભયાને 'ચિત્તાખ્રમ' જરૂર લાગુ પડશે જ. અગ્રમિત મગજવાળા વ્યક્તિ શું નહીં કરે એ કલ્પવું સુશ્કેલ છે.

આમ આકળા ન થાવ. આ કંઈ સામા આડે લટકતી લંઘ તોડી આણુવા જેવું કામ નથી. વિધિના હાથની વતા છે. માનવ કો પ્રજાના નેરે મનોકામના સિદ્ધ કરવાના પ્રયાસ કરી જણે. તમારા મારે હું મારી નજર પહોંચશો ત્યાં લગી ઊડીશ. એક પણ ઉપાય અજમાયા વગર નહીં રાખું. તમારા ભાગ્યયોગે ખુદ મહારાજાએ પણ એ કાર્ય મને જ સાંચ્યું છે. પણ તમો ચિંતાને કહાડી નાખો અને પહેલાની માઝું હસતા રમતા બની જાવ. વિના કારણું દેહને શોષવાનું બંધ કરો તો જ મને નિરાંત વળો.

પણ જ માર્દ મગજ એ દિશામાં વળો. કાળા માથાના માનવીને કંઈ જ અશક્ય નથી.



પ્રકરણ ૧૪ મું કૌમુદી મહોત્સવ



ઉત્સવ ઉજવણીની શરૂઆત તો સંધ્યાકાળ પછી, આકાશમાં પૂર્ણિમાને ચંદ્ર પૂર્ણ કળાયે ભીલી નીકળતાં થતી, છતાં ચંપા નગરીની પ્રજા મધ્યાનહકાળ વીત્યાને માંડ ધરિકા થઈ હશે ત્યારથી જ એ કુદરતી મોજ માણુવા નગરીની ખારાર જઈ રહી હતી. સામાન્યતઃ આવા ઉત્સવ વર્ષમાં ત્રણેક વાર ઉજવાતા અને એમાં રાયથી માંડી રંક પર્યાત દ્શ્ટથી ભાગ લેતાં. ધણું ખડં આ જાતની ઉજવણી ત્રણ દિન પર્યાત ચાલતી અને કોઈક વાર એક અહવાડીયા સુધી પણ લંખાતી. વસંત ઉત્સવ—કૌમુદી મહોત્સવ અને વિજય દર્શભીનો ઉત્સવ તો લગભગ એ કાળે ભારતવર્ષના પ્રત્યેક રજવાડામાં ઉજવાતા પ્રજનનો મોટી સંખ્યામાં કુદરતને આંગણે જિતરી પડતા અને દ્શ્ટથી મનગમતા આનંદ માણુતા. એમાં રાજવી અને અન્ય અધિકારીઓ પણ વિના સંકોચે ભણતા; કયાં તો વસંત ઝડુની નવપત્રલિંગિત વનરાજુનો આનંદ હોય, કયાં તો સંપૂર્ણ કળાયે ભીલેલી ચાંદનીનો આનંદ હોય, અથવા તો ક્ષાત્રવૃત્તિના નિતરા દ્વર્ણન સમે દરેરાનો

દિન હોય. નગર લગભગ ખાલી થઈ જતું. આમ જનસમૂહના આનંદ પ્રમોદ માટે તેમજ ખાણપીણા માટે હારથંધ દુકાનો જીબી થઈ જતી. શમિયાણા જીબા થતા, તંબુઓ નંખાતા અને નાની રાવટીઓની હારમાળા સર્જાતી. એકાદ નાનકડા ગામ જેવો દેખાવ બની રહેતો, શહેરમાં મોટા હાટો એ દિનોમાં જીદંતર બંધ રહેતાં. બાળ-યુવાન અને પ્રૌદ વર્ગનો લગભગ નેવું ટકા ભાગ આમાં હાજરી આપતો. હોનાથી નગરના આવાસો ખાલીખમ જણ્ણાતા. ડોધમાં અતિ વૃદ્ધ આદમીઓ જણ્ણાતા તો થોડાકમાં આજરીની ખથારી દષ્ટિગોયર થતી. આવાજ કારણ્ણવાળા કે શોક નિમિત્તવાળા અથવા તો ખાસ કોઈ વતધારી સિવાય નાનું મોદું સૌ કોઈ ઉલ્લાસપૂર્વક ઝુલ્લા મેદાન પર આલલાના વિશાળ છત્ર હેઠળ, વનરાજીથી વિપુલ અને વિવિધ પ્રકારના પક્ષીવંદ્ધી ગાજ રહેતાં સ્થાનમાં કુદરતે છૂટા હાથે વેરેલા આનંદનો ઉપભોગ કરતું.

રમતોમાં દેહને ખડતલ બનાવે અને એના અંગોખાંગને પુષ્ટિ આપે એવી જાતજાતની, જુદા જુદા પ્રહેશમાંથી આવેલા કુર્સ્તીખાને તરફથી થતી. અન્ય સ્થળે વળી અંગ મરોડના વિવિધ અભિનય થતા, કોઈ ભાગમાં સંગીત વિશારદોની હુક જામી જતી અને વિધ વિધ વાજિંગ્રોના મીઠા રવની રમજટ બોલતી. એકાદ ખાજુના તંબુમાં હુક્કાણાના નિતરાં પ્રદર્શન કરાવતાં વિવિધ રંગી ચિત્રોની એણી નજરે ચઢતી.

અહીં શિલ્પોએ અને કણાકારો આવતા. અર્થ વેચનાર સોદાગરો કે કરિયાણ્ણાના વેપારીઓ પણ આવતા. એ વસ્તુઓના પરીક્ષાઓનો પણ અભાડો જમતો. પોતપોતાના અનુભવથી એનાં મૂલ્યાંકન થતાં. એ અંગેના મોટા સોદા કે લેવડહેવડનો ઉત્સવ પછી થતા, પણ ભાવ તાલ તો અહીં જ નક્કી થઈ જતા. જુદા જુદા નજીકના પ્રહેશની નવ નવી ચીને, હાથ કારીભરીનો માલ અને વિવિધ ફ્લાન્ડિંગ અહીં જોવાનાં મળતાં.

દ્રોંકમાં કથીયે તો વીસમી સહીના સંગ્રહસ્થાન કે પ્રદર્શનની શરત આવા ઉત્સવ સારતા. કોઈના ચહેરા ઉપર ચિંતા જવલ્યે જ જણ્યાતી. ઉમંગ-ઉલ્લાસ-પ્રકુલ્લતા વિનોદ અને કુતૂહલ વૃત્તિનાં જ સર્વત્ર દર્શન થતાં.

પુર્ખિંમાંની ચાંદની ખીલે અને ચંપાના પુરજનો એમાં મહાલે તે પૂર્વે વાંચક જરા રાણી અભયના આવાસમાં ડેક્કિયું કરી લે.

ઉત્સવ આવતાં પૂર્વે સુંદર વખ્તોની અને કિંમતી આભૂષણોની તૈયારી કરી જણું દ્વિન માટે જનતાતના શાણુભાર નક્કી કરનાર સુંદરી અભયા! આજે વેત્રાસનપર શાન્યમનરસં જણ્યાય છે. સંધ્યાકાળ આવવાની ઘડીયો ગણ્યાધ રહી છે છતાં જવાની તૈયારી જણ્યાતી નથી. ત્યાં પંડિતાનાં પગલાં થયાં.

એને જોતાં જ રાણી બોલી જઈ. કેમ સિંહ કે શિયાળ ? અનુભું જ મુહૂર્ત છે ને ?

બા, અનુદૂળ તો આજનો દિવસ છે. આવો યોગ પુનઃ ગ્રાસ થવો સંભવિતી નથી. છતાં છષ્ટ સિદ્ધિ માટે સો ટકા શાંકા છે. એ માર્ગ પણ કુલીનતાનો નથી. અને જે આડું ફાટે તો સામે જ સર્વનાસ સુખ ફાડી બોલો છે.

છી, છી, એવી વેવલાધની વાતો આ ક્ષત્રિયાણી સાંભળવા ટેવાધ નથી. જ્યાં અંતરની આજ હંરવાની, અને સંતાનની ભૂખ ભાંગવાની તમના મધ્યાનહે પહોંચી હોય લાં ‘જે’ ‘તો’ ની વાતો ન ચાલે. શાંકા ન જ સેવાય અને કુલીનતાને આડી ન જ અણ્યાય. આંધળાયા કરીને ઝુકાવલું જ રહ્યું. પેલા કવિનું વચન યાદ કરવું હે—‘યાહોમ કરીને પડો, ફેઠે છે આગે.’

જે તમો આટલી હુદે તૈયાર છો તો મને ભીતિ ધરવાનું કંઈજ કારણ નથી. રાજવીની સૂચના પઢીથી એ અંગેતી ભારી કાર્યવાદી

તો આરંભાધ ચૂકી છે. અંતઃપુરના પહેલેગિરે. અને દાસદાસીએ. સૌ કોઈ જાણે છે કે રાણીજી સંતાનપ્રાપ્તિ અર્થે કામિતપૂરણું યક્ષની મૂળ પ્રત્યેક રવીવારે કરે છે. જી સારુ પંડિતા, યક્ષની મૂર્તિને પાદખી-માં લઈ આવે છે અને પાછી મૂકી આવે છે. કામિતપૂરણું યક્ષની પાથાણું પ્રતિમાને સ્થાને આજે સાક્ષાત્ કામહેવને લાવી તમારી સન્મુખ ખડો કરું. અને પટાવી-મનાવી છંચ્છા પૂરી કરવાનું તમારું કામ.

હા, હા, મારા કમરામાં એક વાર તું એને રણુ કર, પછી એ છે. અને હું છું.

મદભર યુવતિના કટાક્ષ બાળોમાં એકાંત આવી જનાર હર કોઈ લોભાવાનો જ. અરે પગ ચૂંબવાનો. પણ અને વનસ્પતિ જેવામાં એ આકર્ષણું છે તો પંચેંદ્રિય માનવીમાં તો વિશેષ હોય. વીસ નખીના પાશમાં એકવાર પડયા પછી કોઈ છૂટે ખરો?

જ, જ, પાડી તૈયારી કર. શુભસ્ય શિદ્ધિમ.

હું પણ મહારાજને 'તબિઅત નાદુરસ્ત છે માટે કૌમુદી મહો-ત્સવમાં ભાગ લેવા નહી આવી શકાય એમ કલેવડાવી દઈછું.

એમના સિદ્ધાવી જયા પછી મોહિનીનો સ્વાંગ પૂર્ણપણે સજી તૈયાર રહું છું. તહારી જ માર્ગપ્રતીક્ષા કરું છું. આજે તો કાર્ય સિદ્ધ કરવી જ છે. કયાં તો આ પાર કે પેલે પાર.

રાણીનો કમરો છોડી દરખાર ગરમાં પગ મૂકતાં જ સ્વારીની તૈયારી આંખે ચઢી. સૈનિકો-અશ્વારોહીએ અને નાના મોટા સામંતો. મહોત્સવમાં જવા સારુ પોતપોતાના પોશાકમાં સજજ થઈ જિલા છે. રાજીવી દધિત્રાહન પધારી આજા આપે એટલી જ ઠીક છે. ઉંકા નિયાન તો મણી બહાર પણ પહોંચી જયા છે.

ત્યાં તો ભૂપ આવી પહોંચ્યા. પણ સાથમાં પ્રેયસી અભયાસુંદરી નહોતી. સર્વ તૈયારી નિરૂપી વિલંઘ કરવાનું પ્રયોજન ન જોઈ.

મહાવતને આજો કરી કે અજરાજને નજુક લાવો. અને રહસ્યમંત્રી યથપાત્ર પાસે આવી ગ્રદ્ધ કરે તે પૂર્વે જ એ બોલ્યા—

રાણીની તથિઅત અસ્વર્ણ છે. છેલ્લા ઉઘાન દર્શનથી પાછા કૃષ્ણી પણ દંડિક માનસિક પોડા રહે છે. ખાસ ચિંતાનું કારણ નથી. આ વેળા તેણી સાથમાં આવનાર નથી.

મહાવત હાથીને ઓટલા નજુક લાવ્યો કે તરત જ કુલાંગ મારી ભૂપતિ હોદ્દામાં ચઠી બેઠા અને સવારીને આગળ વધવાની આજો સંભળ્યા. બનાર માર્ગે જેમ જેમ એ આગળ જતી ગઈ તેમ તેમ જનસમૂહની લીડ પાછળ વધતી ચાલી. જેનારા કરતાં સાથે જનારાની સંખ્યા અતિ મોટી હતી.

સુદર્શન રોટની હવેલી આગળથી સવારી પસાર થઈ રહી. રાજવીની નજર ગ્રદ્ધામાં ઉલ્લેખ રોટ પુત્રો તરફ ગઈ. તેએ પણ જ ઉત્તરવા માંડ્યા. અને પાછળના વુંદમાં લેણાયા. પ્રણિંભા એટલે પાખીનો દિવસ. સુદર્શન રોટ તો દેવાદ્વય સમીપની પૌપદ શાળામાં પૌપદ પ્રતમાં સવારથી બેઠેલા. માત્ર જનતાનો મોટો ભાગ જ નહીં મુલુ ખુદ રાજવી પોતે જ્વાલા હતા કે રોષ્ટી દરેક પર્વણીમાં પૌપદ પ્રત કરે છે એટલે જ એ ઉત્સવમાં જોડાઈ શકતા નથી. રાજમાર્ગ વટાવી મુખ્ય દરવાજમાં જઈ સવારી જ્યાં કૌમુકી મહોત્સવની ઉજવણી થવાની હતી એ મેદનમાં આવી પહોંચી લારે ધરતીપર સંખ્યાના એળા. ઉત્તરી ચૂક્યા હતા. ડેર ડેર દીવાઓની શ્રેણી પ્રગટવણો જ્યારંભ પણ કર્યો હતો. આકાશમાં હજ ચંદ્રદેવ પૂર્ણ દળામાં પ્રવેશ્યા નહોતા; એટલે દીપકોના પ્રકાશમાં જનસમૂહ સવારી-માંથી રાજવી જ્યાં પોતાના માટે નિયત કરેલ જરિયાનભરીત શમિયાનામાં સિખાવ્યા કે તરત જ, વિભરાવા માંડ્યો. અને રાત્રિ મહેના નિશ્ચામરણની એણખુમાં પડ્યો.

નાનકડી છાવણી સમા આ પ્રદેશવાસીઓને કૌમુદી મહોત્સવ ભાષુના દ્વારા ફરી એક વાર રાજમહાલય પ્રતિ ટાપ્ટિ વાળાએ. દરવાજા પરના પહેરેગીરે સિવાય અત્યારે ત્યાં જાઝી ધમાક દેખાતી નથી. જે કંઈ પ્રકાશ જીડીને આંખે વળગે છે તે રાણી અભ્યાના પ્રાસાદમાંથી જ આવે છે. સમયનું ચક્ક અરખલિત અતિએ પોતાની કુચ ચાલુ રાખતું હોવાથી ઘંટાધરમાં જ્યાં નવના ટકોરા વાગ્યા કે એ મહેલના દાહરપરથી એક અખણા ત્વરિત અતિએ ઊતરતી દેખાઈ. અરે આ તો રાણીની રહસ્ય સખી પંડિતા. ઉભય વચ્ચેના સંકેત અનુસાર નિશ્ચિત કરેલા કાર્યની સિદ્ધિ અર્થે તેણી જતી હોય એમ જાણુાય છે.

ચંચળ ગતિએ ચાલતી એ રમણીને નથી તો ચોકીદારની પરવા કે નથી તો દરવાજાપરના પહેરેદારની રોકોડાઈ. એની અવરજનવર આટલી હુદે, સંકોચ વગર થવામાં એની પ્રણાએ પૂરી યારી આપી છે. દિવસો પૂર્વેથી આદરેલા પ્રયોગની આજ તો સિદ્ધિ કરવાની હતી. એ પ્રયોગો દ્વારા એને પહેરાપરના રક્ષકોમાં એવી સંચોટ છાપ બેસાડી હતી કે એ મોડી રાતે કયાં જઈ રહી છે અને કયારે પાછી દરવાની એનો વહેમ પણ જ્યાં ઉપજે તેમ નહોતું, ત્યાં સવાલ કરવાની વાતું જ આં હતી ?

ત્વરિત અતિએ રસ્તો કાપતી પંડિતા, રાજમાર્ગ વટાવી, મહાનના વાસ પ્રતિ વળી અને જ્યાં આડા એ વળાંક લીધા ત્યાં અમણો ચોમાસામાં જે સ્થાનમાં સ્થીર વાસ કરતા એવી પૌથંશણણા સમીપ આવી પહેંચી. આ સ્થાનની નજીકમાં શ્રી અરિહંત દેવનું મોદું મંદિર હતું. એને દરતો કોઈ હતો. એ અત્યારે બંધ હતું. સંધ્યાકાળની આરતી થયા પછી આ ભાગમાં નહિ નેવોજ અવરજનવર રહેતો. ધર્મ-કરણીના આ સ્થાનો, ઉપાસક વર્ગની કસ્તીના છેડા તરફ આવેલાં હતાં.

પંડિતા પૌર્ખશાળાના અંભંગ દાર આમળ થોલી. જ્યાં અજ-
ગાળામાં પોતે આવી તે દિશાન્ત સામી દિશામાં નજર નામે છે ત્યાં
ખુફાની બાંધી છે જેમણે એવા ચાર માનવીઓ પાલખી ઉપાડી આવી
. રહેલા અને એમની આગળ તૃપ્તિથી ચાલી, માર્ગદર્શકનો ભાગ
ભજવતો તેમનો સુખી દણ્ણોચર થયા.

તરતબ એનો ચહેરો રિમતથી છવાઈ ગયો. અને તેણી ધીમેથી,
સુખી નજ્ર આવતાં ખોલી—

એડાન્સિંહ, તમો વખતસર આવી પહોંચ્યા. મારી વાત તો ચાદ
છે ને? તમારી ભૂત થાય તેમ નથી છતાં કરીથી સાંભળી લ્યો—

આ ડિલાડા દરવાળમાં થઈ સિધા જવું. સામેજ દાદર છે. એ
ચઢ્યા કે પહેલોજ પૌર્ખશાળાનો સુખ્ય કુમરો આવશે. આ સ્થાનમાં
દીવો તો હોતો જ નથી, પણ ખારી વારે આવતા ચાંદનીના પ્રકાશમાં
હાથમાં ચરવલો. અને સુહૃપત્તિ પકડી નીચી મુંડીએ જિલેલા માનવીએ
નજરે પડ્યો. સુદર્શન શેદ્દને તો તમો પિછાનો છો. મેં આજ સત્રના
જ એ અહીં આવી રહ્યા હતા ત્યારે દૂરથી અતાવ્યા હતા ગેજ. સાથેનો અંધાર કપડો ઓઠાડી તરતજ એમને ઉઠાવજો. એમની આ
ધર્મક્રિયા એવા પ્રકારની છે કે ન તો એ, અથવા સમીપમાં જિલેલા
ખીજાએ જુચ્ચાર સરખો કરે! એ તકનો પૂરો લાલ ઉઠાવી, જટ દાદર
જિતરી, પાદખીમાં નાખી, ઉપરના વખ્તને બરાબર ચારે ખાજુ ઢાંકી,
મેં નિર્દિષ્ટ કરેલા ગલીકુંચીના માર્ગ થઈ, દરખારગઠ સામેના બડુલ્સ
હેઠળ આવી પહોંચ્યો. ત્યાં હું તમારી રાહ જેતી જિલી છું.

હું સિધાવું છું, જાવ કરો ઇંદે.

પંડિતાની જોડવણીમાં ખામી સંભવે જ નહિ. કર્મ વૈધવ્ય
ઓઠાડી સુખ ધીનવી લીધું હતું પણ એનું જેર કોહામાં વસતી પ્રસા
પર નહેઠાં ચાદ્યં. પાકી ગણુતરી અને પૂરી તપાસ પછી જોડવેલી આ.

તરકીએ જરા પણ વિદ્ધન વિના પાર જેતરી. વડ હેઠળ તેણીને આજુ થોબલું ન પડ્યું. ખડગસિંહ શિકાર સહ આવ્યો. ત્યારે દરશ ધંડા અન્યાને થોડી પણોંજ વીતી હતી. એ આગળ, પછી પાલખી અને પાછળ સુખી. એ રીતની ગોડવણુંથી આ નાનકડું સરખસ સુખ્ય દરવાળ પાસે આવી પહોંચ્યું.

પહેરેગીર કંઈ પ્રક્રિયા કરે તે પૂર્વેજ ઝેંડા મલકાવી પંડિતા ઓલી— આપલીઆ, આ જાતના જ્યુ-તપ અને વિધિવિધાનથી હું તો થાકી ગઈ ! જ્યારથી રાણીજ દર્શન કરી આવી પથારીવશ થયા છે ત્યારથી મને તો જરી પણ જંપવાવારો નથી ! તકદીરમાં ડિટ-એસ અને ઉનિગરા. હું પિયર તરફની રહી એટલે મારા શિરે એવડી મજુરી.

દાદા ! આરામ વિના તે ચાલી શકે ? પશુને પણ વિશ્રાન્તિ જોઈએ છે તો માનવ જેવાને ન જોઈએ ? સાચું ખોલજો !

દાદા, કંઈ કહે તે પૂર્વ, પાલખી ઉપાડનારા તરફ આંખ મચ્છોડી ઓલી—

અરે તમો શા સારુ થોબો છો ? જવ, જલ્દી કરો, જો પેલો સામે દીવો. બણે છે એ મહેલ. અટપટ દાદર ચઢી, દેવને પધરાવો. ત્યાં તો હું આવી પહોંચ્યું છું. આ તો એકજ માલિકના નોકરો. એટલે જરા હુદયની વાત ઠલવાય ! અને તે પણ દાદા જેવા ખુર્જગ પહેરેગીર છે તોંજ. આંવાત રાણીજના કાને જાય તો રોટલો. ને ઓટલો. અને. જય. તરત જ પોટલું બંધાવી પાણીયું ચાંપે !

કેમ દાદા ? એકું કહું છું ?

હાં, હાં, એટી ! નોકરી એ તો એધારી તરવાર !

પંડિતા, સરખસને સહીસલામત પહોંચેલું જોતાંજ, મોટેધી ઓલીઃ એંચ કામિતપૂરણ યક્ષરાંજ ! મારા રાણીજનો રોગ ટાળજો અને એમની કામના સિદ્ધ કરજો. એમતું હુંઘ ટલે તો મને પણ ધડી અરામ મળે.

આ દાદા પાસે સુખુઃખની એ વાત પણ કરવા અવાય. પ્રભુ ! આજની પૂજનથી જરૂર સંતુષ્ટ થને. તરતજ એ ચાલી નીકળી અને પાછું જોતાં કહેતી ગઠ.

દાદા ! પેલાં મજુરોને હમણાંજ વિદ્યા કરું છું એટલે એમના ગયા પઢીજ દરવાળે બંધ કરને.

રાણી અભયાના ક્રમરામાં સુદર્શન શેઠને કાયોત્સર્ગ ધ્યાનમાં જાબેલી અવરથામાં મૂકી દઈ, મુખી અડકસિંહ પાલભી ઉપાડનારા માણુસો સાથે મહેલમાંથી વિદ્યા થઈ જયો. પંડિતા પણ રાણીજને ખબર આપી આવી કે નક્કી થયા મુજબ શેઠને ઉચ્ચકાવી લાવવાની ફરજ પોતે બજાવી ચૂકી છે અને શયનગૃહમાં એમણે ખડા કરી દીધા છે. તમે સત્તર જ્યા અને તમારી કળાથી રીતવી છદ્દ સિદ્ધિ કરો.

સોણ શણભાર સજી જ્યારે અભયાને શયનગૃહ ખંડમાં પગલાં પાણાં ત્યારે તેણુંને. દેખાવ કોઈ સર્વાની અભસરાને પણ ટપી જય તેવે હતો. દેહયદ્ધિના પ્રત્યેક અંગો જણે નવયૈવનને. તનમનાટ દાખવતાં હતાં. મદનહેવે પૂર્ણપણે રાણીના તનમન પર પોતાનું સાખાન્ય પાથરી દીધું હતું. પોતે ડેવું પગલું ભરી રહી છે કિંવા એથી ડેવું પરિણામ આવશે એનો. વિચાર સરખો. રાણીને ઉદ્ભબ્યો નહિ. કોઈ પણ પ્રકારે વિર્દ્ધણતા ટાળવી, અંતરની આગ ઝુઝાવવી; અને સંતાન-મુખ દર્શનનો લાલ મેળવવો. એજ એક માત્ર ધ્યેય હતું.

ખીનાતિસુલભ લજન તજ દઈ આવતા વેંતજ નીચી નજરે ઊભેલા શેઠને એ વળગી પડી. જોર કરીને પલંગ સુધી ધસડી ગઠ. પોતાની ભનકામના પૂર્ણ કરવા વિનવણી કરી અને મનોરમાને બગીચા-માં જોયા પછી પોતે સાનકાન ગુમાવી ડેવી બની ગઠ છે એ ટૂંકમાં કઢી સંભળાયું. એકાદી અભિસારિકા પોતાનાં પ્રીતમને મનાવી લેવા -રીતવી લેવા પોતાની માગણુંને અનુદૂળ કરવા, જે જે વચન વિલાસ

કરे, નેત્રના કટાક્ષ ફેંકે અને કાયાના હાવભાવ દાખવે, તે સુજબ અભયાચે સર્વ કર્યું.

પણ એ સર્વ ઉખર ભૂમિમાં ભીજારોપણું સમ નિષ્ઠળ ગયું. શેદની ચક્ષુઓ ન તો જાચી થઈ કે ન તો હોઢમાંથી કંઈ હરક અહાર આવ્યો. નાણે પાથાળની જિલ્લી મૂર્તિ સાવ અચેતન.

ડામાઝિનથી જળી રહેલી અભયા આથી અકળાઈ ગઈ. તેણુંનો ઉન્માદ મર્યાદા વટાવી ગયો. દેહની ચેષ્ટાએ માત્રા મૂકી.

આવા સંયોગોમાં-એકાંત પ્રદેશ, ચાંદની રાત, અને સંપૂર્ણ કુળાયે રતિ સમ શોભતી રમણીની બેટમાં-કવિના શણ્ઠો યાદ કરીએ તો—

‘મનો ન સુહૃત્તિ યસ્ય સ યોગી અથવા પણુઃ ।’

અર્થાત્ ભલભલાના પાણું એસરી જાય જ. કયાં તો પણ જેવો જરૂર પ્રકૃતિનો અથવા દીક્રિયો ઉપર સંપૂર્ણ દાખૂ ધરાવતાર યોગી જન જ આવા સંયોગોમાં ન લેપાય. મનોરમાના પતિ સુદ્રશ્ન શું યોગી હતા ? એ પ્રશ્ન સહજ જ હોય. શાસ્ત્રકાર રૂપણ શણ્ઠોમાં સુણવે છે કે એ હતા તો ગૃહરથી; સ્વદારા સંતોષી; પણ શિથલપત્ર જેવા મહામૂળા ગુણને એટલી હદે પચાવી ચૂક્યા હતા કે એમની દફતા ટંકશાળા સિઙ્ગાની ઉપમા પામી હતી. એ કારણે તો તેએ ભગવાન અરિષ્ટનેમાં, જંબુકમાર જેવા વિશિષ્ટ સંતોની શ્રેણીમાં યાદ કરાયા. રથૂલબદ્ર સંબંધમાં કામહેવને ટુપકો આપતાં કવિએ તેએશ્રીને ગળુંત્રીમાં લીધા.

આટલી હદ્દોનો ટુંડો આવકાર સુંદરી અભયાની કદ્દપનામાં પણ નહોતો. એક તરફ ચીરકાળ સંચિત ડામાઝિન સામની સંયોગથી બડકે બળી દેહયષ્ટને બાળી રહ્યો હતો. કાયાનો ઉકળાઈ શમાવવા શણ્ઠોની જરૂર નહોતી રહી, પણ પ્રત્યક્ષ આચરણુંની અગત્ય હતી.

સામે પક્ષે નહોતું આચરણ અને નહોતું ઉચ્ચારણ; હતું કેવળ મૌન ! તદ્દન પથ્થર જેવી જડ દશા !!

આ પરાજ્યે અભયાના હૃદયમાં રમતા રનેહના ચૂરેચૂરા કરી નાખ્યાં. આશા વેલડીનું નિકંદ્લ કરી નાખ્યું. અવર્ણનીય રોપ પ્રગટાવ્યો. પ્રાર્થના ભંગતું આ મહાન કષ્ટ વેર લેવામાં પરિણુભ્યું.

ઝૂખ્તો આદમી તરણું પકડી બચવા જેમ પ્રયત્ન કરે એમ માત્ર મૂઢ દશાનો ભાગ ભજવી રહેલ શેઠના શરીરને જોરથી ભેટી પડી. એટલું જ નહીં પણ ખુસસાથી અંગોપાંગોને ઘસવા લાગી. મન ગમતા ઉપાલંભો અને કોઈ પણ મરદ ન સહન કરી શકે એવા ટોણું મારવા લાગી પણ એ સર્વ પથ્થર પર પાણી સમ નકામું નીવડ્યું.

‘ ચંદ્ન શીતલતા ઉપજવે, અહિન તે શીત મીટાવે ’ એ વચનમાં જેનો જે સ્વભાવ અતાવ્યો છે એનાથી વિપરીત જોવાનું મળે તો અહીં સુદર્શન શેહને કંઈ અસર સંભવે !

‘ માન સર્વાર્થ સાધનમ् ’ એ સૂત્રનો સધિયારો લધ શેહ તો પોતાના ધ્યાનમાં અડઅ જ રહ્યા.

એલ ખલાસ; કામનો નશો જિતરી ગયો. ચઢેલો મહ જિતરતાં જ અભયાને જ્ઞાનું કે પોતાની સાં એથ ખુલી ગાઈ. છાટ સિદ્ધિ તો થઈ નહીં પણ એક નાગરિક આગળ પેલે સાત કલંકિત દશામાં ભડ્કાએની ! અરે કોડીની બની ગાઈ ! તરત જ વિચાર આવ્યો. કે એમ તો ન જ થવા દેવું. સ્વીચ્છિત્ર આદર્દા, માથાના ચોટલાને વીઘી નાંખી, અંગ ઉપર જતે થોડા ઉગરડા ભરી એકદમ કમાડ ઉધાડતી જૂમો પાડી રહી.

કોઈ દોડા, કોઈ દોડા, મારં શિયલ લુંટવા આવેલ આ નર-પિરાચયી મને બચાવો.

આ સાંભળતાં જ નોકરો દોડી આવ્યા અને પહેરેગીરે આવી. શેહને બંધનમાં જકડા.



પ્રકરણ ૧૫ મું શુળીનું સિંહાસન

પૂર્ણિમાની ચાંદનીમાં મોડી રાત સુધી સંગીતનો અપૂર્વ
આનંદ માણી રોજ કરતાં મોડેથી જિઠેલા ભૂપ દવિવાહન જ્યાં દંત-
ધાવનની તૈયારી કરે છે ત્યાં તો પહેરેગીરે ગત રાત્રીના અનાવની ખથર
આપી. એ સાંભળતાં રાજના મળજની ગરમીનો પારે પૂરી ડીગ્રીએ
પહેંચ્યો. નારીનિના ગૌરવ પ્રત્યે બહુમાન ધરનાર રાજવી, પ્રથમ
રાણી પદ્માવતીના સમાજમાં આવ્યા પછી અતિશય વિશ્વાસુ બન્યો
હતો. એ વર્ગની પ્રેમાળ દશા અને પવિત્રતા સંબંધમાં એ કદી પણ
શાંકાશીળ થતો નથી. આવો વિશ્વાસ નરજલિ પ્રત્યે એને હતો. મહે-
લના કમરામાં, આજલરી સ્થિતિ અનુભવતી પોતાની પ્રેયસી પર અળા-
કારના હુમલાની વાત સાંભળતાં જ એના ગુસ્સાએ માઝા મૂક્ષી. 'એ
અળાકાર કરવાનાં પોતે જેને માટે ગૌરવ લે છે એવા શેહ સુદર્શન છે
એ વાતનો ખ્યાલ કર્યો વિના હુકમ કર્યો.

'જાવ, સત્તર એ ગુનહેગારને નગરમાં ફેરવી સૂળીપર ચઢાવી હો.'
'રાજ, કાનના કાચા' અથવા તો રાજ વાજ અને વાંદરા; કોઈ વર

નહીં પાધરા. એ આવા ઉતાવળીએ પગલા પરથીજ સરળયેલી કહેવતો છે.

‘પાના રાજમાર્ગ ઉપરથી રાજસેવકો સુદર્શન શેડને બંધનમાં જડકી, મનમાની દેંડી ઉડાવતાં શરીર રથાન પર લઈ ચાલ્યા. મેરો સમૃદ્ધાય કૌમુદી માણુવા જયેલ હોવાથી શહેરમાં એ દશ્ય નિરખનારી સંખ્યા જાડી નહોતી. એમાં ઘણું ખરા તો ‘આ પવિત્ર અને સદાચારી શેહ આવું’ કરવા જાય જ નહીં’ એમ હૃદયથી માનતા અને સાથીદારના કાનમાં ધીમેથી કહેતા.

‘ભાઈ ! જરૂર દાળમાં કાળું છે. શેહ તો નિર્દેષ જ છે.’ જવાબ મળતો કે વાત કંદૂડી નાંખવા જેવી નથી પણ સત્તા આગળ શાણપણ શા કામતું ? આ તો રાજવી જીતશત્રુ ! તૂઢે તો રાજ દધ હે નહીં તો ઘેદાનમેદાન કરી વાળે ! અસત આચરણ પ્રત્યે એની ચીડ જણુંની છે.’

શેહ ભાર્યા મનોરમાના કાને વાત આવી ચૂકી હતી. પોતાનો સ્વામી પ્રપંચનો ભોગ બન્યો છે એવી તેણુંને પાકી શક્ષા હતી. છતાં બનાવ એવી રીતે બની ગયો હતો કે એના અંકોડા હાથ આવતા નહોતા. ‘હુનિયા દોરંગી છે’ એ જનવાયકા સાચી છે. થોડાક એવું પણ છડે ચોક બોલતાં—

“ જુવો આ ધરમના ટીંગલા. ડોળ ધર્મકરણુંનો રાખી પછીથી તેવા કૂડા કામો આચરે છે. કહેવાય ધર્માત્મા, પણ ચરિત્ર જોઈએ તો સડેલા ! પાકા દંભીએ ! ! ”

આવું સાંભળી આ પતિવ્રતાનું દિવ બળી જતું. પતિના શિરે એક તો ખોડું આળ, અને એ ઉપરાંત પવિત્ર આર્દ્દ ધર્મ ઉપર એઠાતું !

પુત્રો ઉત્સવમાં જયા હતા. એમના કાને આ વાત નાખવા જ્યાં અતુચરને હાકુલ કરે છે ત્યાં તો દ્વાર આગળથી પસાર થઈ રહેતા

સરઘસને જોયું. નીચી મુદ્રા અને એકધ્ય ક્ષમતાર્થ પોતાના નામ ઉપર વરસી રહેલા કટુવાળી-વિચિત્ર પ્રકારના ઉપાલંબો સહન કરતા રોટ પસાર થઈ રહ્યા છે. કીટકારેની ઝડી વચ્ચે પણ એમની શાંતિ જરા પણ જોખમાઈ નથી.

આ દશ્ય જોયું અને મનોરમાના વિચાર બદલાયા, અંતર ગોકારી ઊઠ્યું—‘શા સાર પુત્રોને બોલાવવા ? કર્મના પ્રપંચને લોગ જ્યાં ભલભલા માંધાતાઓ બન્યા ! છે ત્યાં મારા નાથ જેવાની શી અણુના ! અહણું સૂર્ય, ચંદ્ર જેવાને જ લાગે છે ને ! સતીઓના શિરે કચાં કલંકો નથી ચટ્યા ? આ ચંપાનગરીમાં જ જન્મેલી સુભદ્રા સતીને કલંક નહોતું ચોંટયું ? સાચું સોનું જેમ જેમ તવાય તેમ તેમ વધુ તેજને ધારણું કરે. કલંક એ તો સતીઓ માર્ટ્ઝ પરીક્ષાનો પ્રસંગ. રાજ્યવી વિચારે નિમિત્ત ઇપ છે, સાચાં હોષિત તે ! પૂર્વ કર્મો જ છે. એને હહાવવા સાર નિશ્ચળ ધ્યાન ધરવું એ જલદ ઉપાય છે. ભગવંતો થાલી વગાડી કઢી ગયા છે કે સત્યમેવ જયતે. અર્થાત् ‘સાચેને આચ’ આવતી નથી જ.

સહધર્મચારિણી તરિકે મારો ધર્મ, આવેલ કષ્ટમાં ભાગ પડાવવાને છે. ખીંચ ત્રીજ વિચાર છોડી જટ એમાં જ ચિત્ત પરોવવું જોઈએ એમ બોલતી મનોરમા, પોતાના આવાસના ધરમંદિરમાં શ્રી અર્હન્ત પ્રલુની મૂર્તિ સામે હસ્તદ્રય જોડી કહેવા લાગી, ‘હે પ્રલો ! મારું ફુદ્ય પોકારે છે કે મારા સ્વામી નિર્દોષ છે. તેએ સ્વર્ણે પણ આ માર્ગે જય નહીં. જ્યાં લગી તેમના શિરેથી આ કલંક ઊતરે નહીં ત્યાં લગી હું મારી કાપાને વેસિરાવી, કાયોત્તસર્ગમાં ચિત્ત પરોવું છું.’

સૂર્યની ગરમીના વધવા સાથે, શરીના હુકમની વાત જેમ વિસ્તરવ. માંડી તેમ આમજનતાની ગરમી પણ વધવા લાગી. મહોસુનના પ્રહેશમાં પણ કચવાટ શરૂ થયો. શેઠના હાથે આવું હુષ્કૃત્ય થાય જ નહીં એમ વહનારે. વર્ગ અતિ મોટા હતો. મહાજનના અગ્રેસરો...

એકત્ર મળ્યા અને લાંબા વિચાર પછી નિશ્ચય પર આવ્યા કે આપણામાંના પાંચ આગેવાનોએ રાજવીના ખિભિરમાં સત્ત્વર જવું અને સ્પષ્ટ સંભળાવી હેવું કે—

મહારાજ ! આ ઘનાવ પાછળ, જરૂર કાવતરું છે. સામાન્ય વાતમાં પણ અસત્ય આચરણ ન સેવનાર, આપણી નભરીના ડેઢિનૂર રલ જેવા શેડ સુદર્શન ધર્મનો સ્વાંગ સજી આવા કાર્યમાં હાથ નાંએ એ સંભવિત જ નથી. કદાચ સાગર મર્યાદા મૂકે કિંવા અજીવ શીતલ થાય પણ આ આત્માના હાથે એવું અધમ કાર્ય થાય જ નહીં... મારે પૂરી તપાસ કરો. આવા પુન્ય શ્લોકીના અક્ષાળ અવસાનથી તો આપશીની દંજાતનું લીલામ થશે એટલું જ નહીં પણ આ નભરીના માથે ભયંકર આંધિના ઓળા જિતરશે. નિર્દેષ આત્માનો રક્તાપાત કુદ્રત ન સાંઘી રહે.

પ્રાતઃકાળના આવશ્યક કાર્યોથી પરવારી સ્વર્થ બનેલ ભૂપદધિ-વાહન, મહાનન મેવડીઓની વાત સાંભળી વિચારમાં પડ્યો. એક અનુચરને આજા ઝરમાવી હે—

સત્ત્વર જઈ, પ્રધાનજી તથા યશપાલને બોલાવી લાવ. અહૃપકાળના વિચાર પછી ક્યાં જવાબ આપવાની શરૂઆત કરે છે ત્યાં અનુચરે આવી જણ્ણાંચું હે

કોટવાળજી, પ્રવેશની આજા માંગે છે.

ભલે આવે, એમ કષી ભૂપ મૌન રખાટ

ત્યાં તો, કોટવાલ, અને પાછળ પ્રધાન તેમજ યશપાલને આવતાં જેથાં

પ્રખ્યામ વિષિ પતપનો સૌ ઉચ્ચિત સ્થાને ગોડવાયા. રાજવી તરફથી

નેત્રનો દરશારો થતાંજ ડોટવાલે શરૂ કર્યું. ‘મહારાજ ! આપશીની આજા મુજબ ગુનહેગાર સુદર્શન શોઠને, નગરીમાં ફેરબી શળા નજીક લઈ જયા. સામાન્ય રીતે ખને છે તેમ આ બંધવાએ ડોએ જાતની આડાઈ કે ઉધામા ન કર્યા ! વળા તેમના ચહેરામાં ભરવાની પળ સામે હોવા છતાં જરા માત્ર વિપાદ ન હેખાયો ! મારા જીવનમાં આ પહેલોજ પ્રસંગ હતો. મન પોકારી ઊઠયું જરૂર આ બનવમાં કાચું કપાયું છે. પણ ચિક્કીના દાસ એવા મારે દુભાતા હંદુરે ફરજ બનવવી પડી. પ્રલુને સંભારવાનું કહેવા ઇપ સ્ક્ર્યન પણ કરવું ન પડયું !

હું કહેવા મુખ્ય ખોલું તે પૂર્વે તો શેડ ભાડા સાહે એલ્યા—‘હું તો તૈયાર જ છું. મારા અંતરમાં ભગવાનનું નામ તો કાલ સવારથી જ રમે છે. આત્માને સાચું શરણ એજ છે. વિના સંકેર્તને તમો તમારી ફરજ બનવો. ’

માલિક ! મારું હૃદય તો હાલી ઊઠયું. પણ જેનો રોજનો ધંધો અણ્ણાય એવા ‘મારા’ નો હાથ પણ ધ્રુજ ઊઠ્યો ! આજા ઊલંઘનની કારમી શિક્ષા જાણુનો હોવાથી એક બે અને જાણુનો ઊચ્ચાર કર્યો—આંખો માચી દીધી. મને માની લીધું કે એવું ખલાસ થઈ અયો !

ન્યાં અંખ ઊધાડું ત્યાં તો અખબ દસ્ય જેયું !

શળી તૂટી પડી છે. શેડ વિંધાવા વિના તો અખંડ છે. હવે શું કરવું ? એ આજા દેતા આવ્યો છું.

રાજવી નેરથી પોકારી ઊઠ્યા—

હવે કંધ કરવાનું હોય તો એ મહાત્માના પગે પડવાનું ! ચાદો સૌ સત્વર ! એ દસ્ય નજરે જેઠ જીવનને સંશોધન કરો.

ન્યારે ચંપાપતિ અધિકારી આદિના વિદ્યાળ સંમુદ્દર સાથે આવી પહોંચ્યા ત્યારે આશ્રમમાં ઉમેરો થયો. હતો. શળાના રથાનમાં તો એક ઝળહળતું સુવર્ણ સિંહાસન શોભતું હતું.. શોઠને એ છિપર વિરાજમીન-

કરી શાસન હેવી તેમના ગળામાં પુણ્યતી માળા પહેરાવી રહી હતી. પ્રેક્ષક ગણુભાં અદ્ધિતી પવિત્રતાના ગુણગાન થઈ રહ્યા હતાં. એક ખડતલ શરીરનો આદમી તો એમના પગ આગળ લાંબો થઈ દંડવત ગ્રણું કરતાં કંધ લંબી રહ્યો હતો.

ત્યાં તો શાસનમુરીનો હિંબ્ય રવ સૌ કોઠના કર્ણપટ પર ચ્યાની ઘંટડીના રણકાર સમ અથડાયો—

“ ચંપાના પુરજનો ! સતી મનોરમાના—પોતાના ગૃહમંદિરમાં—
નિશ્ચળ ધ્યાનના અળથી આકર્ષાંધ, દધિવાહન કેવા પ્રભનવત્સલ અને
ધર્મ વૃત્તિના ભૂપના હાથે આવો અધર્મ ન થાય એ અર્થે હું આવી
હું. ન્યાયના તોલનમાં કોઈ માનવ કે કોઈ હેવને આડા હાથ ધરવાનું
કારણ ન જ હોય. પ્રભ સમૂહમાં આચાર-વિચારની પવિત્રતા
જળવાય એ જોવાની નગર સ્વામીની ફરજ જણાય. પણ સાથે સાથે
એ અવસ્થય યાદ રાખવું પડે કે કોઈ ઉતાવળીયા પગલાથી અથવા તે
રલસવૃત્તિના જેરે નિર્દેષ વ્યક્તિનો સર્વનાશ ન થાય. નિર્દેષ
માનવના એક રક્તઅનિનુમાં સારીયે જનતાનું અકલ્યાણ નોતરવાની
તાકાત છે. નિર્દેષ-ગરીબ-રાંકની હાય નિષ્ઠળ જતી નથી. આ
ભનાવ પાછળનો દોરી સંચાર કોણે કર્યો અને દોષિત ક૊ળું છે ? એ
તપાસવાનું કાય પાય તોલનારા શિરે રાખી હું એટલું નિઃશંકપણે
જણાવું છું કે—

આ સુદર્શન શેડ સ્વદારા સંતોષી વર્ગમાં મુગટ સમા હોંધ રંચ
માત્ર હોષિત નથી. પૌષ્ઠ જેવી ધરમ કિયા અને ધ્યાનમાં રક્ત એવા
તેઓ પડ દંતકારીઓના હાથે ઉચ્ચકાયા અને આ કુલંકિત દશાએ
પહોંચ્યા. આમ છતાં પાપીઓના હાથ હેઠા પડ્યા ! પ્રભળ પુન્યના
યોગે અને અખૂટ આયુધના જેરે શળાનો કાંઠો પણ તેમનો પ્રાણ ન
હારી શક્યો. પુન્યશાળાની તેજસ્વિતા સામે નિધન પણ નિધાનસમ

અની જાચ છે. એનો પ્રત્યક્ષ પુરાવો તમારા નેત્રો સામે છે. આવા પુષ્ટખોડી આત્મા તો ધન્યવાદને પાત્ર છે.

રાજ્યાં આગળ આવી, પોતાનો પ્રમાદ કખૂલવાની તૈયારી દાખલી, શાસન દેવતા પ્રતિ જ્યાં જાચી નજર કરે છે ત્યાં તો આલ સિવાય કંઈ જ નથી!

સાચા ગુનહેંગારને શોધવાની જવાબદારી તો નૃપશિરે બિલી રહી! રનેહ અંથીમાં સુંગધ એવા નૃપને અભયારાણી માટે શાંકા જય પણ શારીરે ? શેહ તો સો ટચના સુવર્ણ જેવા છે એ હેવી વચનમાં પણ શાંકા ન રહી. તો આ ઘનાવ પાછળ સત્ય શું?

સૌ કોઈ વિચાર મળન દ્રશ્યામાં મૌન અન્યા ! ત્યાં તો શેહના સિંહાસન આગળ આગોઠી રહેલા ખડકસિંહના શખદો રૂપણ સંભળાયા.

ઓ મહાત્મા ! મારો અપરાધ માઝ કરો. ડેવળ ધનના લોલે આ કામમાં મેં હાથ એખ્યા છે અને આપ સરખા ધર્માત્માને વિટાંઅણામાં હડસેલ્યા છે.

તરત જ ભૂપે પાસે એલાવી સવાલ કર્યો—

અલ્યા માનવી ! આ કેમ અન્યું તે તું જણે છે?

મહારાજ ! મને આજી ખખર તો નથી; પણ માણામંદિરની નજિક આવેલી વંસતીમાંથી આ સાંધુ પુરુષને ઉચ્ચકાવી પાલખીમાં નાંખી, દરખારગઢમાં પહોંચાડી આવનાર હું જ છું. રાજમહાલયની, ઉજળા ચહેરાની અને કુલિન ધરની નારી સમ શોભતી એક રમણીએ મને લગભગ મહિનાથી રોક્યો હતો. મહેં માંગ્યા પૈસા મળવાના લોલે હું આ કામમાં પડ્યો હતો. શરૂઆતમાં તો મ્હારે માત્ર ભાગોળના શિવમંદિરમાંથી રવિવારના દિને એક યક્ષમૂર્તીને પાલખીમાં મૂકી દરખારગઢમાં લઈ જવી પડતી, અને પૂજન વિધિ પૂરી થતાં પાછી લાતી મંદિર મૂકી હેવી પડી. એ સારુ મેં ચાર માણસ રોક્લા. થોડી

ઘટિકાના આ કામમાં અમને સારી રોજ મળતી. આ કાર્યમાં કંઈ પણ ભેદ હેઠળ કાવતરં હશે એવી જરા સરખી ગંધ પણ નહોંતી આવી.

આ તો અધ સવારે મને વસતી બતાવી, રાતે હાજર રહેવાની વરદી આપી. હું સંમજ્યો કે આજે આ સ્થાનમાંથી મૂર્તિં લઈ જવાની હશે. રાતે પાલખી સાથે આવ્યા પછી જ ખખર પડી કે સવારે જે ગૃહસ્થને ઓળખાવેલા એ ગૃહસ્થને જ પાલખીમાં લઈ જવાના છે. સાંભળતાં મનમાં કંઈક ઉકળાટ થયો. પણ આ બાઈની લાગવગ અને એની કાર્યવાહી, વિના રોકટોઝ થતી લોઈ એ તરત જ શરીર ગયો. માની લીધું કે આજે આ પવિત્ર પુરુષની ચરણ રજ લેવાની હશે.

માલિક ! જે સ્થિતિમાં એ ધ્યાનમાં ભિલા હતા એ સ્થિતિમાં જ અમે જીયકેલા (નથી તો એ કંઈ ઓલ્યા કે નથી તો કંઈ વાંકા ચૂંકા થયા) મારી નજરે જીવંત પ્રતિમા જેવા જ લાગ્યા ! પાલખીમાં ગોઠવાની વ્યવરથા પણ મારે જ કરવી પડી. મહેલના કમરામાં ઉતાર્યા તો ત્યાં પણ એ જ ધ્યાનમાં. આવા પવિત્ર સંતની ચરણ રજ જરૂર મનખા દૈહને સફળ કરે.

મૃક્ષિને પાછા વળ્યા ત્યારે અમોને સર્વને દ્રાવેલા દામ ઉપરાંત વધુ આંદી ખુશી કર્યા અને પાલખી લેવા પાછા આવવાનું નથી એમ કહી નિદાય આપી.

કાલે વળી નવું કામ શોધવાની વાતો કરતાં અમો સર્વ પોતાના ધેર સિધાવ્યા. આજનો દિવસ આરામ લેવાના ધરાદાથી હું ધેર રહ્યો હતો. અને નાસ્તો કરી જરા બજાર તરફ નીકળ્યો હતો. ત્યાં સરહસ જેયું. શેહને ઓળખ્યા. પણ એમના માટે તો તહેન જુદું જ કહેવાતું સાંભળ્યું. એ જણી હું તો હરી ગયો. આવે પવિત્ર પુરુષ, રાણી માતાના દેહ ઉપર હુમલો કરે એ વાત મારા જો શે જિતરે ?

પાસે જીબેલા માનવીને પૂછ્યું. શું આ સાચું કહે છે ? એ ઓલ્યો —અરે ગાંડા ભાઈ ! ચંકા કરતાપણું જ નથી. ચોકીદારોએ પૃકૃત્યા

અને રાજ્યાચે શળી પર ચંદ્નાવી દેવાની આજા પણ આપી ! તેથા તો કાટવાળ તે તરફ લઈ જાય છે તે જોતો નથી ?

આવા તો કંઈ ધતિંગો ચાલે છે. આ તો ઉજળા હગ ! આ સાંભળતાં જ મને આધાત થયો. અંતર પોકારી જિદ્દું-હરગીજ આ શેહ તો નિર્દેષ છે.

બાપુ ! અમ સરખા અભણુ-ગામડીઆની વાત માને પણ ડોણુ ? વળી હું પૂર્ણ સમજયા વિના કહું પણ શું ! હું પણ પાછળ પાછળ ચાલ્યો. મનમાં પરભુને કહેતો હતો હેવ, તું તો તારણુહાર છે. નોધારાનો આધાર છે. બાપજી આ શેઠને ખચાવને. એમને ઉદ્ઘાતી લઈ જનાર અપરાધી તો હું છું. મને શી ખખર કે એમ કરવામાં એનો સર્વ નાશ થશે. પણ મારી એ પ્રાર્થના સાંભળાઈ; અને આ બન્યું એ તો આપ નજરે જુવો છો.

મારે એ મહાત્માની માઝી માંગવી જ ધરેને ! પ્રેક્ષક વર્ગ ખડકસિહની કહાણી સાંભળી આશ્ર્યથી ગરકાવ બની ગયો. પણ રાજના મગજમાં એ સાંભળ્યા પછી આ બનાવ પાછળના થોડા અંડોડા સંધાયા. તેઓ શેઠને પ્રણામ કરી, ધન્યવાદ આપતાં બોલ્યા. ધમી પુરુષ ! મારી ઉતાવળથી તમોને ધણો જ અન્યાય થયો છે. એ મારે હું દિલગીર છું. તમો એ મનમાં ન લાશરો. યશપાળ, જવ શેઠશ્રીને માન પુરરસર તેમને ધેર લઈ જવ. સતી મનોરમાને કાચોતસર્ગ પળાવો; અને આ સંબંધમાં વધુ માહિતી મળો શકે તેમ હોય તો તેમની પાસેથી મેળવો.

પ્રધાનજી, બ્યોરના દરખાર ભરવાની જહેરાત કરો. ગુન્હેગારને શોધી જરૂર નશિયત કરવી જોઈએ. એ સાથે આ નરરતનનું સન્માન પણ કરવાનું જ.

કાટવાળ ! તમો જલ્દી અંતઃપુરમાં જવ, અને ત્યાંથી એક પણ વ્યક્તિ—દાર્શા—દાસ પહેરેગીર કે ખુદ રાણી ખસવા ન પામે એવો અંદોખરત કરો.

હું સમય થતાં શિબિરમાંથી આરોખાર આવી પહેંચીશ.



પ્રકરણ ૧૬ મું કષ્ટ વાડીનો મૂળો ?



વૃદ્ધમાં અનારી મોટી જિથલપાથલેના મૂળમાં ડાંડા જીતરીશું
તો જણારો કે એનો ઉદ્ભવ એકાદા નાનકડા અનાવમાંથી થયો હોય
છે. વાચકની નજર સામે વર્તમાન યુગનો યુરોપનો ધર્તિહાસ એ વાતના
જીવંત દષ્ટાન્તરિક છે જે. એમાં ચઢતી પડતીના રહેંગો જોવાના મળો છે
અને એથા નક્શાના રહેંગો તેવી ઝડપથી બદલાઈ જય છે એ જણુવાનું
પણ પ્રાપ્ત થાય છે. ભૂતકાળના ગર્ભમાં પણ આ જાતની સેંકડો
કઢાએયા ભરી પડી છે. જે ભૂમિ પર ત્રણ ત્રણ ચક્કવતીએયા થયા
એવી હસ્તિનાપુરની પ્રતિષ્ઠા હવામાં ડાડી ગઢ અને નિખંડાધિપતિ
શ્રીકૃષ્ણ વાસુદેવની અલકાપુરીને ટક્કર મારે તેવી દ્વારામતી નગરી
ભડકે બળો રહી. એ પાછળ ભલેને સાંકળના અંકોડાની હારમાળા
રવાઈ હોય, છતાં મૂળમાં તો એકાદા નાનો અનાવજ આંખે ચઢે છે.

ચંપાપતિના દરખારમાં આજનું દર્શય જુદું જ તરી આવતું હતું.
દધિવાહન જુદોનો દિમાળ આજે તો કોઈ જુદા જ સ્વરૂપે ઓઝસ
પાથરતો સલ્લા જનો પર અનોખી છાપ પાડી રહ્યો હતો.

સામાન્ય કુમ પૂરો થતાં જ એકાદ કેશારીસિંહ ગુજરાતીઅહાર આવી ગર્જના કરે તેમ રાજ્યાએ શૌર્ય ભરતી વાણીમાં ઘોલવાનું શરૂ કર્યું—

નહાલા સભા જનો અને પ્રિય નાગરિકો !

- આપણું સમક્ષ આજે ઢોંગ જુદો જ પ્રસંગ ડિલો થયો છે. આપણું સર્વના ભાગ્યે જો કુદરત મદ્દે ન આવી હોત તો એવું અન્યાયી કાર્ય થઈ જતે કે જેથી અંગરેખના વહીવટ પર કાયમી કલાં ચેંટી જત અને ધતર રાન્યોમાં આપણે હાંસીપાત્ર બનત.
- આપણું રાન્યના આભૂષણું રૂપ સુદર્શન શેડને કલાંકિત કરવામાં સુખ્ય જવાઅદારી તો મારી જ છે. અંતઃપુરના નારીવર્મ એમાં સુખ્ય ભાગ ભજવ્યે. અને મેં રભસંઘતિએ શળાએ યદ્વાવવાનો હુકમ આપ્યો. એમાં શેડ જેવા પવિત્ર મહાત્માનું અળિદાન દેવત અને સાથે સાથ ન્યાયદેવીની કૂર મસ્કરી પણ થઈ જત.

ચંપાનગરીનું રાન્ય ડેટલાક અકળિત બનાવેથી પડોશી રાન્યોમાં આપે તો ચદ્યું છે પણ જો ઉપરનો પ્રસંગ બન્યો હોત તો જરૂર એ દાઢણું દીકાપાત્ર લેખાત. પૂર્વનોના પુણ્યયોગે-પ્રજનાના સદ્બાળયે— શળાનું વિધ સોયે ગયું છે અર્થીત શિલાનું સંકટ કાંક ફેલાયું છે. ’

સૌ પ્રથમ મારો નિશ્ચય એ છે કે— ‘આ બનાવમાં ગુન્ડેગાર ને શાધી એને સખત નસિયત આપવી. ચાહે તો એ શાધમાં દાસીનો હાથ હોય કિંબા ખુદ રાણી પોતે ગુન્ડેગાર હોય.

પતિવતા મનોરમા તરફથી આ સંબંધમાં કંઈ અજવાળું પડે રેવી માર્હતી ભળ્ણ છે કે ?

ના, રાન્યધિરાજ ! તેણીએ એટલું જ જણાવ્યું કે પર્વણી દિને પોતાના પતિને પૌષ્ણભૂત ગ્રહણું કરવનો નિયમ છે. એ સુજ્યુ તે

પ્રાતઃકાળે જયા હતા. મકાન આગળ બીજે દિને સરધસ આવ્યું ત્યારે જ ખર પડી કે એ ગુન્હેગાર તો પોતાના સ્વામી છે. કદાચ સૂર્ય પશ્ચિમમાં જગે કિંબા સ્થિર એવે મેઝિગિરિ ડોકાયમાન ચાય, પણ પોતાના પતિના હાથે આવું હલકટ કાર્ય કદી પણ ન સંભવે. એ પાકી ખાતરીના જેરે પોતાના ગૃહમંહિરમાં દેવાઘિરેવની સન્મુખ એ કલંક જિતરે નહીં ત્યાં લગી કાયોત્સર્ગમાં રહેવું. એવી પ્રતિજ્ઞા કરી જિલ્લી. અને કલંક જિતયીની વાત સંભષ્યા પછી જ કાયોત્સર્ગ પાણ્યો.

શેષ સાહેબ ! તમો આ વાત પર પ્રદાશ પાડશો ?

મહારાજ ! કાયોત્સર્ગમાં રહેલ હું જે કંઈ કદર્થના પામ્યો છું એમાં ભાગ ભજવનારા પાત્રો તો નિમિત્ત ઇપ છે. સાચા શત્રુઓ તો મારા પૂર્વના કર્મો છે. મારી સમજથે મને અકાર્યમાંથી બચાવ્યો છે એટલું જ નહીં, પણ સૌ સારાં વાનાં કર્યાં છે. આટલેથી આ બનાવ પર પડ્યો પડે એવી મારી ધર્યા છે.

પ્રજનનો ! શેષનો જવાબ એક ધર્મી પુરુષને શોખે તેવો હોવા છતાં, ન્યાય તોલવામાં ઉપયોગી થએ પડે તેવો ન જણ્યાય.

મંત્રીજી ! અંતઃપુરમાં માણુસો મોકલી અભયારાણી અને એની સખી પંડિતાને સત્વર તેડાવો. તેમની જુખાની વિના આ બનાવ પાછ-જનો બેદ કળાય તેમ નથી. ખડકસિંહની વાતપર્યથી આ પ્રપંચમાં તેએજ જવાખાર છે એ વાત દીવા નેવી રૂપણ જણ્યાધ આવી છે. હવે તેમના ઝેડે એ કણૂલાવીએ એટલે કાર્ય પૂર્ણ થાય.

રાજધિરાજ ! આપની માફક મારી માન્યતા હોવાથી સવારમાં આજા થતાં જ હોડવાળને અંતઃપુર પર નજર રાખવા હોડાવેલા. પણ અફસોસ ! એ પહેંચે તે પૂર્વે શળીના સિંહાસનમાં પરિણમવા સંબંધી સમાચારે રાણીજ તથા પંડિતાના હૃદયમાં ક્ષોભ જન્માવ્યો હરો એટલે તરતજ તે ઉભય મહેલ છોડી ભાગી જયા છે. આસ પાસ ધર્યે સુધીં

તપાસ કરાવી પણું હજુ સુધી તેમનો પતો લાગ્યો નથી. વેષપરિવર્તનમાં પંડિતાની ચપળતા ભારી હોવાથી આપણા સૈનિકાની આંખમાં તેઓ ધૂળનાંખાં છટકી ગયા છે.

અમે તેવા ઘટાએઅ કરવામાં આવે પણ પાપ ક્ષેપું નથી રહેતું. એ છાપરે ચઠીને બોલે છે એ વાત સાચી જ છે. જે તેઓ આ કુલાંઘમાં સંડોવાયા ન હોત તો શા સાડ ભાગી જત ? શેડ ગમે તેવા ટાંક-પિછોડો કરે, અરે પોતાના કર્માને દોષ હે, પણ માર્દ અંતર રૂપણ પોકારે છે કે આ કરતૂક પેલી પંડિતાના છે અને એની આંખે જેનાર રાણી અભયા પણ એમાં ભળ્યા

એર, બનનાર બની જઈ ! તપાસ ચાલુ રાખો. શેડ જેવા પવિત્ર પુરુષને બદલે કોઈ બીજો હોત તો આજે મારી આખરનું લીલામ બોલ્યું હોત. મારે હવે એવી રાણીઓથી સહ્યું ! હવે હું પદ્માની શોધમાં જતે નીકળાશ. મળશે તો ડિક, નહીં તો રાજ્ય ધૂરા કોઈ યોગ્ય પાત્રના હાથમાં સેંપો, આત્મબ્રેયના પંથે પડીશ. મારે આ નિર્ધાર છેવટનો છે. અધિકારી વર્ગમાંના કોઈએ પણ લાગણીથી દોરવાદ જઈ, મને એમાંથી પોછે હું કરવાની સલાહ ન આપવી એવી મારી આગ્રહભરી લલામણું છે.

સુદર્શન શેડ વાળા પ્રપંચમાં રાણીનો હાથ છે એ રૂપણ છે તેમ મારા પાકી વયના લગ્ય પણ એમાં ઓછા જવાબદાર નથી. એ સંખ્યાંધમાં વધુ ઉહાપોહની હવે અગત્ય નથી રહી, ધરાપાળ ! કિંમતી પોશાક જલ્દીથી મંઝાવો કે જેથી અણિનું સન્માન કરવાનું કાર્ય આટોપો શકાય. આજથી હું જાહેર કરું છું કે તેઓ રાજ્યમાન પુરુષોમાં અગ્રપદે છે અને તેમનાં નામ પૂર્વે ‘રાજરતન’ વિશેપણ વાપરવાની કર્મચારીઓને મારી આજા છે અને પ્રણને વિનંતી છે.

સભાજનોના હર્ષનાદ વર્ષે ચારિત્રશીલ શેડ સુદર્શનને કિંમતી ચોખાક અર્પણું કરવાની કિયા ખુદ ચંપાપતિ એ પોતાના હાથે બજવી. એ પવિત્ર મહાત્માના નામની જ્યથી દૃઢારગદ ગાજ રહ્યો.

ત્યાં પહેરેગીરે આવી નભ્રતાપૂર્વક જણાવ્યું કે મહારાજ ! કોઈ પર-
દેશથી આવેલ વિપ્ર આપની હજુરમાં આવી કંઈ નિવેદન કરવા ચાહે છે.

જ, જ, સત્તર એને પ્રવેશ કરાનું આ માંગલિક પ્રસંગે ભૂદેવનું
આગમન શુભાશિષ રૂપ જણાય.

ધાર્થણે આવી નમસ્કાર કર્યા અને પોતાના હાથમાંને પત્ર રાજવી
સન્મુખ મૃક્યો, એ સાથે જિગેર્યું કે,

હું કંચનપુરતા સ્વામીનો આ રૂક્ષો લઘ સીધો ચાલ્યો આવું છું.
એમાં લખ્યા સુજબ વાતનો અમલ તાકીદે કરાવી, આ કિંકરનું હુંઘ
જલ્દી ટાળશો. એ મેળવતાં મારા લોહીને પાણી એક થયા છે. આપદો
વેહુવામાં કભીના નથી રહી.

પ્રધાનજી, જુઓ, એ રૂક્ષામાં શું લખ્યું છે ?

મહારાજ ! કંચનપુરતા રાજવી કરકંદૂ આપને એક આમ આ
દ્વિજને અક્ષિસ આપવાનું લખે છે. એ અંગે જે બદલો—ગામ અગર
રકમ—જણાવશો. તે તેઓ આપશે એમ જણાવે છે. અંતમાં આગઢ
કરે છે કે પોતાની પ્રતિજ્ઞાના પાલન અર્થે આ ભૂદેવને અંગ દેશમાં ગામ
આપવાનું છે એટલે એ જલ્દી અપાવું જોઈએ.

વાહ ! આ પણ કોઈ વિચિત્ર વાત ! મારા પ્રદેશમાંનું ગામ અક્ષિસ
કરવાનો ધજનો. કોઈ અન્ય રાજવીને મેં આપ્યો નથી. એ તો મારી
મરજુનો સવાલ. કદાચ કારણ પરતે એવી અગત્ય ઉભી થઈ હોય તો
પ્રથમ એલચી મોકલી એ અંગે વાટાધાટ કરવી જોઈએ. આ કોઈ નવો
ગાડીએ આવ્યો જણાય છે. એ વિના તે આવી લખાપટી કરે ! કેમ
જણે અહીં એ મહાશયની આશા ઉઠાવવા આપણે અધા ન એકઢા
થયા હોઈએ !

‘ નવો ’ શાખ સાંભળતાં જ દ્વિજથી ન રહેવાયું. પૂર્વનું વેર અને
અસંતોષ દિલ્હરાઈ આવ્યો. અને આવેગમાં એનાથી ઓથી રેવાયું.

મહારાજ ! આપની વાત સાચી છે, એ કરકંડુ રાજ કંચનપુરની ગાઢીનો સાચો વારસ નથી. રાજ અપુત્રીયો મૃત્યુ પામતાં, અધિકારી વર્ગે પંચ હિવ્ય દ્વારા પરીક્ષા કરી ચંપકવૃક્ષ હેઠળ સૂતેલાં આ માનવીને આણી રાજગાઢી પર ઐસાઈ દીઘે છે. નથી જોઈ જત કે નથી વિચાર્યું કુળ !

એ જતનો ચંડાળ પુત્ર છે. એનો વૃત્તાંત હું તો ધરથી જાણું છું. પણ આરો અવાજ સાંભળે ડોણું ?

દુનિયા વાગતી વગાડે છે. ગરિબનો એલી કોઈ નથી. ચંડાળના. પાય ચૂમે છે જ્યારે દ્વિજને હડસેવા મારે છે.

પ્રધાનજી, આ તો કંઈ ત્રીજું જ નીકળ્યું !

વિલંખ કરીને પણ કંચનચુર નરેશની કહાણી સાંભળવા જેવી જણાય છે. હલકી વર્ણ વિના આવા ઇક્કા ન જ પાડવે !

ભાઈ ! તરિયા વૃત્તાંત યથાર્થ સ્વરૂપે, ટૂંકમાં કંઈ દેખાડ. મારાથી જનરો ત્યાં લગી તને સંતોષ થાય તેમ કરીશ.

મહારાજ ! આવા ભીડા શબ્દો મારી જાંદગીમાં આપશીના મુખેથી પ્રથમ સાંભળવાના મળે છે. એ મારું અહોભાગ્ય સમજું છું. આજે દિકાસો દેનાર પણ જવલ્લેજ મળે છે !

અંગહેશના સીમાડા પરને હું એક ગરીબ આમવાસી નરીઓ અજમાવવા અને કુદુંખના પોપણું અર્થે કંઈ કમાણી કરવાના આશયથી બગલથેલા સાથે પગપાળો દ્વારા દૃષ્ટાંતો દ્વારા ચાલી નીકળ્યો. મજલ કાપતાં અટવાડીયાના પ્રવાસ પછી લગભગ પહેર દહોડા ચલતાં દૃષ્ટાંતો ભાગોળે આવી પહેંચ્યો. જરા આરામ લઈ પછી શહેરમાં પ્રવેશવું એ ધરાદાથી, નજીક આવેલી મશાણું ભૂમિથી થોડે દૂર આવેલ વૃક્ષની છાકામાં પહેંચ્યો, અને આડે પડ્યે થયો. એ વેળા મશાણું ભૂમિનું રખોપું કરનાર ચંડાળપુત્ર અવકર્ણિક ત્યાં એ ત્રણ છોકરા

સાથે રમતો હતો. કંચનપુરને. સ્વામી કરકંદૂ એજ પેલો અવકણીક. એના હાથે ખરજ આવતી હોવાથી, એ વારંવાર હાથને ખણુતો એટલે સાથે રમતા ગોડીઆઓએ એનું નામ પાડ્યું ‘કરકંદૂ’. પછી તો એ નામથી જ પ્રસિદ્ધ થઈ.

આડે પડુએ થયેલ હું જગૃત દરામાં હતો. એવામાં એ માર્ગ થઈ એક સુનિ ચુગલ નીકળ્યું. એમાંના નાના સુનિએ હું સ્ફુર્તો હતો. એ ઝાડની સમીપમાં એક સુંદર વાંસને ઉગેલો જોઈ, સામાન્ય વાંસો કરતાં આ વાંસમાં ભનોહરતા ભાળી, મોટા સાધુને પ્રશ્ન કર્યો.

વનસ્પતિના આ જીવમાં પણ ભાગ્યોદ્ય સંલબે છે ને ! તે વિના આટલી સુંદરતા ને સીધાપણું ન લાભે.

ભાઈ ! વાંસના આ દંડમાં તો જણરી શર્કિત છૂપાઈ છું. ત્રીજ ગાંડુ આગળથી કાપી લઈ, એને પાસે રાખનારૂ, જરૂર રાજગાઢી પામે એવો યોગ છે.

ઉભય સાધુ વચ્ચે ચાલી રહેલી આ સામાન્ય વાત મેં તેમજ પેલા અવકણીકે સાંભળી. અમો બન્ને એ દંડ હાથ કરવા દોડ્યા. મારો હાથ એના ઉપર પહેલો પડ્યો. પછીજ અવકણીકે ત્રીજ ગાંડ આગળ, પાકી ભૂડ ભરી પોતાના સાગરીતને જુંપડીમાંથી દાતરડું લાવવાની સુચના કરી, અને એ આવતાં જ વાંસને કાપી, મારા હાથ-માંથી એ દંડ છીનવી લીધો.

ન્યાય મારી બાજુ હોવા છતાં બળિયાના એ ભાગ નેવી દર્શાનો હું બોગ બન્યો.

શહેરમાં જઈ આ વાત મેં પ્રથમ તો મારા જત ભાઈએને સંભળાવી. વલોમાં શુરૂ તરીકે જણુતા તેઓ જિસ્કેરાઈ ગયા. વાત મહાજનના કાને પહોંચી. સૌ હોઠના હૃદયમાં ચાંડાળપુત્રનું આવું વર્તન ઉચ્છુંખલતા ભર્યું જણ્યું. નમરશેડે અવકણીકના બાપને

ઓલાવી, દંડ આપી હેવાની અને પરે પડી માઝી માગવાની આશા કરી. એ સાંજે તો હું રાજ થવાના સ્વખનમાં મશગુલ બન્યો. પણ સાર પડતાં જ અયોધ્યાની પ્રણાયે શ્રીરામની રાજગાહીને બદલે જેમ વનવાસ પ્રયાણ જેયું તેમ મારી આશાનો કોટ ધરાશાયી થઈ ગયો.

મહાજન અને નગરશોઠના દાખાણું વશ થવાને બદલે પેદેા ચાંડાળ પોતાની ધરવખરી સાથે ઉચ્ચાળા ભરી ગયો હતો.

દંડ પાછળની મહત્ત્વા મારા અંતરમાં હસી હોવાથી મેં એની પાકી શોધ કરવાનો નિશ્ચય કર્યો. એ અંગેની તીવારીમાં ચેડા દિન દાતપુરમાં જ વીતી ગયા. પછી આસપાસના પ્રદેશ ખૂંદ્દો હું આગળ વધ્યો. કંચનપુરમાં આવ્યો ત્યારે ત્યાં પૂર્વે જણાબ્યું તેમ કરકંદૂ રાજની જાહીએ આવ્યા સંખારી વાત જણ્ણી. અશ્વારીએ નીકળેલા એ ભાઈશી પાંચને નજરે જેયા પછી પાકી ખાતરી થઈ. સાધુવચનની સત્યતા નજરે જોઈ. પણ રાજ સામે મારં શું ચાલે? બહુ બહુ પ્રયાસ કરી, પ્રથમ જતભાઈએને ઢંઢોયા. એ પછી મહાજનમાં વાત પહોંચાડી. ચાંડાળપુત્ર રાજવી બને, એ સામે સૌનો પ્રકોપ જગાવ્યો. પવિત્રતાના નામે સૌમાં ઝનૂન પ્રગટાવ્યું.

પ્રણાયે તક સાધી બળવો કર્યો. પણ કરકંદૂએ તો અજર્ય શરાતન દાખાબ્યું. ભલભલા ક્ષત્રિય મહારથીને હંકાવે તેવા પરાક્રમથી બળવો દાખી દીધો. આપોકાર જહેર કર્યું કે—‘વીર બોણા વસુધરા’

વિશેષમાં જણાબ્યું કે—ઉંચ નીચના બેદ એ જન્મભાશ્યાની ન સંભવે પણ કર્માશ્યાની જણાય.

મારા હાથ હેઠા પડ્યા. રાજ્યની આશા લુપ્ત થઈ. મેં ભૂપને આજુજુ કરી કે મારા હુક્ક તરીકે અડવો ભાગ જોઈએ. ભલે એ ન મળે પણ મને એક મનપસંદ ગામની બેટ મળવી જોઈએ. રાજવીએ ઉછળતા હૃદ્યે એ વાત સ્વીકારી.

મેં મારા વતનમાં પાછા ફરી સુખે રહેવાની દશ્યિયે અંગરેશનું ગામ માંગ્યું.

સ્વામી ! આ મારી કરમકથની. વિપ્ર નેવાના કુળુમાં અવતર્યા છતાં મારે જ્યારે રોટલાના કાંદાં છે ત્યારે પેદેા ચંડાળ કુળોત્પન્ન અવકર્ણિક રાજ્યમહાલયના સુખે ભોગવે છે. ઓ વિધાતા ! તારી કળા ગહન છે ?

કેમ પ્રધાનજી ! આ વિષયમાં તમારી શું સલાહ એસે છે ?

મહારાજ ! આએં કિરસો એકંજ વાત બતાવે છે કે-'લલાટના દેખ મિથ્યા નથી થતા અને ભાગ્યવાનને ધેર ભૂત રો છે' તે વિના એવારના પડકાર સામે સામાન્ય એવેં અવકર્ણિક ચંડાળપુત્ર ટકી શકે ખરો !

બશપાળ કહે, વચ્ચમાં એલવા માટે ક્ષમા ચાડું ધૂં, પણ મને પ્રધાનજીના અતુમાન ઉપરાંત એમ પણ એસે છે કે-અવકર્ણિક ચંડાળ પુત્ર ન હોવો નેચું. એણે જે ક્ષાત્રતેજનું પાણી બતાવ્યું એ વાત પરથીજ મારી આ માન્યતા બંધાવ છે.

તમારા ઉભયના અભિપ્રાયનો અર્થ એ થયો કે રાજ્યવી કરકંદુના આ રૂક્ખાને માન આપી, આ ભૂહેવને મારે જામ આપવું. એવું વેચાણ કરજીયાત કરવું !

પણ અહીં આપણા મંત્રયમાં ફેર પડે છે. મારા પ્રણનન એવા આ દ્રિજ પ્રત્યે મને માન છે. એની આજીવિકાનો પ્રથમંધ તો કરાવીશ પણ સાથેસાથ એના હક્કનું રાજ્ય પણ અપાવવા જરૂર હું કુમર કસીશ. દંડ પર એનો હાથ પ્રથમ પડ્યો છે.

એ કરકંદુ તે કંઈ વાડીનો મૂળો કે જેના લખાણથી હું મારું જામ આપું કિંवા એ રૂક્ખાનો અમલ કરું ?

એ ચંડાળ તતુજ ભલે દાતપુરના મહારાજનની આંખમાં ધૂળ નાખી

गयો અને આકસ્મિક રીતે કંચનપુરનો સ્વામી બની એઠો ! આખ્રે તો ચંડાળનું ઘોળાયું જ ને !

સત્તાના જોડો, અને શાસ્ત્રોના બગે કંચનપુરની પ્રજા દ્વાચ જાય એ સંભવિત છે. ‘વીર ભોગ્યા વસુંધરા’ જેવા ઉલ્લેખને આગળ ધરી એણે ધાર્યું, કાઈ કરી દીધું એ પણ ડીક છે. છતાં એ ડોળ દમામથી હું દધિવાહન ન બોળવાચ જઈ. ‘વીરતાનો વાસ છે કે કાયરતાનો પાશ છે.’ એ તો રણાંગણું પરજ પરખી લેવાશે. ચંપાનું રાન્ય ઓછું જ ઢોચ એડી બામણીના એતર જેવું છે !

પ્રધાનંશ ! સૌ પ્રથમ રતન સુદર્શન શેડને માન પુરસ્સર તેમના આવાસમાં પહોંચતા કરવાનો પ્રથંધ કરો. આ આલાણને આજી-વિકાનો પ્રથંધ કરાવી હો. ઉદ્ઘાનમાં આવેલ શ્રી વાસુપૂર્ણ સ્વામીના પ્રાસાદમાં અષ્ટાનિંદ્રકા મહોત્સવ શરૂ કરવો, અને આજેજ દૂત મોકલી એ ચંડાળપુત્ર કરકંદૂને કહેવરાવો કે “ ઇક્કા મુજબ ગામ નહીં આપી શકાય. કંચનપુરના રાન્ય પર હક્ક એ ભૂદેવનો છે માટે સત્તવર ગાઢી છોડી ચંપાપતિના શરણે આવી જાવ. એમ કરવાની તૈયાર ન હોય તો રણ મેદાનમાં મુકાબલો કરવા સજજ થાવ !”

સેનાપતિ ! દૂતના આગમનની રાહ જોયા વિના તમો તો આપણા સૈન્યની તૈયારી કરવા માંડો. આ ચંડાળ સંતાન એકદમ શરણે આવી જાય એમ લાગતું નથી જ. મારે પણ જગતને દેખાડી આપવું છે કે શિરકેશ શેત થયાં છતાં ચંપા પતિની નાડીમાં વીરતા પૂર્વવત જ વહે છે. ભલે એના ભાગ્યમાં પતિન સુખની ઉણુપ હોય છતાં ક્ષાત્ર તેજની ઉણુપ નથી જ. હવે તો વિજય ડંડો વગાડ્યા બાદજ પ્રેયસી પદ્માવતીની શાધમાં નીકળીશ.



પ્રકરણ ૧૭ મું

સમરભૂમિ ઉપર ચમત્કાર !



‘જીર, જોડ અને જમીન’ એ કળયાના ભૂળ-લેખાય છે. ચર્ચિતહાસના આદિ કાળથી એ નિમિત્તે હળવો ને લાઘે માનવીઓના રક્તપાત થયાનાં ઉદાહરણો શોખવાં જવા પડે તેમ નથી. યુઆદિ જીનેથ શ્રી ક્રષ્ણાદેવના પુત્રો-ભરત અને બાહુભણી-સમજમાં ઓછા નહોતા. અરે તહુબવે મોક્ષે જનારા હતા, છતાં એમણે યુદ્ધક્ષેત્ર ને એછો બોગ નથી ધર્યો ! વિશ્વનું સંચાલન યંત્ર કારણે એવું અજ્ઞય રીતે થયા કરે છે કે એમાં રણ્ણચંડી પોતાનો હિરસો માંગે છે અને મોટી સંપ્રાનો બોગ લે છે.

પૂર્વે જોયું તેમ દર્ધિવાહન ભૂપનો દૂત કંચનપુર ગયે હતો. પણ જેનું નામ કરકંડૂ, એ દંડનું મહાત્મ્ય નજરે અનુભવ્યા પછી ગાંન્યો : જય તેમ હતું જ નહીં.

એના હાથે ચળ તો કુદ્રતી રીતે આવતી હતી, પણ હુદે એમાં આત્મચક્ષિતનું બબ્બ ઉમેરાયું. પોતાની ન્યાયી વાત પણ ચંપાપતિના

ગણે ન જીતરી અને આગળ આજ્યું ફેલવ ચંડાળપણું ! એનામાં પણ જરૂરો ઉકળાઈ ઉદ્ભવ્યો. ચંડાળપણ થરવીર હોય છે. જગતને દેખાડી આપવાની નિર્જાસા જાગી.

ચંડાળ એટલે હલકટ ! સત્તવહીન ! નમાલો ! એ અર્થ ભૂંસી વાળવાની જરૂરી ભૂખ ઉપની.

દુષ્ટને કહી નાખ્યું —

ભાઈ ! સત્તવ જા, તહારા સ્વામીને કહેને કે આ કરેકંદૂ ખાંડાના દાવ ખેલવા તૈયાર જ છે. સાચો. હક્કાર ડોણું છે એ શખ્ષથી પુરવાર કરવા કરતાં કાર્યથી પુરવાર કરી અતાવશે. કુળના નામે અહેંકાર કરનારા રાજવીએ ! તમને માટે જ કુદ્દરતને ખોળે આ કરેકંદૂ અવતર્યો છે.

x

x

x

x

કંચનપુર અને ચંગદેશની સરહદ પર ઉલ્લય રાજવીએની સેના પથરાઈ ગઈ છે. સામસામી છાવણીએ. અડી કરી દેનામાં આવી છે. એમાં આવતી કાલના ચુંદ અંગેની જુદા જુદા પ્રકારની તૈયારીએ. અને વ્યૂહરચના સંખ્યાંથી મસ્લાતો ચાલી રહી છે. જાગૃત ચોકીદારોના પહેરા ગોઠવાઈ જયા છે. પોતાનો ભરમ રાત્રું કળી ન જાય એ અંગે પાકો બંદોખરત રખાયો છે.

કંચનપુરના સ્વામીની છાવણીનો વિસ્તાર ચંપાપતિની છાવણીના ગ્રમાણુમાં નાનો જણાય છતાં એમાં શૌર્યનો જળકાઈ વધુ જણ્ણાતો હતો. સૈનિકોમાં જ નહીં પણ શિખિરના સામાન્ય ચોકીદારમાં પણ જીડીને આંખે ચઢે એવી સતેજતા હતી.

એક શેવેલ વખતમાં સનજ થયેલ, ગ્રૌંડ અવસ્થામાં પાંખરી રહેલ સાધ્વી મૈયા રાજવી કરેકંદૂને મળવા માટે ચોકીદારની રજ માંગી રહ્યા હતા, છતાં પેદો જરા પણ મયદું આપ્યા વિના બેલ્યો —

‘ મૈયા, આજ કાલ બિલ્ખુડના વેશે ગુમચયરો છાવણીમાં પ્રવેશી જઈ, જરૂરી ઘાતમી મેળવી, ભવલજા યુદ્ધ વિશારદોની ભડી બગાડી નાંખે છે; જંગીની કમાણી ધૂળ કરી નાંખે છે. રાજીવીની આજા છે કે સંકેત ચિનહે વિનાના ઢોધને પણ પ્રવેશ ન કરવા હેવો. ચાહે તો તે મરદ હોય કે ઓરત હોય; જાસુસો નારી વેશે આધ્યાત્માના ખનાવો પણ નોંધાયા છે.’

‘ ભવા આહમી ! તહારી વાત સે ટકા સાચી છે. પણ મારા સરખી બિલ્ખુણીના વેશ પ્રતિ જરા નજર તો માંડ. આ સ્વાંગ સ્ત્રીકાર્ય પછી પહેલી જ વાર આ ભૂમિમાં પગલાં માંડું છું. કામ અગત્યતું ન હોત તો મારો સ્વાધ્યાય છોડી અહો આવતે પણ નહિ. હું ઢોધ ધૂપી ઘાતમીદાર નથી. મારા સરખી સાધ્વી પાસે સંકેત ચિલ્લ કેવું ?

‘ મૈયા ! તમારી મીડી વાણી મને વિશ્વાસ મુક્ષવા લક્ષ્યાવે છે. જીભા રહે. હું એ માટે રાજીવીને પૂછાવી લઇં.

ચોકીદારે પોતાના સાથીદારને હાથ પાડી, સાધ્વીવાળી વાત સમજની, આજા લેવા વિદ્યાય કર્યો.

અંદ્ર્ય સમયમાં જ એ પાછો ઝર્યો, અને સાધ્વીનું ને મુખ્ય દારથી દાખલ કરી, કરકંદૂ રાજીવીની શિબિરમાં દોરી ગયો.

એ કાળે ધર્મનાં બહુમાન સવિશેષ હતાં. સંપ્રદાયના વર્તુંણો કંડક નહોતાં અન્યાં. ત્યાગી જીવનમાં રમતા આત્મા પ્રત્યે રાજીવીએ અને એમના પ્રજનનો મરતક નમાવતાં. એમાં ધર્મની સાચી સમજ કરતાં જીવનદારની પ્રધાનતા વધુ જણ્યુતી.

. સાધ્વીનાં પગલાં થતાં જ કરકંદૂએ સામે જઈ, તેમના ચરણમાં મરતક નમાયું.

દસ્તક્ષય જોડી, પ્રાર્થના કરતાં ઉચ્ચાર્યું કે—પૂજય શુરણીજ ! આપને ને કંદ્ચ કહેવાનું હોય, અમર તો ને કંદ્ચ માંગણી કરવાની

હોય તે સત્તવર કરશો. આવતી કાલે જ ખાંડાના ખેલ આરંભાય છે એટલે આજની ઘટિકાઓ મારે મારે મહામૂલી છે.

રાજ્યી કરકંદૂ ! મારી એક જ સૂચના છે કે તું યુદ્ધથી વિરામ પામ. એમાં અધર્મ છે, જ્વોનો ભયંકર સંહાર છે, અને વિનયધર્મનું ઉલ્કાંધન પણ છે. તહારા સરખા સપુત્રને એ શાબુતું નથી.

સાધ્વીમાતા ! આપ અન્ય કંઈ કરવા કહો તે હું કરવા તૈયાર છું, પણ રાજ્યધર્મના પાલન અર્થે—ક્ષાત્રવટની લાજ માટે—જે આવશ્યક છે તે ત્યા હેવા હું શક્તિવંત નથી. આપ એમાં અધર્મ જુઓ છો. એ આપના સ્વાંગને જરૂર બંધેસતું છે. ભયંકર સંહાર યાને માનવ જીવનની હાનિ છે એમાં શાંકા જેવું નથી. પણ જ્યાં અતિ ધણે અધર્મ અને અમર્યાહિત માનહાનિ ચાલી રહી હોય ત્યાં ખીજો ઉપાય શું ! જ્યાં સત્ય અને ન્યાય—નીતિનું છેડે ચોક લીલામ બોલાવાતું હોય, જ્યાં જન્મથી જ જાચ નીચના બેદ પડાતા હોય ત્યાં આ તલવાર દ્વારા કેંસલો કરી લેવાની અગત્ય જીલી થાય છે. મારી દૃષ્ટા સંગ્રામ ખેલવાની નહોતી છતાં ચંપાપતિએ એમાં મને ફરજ પાડી છે. :

પવિત્ર માતા ! આપને એ વાતની ખખર નહિં હોય પણ મારે જણાવવું જોઈએ કે આ ધરતી પર ધર્મ અને સમાજને નામે ધણાં ધણાં ધતિગે ચાલી રહ્યાં છે. એ પાછળ સત્ય, નીતિ, કે પ્રમાણિકતા જેવા અણુમૂલા ગુણોતું ખૂન થઈ રહ્યું છે. છતાં એ ખૂનમાં પ્રત્યક્ષ કે પરેક્ષ રીતે હાથ બોળનારા પોતાની જતને પવિત્ર માને છે.

મારો જ દાખલો આપું. ચંડાળને ત્યાં જન્મ્યો એટલે અસ્પૃષ્ય ગણ્યાયો. કુદરતની કૃપાથી—ભાગ્યના યોગે—રાજ્ય લક્ષ્મી પ્રાપ્ત થઈ છતાં મારા તરફ જાચ તરીકેનું જૌરવ લેતાં દ્વિજ સમુદ્ધયનો વિરોધ ચાલુ જ રહ્યો છે. એક દલીલ એ કરવામાં આવી છે કે હલકા કુળમાં જન્મેલ હું રાજ થઈ જ ન શકું. પવિત્રતાનો ધનરો ડેવલ ખાલિએ વર્ગનો જ છે. એ કહે તે જ અહીંવાક્ય ગણ્યાં જોઈએ.

મેં એ સામે બળવો પોકાર્યો અને ભુજના ખે દેખાડી આખું હે
ધરતીને ભોકના હરકોઈ પરાકર્મી થઈ શકે છે. એમાં વર્ષાભેદને ચાડા
આવવાનું જરાપણ કારણ નથી. જીંય નીચની ગણુના જન્મ આશ્રિત
નથી પણ કર્મ આશ્રિત છે. પવિત્ર આચરણવાળો જીંય ગણ્ય અને
અધમ કર્મ કરનારો નીચ લેખાય. એક દ્વિજને મેં વચન આપેલ, તેના
પાલન અર્થે જ મારે આ યુદ્ધને નોતરવું પડ્યું છે. પેલાને અંગહેશમાં
જામ જોઈએ, એ સાર ચંપાપતિને મેં રૂક્ખો પાઠવી, એ આપવા તેમજ
એના બદલા તરીકે જે કહે તે આપવા છૂટા દર્શાવી.

જવાબ મળ્યો—‘ તહારા જેવા શરૂને હું રાજ તરીકે સ્વીકારતો જ
નથી. રાજ્ય પર અધિકાર તહારો નથી પણ પેલા દ્વિજનો છે. ’

પૂન્ય આર્યા ! મને કહેશો કે વચન પાલન માટે મેં જે કર્યું એમાં
ક્ષયાંયે અધર્મ—અનીતિ છે ! અફ્સોસ તો એ થાય છે કે ધર્મનીતિ
પાલનનો દાવો કરનારા તરફથી એ સામે હેવો અસભ્યતાથી ઉત્તર
અપાય છે ! ચંડાળને ત્યાં જન્મ એટલે એ માનવની કોટિમાંથી જીતરી
ગયો ! આવી હડધૂત દરા તો કૂતરા—બિલાડાની પણ નથી કરવામાં
આવતી ! સમાજના આ ખોટા બંધનો સામે મેં લડી લેવાનો નિશ્ચય
કર્યો છે. ચંડાળ તનું જ પણ વચન પાલન અર્થે પ્રાણું કુરાયાન કરી
શકે છે એ જગતને દેખાડું છે. માણુસાધજેવી ચીજ નીચ ગણુના
વર્ગમાં પણ છે એ બતાવવું છે તેથી જ હું મારા નિશ્ચયમાંથી
ચળનાર નથી.

વિનય સાચવો એ ધર્મ જરૂર; સામેનું પાત્ર પણ જેવું જોઈએ
ને ! અંગહેશના સ્ત્રામીના વિશાળ પ્રદેશ આગળ માર્ઝ રાજ્ય તો એકદા
નાનકડા ટાપુ જેવું લેખાય. વળો એ ભૂપ મારા વડિલ પદે શોભે એમાં
પણ ના નહોં; છતાં એવા જિડિયા પાસે ભાષાની મીઠાશની આથા તો
હું રાખું ને ! જે તેરા વેણો આગળ નમતાં જવું એ તો પામરતા
ગણ્ય. એરા જીવનનો હું પડ્યાયો પણ ન લડું.

રાજ્યી કરકંદુ ! તારી વાતમાં ભૂલ કહાડવા જેવું નથી. આમ છતાં જે કાર્યમાં હજારો જીવોનો ઉધાડો વિનાશ ડેક્કિયાં કરી રહ્યો છે એ અટકાવવાનો મારો ધર્મ ગણ્યાય. એ શુભ હેતુ ન હોત તો હું અહીં દોડી પણ ન આવત. મારું હૃદય પોકરે છે કે એ સંહારલીલા જરૂર અટકો અને તે રહારી જ મારાઝે. મારી છચ્છા નહોતી છતાં એ પાછળનાં કારણો જગ્યાવવા જરૂરી હોવાથી જ ભૂતકાળનો અંધારપટ ઉદ્દેશ્યું હું.

રાજ્ઞ ! તું ચંડાળપુત્ર નથી. તું મારો પુત્ર છે.

પૂન્ય આર્ય ! આપ શું વહી રહ્યા છો ? આપ અસત્ય ન વહો, એ જેમ ખાત્રીલયું છે તેમ મારા માથાપ મોળુદ છે એ વાત પણ કાવના ચણુતર જેવી પાકી છે.

પુત્ર ! તહારા ચંડાળ માનપિતા એ સંરક્ષક વડિલો છે પણ જનમદાત્રી માતો હું જ છું અને જેમની સાથે તું યુદ્ધ ખેળવા કરિઅદ્ધ થયેલ છે, એ ચંપાપત્ર તહારા પિતા છે.

અરે ! આ તે સ્વર્ણ છે કે સાચી વાત છે ? આશ્રયની આ ગાંઠ મારાથી નથી છોડાતી ! એ પાછળના અંકોડાડપી દોરા આપ છૂટા પાડી આપો તો જ સમજાય.

ભાઈ ! ઉતાવળો ન થા. તું જેમ મને માતા તરિકે નિરખી ચમત્કાર અનુભવે છે તેમ તહારા પિતા પણ મહારા આ વેશ પરિધાનની કે જન્મ પઢી રહાં અને મહાં શું થયું એના છતિહાસથી વંચિત છે. વિધાતાની એ પાછળ કોઈ અતોખી કરામત છે. પૂર્ણ શાની વિના એનો પાર ન જ પામી શકે.

સાંભળ ! હું મર્ભવતી હતી. હસ્તિસકંધ પર બેસી મને છૂટે હાથે દાન હેવાનો દોઢલો જીપણ્યો. ચંપાપતિનો સ્નેહ મારા પર સંપૂર્ણ હતો! ચેટકરાજની તત્યા હું પદ્ધાવતી તેમના અંતઃપુરમાં એક માત્ર

પ્રાણુષસે હતી. અન્ય રાજ્યની જેવી અમરવૃત્તિવાળા તે નહોતા. મારી વાત સાંભળાને દોહલો પૂર્ખ કરવાની વ્યવસ્થા તેમણે કરી. અંગરક્ષકોના ઘરિવાર સાથે હાથીપોઠ પર બેસી અમો નીકલ્યા.

નગરકાર વટાવતાં જ ડેઢ દૈવી કારણે હાથી ગાડો બની દોડના લાગ્યેટ કેમે કર્યો મહાવતના કાણૂમાં ન રહ્યો. અંગરક્ષકો પાછળ રહી ગયા. મહાવત અથડી પડ્યો. અમે! દંપતી ભયને કળી ગયા. સામે દેખાતા વડ નીચે હાથી જાય કે એની વડવાઈઓ. પકડી લેવી એવો નિશ્ચય કર્યો. ચંપાપતિ તે પ્રમાણે કરી શક્યા પણ મારાથી એમ ન થઈ શક્યું. નતિબ્લે એ આવ્યો કે હાથીની પોઠ પર એકાકી રહેલી હું વિકરણ વનમાર્ગ, તેજ્ઝાની વાયરામાં સપડાયેલ નાવ માફક ખેંચાઈ રહી. સંસારનાં દુઃખો અને કર્મરાજ, જીવાને કેવા કેવા વેશ સજાવે છે એનો સૌચો ખ્યાલ મને એ વેળા જ આવ્યો. રાજ મહાલયનું જીવન કૃથી અને આ કપરી દથા ક્યાં! ઉભય વર્ચ્યેના તશ્શવતનો પૂરો સાક્ષાત્કાર થયો. એ વેળા શ્રમણ ભગવાન મહાવીરનો સંયમ માર્ગ એકલો જ નિર્ભય છે એમ સુમન્યું.

સીતારો યમકારો એટલે એક સરોવર નજીફ એ જળ પીવા શોક્યો અને હું બાળુના જાડની ડળી પકડી, એની પોઠ પરથી ચિતરરી ખરતી પર આવી. મહા કષે, કુધા-તુખાના કપરાં દુઃખ વેઠી એક કુલપતિની રહાયથી દચ્ચપુરની ભાગોળ બેખી થઈ. પણ ઇવાન રમણી અને કુલીન ધરની નાદીને એ મોટા નગરમાં જય સ્થાનદો એછાં નહોતાં. જે અનુભવો મને છેલ્ખા થોડા દિવસોમાં મળ્યા હતા એનાથી મારો હૃદય તાર હાથી જિદ્યો. હતો. ચારિત્ર પંથ પ્રતિ સ્નેહ જન્મ્યો. હતો. સંસારની અસારતા આંખે બળગી હતી. પહેંચી સીધી સાધીલુની વસતીમાં. ભાઈવિનો વિચાર કર્યો વગર અને જર્બિવતી હું એવી રીત ઉચ્ચયાળી વિના મુદ્દા પાસે ફક્સા લાદ લીધી. એક રીતે કહું રો સંસારના દ્વેક ભર્મેણી અન્ય વડુંપારિક બંધનો હી હું મુક્તા બની.

મારા દિવસો ડોછ અનેરી રીતે જ્ઞાનાર્જનમાં અને આત્મચિંતનમાં વ્યતીત થવા લાગ્યાં. પતિ, પિતા, કે અન્ય ડોછ સર્જાં સ્નેહીઓની વાત જાણું એક ગતકાલિન સ્વભસમ બનાવી દીધ્યી.

પણ કાળનું ચક્ક તો અસ્ખલિત જતિએ વહે છે. ગર્ભવૃદ્ધિ થતાં જ શરીરના ફેરફાર ધૂપા ના રહ્યા. પ્રશ્ન શંકા શીળ ઘન્યો. આખરે ગુરુણી સમક્ષ મેં મુહાની વાતનો સ્ફેટ કર્યો. એ સંભળતાં ડોછને મારા વર્તન સંખ્યા શંકા ન રહ્યી. પણ સાધ્વી જીવન ટીકા પાત્ર ન દેખાય અને નિર્ણયોના ધર્મ સાને અન્ય પંચ પ્રવર્તણો આંગળી ન ચીંધે એ સાંદ્ર મારા પ્રસ્તુત સુધીનો વર્તાન્ત ગુપ્તપણે જોક્લી લેવાનું નક્કી થયું. અદ્ધા સંપન્ન ઉપાસક મારફતે એ કામ પાર પડ્યું. જન્મ આપ્યા પછી ઉચ્ચિત સમય વીતતાં હું જ રહેને કામળમાં લપેટી, ચંડાળની પર્ણકુટિ નળક ગુપ્તપણે મૂકી આવી હતી. સાધ્વી જીવનમાં હોવા છતાં લોહીનો સંખ્યા સાવ ભૂલી ગઈ નહોતી. મૂક્તા પૂર્વે એ ચંડાળ દંપતીને કંદ્ચ પણ સંતાન નથી, અને પતિને એ અભાવે હુઃખ થાય છે એવા સમાચાર ખાનગી રીતે મેળવી લીધા હતા. એ ઝુંપડી ભલે ગરીબની હોય, અરે મહાબ્લનમાં એ જાતિ ભલે ફલકી લેખાતી હોય છતાં પુત્રનો ઉછેર તો ગ્રેમપૂર્વક થશે એવી પાકી ખાતરીથી એ કામ કર્યું હતું. અવાર નવાર એ એકાંત ભાગ તરફ જઈ, દૂરથી ઉછરતા પુત્રનું સુખ દર્શન સરળતાથી થઈ શકશે એ પણ આંતરિક આશ્ય હતો જ.

પુત્ર ! સાધ્વી જીવનને ન છાને, છતાં સ્નેહથી એંચાછ હું ધખ્યોવાર એ તરફ આવી મારી ચક્ષુઓને હારી ગઈ હતી. મોરો થતાં, આન્દે તું ને નિર્ભયતા, પ્રમાણિકતા અને સલ નેરો ગુણો માટે માન ધરાવતો થયો. છે એ અમાં। દંપતીજીવનના એકખારા, સંરક્ષારના ફળરપે છે. અમૃતવય છતાં તું ને દિનમિત દાખલતો એ જોઈ હું દૂરથી રાજ થતી.

ઘડીભર સ્વામીની છથી યાદ આવતી. પણ આખરે મેં જાણીથૂલ ને સ્વીકાર્યું હતું એને વિશ્વાર રહેવા, દફ્તા ધરતી અને સંસારના જીવનને ભૂલી જવા ઉધ્ઘરનંત અનતી.

‘એકા એક ચંડાળ કુટુંબ ઉચાળા ભરી જયું’ એ સમાચાર આવિકા દારા મારા કાને અચડાતાં પ્રથમ તો મને ક્ષોભ ઉદ્ભવ્યો. એ પાછળનો વૃત્તાન્ત મેળવવા પ્રયાસ શરૂ કર્યા. થોડા દિવસ પછી, ચંડાળ પુત્ર અવકર્ષિણુંને રાન્ય ભણ્યું છે એવા ઊડતા સમાચાર સાંભળ્ય. પાકી તપાસ અંતે વાત ખરી જણાઈ; અને કંચનપુર નરેશ કરકંડૂ એ જ મારો બાલુડો છે એ જાણી સંતોષ થયો. એ દિવસ પછી મને પૂરી શાતા વળી અને સંખમ માર્ગમાં હું એક તાર અની. સ્વામી અને સંતાન પ્રત્યેનો ને એક સ્નેહતંતુ, ભાવના ટાણે નેત્રો પર છવાતો, તે અગાઉ કશ્યું તેમ સંસારની નજરે પૂર્ણ દર્શાને પામ્યો જોતાં જ એ તરફથી મન પાછું વળ્યું. ત્યારથી હું મારા ચારિત્ર પાલનમાં રક્ત હતી.

એકા એક તમારી આ લડાઈના સમાચાર સાંભળ્યા. તરત જ ક્ષોભ થયો. મન પોકારી ઊદ્ધું કે—લડારા રાન્યો. પોતે અતિ નિકટના સ્નેહીઓ છે એ વાન જાણતા નથી અને જગતના માનવીઓ. પણ સાચી સ્થિતિથી અજ્ઞાત છે. વિના કારણ થતો હજરો જીવેનો સંહાર અટકાનવો હોય તો મારે ઉપાશ્રયની દિવાદો બહાર નીકળી સાચી પરિસ્થિતિથી એ ઉભયને વાકેક કરવા જ જોઈએ..

વત્સ ! આ ભાવનાના જોરે હું બહાર પડી એટલું જ નહી પણ વિહારના કપરા કણ્ઠોની પરવા કર્યા સિવાય અહો દોડી આવી છું. વિસારી મુક્તી વાતોને પુનઃયાદ કરી છે. આરા છે કે હવે, તું આ કાર્યથી હાથ ઉડાવશો.

રાજવી કરકંડૂ એકીઠણે સાધીના મુખ તરફ જોઈ રહ્યો.

એને આ રીતે મૌન દેખી સાધીજ બોલ્યા—

હજુ પ્રતીતિ નથી થતી ? અનવા જોગ છે. આ પવિત્ર સ્વાંગ હેઠળ જ્યાં પ્રપંચ રમનારા હોય ત્યાં શાંકા ઉદ્ભવે ! ફિકર નહીં, દીકરા ! જરા તહારી આંગળી પરની વીટી કંહાડી એ પરના ઝીણું અક્ષરે વાંચ્યો લે. પ્રેયસીને પ્રલુતામાં પમદાં મૂકવાના પવિત્ર પ્રસંગે ગ્રાન્ટ થયેલી એ બેટ છે. ચીર કાળ સંધરેલી એ બેટને અણુગાર જીવનમાં પણ અળગી નહોંતી કરી. કંખળમાં તહેને વીટાળી મૂકૃતી વેળા એને પણ એ બેગી હેતુસર રાખી દીક્ષી હતી. તહારી આંગળી તરફ નજર જરાં જ એ પરખાઈ ગઈ.

હજુ પણ શાંકા ન ખસતી હોય તો તહારા પાલક માતાપિતાને જઈને પૂછી જો.

દ્વાલી માતા, અરે ભૂલ્યો પુન્ય આયો ! મને આપની વાત પર જરા પણ અણુભરોસો નથી. હાથ કંદણુને આરસીની જરર ના જ સંભવે.

તો પછી, વિલંઘનું કંઈ જ પ્રયોજન નથી. જે ગૂંચ પડી છે એ મારા જીવન ચરિત્રના અવણુથી સહજ ઉકેલી શકાય તેવી છે. તું માત્ર પમ ઉપાડે એટલી જ ઢીલ છે. કદાચ તહેને એક માતાએ અનલવવી જોઈતી ફરજ અંગે મારા વર્તાવમાં ઊણુપ જણ્યાય તો પણ હવે એ અછ ગુજરી ભૂલી જવામાં જ ડહાપણ છે. મારા અને તહારા રાહ જુદા છે. તું વીતરાગ કચિત ‘કર્મની ભતિ વિચિત્ર છે’ એ સૂત્ર તરફ રહાર્યાન બેચ્યું છું. વિધાતાના સાંકેત ખુદ અનંત બળના ધર્શણીથી પણ ફેરવાઈ શકાતા નથી એ દત્તિહાસના પાનાં પરથી અવલોકી શકાય છે. એ જોતાં તહારી આ જનનીથી એવી ભૂલ થઈ હોય તો તે ક્ષાંતબ્ય છે.

ના, ના, સાધીમાતા ! હું કંઈ એ અતકાળની વાતનો વિચાર

નથી. કરી રહ્યો. સંયોગોને આધિન થઈ તમે લીધેલ પગલું મારી નજીરે ટીકા પાત્ર નથી. ‘ જે કંઈ અને તે સારાને માટે જ ’ એ જનવાયકનો સધિયારો લઈ, હું તો વર્ત્માનનો વિચાર કરું છું.

તમારા સરખી ક્ષત્રિયાણીની કુક્ષિએ જન્મેલ, અને એક પ્રસિદ્ધ ક્ષત્રિય કુલાવતંસના કુળમાં અવતરેલ સંતાન, ‘ હું તમારો પુત્ર છું ’ એમ કહેતો સામે જરૂર એમાં મારી, તમારી કેવું દૃધિવાહન ભૂપની શોકા ન અણ્યાય. ક્ષાત્ર વૃત્તિમાં એ જાતના વર્તાવને સ્થાન નથી. એમાં પણ આ તો સમરાંગણુની ધરતી. હું વિનય પૂર્વક આવીશ અને પિતાના ચરણોમાં શિર નમાવીશ એ ચોક્કસ છે પણ તેમના તરફથી ચુલેહ સૂચક શ્વેત ખજ ફરક્યા પછી જ. આ ચુઢના પ્રેરક તેઓ છે, હું નથી જ. પિતા—પુત્રના સંબંધમાં પણ યુદ્ધ રીતિને નેવે ન જ મૂડી શકાય. સિંહ સાવજ પોતાના મોલાને શોભતો જ આહાર કરે. ભૂપે મરવાનું પસંદ કરે, પણ એના મુખમાં ક્ષુધા શમાવવા તણુખલું તો ન જ હોય.



પદ્ગરણ હેતુ મું ચમત્કારેની પરંપરા



સુહૃદુરશિખ દેવની પધરામણી ક્ષિતિજ પર થતાં જ ભૂપ દ્વિવાહની છાવણીમાં રણુભૂંગળના નાદ ગાજ ડિઠયા. પહોર દહાડો ચલતાં પૂર્વે તો દુશ્મનતી નજ્ઞક પહોંચી, હલ્લેલા કરવાના ફરમાન તો રાત્રિના ધૂણી ગયા હતા. ચોતરદ નાદના રવ કાને અથડાતાંજ જગૃતિ આવી ગઈ અને ઝડપી તૈયારીની ઉષ્મા પથરાઈ ગઈ.

ત્યાં તો શત્રુની છાવણી તરફથી સાધ્વી મૈયાનાં પગલાં આ તરફ શીધગતિએ પડ્યાં. તેઓનો શાસ સમાતો નહોતો. લે કંધ એલે તે પૂર્વે દાર પરના ચોકીદારે પડકાર કર્યો—

આટલી ઝડપે આવ્યા છતાં, ગુરુણી ! તમારો હેતુ સિદ્ધ થવાનો આજે અવસર નહિ મળે. સૌ કોણ હલ્લાની તૈયારીમાં પડ્યું છે અને રાજવી પણ વ્યૂહ રચનામાં ગૂંઘાયેલ છે. એટલે તમારી પ્રાર્થના કોણ સાંભળનાર નથી.

ભાઈ હલ્લાની જરૂરજ નથી રહી. અને તો ભૂપતિ પાસે લાઈ જ એટલે મારો પ્રયાસ બર આવે.

મૈયા ! છાવણીમાં કોઈને અત્યારે પ્રવેશ કરવા દેવાની સખત મનાઈ છે. વળી પ્રસ્થાન સમયે તમારાં દર્શન શુક્તિયાળ પણ નથી ગણ્યાતા. દુસ્મન નમતું આપવા તૈયારી દાખવે તો પણ અમારો સ્વામી એ ચંડાળ પુત્રને જતો કરવા કે એતી જોડે સુલેહ કરવા ઉચ્ચુકતા નહિ થાબુ.

અરે ! તું કોઈ નવો ચોકીદાર જણ્યાય છે. જરા મારા ચહેરા તરફ નજર કર અને મને સત્તર આગળ વધવા હે. વિના કરણું વિલંખ ન કર. જે પળ જાય છે એ લાઘેણી છે. સુલેહ તો ડોકિયાં કરી રહી છે. દુક્તા ભૂપને મળવાની જ ઢીલ છે.

મૈયા ! હું જરૂર નવો છું, છતાં દુરજમાં ચુકું કે કોઈના ચહેરાથી બોણવાઈ જઈ એવો નથીજ. તીબા રહો, વૃદ્ધને ઓલાનું.

અરે, ધરસિંહ જલ્દી જ અને સામેના કમરામાંથી માનસિંહજીને અહીં ઓલાની જાવ.

વૃદ્ધ માનસિંહ ધીમે પગલે આવી પહેંચ્યા. સાધ્વી મૈયાના ચહેરા પર નજર પડતાંજ એનાથી ઓદી જવાયું —

મહારાણીજ, આપ આ વેશમાં ! અહો કેટલે વર્ષે અચાનક અહીં આવી ચઢ્યા ?

ભાઈ ! હું ઉતાવળમાં છું. મારે જલ્દી રાજવીને મળવું છે. આ દારપાળ રોકી રહ્યો છે એને તું સમજાવ.

પવિત્ર માતા ! આપ સુખે સીધાવો. આપના ગુમ થયા પણી ચંપાના શિરે ઓછી નથી વીતી !

અરે, ધરસિંહ ! સાધ્વીમાની સાથે જ.

વર્ષોની શોધ છતાં રાણી પદ્માવતીનો પત્તો નહોતો. મળ્યો. જીવતા કે મૂચાના સમાચાર નહોતા લાધ્યા. સૌના હાથ હેઠા પડ્યા ફટા એમનો આમ અચાનક મેળાપ થતાથી વૃદ્ધ માનસિંહનું ધેંતર આન-

દ્વારાં નાચી જિડું. હક્કેથી લઈ જવાની વાત પણ એ વીસરી ગયો. ‘એજ ચહેરો, એજ મુખારવિંદ, એજ રાણી પદ્માવતી’ ઓળખવામાં આરી જરા પણ ભૂલ નથી એમ કવતો ને મળે તેને એ વાત કહેવા લાગ્યો. ધરીભરમાં આ સમાચાર સૈનિક ગણુમાં પ્રસરી ગયા અને છાવણીમાં એક છેડાથી બીજા છેડા પર્યાત આનંદ છવાઈ ગયો.

‘તારાની જ્યોતામાં ચંદ્ર દ્વારે નહિ’ એ કન્વિ વચન સુજબ સાધ્યી પદ્માવતી નેમ આગળ વખતાં જયાં તેમ ઓળખીતા ચહેરા મળવા માંડ્યા અને એ વધુ ને વધુ પ્રકાશમાં આવતા જયા. સૌને આશ્ર્ય ચવા માંડું. પાછળનું વુંદ ધીમે ધીમે મોદું થતું જયું.

રાજવીના શમિયાના આગળ આવતાં તો નાનકડા મેળા જેવું થઈ પડું. કોલાહલ ને લીડ વધી પડી. એકાએક ભૂપ દધિવાહન બહાર આવી કંધ કહે તે પૂર્વે સામે શાંત સુદુરધારી સાધ્યીને જેતાં-ઘરાબર નિહાળતાં-અનયણીમાં ગરડકાવ બની બોલી જિડું.

વહાલી પ્રિયે, પ્રેયરી પદ્મા ! આટલા વષે સુધી તું કચાં દ્વિપાદ ગઈ હતી ? આમ એકાએક કચાંથી પ્રકટી નીકળી ? તારી પાછળ મેં શોધ કરવામાં કચાશ નથી રાખી. ગર્ભનું શું થયું ? આ વેશ શાકારણે ધરવો પડ્યો ?

પ્રધાનજી, યશપાળ આદિને ખખર પડતાં સૌ દોડી આવ્યા. એમાં રાજયુરુ પણ હતાજ. તેમનું વચન સત્ય નીવડવાથી હર્ષ સમાતો નહોતો. એ બોલ્યા—

મહારાજ ! તું નહોતો કહેતો કે રાણીજનું મૃત્યુ નથી થયું. મેળાપ જરૂર થશે. જ્યોતિષ ખોડું નજ પડે. લાંબા સમયના વિરણી જનો-એમાં અતિ નિકટના પ્રેમીઓ મળે લાં આંખો અશુભીની થાય પણ એ આંસુ હર્ષના હોય છે. એનું સુખ મૌનપણે જ બોગવાય છે.

પદ્માવતી સાધ્યી વેસમાં હતા, અરે આ સંસારિક સ્નેહના તંતુથી

જાતે અળગા થયા હતા; છતાં આખરે માનવ હતા. બડીભરની આ સુખદ શર્ણિતને છોડી એ કહેવા લાગ્યા—

મારી રામકથાણી લાંખી છે. એ વર્ણવવાનો આ સમય નથી તેમ એનું પારાયણ વારંવાર કરવાનું મને જમતું પણ નથી.

ત્યાં તો ભૂપાળ દ્વિવાહન વચ્ચમાં જ ઓદ્યો—

પદ્માવતીની વાત સાચી છે. એ સાંભળવા જતાં આપણે આજનું વિજયી મુહૂર્ત ચૂકીએ તે ઢીક નથી. એ જાતેજ આપણી વર્ચ્યે આવેલ છે ત્યારે ઉતારણ પણ શી છે. હુઃખના દિને યાદ કરવાતી છયાં ન હોય તો મારે કરાવવા પણ નથી. કેટલીક મુદ્દાની વાત પછીથી જાણી દેવાશે. ચાંદો, પ્રયાણુભેરી વગડાવો.

રાજન! કેશ શ્વેતતાને ધરવા માંડચા છતાં યુદ્ધને શાખ હજુ પૂરો થયો નથી? એ બંધ કરાવવા તો હું આવી છું:

હે, ક્ષત્રિયાવતસના પુત્રી થઈ, મને રાજધર્મ—ક્ષાત્રધર્મથી પાછો વાળવા આવ્યા છો?

હા, દેવાનુપ્રિય! અહિસાનો પ્રચાર કરવો અને આત્માએને હિસ્કે વૃત્તિથી હાથ ઉદ્ઘાતવાનો એધ કરવો એ તો મારો વ્યવસાય છે. એ સારુ તો આ અંયળો એદ્યો છે.

તો શું આપ સાચા ક્ષાત્રધર્મમાં છો? હું તો સમજતો હતો કે ધરતી પર પ્રતર્તિના ભયોને લઈ, શિયળ સંરક્ષણ કારણે તમે આ સ્વાંગ ધારણ કર્યો છો. આ સલામત રથાનમાં પગ મૂકતાંજ-મારો સમાગમ થતાંજ-એ ઉતારી નાખશો.

એ આશા રાખવી નકામી છે. રાજન થોડા કે ધણું વિલાસ પાછળ આખરે તો વિનાશનું આગમન નિશ્ચિત છે. બનાવો એવા બન્યા કે એ વિનાશની જાંખી મને જરૂરી થઈ. શિયળ રક્ષા અથે

શોધેલ નિર્ણયની વસતી, મને સાચી રીતે અંથો વગરની અનાવવામાં પરિણમી. ભાગવતી દિક્ષા મેં સમજણું પૂર્વિક જ લીધી છે.

આપણા વચ્ચે સ્નેહનું ઝરણું પૂર્વવત વહી રહ્યું છે છતાં એ પાછળ પતિ-પત્ની ભાવ નથી. સ્નેહનું એ ઝરણું મને અહીં ધસડી લાભ્યું છે. મારા સુખે એ કહેવડાવે છે કે આ વય હવે નથી રહી યુદ્ધ ખેલન માટે કે નથી રહી સંસાર સુખો માટે. એકજ ઉપયોગ છે. માનવ ફેરા સંદળ કરવા સારું ચારિત્ર ગ્રહણ કરવા તૃપ્તિ.

મારા અધિકારી સારી રીતે જાણે છે કે આ સંસારી જીવનપર મંત્ર જાઓ મોઢ નથી રહ્યો, પણ એતો અર્થ એ નથી કે એકાદ ચંદ્રાગ પુત્રની સામે હું હાર કબૂલી લડેં, અથવા તો અંગદેશના આ વિશાળ પ્રદેશને રજળતો મૂકી ભાગી નીકળવું. સૌ પહેલી મારી ફરજ યુદ્ધ જીતવાની અને પણી આ રાજ્યને કોઈ યોગ્ય હાથમાં મુક્તવાની છે.

સાધ્યીજ ! તમોએ અંતરના ઉમળકાથી સંયમ સ્વીકાર્યો એ તો હું સમજ્યો, પણ ગર્ભસંધી તો તમો કંઈ ઓલતાજ નથી. એકેક પળ વીતી, રહી છે એ મારે માટે અતિ કિંમતી છે. સત્તવર કહેણે એ પુત્ર કિંબા પુત્રી હાલ કર્યાં છે ?

રાજ્ય ! તમારે માટે એકે એક પળ કિંમતી છે પણ મારે માટે તો તો એથી પણ વધુ મૂલ્યવાન છે. છતાં મૂર્ઝાં કહેણું માની પ્રથમ સુલેહનો શ્વેત ધજ ફરહાવવાની આજા બહાર પાડો. મારામાં વિશ્વાસ રાખો. મારા સુખેથી જે વાત બહાર પડશે એથી આપ સૌને સંતોષ થરો એટલુંજ નહીં પણ સંગ્રામ ખેલવાની અગત્ય નહીં રહે.

યશપાલ-મહારાજ ! આપણ સૌને રાણીમાતાની બુદ્ધિમતા માટે માન છે તો શા કારણે એમની સદ્ગતિ સુજ્ઞ વર્તવામાં વિલંબ કરવો ? એ જે કંઈ કહેતા હશે એમાં-આપનું, રાજ્યનું અને પ્રજાનું ગૌરવ જરૂર હશે.

પ્રધાન—હું પણ રહસ્ય મંત્રીના વિચારને મળતો થાડું છું.

બલે એમ થાય—મહારાજ દ્વિવાહન બોલ્યા, અને સમીપમાં જિલેલા કોટવાળને શ્વેત ધન ચઠાવવાનો હુકમ કર્યો.

પદ્માવતી સાધ્વીએ તરતજ સૌ કોઈ સાંભળે તેમ જણાયું કે—

ત્યાગ માર્ગમાં એકતાર જનેલી હું ને આશયથી આ સમરભૂમિ પર દોડી આવી હતી તે પાર પડ્યો છે. હજારો જીવાનું રક્ષણ થયું છે એ ઉપરાંત ને અપૂર્વ લાભ થયો છે એ તમારા સૌની દ્વિષ્યે ચમતકર રૂપ લેખાશે.

સાંભળો ! જેને તમો સૌ શત્રુ તરીકે લેખો છો, એ મારા ગર્ભમાં જિપનેલ સંતાન કરકંદુ અંગદેશનો ભાવિભાદી વારસ છે. એના અંકોડા જોડતાં ગોતે હસ્તિભીઠ ઉપરથી કેવી રીતે જીતરી, તાપસ આશ્રમે પહેંચ્યો અને દાતપુરમાં કેવા સંઘેગો વચ્ચે સાધ્વીના ઉપાશ્રમાં રથાન મેળાયું એ દૂંકમાં જણાયું.

સાધુ સંસ્થાની પવિત્રતા ન જોખમાય એ રીતે પૂરા માસે પ્રસૂતિ થયા પછી યોઽય સમય થતાં એ પુત્રને રમયાન ભૂમિમાં રાખવા સંભંધી, એના હાથે મુદ્રિકા પહેરાવવા સંભંધી, અને ત્યાં વસતા ચંડાળના પુત્ર તરીકે એ જિછરતો રહેવા સંભંધી વાત પણ વર્ણ્ણવી.

નામ અવકાશીંક રખાયા છતાં કરકંદુ તરીકે ઓળખાવાનું કારણ પણ જણાયું. લક્ષ્યાખ્યાંકત વંશદંના પ્રભાવથી ચંડાગ પુત્રને કંચનપુરનું રાખ્ય કેવી રીતે મળ્યું અને ગોતાના વચન પાલન અર્થે દિજને ઝકડો આપી અહીં મોકલ્યો એ વાત પોતે કરકંદુના મુખેથી સાંભળી હતી તે રીતે કહી.

કથનીને સંકેદતાં જણાયું કે—

આ બધા ધનાવો પાછળ સુખ કરતાં હુઃખતી પરંપરા ઓછી

નથી ભોગવી. ત્યાગ તરફ ચિત્ત વળવાનાં કારણેનું મૂળ એમાંજ છે. વિગતવાર કહેવા એસું તો કલાકો જેઠાં ખણું હવે એતો કંઈજ હેતુ નથી રહ્યો. મારા સિવાય પિતા પુત્ર વર્ચેનો આ સંખાર કોઈ જાણું ન હોવાથી આવશ્યક કિયા છોડી મારે અત્ર આવવું પડ્યું. પ્રથમ મેં પુત્રને એ વાત સંભળાવી. સાબિતી આપ્યે ગણે ઉતારી. એમ છતાં એ સિંહશાવળે માગણી કરી ડે—

વડિલનો વિનય જળવવાનું મન છતાં ક્ષત્રિય વટને ન શોભે એ રીતે હું ન જઈ શકું. સુલેહનો! ધજ ચદ્રો તો હું હોડતો. આવી પિતાના ચરણમાં શિર જુકાવીશ. અરી સ્થિતિ જાણ્યા પછી ધડવાનું સંભવેજ નહીં. શ્વેત ધજ જેતાંજ, રાજવી! તમારો એ બાહુડી અહીં આવ્યોજ સમજો.

ત્યાં તો ઉચિત રસાદા સાથે કરકંદૂના પગલાં થયાં. દિગ્યિત આકારથી પિતાને ઓળખ્યી, તરતજ હોડી જઈ એ એમના પગમાં પડ્યો.

દિવિવાહન ભૂપે ખણું આવા સર્વ ગુણોથી યુક્ત યુવરાજને નિરખી હુદયના ઉમળકાથી લેટી, પોતાની નજિકમાં એસાડ્યે. એટસુંજ નહીં ખણું પોતે ચંડાળ જાણુંને કરુના વેણું કહેતાંન્યા હતા. એ માટે દિલગીરી જાહેર કરી. સમર ભૂમિમાં ચોતરફ આનંદ વર્તાઈ રહ્યો. તરતજ કરકંદૂ ભૂપની છાવણીમાં અહીં આવી મળવાના સમાચાર મોકલવામાં આવ્યા.

સૌને આ વ્યહવાર વિધિમાં મૂકી પડ્યાવતી સાધ્યી તો ધખિસત સંધાતા પોતાના પંથે પડી અયા. સૌના વંદન જીલતાં છાવણી વટાવી તેમણે પોતાની વર્તીનેં માર્ચ લીધેએ.

ન્યાં પિતા પુત્ર પરસ્પરના વાતીલાપથી પરવારી તેમની ગેરહાનંસી નિરખી, તપાસ કરાવે છે ત્યાં ચોકીદાર અખર લાંબે છે ડે—

એ પવિત્ર મૈયાને સીધાની ગયા તો ધડીએ વીતી ગઠ ! સૌ ડેઢને અણયેથી જિપળ. ભૂપ દાખિવાહનના ચડેરા પર નિરાશાની કાલિમા પથરાઈ.

તરતજ કરકં દૂએ ખુલાસો કરતાં જણાયું કે-

પિતાશ્રી, આમાં હુઃખ ધરવાનું કંઈજ કારણ નથી. તેમની સલાહ માની મેં જે સુલેહનો વાવરો ફરકાયો હતે તો તેઓ ત્યાંથીજ પાછા ફરવાના હતા. તેમનો વેરાય રંગ ચોળમજૂહ જેવો હોવાથી આવા સંસારી વિષયોમાં ગુંચાવાનું તેમને અનુકૂળ નથી. વહુ સહચાસથી સ્નેહ કે આકર્ષણી ગાંડ મજબૂત થાય છે એ તેમનું મંતવ્ય.

પુત્ર ! ત્હારી વાત સમજાય તેવી છે. છોડેકી વસ્તુએ પર રંજ-માત્ર મમતવ ન થવા હેવું એનું નામજ સાચો વેરાય. વાતમાં તેમણે મને પણ છશારો કરી દીધો એ જ. હું પણ આ રાજ્ય ચિંતાથી અને સંસારની લીકાઓથી કંડિ આવ્યો છું. તું ભાર ઉપાડી લે કે હું પણ આત્મશ્રેયના પંથે પળવાની તૈયારી કરે.

પિતાજ ! આપ શા માટે ઉતાવળ કરો છો ? ચંપામાં પ્રવેશ કરીએ થોડો સમય સાથે રહીએ. મને અનુભવ મળે. વળી હું કંચન-પુરમાં જઈ અંહોઅસ્ત કરી આવુ. પછી તમો નિરાંતે ચારિત્ર અછણુ કરનો. હું આડંઅર પૂર્વે એ કિયા કરાનીશ.

ના, દીકરા ! એવા લાંઘા વિલંબમાં હું પડનાર નથીજ. ત્હારી માતાના વિરહથી મારં છદ્ય અધ્રું તો ભાંગી ગયું હતુંજ ત્યાં આ રહસ્ય મંત્રોના સંમાગમથી ધારિણી જેવું યોગ્યપાત્ર મળ્યું. થોડાંક વર્ષો સુખના ગયા. ત્યાં ભાગ્ય ઝદ્યું અને એ ચાલી ગઠ. ઠાલી દીકરી વસુમતીનું થું થયું એ હજુપણ જણાયું નથી. એ પંડી આવનાર અભયાએ તો હદજ કરી વળી છે. અંતરમાં પ્રગટેલ હુઃખ અહીં રહેવાથી શમજાનું નથીજ. ભગનહુદ્યા હું ચોગ્ય પાત્રની શોધમાંજ

હતો ત્યાં સહૃદાયે હડારા જેવા સુપુત્રનો ચોગ સાંપડ્યો. રાજ્ય ધૂરા સોંપી હું તો ચારિત્ર લઈશ.

હડાલા બાપુ ! જેમ સહૃદાયે વર્ષોથી વીસરાયેલી મારી માતાનો મેળાપ અચાનક થયો તેમ કદાચ મારી ભગીની વસુમતીનો મેળાપ કેમ નહીં થાય ? હું એની શાધ કરવામાં જરાપણ ખામી નહીં રાખું. ધરતીના ખૂણે ખૂણે માણુસો હોડાવીશ.

વત્સ ! જરૂર તું એ માટે યત્ન કરનો, પણ મને સંસારમાં રોકાનાનું જરા પણ મન નથી. હડારી માતાનો ધરારો મારા માટે નુક્તેચીનીરૂપ છે. કરાળકાળ ક્યારે છાપો મારશે એની કોને ખથર છે ? જે કરવું તો આજે કોણે, કાલે શી વાતો ' એ કવિ વચન સત્ય છે.

પિતા પુત્ર વચ્ચેના આ વાર્તાલાપ પછી કરકંદૂની છાવણીમાંથી અધિકારી વર્ગ આવતાં જ, એમાંના પ્રધાનને કંચનપુર સખાંધી ભલા-મણુ કરી બાકીના સર્વ રાજ્યાની ચંપા તરફ કૂચકદમ્બ કરતા આગળ વધલા લાગ્યા.

આ સમાચાર ચંપાની ગ્રનને ખોણ્યતાં જ ત્યાં અનેરો. આનંદ વર્તી રહ્યો. ચુંદનો ભય નાશ પામ્યો હતો. રાણી પદ્માવતીનો લેટો રાજ્ય વીને થયો હતો. એ જેમ હર્ષનો વિષય હતો. એ સાથે ભાવિ જાહી વારસ: ચુવરાજ કરકંદૂના દર્શનનો લાભ મળવાનો હતો; જે એમાં અધિક ઉમેરો. કરતો હતો. સર્વત્ર સામૈયાની તૈયારીઓ ચાલી રહી હતી. સારાયે નગરને આમ જનસમૂહે હૃદયના ઉમળકાથી બિન્ન ચિન્ન પ્રકારે શાખ-અખું હતું.

આનંદ પ્રમોદના દિનો વહી જતાં વિલંબ નથી થતો. ભાવ-ભીનો પ્રવેશ થયો. અલ્પ કાળમાં રાજ્યની કરકંદૂને રાજ્યાલિપેક કરવાની જહેરાત કરવામાં આવી. ઉચિત વિધિ સહિત એ કાર્ય આરોપાયું અને બીજોજ દિવસે ભૂપ દૃધિવાહન સંસાર છોડી ચાલી.

નીકલ્યા. પુત્ર કરકંઈએ થોડો સમય થાંબી જવા આગહ કરવામાં કચાશ નહોતી રાખી. પ્રધાનજી અને યશપણે તો ખોળા પાથર્યાં હતા. રાજરતન સુર્દર્શન શેઠ ભાર મૂકી કર્યું હતું કે-'હું અમણું મહાવીર દેવ સંધ સ્થાપન કરે એની વાર જેઠ રહ્યો છું. આપણું ઉભય તેઓશ્રી પાસે સાથે જ સંયમ સ્વીકાર્યું.'

પણ જેના અંતરના તાર ઝણું અણી જોઈયા હોય તે થોબે કયાંથી? અંતરમાં એક જ નાદ જોડતો હૈ—

'સેહમયી પદ્માતો કલ્યાણું પથની પથિક બની ચૂકી. હવે તું શા કારણે થોબે? કોની રાહ જુએ છે? ખભો પણ રાજ્ય ભાર ઉપાડી શકે તેવો સમર્થ મળી ગયો. સત્ત્વર ચાલી નીકળ. યાદ કર 'કાળ મતંગજ કરે ઢોળિયો' એ વાક્ય. તેજ તુખારને ચાલુકનો ભાર ન હોય, માત્ર એવું હુલનજ બસ છે. સાચા પ્રેમીને પ્રેર્ભ્સીનો ધરશારો હતો. અને પોતે સ્વજન મળતાં થોબી ન હોતી. એ અચરણું હતી. 'કમ્બે શરા, ધર્મે શરા' એ ટંકશાળી વચન આવા વીરદ્વાઓને જ શોબે છે. લોગવી જણે અને જોગવી પણ જણે.

સાહિત્ય સાગરમાં આ પ્રકારના દષ્ટાંતર્ષપ મોતીઓ ડેટલાંયે લયોં છે. અરિષ્ટ નેમીશરના કુવલ્ય સમાચાર કર્ણ્યુપટ પર અથડાતાં જ દિવ્ય પ્રેમી રાજેમતી ધડીભર થોબી હતી ખરી?

વિધાતાએ પણ ભારે કરી. ભૂપ દખિવાહન આગાર ત્યજ જયાના ત્રીજે દ્વિતી સમાચાર મહ્યા કે ધારિણીની પુત્રી વસુમતી તો કૌશા-અભીમાં છે. ધનાવણ નામા શેઠને ત્યાં એ રહે છે અને નામ ચંદ્નાભાળા 'પડ્યું' છે.

કુઃખ અને સુખ પોતાની પરંપરા લઈને આવે છે એ સાચું છે. ચમતકાર પર ચમતકાર જેવા બનાવો અની ગયા.

પાકા પાયે વાત આવી કે-'અમણું મહાવીર દેવનું પારણું ચંદ્નભાળાના હાથે જ થયું. સોનીયાની વૃષ્ટિ થઈ.'



પ્રકરણ ૧૯ મુ

કૌશાળીમાં ભગવાન

વસુમતી ધનાવહ શેડના ધરમાં પોતાની હંડી પ્રકૃતિ અને હસમુખા સ્વભાવના જોડે સૌ ક્રાઇનું પ્રિયપાત્ર થઈ પડી હતી. ભાત્ર શેડ કે મૂલ્યા શેઠાણી જ નહીં પણ દાસ દાસી વર્ગનો ચાહ પણ સંપૂર્ણ-પણે મેળવી શકી હતી. તેણી ઝાંઝું ખાડાર જતી નહીં. તેમ કોઈ વાર પોતાના પૂર્વ જીવનને ઉકેલતી નહીં. ધરનાં નાનાં મોટાં કામો તેણીએ ઉપાડી લીધાં હતાં એટલું જ નહીં પણ દાસ દાસીની જેર-હાજરીમાં તેમનાં કામો પણ એ કરી લેતી. એમાંથી પરવારતી ત્યારે કુથાં તો જ્ઞાનજ્ઞનમાં મન પરોવતી અથવા તો સામાયિક ગ્રહણ કરી સ્વાધ્યાય કરતી.

તરણું અવસ્થાના આંગણે આવી ઉભેલી વસુમતીને માટે ધનાવહ શહેને મુરતીયે. શોધવાનો એક વાર વિચાર ઉદ્ભવેલો. તેમણે એ વાત મૂલ્યા શેઠાણીને કહેલી પણ ખરી. લનજાથી જેનો યહેરો સદા નમતા દશ્વીવતો. અને જેનું વચ્ચ ભાવ પ્રહેશની છદમાં કંઈક નમતું રહેતું એવી વસુમતીએ શેઠાણી મુખે એ જાણ્યું ત્યારે કહેલું કે—

માતાજી ! તમારે એ સંબંધી કંઈજ ચિંતા કરવી નહીં. મારા પિતાશીને પણ તમો કષી હેઠે કે મારા માટે વર શોધવાની જરૂર નથી. લઘુ અંથીથી જોડાઈ સંસારમાં પડવાની મારી છયછા જ નથી. કું તો કરુંબહેવની પુત્રીએ થાલી—સુંદરી માઝક કુંવારી રહી, યોગ્ય સમયે ભાગવતી દીક્ષા લેવાની અભિલાષા ખરાવું છું. એ કારણુથી ‘ચંદ્રનાળા’ તરફે ઓળખાવામાં મને આનંદ પડે છે. એ નામે મારા જૌરવામાં વૃદ્ધિ કરી છે અને હું અને યર્થાર્થ કરી દેખાવવાના વિચારની છું.

ધર્મિષ્ટ શેઠના કાને આ સમાચાર પહોંચ્યા ત્યારે એમને હર્ષ થયો. એટલું જ નહીં પણ એ બોલેલા કે—

“ ખૂર્ણના પુણ્ય બોઝે જ આવી તરણી પુત્રી ઇપે પ્રાપ્ત થઈ છે. જરૂર એ ડોઈ કુલિન ધરણું સંતાન તે. છે જ પણ સાથે સાથે પૂર્વ ભવના સંસ્કારવાળું રમણી રતન છે. એ વિના આવી યુવાન વયમાં સંયમના પરિણામ ન જ ઉદ્ભવે. ભવિષ્યમાં સાચે જ એ નામ કહાશે. ”

સમયની અતિ અરખલિત પણે વહેતી આગળ ચાલી. એકદા કૌશામ્ભીના આંખણે પરિષહ ને ઉપસર્ગ સહન કરતા શ્રી વર્ધમાન સ્વામીનાં પગલાં થયાં. એ મહાત્મા કર્મપુંજને જળાદવા જત જાતના તપો આચરતા અને જીર્મિ ઉદ્ભવતા, આશ્ર્ય પમાડે એવા અભિગ્રહ અહણું કરતા. એમણે આ વેળા એવો અભિગ્રહ લીધો હતો. કે—

ન્યાં સુધી એકાદી રાજપુત્રી, દાસીપણાને પામેલી, વળી પગે એડીએના બ્રહ્મનવાળી, માસું મૂંડાવેલી, ઉંખરમાં એઠેલી, સુપડાના ઘૂસુામાં અદડ બાંદેલા—આકલા—હાથમાં રાખી કોઈ અતિથિની રાહ જોતી, આંખમાં આંસુવાળી પારણું કરાવવા તત્પર ન થાય ત્યાં સુધી ચારે ઉપસાહમાં જ રહેલું.

સ્વામી ગૌયરી ટાણે જુદા જુદા લતામાં અમણુ કરતા, પણ તેમના સંકદ્યપ્રમાણે સામની મળતી નહો. પરણું કર્યા વિના પાછા ફરતા અને તપ વૃદ્ધિના આંકડાં ઉમેરો થતો.

લિચ્છવી જતિના આ કુળદીપકને હજુ કેવલ્ય દશા પ્રાપ્ત નહોતી થઈ છતાં એમનો ઉપાસક વર્ગ નાનો સૂનો નહોતો. ચેટક જ્યું જેવા પ્રતિભા સંપન્ન ગણું નાયદની ભગ્નિની ત્રિશક્તા ટેવીના મુત્ર શ્રી વર્ધમાન કુંવર એટલે વેશાલીની જનતાનો અતિ મોટો ભાગ તેમની તરફ અહુ માનની નજરે જેતો હતો. વળો ત્રિશક્તા માતાના ચૌદ સ્વસ્પન્નતી વાત જહેર હતી એટલે કેદુલાક રાજ્યાંચો. કુંવર ચક્રવર્તી થશે એ આશાથી, જ્યારે અન્ય રાજુઓ તીર્થુંકર પદ્ધતી પામશે એમ સમજુ ભક્તિથી, તેમની તરફ ટેલેવા હતા. કૌશામ્ભી પતિ શતાનિક, તેમની ભગ્નિની જ્યાંતી અને રાણી મૃગાવતી તો ખાસ ગણુના યોગ્ય ઉપાસક લેખાય. સુયુપ્ત અમાત્ય અને વેની પતિનિ ન'દા તો ચુસ્ત ભક્તોમાં લેખાય. યથા રાજ તથા પ્રણ એ ધોરણે કૌશામ્ભીની જનતા પણ અમણુ મહાનીર યાને શ્રી વર્ધમાન સ્વામી પ્રત્યે આદ્રવણી હતી.

ન્યાં ન્યાં તેઓશ્રીનાં પમલાં થતાં ત્યાં ત્યાં ભક્તિપૂર્વક નરનારી સામે આવતાં, જતજતના પદાર્થો રજુ કરતાં. પણ આ મહાતમા તો કંઈ પણ લીધા વિના પાછા ફરતા. આથી ઉપાસક વર્ગની નાશીપારી નો પાર ન રહેતો. અભિગ્રહ હશે એમ સમજતાં પણ તેવા પ્રકારનો હશે એ ન જણુતાં હોવાથી એનો અંત કચારે આવશે અને પારણું કયારે કરશે એ પ્રભુ સૌ કોઠને મૂંજવતો. રાણી મૃગાવતીએ, તો એક કરતાં અધિકવાર સ્વામી એવા શતાનિકને છોધપણ રીતે તીર્થુંકરનો અભિગ્રહ કળવાનો આગ્રહ કરેલો. આવી વિશાળ નગરીમાં મહન્તને છુચિત બિક્ષા ન મળે એ ઓછા લાંઘની વાત લેખાય!

એક દિવસ ધનાવહ રોહને કામમાંથી પાછા ફરતાં રાજ કરતાં વધુ વિલંબ થયો. મધ્યાન્હ વીતી જ્યા ને લગ્નલગ્ન ઘટિકા જેટલો

સમય થતા આવેલું ધરમાં પ્રવેશ્યા ત્યારે તેમના પગ ધોવડાવનાર નોકર હાજર નહોંતો. બોજન વેળા વીતી જતી હોકાથી ઉતાવળ પણ ઓછી નહોંતી. આ રિથિતિ પામી જઈ તરતજ ચંદ્ના હાથમાં પાણીને કળણશિયો લઈ, માથું ઓળખું પડતું મેલી દોડી આવી. વાંઢી વળી શેઠના પગ ઉપર પાણી રેડતાં, અધૂરો કેશકલાપ એકદમ નીચે લથડવા માંડ્યો. લાંબા, કાળા, ચળકતા વળ જમીન પર પથરાઈ મલિન ન થાય એ આશયથી શેડ પોતાના હસ્ત વડે પકડી લઈ, માથા તરફ ધરી રહ્યા. રસવતી ગૃહમાં એઠેલી મૂળા શેડાણીએ આ દશ્ય દૂરથી જીયું. એ પાછળનો આશય સમજ્યા વિના—એ સમયની પરિરિથિતિ વિચાર્યા વિના—તેણીએ એમાંથી તહેન વિચિત્ર આશય તારવ્યો.

માનવ ભગવાનમાં વહેમનું ભૂત અસ્ત્રાર થાય છે ત્યારે એ ભાન ભૂલાવી સામાન્ય ઘુંઘિનું પણ દેવાળું કઢાવે છે. એમાં પણ આ જનતના વહેમોએ નારીવર્ગમાં અસ્યા—અશાનિત અને ઉત્પાત જનમાંબ્યામાં કુચાશ નથી રાખ્યો. સુખ અને શાન્તિ ભર્યા, સ્નેહ અને ભમતા ભર્યા, આનંદ અને પ્રમોદ પૂર્ણ—સારમાં ભયંકર હુતાશની પ્રગટાવી એ સર્વનો જોતનોતામાં સર્વનાશ નોતર્યો છે.

આ વહેમના વમળમાં અટવાઈ જતાં પુરુષ વર્ગ તો હદ કરી દીધી છે ! એ વેળા સાન—ભાન ભૂલીને જે કાર્યો સરળ્યાં છે એ બચાવ ન થઈ શકે તેવાં છે.

સખી સમૂહમાં સ્વાભાવિક રીતે વાત કરનાર સુંદરી અંજનાના વાક્યને પકડી લઈ, પરણ્યાની પહેલી રાત્રે જ ત્યા દેનાર પવનભ્ય-કુમારમાં એ વહેમનું જ ભૂત ભરાયું હતું ને ! કળાવતીનાં કંડાં કપાવનાર શંખ રાજ્યાની રણ એજ રીતે ભાન ભૂલેલા અને આજે પણ જેમના પશોગાન ગવાય છે એવા શ્રીરામ પણ સતી સીતા જેવીને અભિષ્ટી અવસ્થામાં વગડે મોકલવામાં વહેમના કોગ બન્યા હવાજ ને !

વહેમર્ગ્યે ચુંદેલે આવા તો કૈ કૈ વેશ ભજવ્યા છે અને પોતાના પંજમાં રાજ-મહારાજ, પતિ-પતિન, સપત્નીએ અને સાસુ-વહુએ આદિ જતજાતના માનવોને ફસાવ્યા છે.

શેડપતિન મૂળા ભાન ભૂલે એમાં નવાઈ શી ! તેણીએ કલ્પી લીધું કે સ્વામીનું આ કાર્ય મારા પ્રત્યેનો અભાવ અને ચંદના તરફનો સહભાવ સ્થયને છે. હું ગ્રૌદથવાથી એમના હૃદયથી જિતરી ગાંધ છું. અને આ તરુણીએ પોતાના પ્રભાવથી એમનું મન પૂર્ણ પણે આકર્ષી લીધું છે. જતાં દિવસે એ મારી સપત્નિ-શોક્ય-બની એસે તો ના ન કહેવાય ! ચોટવાની લટને સ્પર્શ કરવો કિંવા એને ધારણ કરી રાખવો એ સ્નેહ વિના ન જ સંભવી શકે.

વહેમના આ તરંગે ધનાવહ શેડના શાંતિમ પ્રાસાદમાં ભયંકર દૂધી આગ પ્રગટાવી. મૂળા આખરે તો વણિક નારી એટલે એણે નિરધાર કર્યો કે—

ગેગતા શત્રુ અને વધતા દોળને જડ મૂળથી ઉભેડવા સાહ અયતનશીળ રહેવું. આ વાતની જાઝી હો હા કર્યા વગર ખારા પાણીએ ખસ જય એવી યુક્તિ લડાવવી.

એકદા તેણીને જેઠતી તક ગળી ગાંધ. શેડ કામ પ્રસંગે નજીકના ગામે ગયા. એમનું પાછા ફરવાનું તરતમાં ન થવાનું હોવાથી જેરહાજરનો લાલ લઈ, નાપિકને બોલાવી ચંદનાનું માથું તેણીએ મુંડાવી નાંખ્યું અને લુહારને બોલાવી, એના પગે બેડીએ જડાવી, આવાસના એક અંધારા ઓરડામાં પૂરી દીધી. આ કાર્ય એટલી સિક્કાથી કર્યું અને એવો એકાંત સમય સાધીને પાર પાડ્યું કે ધરના મેાકર વર્ગને એની કંધ જ ખબર ન પડી. માત્ર એક વૃષ્ટ દાસીને શેહારીની આ ચાલખાળની થોડી અંધ આવી. પોતાના ઉપર શેઠને શંકા ન આવે એ હેતુ ધ્યાનમાં લઈ પોતે પિયર ચાલી ગાંધ !

ઓરડામાં પૂરાયેલ ચંદ્ના ભાગી શકે તેમ તો હતું જ નહીં. એમાં ભૂખે તરસે રીખાવાનું! પણ કષ્ટોની ઝડીઓ વચ્ચેથી પસાર થનાર આ ખાળા રાજ બીજ હોવાથી આ દુઃખ પડતાં ન તો અભરાઈ ગઈ કે ન તો છાતી માથા ફૂટવા લાગી. પોતાના પૂર્વ કર્મની અવળ ચંડાઈ ગણી, સમતાથી એ વેદી રહી અને વિકટ ઉપસર્ગોમાંથી ખ્યાવનાર ચમત્કારિક એવા અદુમ તપનું શરણ લીધું. નાગકેતુનો ખનાવ એના સ્વાધ્યાય વેળાના વાચનમાં તાંને જ આવ્યો હતો. વળા શ્રી પાર્શ્વનાથ પ્રલુની પરંપરામાં વિચરતા પૂજય શ્રી કેશી મહારાજની મીઠી વાણી શ્રવણ કરવાનો યોગ, પૂર્વ ચંપામાં અને અહીં કૌશામ્યી-માં એને મળ્યો હતો.

મનમાં મૂળા માતા પ્રતિ જરા પણ દેષ ન આણુતા એને નિમિત્ત રૂપ લેખી, અત્યારની પોતાની આ દરા પૂર્વ કરણીના કણ રૂપે જ પ્રાપ્ત થઈ છે એમ માની, એ કર્મરોગને ટાળવામાં રામભાણ સમા તપનો સધિયારો લેવો વ્યાજખી લાગ્યો. જે દૂર, અરે માત્ર દૂર જ નહીં પણ દુરારાધ્ય હોય છે તે સર્વ તપના ઓહે હાથવેંતમાં થઈ જથું છે અને નિકાયિત એવા કર્મને પણ પદ્ધતી પાતળા પાડવાનું જેનામાં સામર્થ્ય છે એવા તપમાં પૂર્ણ અદ્ધારી એક તાર અની.

મજખૂત મનવાળી ચંદ્નાને ત્રણ દ્વિના ઉપવાસ પૂરા થયા. એની અસર માંસ લોહીની કાયા ઉપર ન થાય એ અસંભવિત હતું. એમાં ઉમેરો કરતું બંધિયાર જીવન અને અંધકાર ઓરડો સહાયક બન્યા. પણ ચોથા દ્વિના પ્રાતઃકાળે આવશ્યક કિયાનેણા રોજની માફક તપ કરણી તરફ મન ન વળતાં સહજ પારણાનો વિચાર આવ્યો. પણ મનના ભણુકા આ ડેઢભાનામાં ઓછા જ કારગત નીવડે તેવા હતા. પુનઃતેણીએ પૂર્વ થઈ જયેલા સતીઆ આત્માઓનાં દષ્ટાન્ત યાદ કરવા માંડ્યાં. એમાં કેટલો કાળ વ્યતીત થયો. એનું ભાન પણ ન રહ્યું.

એકા એક બહારના ભાગે થતાં ખડખડાઈ અને હાકોટાથી એ જગૃત બની. જાળવાની નિશ્ચાસથી એ કમાડ પાસે પહોંચી તો નીચેના શખ્દો એના કાને અથડાયા—

“ અરે કમલા ડોશી, તમો પણ આટલી હુદે એદરકાર રહ્યા ! તમારા કહેવા મુજબ શેહાણી પિયેર એકલા જ મયા છે તો ચંદ્ના જય કયાં ? બીજા તોકરો તો અમારી હાજરીના અભાવે સર્ગે વગે અહાલવા નીકળી પડ્યા; પણ તમારે તો એ પ્રકારનું કોઈ વળગણું નથી. તમો કાને હાથ દ્વો એ પાછળ જરૂર કંઈ લેદ જણાય છે,

“ કોઈની પણ ધાર્તી રાખ્યા વિના ને સાચું હોય તે કહી નાખો. શેહાણીને આટલા વષોમાં હું ગામાંતરે મયો. ત્યારેજ પિયેર સાંભર્યું એ પણ અજયેણીને ! મને માર્જનો ઓછો થાક નથી ચંદ્યો ! વળી મર્યાન્દ પણ થવા આવ્યા છે અને ઉકળાટ વધી રહ્યો છે છતાં મારી દીકરી ચંદ્નાની ભાળ લીધા વગર જરાપણ મને ચેન પડનાર નથી. એના હસતાં મુખડા વિના, અને ચોતરકી પડતાં પગલાં વિના આ આવાસ મને તૂં ઉજગડ જણાય છે.”

માલિક ! હું જાળું તો જણુતી નથી. હા એટલી ખમર છે કે કારણ ગમે તો હો પણ ખુદ શેહાણીએ ચંદ્નાનું માથું બોડાવી નાખ્યું અને પગે બેહીએ જડાવા. મને કંઈ કામે બજરમાં મોકલી દીધી. હું પાણી આવી ત્યારે તે પેકા ઓરડાને તાળું દ્રદ્ધ રહ્યા હતા. એ કાર્ય પતાવી બહાર નીકળતાં બોલ્યા કે—

કમળાડોશી, ધરની તપાસ રાખજો. એ તાળું કોઈ ખોલે નહીં એ ઘ્યાનમાં રાખજો. હું થોડા દિન માટે પિયર જઉં છું.

હું વધુ કંઈ પુછું તે પ્રેર્ણેતો રથમાં બેસી પસાર થઈ ગયા. આ સાંભળતાંજ યુદ્ધનિધાન શેઠ ચોંકી ઉઠ્યા. મનમાં કંઈ ગણ્યતી જણી લીધી અને બોલી ઉઠ્યા.—

તોશી ! રસોડામાંથી ખાંડવાનો પેલા દસ્તો લાવો તો !

ન્યાં દસ્તો હાથમાં આવ્યો કે અટ ઓરડા પર મારેલા તાજા પર એ જેવા જેરથી ધયકાર્યો કે એના ત્રીજા ધારે તાળાનાં બે ઇડસીઓં જુદાં થઈ જયાં. સાંકળ ઉઘાડી ઓરડો ખુલો કરતાં જ વનાવહ શેહથી બોલી જવાયું.

અરરર ! દીકરી, તારી આ દશા ! અને એ કરનાર મારી પત્તી ! એનામાં અસ્યું કે વહેમનું ભૂત ભરાઈ બેડેલું દેખાય છે. તે વિના આવું સાહસ એ વૈશ્ય નારી ન કરી નાંબે ! એ પાછળ સત્ત્યનો અંશ હોત તો થા સાડ ભાગી જત ! એ હીન ડદ્યાનું સુખ જેવા હું પૂછું હોતો નથી !

કમલાડોશી ! મારી પુણ્યથી પણ કોમળ એવી આ ભાળાના જિરે આવું સંકટ ઉત્તરનાર એ નારીને ધરમાં પગ મૂકવા દેશો નહિ.

આપુ ! આવેગમાં આવી જમે તેવી આજા આપવી આપને ન શોભે. એ તો નિભિત માત્ર છે. સાચા દોષભાગી તો મારા પૂર્વનાં કુમેજ છે. એમના વહેમને હું ટાળીશ, ને આ ધરમાં તેમના વિના હું ધરીભર ન રહી શકું માટે પાછા બોલાવી આણીશ.

જવાદો એ વાત. ડોશી, કંધ રાંધેલો ખોરાક હોય તો તમો લાવો. મારી આ દીકરીના પેટના ખાડાને સૌ પ્રથમ પૂરવાની જરૂર છે. તેને ઉથરા આગળ એસાડી એડીઓ તોડાવવા સાડ હું લુહારને બોલાવવા જરૂર હું.

ધરમાં ડોશી એકલા હેઠાથી અને શેહનું આવવાનું નિશ્ચિત ન હેઠાથી રસોઈધરમ સાતડે ત જેવી દશા હતી. અસ્યપાલકે ધોઝ સાડ અડદ બાઇલા હતા એમાંથા. તી ખ્પ પૂરતા એક સુપડામાં લાવી. ન્યાં એ સુપડું ચંદનના હાથમાં મુકે છે ત્યાં તેણું ચંદનાને સહન/ વિચાર સ્ફૂર્યો.

ત્રણ દ્વિસની પોતે ભૂખી હતી એ વાત ઐથી નહોતી. પણ સાથે જે વાત પણ હતી કે ગોને સમજુને અઠમ તપ કર્યો હતો. આવા પવિત્ર તપના પારણે એકાદ સંતના પાત્રમાં આ બાકણા વહોરાયા પછીજ આરોગ્ય તો એ રોલા રૂપદ અને ઉન્નતિ કારી બણાય. એમ વિચારી માર્ગ તરફ એ દષ્ટિ ઝેંકી રહી.

‘મન ચંગા તો કથોટમાં ગંગા’ એ ઉકિત અનુભવની છે. અહનીંશ ગોચરી અર્થે કરતા જ્ઞાતપુત્ર શ્રી મહાવીર આ તરફ જ આવી રહ્યા હતા.

એમને જેતાં જ ચંદ્રનાના રોમરાય ખડાં થયાં. ‘યાદૃદી માયના તાદૃદી સિદ્ધિ’ જેવા સૂત કરતાં પણ અહીંતો વધુ લાભ સામે તરી રહ્યો! સામાન્ય સંતના સ્થાને ચરમ તીર્થપતિના પગલાં. ભૂખ-તરશ અને બેણીના બંધનનું દુઃખ ભૂલીને તે હરખાઈ જીણી!

ઓલી ગઈ, દેવ પધારો.

આહા! અદ્રમાતિક વિચારે ગ્રહણ કરેલ અભિગ્રહ લગભગ ઝ્ણા રહ્યો છે. ભગવાન તુલના કરતાં જ એમાં એક ઊણપ જોઈ દે છે. સૌ વાતની સરખાઈ છતાં, પોતાની કલ્પનામાં આંખમાં આંસુ હતાં જ્યારે અહીં તો નેત્રો આનંદ્યી નાચી રહ્યાં છે.

, એટલી નાનકડી ઊણપ ન ચલાલી લેવાય એ વિચારે તરતજ ગ્રખ પાછા વળવા માંડે છે.

પૂરુ વળતી જેતાંજ ચંદ્રનાને ભયંકર દુઃખ ઉદ્ભવે છે. આંગણે આવેલ કલ્પતર સમ ભગવાન કંઈપણ લીધા નગર પાછા કરે એ તો દાડણ અભાગીપણાની નિશાની! તરતજ આંખમાંથી આવુણુ-ભાદ્રવા માઝક અશ્રુબિંદુએ છૂટવા માંડે છે અને સુખનો પોકાર પણ એમાં સાથ પૂરે છે.

ભગવંત ! આ હુઃખિની પર કૃપા કરો. મારી પાસે જે કંઈ ખરવા જેવો પદાર્થ છે તે સ્વીકારો. અને મને અભાગીણીને સુપાત્ર દાન દેવાની તક આપો. મારા આહાર સામે ન જેતાં એ પાછળના ભાવને નિહાળો.

અમણું ભગવાન મહાવીરના અભિગ્રહમાં જે ચીજની ન્યૂનતા રહેતી હતી તે આ રીતે પૂરી થતાં જ તેઓશ્રી દાર આગળ આવ્યા અને આકદા અહણું કરવા હાથ એકદા કર્યા. દાનનું વર્ણન કરતાં નીતિકાર જણ્ણાવે છે કે.

આનંદા શ્રુણી, રોમાંચ, બહુમાનः પ્રિયં વચ્ચઃ ।
તथાનુ મોદના પાત્રે, દાન ભૂષણ પંચકમ् ॥

અર્થાત્, દેતી વેળા આંખમાં આનંદાશ્રુ હોય દેહ પરની રોમાંચિ વિકલ્પર થઈ હોય, બહુમાન પૂર્વક આપવાની ડિયા થતી હોય; વળી દાતુની વાણી માડી હોય, અને પાત્રની ઉચ્ચિત પ્રશાંસા હોય, તો એ પાંચ રીતનું દાન ઉત્તમોત્તમંગણાય છે. અહીં તો અહભૂત યોગ ઉપરની સ્થિતિ ઉપરાંત જામ્યો હતો. જગત વંદ્ય પ્રલુબ લેનાર અને બાળ અલયારિણી તેમજ અદૃમ જેવા પવિત્ર તપને કરવાવાલી કુમારિકા દેનાર. વળી આહાર પણ ઉલયમાંથી ઢોઠના નિમિત્ત વિના તૈયાર કરાયેલ. આવો અપૂર્વ પ્રસંગ કોઈ ભાયવંતનાં જ નસીઅમાં આલેખાયેલો હોય છે.

ચંદ્નાળા સાચે જ મહાભાગા હતી દાન દેવા હાથ લંબાવતાં જ પગનાં અંધન તૂટી જયાં. પગનો એડાઓ ઝાંઝર રૂપે અને કર પરની બંંગડીઓ કંદણ રૂપે પરિણુભી-મરતક પણ ચંદ્યક્તિ ને શેલિતા કેશથી ખીલી ડિક્યું !

આ સમયે આકાશમાં હુંહુભિના નાદ સંભળાવા માંડચા. રમ્ય વાંદો અને સુખંધી જળની વૃષ્ટિ તેમજ સોનૈયાની વૃષ્ટિ દેવો કરવા

લાગ્યા. ‘અહો દાન, અહો દાન.’ એવે ધ્વનિ વાતાવરણને ભરી હોતો હજરોના આકર્ષણુઽપ અન્યો.

‘ભગવંત ક્યારે પારણું કરે ! એવી ચિંતા સેવતા નૃપ શતાનિક, રાણી મૃગાવતી આદિને આ સમાયાર પહોંચતાં જ તેઓ દોડી આવ્યા. પુરજનોનો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા. લુહારને લઈ પાછા ફરતા ધનાવહ શોહ તો પોતાના ધર આંગળે આવું અનુપમ દર્શય નિહાળી, હર્ષથી નાચી જિહ્વા.

રાજ્યના સૈનિકો સેનીયા એકઠા કરવાનો આરંભ કરવા માટે ત્યાં હૈવી વાણી સંભળાઈ.

“ એ સધળા ધન ઉપર તો શોહ ધનાવહનું સ્વામીત્વ પહોંચે છે. એનો ઉપરોક્ત તો નયારે આ વસુમતી ભગવંતના શાસનમાં પ્રથમા સાધ્વી થવા ઇપ દીક્ષા અંગીકાર કરશે ત્યારે થવાનો છે.”

મૃગાવતી—ભગવંત ! આ ચંદ્રના તો મહા ભાગ્યશાળી બાળા—જણાય છે. અમો તો એણિ ગૃહે ઘરીદાખ આવેલી એ કોઈ સામાન્ય કુદુંખની દુખ્યારી બાળિક ! છે એમ સમજતા હતા. પણ આ તો ચતુર્વિંદ્સ સંધમાં સુખ્ય ગણ્યાતા એક અંગ સમ છે. તેણીએ ભારે કરી ! બાક્લા વહેરાની આપ સરખાને પણ શરમમાં નાંખ્યા !

ના, એવું કંદ્ચ જ નથી. આત્મ એપના નેમ ધજરા નથી, તેમ ત્યાં નથી તો દાક્ષિણ્ય કે શરમા શરમી ! ચંદ્રના, કોઈ સામાન્ય ધરતી બાળા નથી. એ તો રાજકુમારિકા છે અને ત્હારી ભાણુ જ છે.

અહો ! આ વળા નવી વાત ! વષોંથી મારા નભરમાં રહેનાર, મારી ઝેનની દિક્કરીને હું એણખી પણ ન શકું ! એ તે કેવી વાત !

ભગવંત ! આપ પોતે જ એ સખંધ સમજાવો.

સાંભળો, કૌશાખ્યિન ! અચાનક હુલ્લા વેળા ફંખિવાહન ભાર્યાં

ધારિણી અને વસુમતીનું હરણ થયાની વાત તો સુચિદિત છે. સ્વશીયલ રક્ષણાથે ધારિણીએ અપધાત કર્યો અને એની આ પુત્રીને ધનાવહ શેડે વિકયના બજારમાંથી ઘરીટી ચંદ્ના નામ એમણે જ પાડેલું છે. દ્વિવાહન અને ધારિણીનું આ સંતાન બાળપણથી જ ઉત્તમ સંરક્ષારાન્વીત છે અને અસાધારણ પરાક્રમ ધરાવે છે. ‘મા તેવી એટી’ નેવી ઉક્તિ એને અક્ષરચઃ લાગુ પડે છે. નેમ ધારિણી કોઈથી ગાંઝ લય તૈમ ન હોતી તેમ આ વસુમતી પણ શરી ક્ષત્રિયાણી છે. એનો પ્રભાવ જોઈને હરણ કરી જનાર તમારો નાયક હેઠતાઈ ગયો અને અન્ય કોઈ લાલચમાં ન પડતાં એને વેચી માત્ર ધનગાડે ખાંધી દેશ છાડી ગયો.

પદ્માવતી લારી બહેન અને ધારિણી એની રોક્ય. એટલે એ પણ બહેન જણાય. તેથી તું ચંદ્નાની માસી લેખાય. બનાવ એવી રીતે અન્યા છે કે જાની વિના એના અંકોડા કોઈ છિંદ્રસ્થથી ન મેળવાય. ‘કર્મની ગતિ વિચિત્ર કહેવાય છે એ સાચું જ છે.’ જનસમૂહના કાન પર ફેટલીક વાતો સાથં દે પ્રકાશ પડતાં વર્ષોનાં વર્ષો વહી લય છે.

રાણી ! તને એ અભર પણ મળવાની તૈયારીમાં છે કે ચંપાપતિ દ્વિવાહન ને પ્રેયસી પદ્માવતીનો સાખી વેક્ષમાં મેળાપ થયો અને આત્મસાધન કરવાનો સંદેશ પણ મળ્યો. કંચનપુરના રાજ કરકંદૂ એનું એમનો પુત્ર. ચંપાપતિએ કરકંદૂને જાહીએ એસાડી સંયમ પણ સ્વીકાર્યો.

દ્વિવાહન પદ્માવતી-ધારિણી અને આ વસુમતી તેમ રાજવી કર-

કંડૂ એ ખાંચે એવા પ્રભાવશાળી આત્માએ છે કે જેમનાં જીવન વર્ષોનુંથી આમ જનસમૂહને પ્રેરણુદાયી નિવડવાનાં.

ચંદનથાળા, મારા શાસનની પ્રથમા સાધીજ નહીં, પણ મુખ્ય પ્રવર્તિની બનવાની. નાની છતાં જ્ઞાન જરિમામાં વધી જઈ, મોખરે રહેવાની. અરે તહારા માટે પણ ઉપકારી થવાની.

સમજણું હેઠે મુદ્દાની વાત કહી સંત તો સીધાવી જયા. શેહની રજ મેળવી માર્સીઓ પુત્રી ચંદનને થોડા લિન માટે પોતાને ત્યાં તેડી ગયાં.



પ્રકરણ ૨૦ મું કમળ સમ નિર્લેખ



કુદેવમાં પેદા થનાડાં અને જળથી વૃદ્ધિ પામનાડાં કમળ જેમ
શુદ્ધ રહી, સુવાસ ફેરવી, કાદ્વ અને જળ એ ઉભયની ટોચે આવી,
પાંખડીનો વિસ્તાર કરે છે. તેમ ભગવંતને પારણું કરાણી પછી વસુ-
મતીના દુઃખના દહ્યાડા પૂરા થઈ જયા અને સુખનો ભાતુ પૂર્ણ તેને
પ્રકાશી ઊઠ્યો. જાતે નિર્લેખ રહી સર્વત્ર અજવાળાં પાથયો.

અમણું ભગવાન મહાવીર હેવનો અભિગ્રહ છ માસમાં પાંચ દિનો
બાકી રહેતાં પૂર્ણ થયો. રાણી ભૃગુતીના પ્રશ્નમાં એમણે થોડામાં ધાર્યું
કહી દીધું. પછી તો સારી ડોશામ્ભીમાં ચંદ્ન બાળાની મહત્ત્તા જોર
શોરથી ગવાવા લાગી. નગરી સમીપના ગામમાં પિયેર ગયેલી મૂળા
શેદાણીના કાને પણ સમાચાર પહોંચ્યા. એની શરમ તો બેબુદ વર્ધી પડી.
ધર બહાર નીકળી મહેં દેખાડવા જેવી સ્થિતિ ન રહી. ત્યાં નમરીમાં
પાછા ડગ ભરવાની વાત કૃયાંધો સંભવે! ધનાવહ શેદને તો એની
તરફ તિરસ્કાર આશ્યો હતો. જે કે ચંદ્નાના કદ્યમાં કંઈ રોષ

નહેતો. છતાં એ હવે માસી જેઠે રાજ મહેલમાં રહેવા આવી હતી. જગતની આંખે એ સુખના શિખરે ઘેરી હતી. સંસારમાં રાજ્ય મહાલયના મન ગમતાં સુખે હાજર હતાં અને એ ત્યાગવાનો સમય આવતાં ચરમ તીર્થ કરનાં ચરણુની સેવા મળવાની હતી.

પણ ચંદ્રનાના અંતરમાં ચંપાનો મહેલ, માસીનો આવાસ કે પ્રભુ સેવા રૂપ ભાવિ સોણુલાં કરતાં, ધનાવહ શેહતું ધર અગ્રપદે હતું. કોઈ પણ ઉપાયે મૂલા માતાને તેડી લાવવાના અને પિતાના ધરને પૂર્વવત અનાવવાના એને કોડ હતા. એ તક જોઈ રહી હતી.

થોડા હિન પસાર થતાં જ મૃગાવતી રાણી પર ભાષેજ એવા કરંડુ રાજ્યનો સંદેશો લઈ હૂત આવી પહેંચ્યો. સંદેશામાં પ્રભુ કથિત પગાવતી અને હવિવાહન વાળી વાત હતી અને પોતાના તરફના પ્રણામ હતા. વિશેષમાં લગિની વસુમતીને તાકાદે પોતાના તરફથી આવનાર રસાલી સાથે ચંપા મોકલવાનું કહેલ્ય હતું.

માસીખાના સુખે ભાઈનો સંદેશો સાંભળતાં જ ચંદ્રનાનું કદમ્ય નાચી જિદ્યું. પ્યારી માતૃભૂમિને નિરખવાનું મન કોને ન થાય? સાચા માતા પિતાનો આશ્રય સુમાવી એઠેલી વસુમતીને ભાઈનો મેળાપ હેતીના રણમાં મીઠા પાણીની વીરડી સમ હતો. સાથે સાથ જવાનું નિમિત મળતાં પોતે જે તક શોધી રહી હતી તે મળો જવાનો. આનંદ પણ હતો. તૈયારી કરવાના મિશે એ ધનાવહ શેહને ધેર આવી પહેંચ્યી. બીજે જ દિવસે રથમાં એસી મૂલા શોડાણીના પિયરવાળા ગામે હોડી ગઈ.

ધર આંગણે રથની ધૂધરીએ સાંભળતાં જ મૂલા જ્યાં બહાર ડોક્યું કરે છે ત્યાં તો વસુમતીને રથમાંથી જિતરતી જોઈ. એને જોતાં જ મૂલાના મોતિયા મરી ગયા. ધરમાં દોડી જઈ એટકમાં પગ મૃકતાં જ એનાથી રડી દેવાયું. પોતે શું મોઢું બતાવે એ વિચારથી ઝદન કરતી

તેણીયે જિચુ સુખ કરવાની હિંમત જ ન કરી. ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું તેણીને મન થયું.

આવનાર ચંદના, સાચેજ ચંદન કરતાં પણ અધિક શીતળ હતી. રોષ કે વેર તો એનામાં લવ માત્ર હતાં જ નહીં. પોતાના હાથથી મૂળાનુ માથું જિચું કરતાં એ એલી.

માતુશ્રી! તમો શા સાડ આટલી હૃદે લળજવશ ઘનો છો? પુત્રોના વાંકે માતા શિક્ષા કરે છે એ પાછળ એંછો તેણીનો. આશય ખરાખ હોય છે. તમોએ જે પગલું લીધું એ મારી ભૂલ, અગર પ્રમાદ સુધારવા જ ને! માની લઈએ કે એમાં તમારી ઉતાવળ થઈ છે તે. પણ એથી મને જે અપૂર્વ લાલ પ્રાપ્ત થયો તે એટલો કિંમતી છે કે એની સરખા-મણીમાં તમારી ઉતાવળ તો લેખામાં પણ ન આવે. જંગમ કલ્પતર સમ ભગવાન જ્ઞાતપુત્રના કરમાં મારો આહાર પડે, એટલું જ નહીં પણ તેએ શ્રીમુખે મારા પૂર્વ જીવનની આમ જન સમૂહને ઝાંખી થાય અને એ ઉપરાંત નેત્રો સામે ઉજવળ ભાવિ ઝડું થાય એ સર્વનાં નિમિત્ત ડ્રપ તમે. જ છો.

માતા! જલ્દી તૈયાર થાઓ. મનમાં સંધરેલ વિપાદ ખંખેરી નાખો. અનતાનું બની ગયું. જઈ વાતનો શોક હેવો! ભૂતને ભૂલી જઈ વર્તમાન ને નજર સન્મુખ રાખી બાળ સુધારી લ્યો.

પુત્રી! તહારામાં નામ પ્રમાણે ગુણો ભરેલાં છે. રાજકુળમાં જન્મ્યા છતાં અભિમાનનો છાંટો નથી. મારા ગુન્હાની ઝંભીરતા એછી? નથી છતાં તું એ પહાડ સરખો હોય ન જેતાં એમાં પણ ઉપકારની મહત્ત્વ નિહાળે છે એ તહારા હૃદયની સરલતા અને નિષ્પાપ વૃત્તિને આભારી છે. હું પારિપણી વહેમના નશામાં ન કરતાનું કરી એફી. તહારા નસીબે ભલે એ શરીરનું વિધન સોયમાં પરિણમ્યું; પણ તેથી મર્રી જવાઅદારી

અને અસ્થુયા, અરે અવિચારીપણું ઓછા ટીકા પાત્ર ન ગણ્યાય. એ ધરમાં ક્યા મોઢે હું પગ મૂકું? સ્વામીના સામાન્ય કાર્યમાં ફૂષણ જોનાર અને શાંકા ધરનાર મને હવે એ ઘડીભર પણ સંધરે કે?

દીકરી! અરે ભૂલી, રાજકુમારી! મારો અપરાધ તું સાચા હૃદયથી માઝ કર. મારો આ પ્રશ્નાતાપ ઉપરછલ્લો નથી. પણ અંતરના ઊડાણુનો છે એની પ્રતિતી તું શેહળને કરાવજે અને મારા સરખી દોપિત પ્રત્યે વધુ નહીં તો તેમના હૃદયના એકાદા ખૂણુંમાં સ્થાન રાખે એટલી ગ્રાર્થના મારી વતી જરૂર કરને.

મારી! તમારા શબ્દોથી ભોળવાઈ આ ચંદ્રના પાછી કરવાની નથી જ. હું તો તમોને મારી સાથે રથમાં એસાડીને લઈ ગયા વિના રહેવાની નથી.

જ-મદાત્રી માતા કરતાં પણ તમારો ઉપકાર તો મારા પર અતિ ધંદો છે. સંકટ સમયે તમારો સધિયારો ન મળ્યો હોત તો આજે હું ભવસાગરની કર્છ ગર્તામાં ગબડતી હોત !

ચંપા નગરીના રમણીય રાજમહેલ કે ભાતા કરકંઈના રનેહ-સગપણ અગર કૌશામ્ભીના રાણી મૃગાવતી મારા માસીયાના સહવાસ કરતાં પણ મને તમારા ધરના ઓદડામાં વધુ મમત્વ છે. મારા જીવન ધડતરમાં અગ્રપદે ત્યાંનું વાતાવરણું ભાગ ભજવે છે.

માતાજી! ધનાવહ શેઠ દારા જ મારી દીક્ષાનો વરધોડો ચદરો અને એ પવિત્ર પંથ સ્વીકાર્યો પછી ધારણું કરવાનાં વચ્ચો તેમજ પાત્રોની છાય તમારે જ લેવાની છે. વિલંબ ન કરો અને સત્ત્વર તૈયાર થાવ.

તમો એ વાત કદાચ નહીં જણુંતા હો કે મારા રાજવી પિતાજી દૃષ્ટિધારુને સંયમ સ્વીકાર્યો છે અને તેમની પ્રથમા રાણી પુણ્યાવતીના-

પુત્ર કરકંદૂને ચંપાતું રાજ્ય સોંઘું છે. મારા એ વડિલ ભાતા કરકંદૂને હું કૌશામ્ભીમાં છું એવા સમાચાર મળવાથી તેમના તરફથી મને ત્યાં તેડી જવા સાહુ યશપાળ આદિ અધિકારી વર્ગ આવનાર છે. મને પણ મારા માદર વતન રૂપ અંગરેખને જેવાના ડેડ છે. ખાસ રેણ્ણી વર્ગમાં ગુરુ રથાન કહું કે વડિલ તરફે ઓળખાવું તે મારા એ મોટાભાઈ કરકંદૂને મળવાની, અરે એ ભાંડુ સાથે વાતો કરવાની-અભિવ્યક્તિ પણ છે જ. પાલક પિતા એવા ધનાવહ શેઠની સરભરા તમારા કે મારા વિના સાચવે તેવું ધરમાં ડોણું છે ?

આ પરિસ્થિતિનો ખ્યાલ કરી, જણે કંઈ જ અન્યું નથી એમ માની લઈ, સત્ત્વર અહોથી ઉપડવાની તૈયારી કરે.

ચંદ્નાની મીઠી વાણીએ જાહુા અસર કરી. મૂલામાં પોતાના અપરાધ અંગે જે નથળાઈએ ધર કર્યું હતું એ લગભગ નાશ પામી અઈ. પાછા કરવાનો અને એમ કરવા જતાં હોરંગી દુનિયા તરફથી જે ચીધામણ થાય તે ચાંતિથી વેહી લેવાનો નિશ્ચય કર્યો. મા-દીકરીએ પરવારી, રથને કૌશામ્ભી તરફ હંકાવી મેલ્યો.

હાઈ, ચૌટુ અને ચોક વટાવી રથ આવાસ નજીક આવી પહેંચ્યો. એ દૂરમિઅન જનતા તરફથી અંગુલિ દર્શાનના પ્રેસંગે નહોતા આવ્યા એમ તો ન જ કહેવાય; પણ ચંદ્નાને મૂળા સાથે હરતા સુખડે વાત-કરતી નિહાળા, સૌ ડેઢ મસ્તક મુંઝનવાળા ધનાવને વીસરી જતું અને વસુમતીની ભારોભાર પ્રશંસા કરતું.

ધનાવહ શેઠના અલાસમાં થોડા દિનમાં જ તંત્ર પૂર્વવૃત્ત ચાલવા ભાંડયું, ત્યાં તો દસ્તુમતીના ચંપાપ્રતિ પ્રયાણુની ધરિકા આવી ગઈ. શેઠદ્વંપતીને ચંદ્નાનો વિરહ વેહવો જે કે ભારી હતો છતાં આ વાતને ડેલાય તેમ ન હોપાયી હુઃઅભર હંદ્યે તેણીને વિદાય આપી અને ભાર અછીને કહું —

દીકરી ! ભલે તું રાજકુમારી હો પણ અમારા ફુદ્યમાં તો તહાંથી સ્થાન પોતીકા સંતાન જેવું જ છે. રાજ્ય મહાલયના સુખમાં-રાજ્યની ભાતાના મીઠા રનેહ ઝરણામાં-ભાલીએ. સાથની મધુર હાસ્ય કીડામાં અમને સાત ભૂલી ન જતી. આ રંકની ઝૂંપડીનું સંભારણું રાખને અને જરૂરીથી પાછી ફરજે.

ચંદ્રાળા પણ અધિકારી વર્ગ સાથે વિદ્યાય લેતાં જેમ બને તેમ ઉતાવળે પાછા ફરજાનો, અને પ્રભુશીના કૈવલ્ય પર્યાત આ ઘરમાં જ વસવાનો, દિવાસો આ રિને, વડિલની ચરણરજ માથે લઈ વિદ્યાય થઈ.

શેહ શેહાણુ ક્ષિતિજમાં અદ્દસ્ય થતાં રથને નિહાળા રહ્યાં અને અન હૈયે એ દેખાતો બંધ પડતાં ધરમાં પાછા ઇર્યાં. તરિત ગતિએ માર્ગ કાપતો રથ અંગ હેશના સીમાડામાં પ્રવેશતાંજ, પરિસ્થિતિમાં સહજ પદ્દો આયો. રાજકુમારીનાં દર્શને અન્જન ટોળાઓંધ એકદ્દાં થવા લાગ્યાં. એમના હાર્દિક સત્કારને અવગણી ઉતાવળ કરવાનું યશાપાલે ચોગ્ય ન ભાન્યું. હાડોર હરનામસિહના 'કહેખુથી પોતાના માદર વતનનો સમાવેશ પણ કૂચ કરવાના કાર્યક્રમમાં કરી આમજન સમૃદ્ધને આતંદ આયો. વસુમતી ખાળવયમાં એકાદ વાર માતા સાથે અડી આવેલી. એટલે તેણુંને કંધ જાડી રમૃતિ નહોતી, પણ હરનામસિહ પાતાની એક માત્ર દીકરીની આ દીકરીમાં ધારિણીના ગુણો તેમજ સંસ્કારિતા પૂર્ણપણે જિતરેલાં નિરખી, અતિશય આનંદ પાખ્યા. ધારિણીની સખી ભાલ્યિકા તો વસુમતીને જોઇ ગાંડી ઘેલી બની ગઈ. હાડોરના આગ્રહથી આ ગામમાં સ્થિરતા વહુ દિવસ લંખાઈ. ભાઈ ભાલી સાથે લાંઘો સમય રહેવાનો પ્રસંગ યશપાળના જીવનમાં આ પ્રથમ વારજ નાયો.

દીકરી એટંદેજ રિંડાં ખરની વર્તી. પાળી પોણી મોટી કરી,

સંસ્કારી બનાવી, આખરે તો નવિન ધરેજ વિદ્યાય કરવાની—કાળ જૂતો આ રવૈયો. વૃષ્ટ હરનામસિહ ધારિણીના અપહરણું અને પાછળથી મરણના ખ્યાલ બહુ દુઃખી થયા હતા. એમને વસુમતીને પુનઃ જેવાનો સ્વખે પણ ખ્યાલ નહોંતો. એકના એક સંતાનનું કરણું મુલ્ય એમને ખંજરના કારા ધા સમ આધાત પહેંચાડી રહ્યું હતું. ત્યારથી તે લગ્ભગ એકાંતવાસમાં રહી, પ્રલુબ્ધકિલમાં સમય વ્યતીત કરતા. આમજનતાને જરા સરખી પણ પીડા ન પહેંચે તેવી રીતે વહીવટ કરવાની તેમણે અધિકારીઓને સખત આજા આપી હતી. પોતાના અવસાન ગણીથી જમાઈ એવા દ્વિવાહન રાજવીની પૂરી સંમતિની આ જાગીર યશપાલને અક્ષિસ કરવાનું નષ્ઠો થયું હતું. પણ શ્યામ વાળાંમાં એકાએક વિજળીનો ચમકારો થાય તેમ વસુમતીના ભગવંત વર્ધમાનને પારણું કરાવ્યાના પ્રસંગે દુઃખી અંતરોમાં અનેરો પ્રકાશ પાથરો. નિરાશ હૈયામાં ધારિણીનું સંતાન જીવંત છે એ વાતે આશાનો દીવડો પ્રગટાવ્યો. આને નજરો નજરે એ હુહિતાના સહવાસમાં ડેટલાયે દ્વિતો વ્યતીત થઈ ગયાં છતાં, વૃષ્ટનો જીવ વિદ્યાય દેવા તો રાજ ન હોલો! જીવના આથમતા કાળે નજીકના રનેહીનો સમાગમ ખારા જળમાં ભીહા પાણીની વીરઠી સમ મધુર અને સ્વાદુ લાગે છે.

પણ વસુમતીનાં દર્શન માટે તલસી રહેલો સમુદ્રાય નાનો સુતો ન હોતો. રાજવી કરકંડુની તલપ સૌ કોઈને ટ્યુની જાય તેવી હતી. એના કહેણું તો ચાલુજ હતા. એમાં ખુદ વસુમતી પોતે પણ ઉતારળમાં હતી. તેણું ‘આડે ધરીમાં પહેલે પતાવવાનો હતો’ અર્થાત ત્રણ કલાકમાં જે કાર્ય પતાવી શકાય એવું હોય તે સાડા ત્રણ ધરીમાં એટલે કે ચોરાશી મિનિટમાં પતાવવાનું હતું. કૌશાખીમાંથી નીકળો ત્યારે આ પિતામદને મળવાનો ખ્યાલ ન હોલો. ભાઈ ભાબી સાથે થોડા માસ ગાળી, સતતર પાદક પિતાના ધરમાં પાણ કરેની ધારણા હતી અને

આવ્યા પછી સંયમ પંથ માટે તૈયારી કરવાની હતી. ભગવંતને ડેવલ-
રાન થાય એટલોઝ વિલંબ હતો. તેઓશ્રીના ને સમાચાર ગ્રાપ્ત થતો
હતા એ ઉપરથી કૈવલ્ય દરા હાથ વેંતમાં જણ્ણાતી હતી. તીર્થ સ્થા-
પન કાળે તો એણે પહેંચી જવુંઝ જોઈએ. જવનમાં જવલ્યે સાંપડતી
એ તક નજ ગુમાવાય.

એટલે પિતામહને સમજાવી વસુમતીએ પ્રવાસ યાત્રા શરૂ કરાવી
અને માર્ગમાં હવે આજો વિલંબ ન થાય એવી તાકીદ કરી. ભાવ ભીના
સ્વાગત જીલતું આ સરધસ ચંપામાં પ્રવેશ્યું ત્યારે તો જણે સારી
નમરી એકાદી નવયૌવના તરણોને તનમનાટ અનુભવી રહી ન હોય
એમ લાગતું. વાટે, હાટે અને બારી કે ઝડપામાં માનવ માથાં સિવાય
કંધ જણ્ણાતું નહિ. રાણી ધારિણી કરતાં પણ વધારે દીપી નિકળેલી,
શરાતનમાં જરાપણ શિથિકતા ન ફાખવે એવી, છતાં શાંત પ્રકૃતિ
વાળી અને અહૃત્યર્થ અવસ્થામાઝ રાજમહાલયના વિલાસોને સંસારના
સુખોને-લાત મારનારી વસુમતીનાં દર્શન એ ડોઢ ભગવતીનાં દર્શન
ન હોય એમ સૌ ડોઢ પ્રજનનોને લાગતું. ડોઢ પુષ્પોની વર્ષાં કરતું
તો ડોઢ અક્ષતોથી વધાવતું.

પ્રાસાદનાં પગથીયે જલેલા વડિલ બંધુને જેતાંજ, રથમાંથી
જિતરી વસુમતીએ પ્રણામ કર્યા. બહાલી ભગીનીને પ્રથમ વાર જેતાંજ
રાજવીની આંખ લીની થઈ. તરતજ તેણીને હાથ પકડી પોતાના
આવાસ તરફ દોરી ગયો. ગ્રેયસીએ તો નણુદીને વધાવવા સામે તૈયારજ
જલેલી હતી. એમને જેતાંજ કરકંદુ સિમત કરતાં ખોલ્યો—

ચીર કાળથી જેની ઝંપના કરતા હતા એ મારી બેન વસુ-જીવે
તો ખરી, આપણે વાટ જેતાં જેતાં થાકી જયા જ્યારે બહેન ખા ને તો
એનો હિસાબ પણ નથી ! મોંધા તો એટલા થઈ જયા કેરોઝ એપીએ
દોડાવવા પડે !

મોટા ભાઈ, તમો પિતાના સ્થાનકે કહેવાયો એટલે જે કંધ કહો તે નાની બહેને સાંભળી લેવું જ રહ્યું એ સામે પ્રતિવાદ નજ થાય. આકી તમારા વેળુ મારી વર્તાણું કને લમારે બંધ બેસતા નથીન્ન. મેં મેહું કર્યું જ નથી. સરવસનો કાર્યક્રમ તમોએ જ નક્કી કર્યો હતો. આગમન પૂર્વની અને પછીની મારી રામકઢાણી સાંભળતાં જ તેમોને જણાશે કે જે કંધ વિલંબ થયો છે તે સકારણું છે.

જ્વાલી સ્વસા, મારી મજલકથી જિનજધર નહીં. વડિલો તો વિદાખ થઈ ગયા. પરસપરની હુંકમાં આપણું એ ભાડું એંચ રહ્યા છીએ. એ પણ જાણે દૈવને ઝચતું ન હોય, એમ અનુમનાય છે. ત્હારા મેળાપ પછી તો એ દૈવનો પણ સામનો હું કરવાનો. હા, તેં મને વડિલ તરીકે સ્વીકાર્યો છે તો એમાં પોછે હક ન કરતી. આ ભાઈ ભાડુંને છૂટા પાડનાર કોણું છે તે હું જોઈ લઈશ.

એકજ પિતાનાં આપણે સંતાનો. તમો ભાઈ અને હું બહેન, તમો વડિલ એમાં પણ મીનમેખ નહિ. શા સાડ દૈવને દોષ દેવો? આજે મણ્ણાં એમાં જ આનંદ માનીએ.

વસુમતીની મીઠી વાણીમાં ભાલીઓનો સૂર પૂરાયો. સૌ હસતાં-બોલતાં આવસ્થક કાર્યોથી પરવારી રસવતી ગૃહમાં પહોંચ્યાં. જમી પરવારી વાર્તાદાપમાં ગુંથાયાં.

કાળની કરામતનો તાગ નજ જડે. વિરલા એવા જાની સંતોના હાથેજ એ છિકલી શડે. પૂર્વ ભવોનાં વેર-ઝેર કેવાં દસ્યો જન્માવે છે!

પતિત્ર ગ્રેમી દંપતીને પુત્રને સામે રાખી બેસવાનો યોગ જ ન સાંપડ્યો! પદ્માવતીનું કાર્ય તો જન્મ દેવામાં જ પૂર્ણતાને પામ્યું! દ્વિજાહને રાજ્યાસન દ્ધ પૂર્ણાઙુતિ કરી.

ધારિણી અને વસુમતીના સહવાસમાં દ્વિજાહન ભૂપે આ મહેલમાં બોડાં વર્ષો વીતાણ્યાં અને આશા હિંચોળે હિંચ્યા. ત્યાંતો રાણીનું મૃત્યુ

અને પુત્રીનું અપહરણ ! એ ધા માંડ રાણી અભયાના આગમનથી ભૂજાયો- ત્યાં એની કરણી જુદેજ ચીલે ચડી ગઈ !

સ્વજનોના સહવાસનો યોગ સાંપડ્યો પણ તે અતિ મોડો ! આંધિ ચડી, જળ મારે ઉછાળા, ભૂલ્યો સુકાની દાવ ! જેવી સ્થિતિ થઈ. હદ્યના તાર તૂટ્યા તે પુનઃ ન સંધાયા !

ચંપાપુરીની એ લીલીસુકી અનુભવનાર પ્રાસાદમાં નૃપતિ દ્વિવાહન જેવા પરાક્રમશાળાના એ બાલુડા પરસ્પર વાર્તાવાપમાં મશ્ગુલ થયા છે. એમના ચહેરાન્ન બોલે છે કે વાતનો વિષય ગહન છે. આમ છતાં જવાય આપતી ભગિનીના સુખારવિંદ પર ગહનતાની જાંખપ નથી જણાતી પણ સ્થિતનો કુવારો જિડી રહ્યો છે.

કથાનાયિકા વસુમતી, કે એને જુદાં જુદાં દષ્ટાન્તો આપી વાત કરનાર અંગહેશ અને કંચનપુરનો સ્વામી, પ્રથમ પ્રતાપી કરકંડુ વાયકગણથી અજાણ્યા નથી. અહીંના આગમન પછી તો મહેનાઓ વીતવા છતાં ભાઈબહેનની વાતનો છેડો આવ્યો નથી. એ દરમિયાન વસુમતીએ, મંદારગિરિનો સ્તરૂપ તેમજ કંદરાએ અને ધ્યાન વેળા કૃપયોગની ગુફાએ, સતી સુભદ્રાએ ચાળણીથી કૃવામંથી જળ કાઢેલું તે કૂપ અને ચંપાનો ઘ્યાતિ પામેલ દરવાળે આદિ જેવા લાયક કંઈ કંઈ સ્થળો ખૂદી નાખ્યા છે. વડિલ ભાઈએ પોતાનું વિશાળ ગોકુલ બ્યાતાવી એ પાહળનો આશય સમજવવામાં કચાશ નથી રાખ્યી. જે પ્રજ્ઞ શુદ્ધ દહી-દૂધ અને ધી જેવા પૌષ્ટિક પદાર્થીથી સુપ્રમાણમાં પોથાય છે એ મજબૂત સંધ્યાણવાળી અને અહલુત વીર્યશાળી બને છે. એની શરીરસ્થિતિ નિરોગી રહે છે. એ મહત્વના પદાર્થના કારણુંપ્ર ગૌવંશનો ઉછેર અને વિરતાર હું જાતે કરું છું અને મારા ઉદાહરણ દ્વારા પ્રજનનોને એમ કરવા આકુંઝું. પેલે હિન મેં બતાવેલ શ્વેત વર્ણન વંચેરા પર મને કોઈ ગાઠ પ્રીતિ અંધારું છે. એ નાના અર્લ-

‘કને દૂધ પૂરતા પ્રમાણમાં પીવડાવી મસ્ત બનાવવાનો મેં નોકરોને દુકમ આપેલ છે. મને એક વાર અને જેયા હિના ચેન પડતું જ નથી.

જે કંઈ પણ મને ડંખતી આખત હોય તો તે તારી પ્રવન્ધા લેવાની. દુનિયાનો મોટો ભાગ જે માર્ગ જઈ રહ્યો છે એ મુજબ તું પણ મનપસંદ સાથી શાધે, યુવાનીની મોજ માણે અને પછી દીક્ષા કે તો શું ખોટું ?

વડિલ ભાત ! રા સાડ એકની એક વાત ફરી ફરી ઉક્ખેલો છો ? શું તમો એમ સમજે છો કે આ ચંદ્નાએ દુઃખના ઉછાળાથી એ માર્ગ લેવાનો નિર્ધાર કર્યો છે ? અથવા તમે જેમાં સુઝોની કલ્પના કરો છો એના જાનથી એ સાવ અજ્ઞાત છે.

ભાઈ ! અંધા કંઈ એકજ ચીલે ચાલનારા ન હોય. તમારી માતુશ્રી-નું દષ્ટાન્ત તો નેત્ર સામે છે. તેણું તુખારને ચાખુકના સપાઠા ન હોય એને માટે માત્ર હવામાં વીજ બસ ગણ્યાય. જ્યાં સંસારના વિલાસોમાં મારું મન ખૂંપતું જ નથી ત્યાં એના ચર્વિતચર્વણું શું પ્રયોજન !

વારુ, ભગિની ! તારી એ છંચા હું કખૂલ રાખું છું અને તું મને વડિલ તરીકે માને છે એટલે તારું પણ માર્ગ એક છંચા માન્ય રાખવી જ પડશે. જ્યારે પણ સંયમ માર્ગ સંચરવાની પળ આવે ત્યારે આ ચંપાનગરીમાંથીજ ધામધૂમ પૂર્વક નીકળવાનું. એ અંગે જે કંઈ કરવાનું છે તે મારા હાથેજ થાય. રાજકુમારી ને પ્રવન્ધા રાજ્યને રોલે તેવી રીતે હેવાય.

આહો એવ વાતને ! મોટા ભાઈ ! એમાં માર્ગ આડા હાથ ધરવાનું કારણ હતું જ નહિ, પણ વિધાતાએ ને નિર્માણ કર્યું હોય એમાં થાય શું ? પૂણે જાની પણ, એ વિધાતાના શિરે ખીલો ઢોકવા તૈયાર નથી થતા. એરુદેજ કલેવાય છે ને કે ‘દોષુહાર મિથ્યા ન થાય.’

પ્રભુને વહેલાવવા ટાણે જે સોનૈયાની વૃષ્ટિ થઈ એ દ્રવ્ય અનામત પડ્યું છે. એમાંથી જ સંસાર ત્યાગની વિધિ થવાની છે. મહાત્માનું કૌશાળી વચ્ચેન છે.

જ્યેષ્ઠ ભ્રાતા ! થીજુ પણ એક વાત ધ્યાન બહાર કરવા જેવી નથી. જનેતાના ઉપકારનો બદલો. જેમ નથી વળી શકતો. તેમ પાલક માતાપિતાના ઉપકાર ઓછા નથી. એ વિચારણામાં આપણે ભાઈ અહેન સરખાં જિતરીએ. તેમ હીએ.

રાજ્યી કરકંઈના વર્તમાન ઐશ્વર્યમાં, ક્રમશાન ભૂમિવાસી ચંડાળ દંપતીનો ક્ષાળો નાનો સૂતો નથી. એ જ ધોરણે તમારી સામે વાત કરી રહેલ ચંદ્રના ઘડતરમાં કૌશામ્ભીના ધનાવહ શેડ જ મુખ્ય છે. કીલામના અનારમાં કુદ્રત કરામત કરી, એ મહાશયને બેંચી ન કાવી હતે તો આજે હું કચાં હોત ? અરે તમારાં વચ્ચને વેદ વાક્ય ગણી, એ વૃદ્ધોએ પોતાનો વંશ ઉતાર વાસ ન તન્યો હોત તો જે અન્યું તે અનત કે ? મૂલા માતાએ જે ભાગ લજ્જયો. તે ન ભજવાયો હોત તો શ્રી મહાવીરના પાત્રમાં મારો આહાર, અભિગ્રહની પૂર્તિ રૂપે સંભવતે કે ? ‘વિધિરેવ બલિયસી’ અથવા તો ‘વિધિરેવ તાનિ ઘટયતિ, યાનિ પુમાનેવ ચિંતયતિ’ જેવા સૂત્રો યથાર્થ છે.

વડિલ ! મારી વિનવણી છે કે એ અધી ભથ્થામણું તમે જતી કરે. મને સુઅં કરવામાં-આનંદ પમાડવામાં અરે સંસારી માનવી કરી શકે એવું સર્વ કંઈ કરવામાં તમે કંઈ જ કચાશ રાખ્યો નથી. મારી ભાબીએ તો નખુદી પાછળ ગાંડપણ નોતર્યું છે. આ બહેનના અંતરના અશિર્વાદ છે કે તમો નિવિધને રાન્ય લક્ષની બોગવો અને એ વંશ ઉતાર વિરતાર પામો. જેડે બહેનના રક્ષાખંધન જેવી એક વાત યાદ આપું તુ-જ્યારે પણ કુદ્રતનો સર્કેત, ચક્ષુ સામે જુવો અને

એ સાથે હૃદયમાં અવાજ ઉડે, ત્યારે આ સર્વને ઢોકર મારી નીકળી પડેને. ધડીલર પણ ‘ જે ’ ’ તો ’ ના આંકડા મૂકવા ન થોબતા.

સામા વીરલા તો એજ કે ને ભોગવી જણે તેમ જોગવી પણ જણે. પ્રિય ચંદ્રના ! બહાલી સ્વસા ! તમારી મધુરી વાણી અને એ પાછળની અડગતા મને મૂક બનાવે છે. મારા હાથ હેઠા પડે છે. ઇરજ્જુયાત હા ભણવી પડે છે. ‘ આવી છેને પણ વડિલોના માર્ગ પળશે અને હું એકલવાયોજ અહીં પડી રહીશ ’ એ વિચારે માર્ગ અંતર વદોવાયાછે.

બહાલા બંધુ ! તો હવે મહારે પાછા ઇરવું જ જોઈએ. જે તમેને અનુકૂળ હોય તો મને ડૈશાભ્યીમાં જતાં પહેલાં સંયમ પંથમાં વિચરી રહેલી માતા પિતાને મળવાની એ ત્યાગી પુંજવેનાં દર્શન કરવાની છચ્છાછે.

બહેન ! તેણે ધણ્ણીજ ઉત્તમ વાત કહી. રાજકાર્યોમાં પડોલ હું એ વાત તો સાવ વીસરી ગયો હતો. હમણું જ માણસો દોડાવી તપાસ કરવું હું કે તેઓ હાલ કયા સ્થળમાં વિચરે છે.

ભાઈ ! મેં એ સમાચાર મેળવી લીધા છે. પુરુષાદાની પાર્શ્વભગવં-તની શિષ્ય પરંપરામાં ઉત્તરી આવેલા પુન્ય શ્રીકૃશી મહારાજના ગર્ભમાં તેઓ દીક્ષિત થયેલ છે. એ શ્રમણેનો સમૂહ હાલ કલિંગ દેશમાં વિચરી રહેલ છે. સાંભળવા પ્રમાણે કુમાર-કુમારી નામની એ ટેકરીએ કે ને ચિંતન-મનન કિંवા ધ્યાન મારે અનુકૂળ ગણ્યાય છે, તેની નજિકના પ્રદેશમાં સંત દ્વિવાહન અને સાહણી પદ્ધાવતી છે.

આતો ધણ્ણા સારા સમાચાર. બહેની ! તું તથા તહારી ભાબીએ જદ્દી તૈયારી કરો અને હું પણ કૃલીદ જોઈવણો કરી લઈ કે નેથી ચાર પાંચ રોજમાં અહીંથી ઉપડી શકાય.



પ્રકરણ ર૧ મું શ્રમણ જીવનની સુવાસ

ભૂગિની ! તારા સમાચારને આધારે આપણે આ સ્થાનમાં આવી તો ચૂક્યા પણ આપણા હેતુને સિદ્ધ કરે તેવાં કંઈ ચિન્હ જણ્ણાતાં નથી !

કલિંગ દેશ લગભગ આપણે વીધી આવ્યા. ‘તોપાલી’ તરિકે ઓળખાતા નગરને પાછળ મૂક્યું. સામે દેખાય છે એ ઓરિસા યાને ઓડિયા પ્રાંત-પેલી પર્વતમાળા જણ્ણાય છે એ ખંડગિરિ અને ઉદ્ઘટનિ ઇરતી નાની મોટી ટેકરીઓમાં જ તેં સૂચવેલ કુમારી પર્વત હેવો જોઈએ. આખ્યતાં આશ્રયની વાત તો એજ છે કે આ તરફની વસ્તીમાં ભદ્રિકા સિવાય અને સામાન્ય ખેતી પરના ગુજરા સિવાય ખાસ મહત્વના ઉદ્ઘોગ જણ્ણાતા નથી અને નથી જણ્ણાતી વહેવાર પડુતા.

મોટાભાઈ ! ભદ્રિકા જીવન જીવનું સહેલું નથી. વળી સ્વયં પર મુસ્તાક રહી, પરિથમથી આજુનિકા ચચાવવી એ તો પુન્યાધનું લક્ષણ છે. જેમ કાવાદાવા એણા તેમ કર્મઅંધન પણ ઓછુંજ ને ! અને

ઉદ્ઘોગ જરૂરી છે. આણસ નજ જોઈએ. તે વાત પણ સાચી છે છતાં ભારે ઉદ્ઘોગો. ખ્રી કરતાં વહુ ઉત્પાદન તો તૃષ્ણા વધારી મુક્તિ અન્યને ચૂસવાની લાલયમાં નાંબે છે એ વાત ભૂલવા જેવી નથી. પોતાની જરૂરિયાતો પોતે નીખળવી દે છે અને સંતોષી જીવે છે, એ તો પ્રશ્નસનીય ગણ્યાય.

અમણુઓ આ તરફ છે અને ધણા ખરા ધ્યાન નિમિત્તે ખંડગિરિમાં વસે છે એ તો તેમની ભારકૃતે જાણવા મળ્યું છે. હા, નામ ન જાણે એટલે ખાતરીથી શી રીતે કહી શકે ! જેમને કામ સાથે સંબંધ છે તેઓ નામ જાણવાની તકલીફમાં નજ પડે. ખ્રી પૂરતો સંત સમાજમ સેવે. એમાં જ રવકલ્પાણ માને. પરમાર્થ કરવાની તક ન ચૂકે એ ધર્મ-પરિણામ્યાની નિશાની રૂપ છે. બાકી રાગી-ત્યાગીના રાહ જુદા હોય.

વસુમતી ! તેણે પણ ભારે કરી ! મારા સામાન્ય પ્રશ્ન ઉપરથી અનુભવ જ્ઞાન ઢાલબું અને સાથે અજ્ઞાત-પ્રદેશના માનવોની વકીલાત પણ કરી. એ પ્રકારની દક્ષતા મેળવવાનું ગૌરવ જરૂર કૌશાભીના વસવાટને ફાળે જાય છે. પણ બહેની ! રોજ કરતાં આજે આપણુંને માર્ગ કાપતાં મોડું થયું છે, તડકો પણ વહુ ચડ્યો છે, હવે આપણે સત્તર મુકામ કરી સવારના આવસ્યક કાર્યોથી પરવારવું જોઈએ. મારી દર્શાતો એ છે કે સામે જણાતી પર્વતમાળા નજિક જવાનું કે કુમારી પહાડ સંબંધી પૂછ પરછ કરવાનું હાલ મોડું રાખી, સીધા ડાખા હાથે આગળ વધવું. મંદિર પરતી ધ્વજ આદિના ચિન્હોથી ઢોંધ જામ સમીપમાં હોય તેવું જણ્યાય છે. ત્યાં પહેંચી ભાગોળમાં જ ડેરા તંણું ખડા કરી દેવા, હે નેથી જોઈતી જણાશ ભાવ લાવવાનું પણ સુગમ પડે.

વડિલ ભાતા ! તમારા વિચારને હું સંપૂર્ણપણે મળતી થઈ છું. આપણું પહેંચીરોને એ આજા આપી હો. કંત આપણે પેલી જિરિ-માળની તળાટીમાં દેખાતી જુખી સુખી જઈ આવીએ. ત્યાં વસતી કેવું જણ્યાય છે તો કંદ ભાળ મળે પણ ખરી. પછી તરતજ પાછા

કરી જઈશું. દરમિયાન આપણા માણુસોએ વસવાટની ગોડવણુ કરી લીધી હશે.

તળાટી નજીક આવતાં જ એક નાનકડી સરા, પાછળના ભાગમાં પાણીનો અરો અને બાળુના ભાગમાં એક અંડવાળી, આગળના ભાગમાં મોટા એટલાવાળી ઝુંપડી નજરે પડી. ઝુંપડીનું દાર અંદરથી બંધ હતું એટલે એમાં કોઈ વ્યક્તિ જરૂર હોયો જોઈએ એમ અનુમાતી વસુમતી એટલે ચઢી દાર ખખડાવવા લાગતી.

અંદરથી અવાજ આવ્યો.

ભગવતી મૈયા ! જિલ્લા રહો. હું કમાડ ખોલું છું. આપ આટલા વહેલા આવશો એવો મને સ્વપ્ને પણ અધ્યાત્મ નહિ. રોજ કરતાં ગુરુણીજી, આજ લગ્નભગ ચાર ઘટિકા વહેલા છો.

એ શબ્દો પૂરા થતાંજ દૃવાળ ઉધાર્યા.

વસુમતી તો સામે જિલ્લેલી વ્યક્તિનો બહેરો જોતાંજ અજાયધીમાં હરી જધ. દાર ખોલનાર વ્યક્તિ તો આલીજ બની અછ ! વિચાર-મન્દ બની.

ભગવતીના સ્થાને હૃપ સંપન્ન અને જૌરવશાળી કુમારિકા, નજિકમાં જ રથ અને સાથમાં ભલકાદાર-રાખવંશી પોશાકમાં સજજ થયેલ પ્રભાવશાળી પુરુષ તથા એ રમણીએ; જણે એકાટી રાતમાં સ્વર્ગપુરી-માંથી કોઈ હેવે ભતરી આવી આ સર્જન ન કરી દીધાં હોય !

પોતે છેલ્દા નણેક માસથી અહીં વસે છે, છતાં ગણુનીના માનવ મુખો સિવાય ભાગ્યે જ કોઈ આ તરફ ઇરહે છે ! સમીફના ગામમાં પણ જે મનુષ્યો વસે છે એ સામાન્ય સ્થિતિના છે. નજિકની ટેકરીએ પર જે શ્રમણ-શ્રમણીએ વસે છે, એમાંના ધણ્યા અરા તો ધ્યાન મળ રહેતા હોવાથી જવલ્યે જ તળાટીમાં આવે છે. જે ચોડા આવે જય

છે તે પણ માત્ર જોયરી અર્થે જ. કોઈ પર્વ દિન હોય છે તો ગામમાંથી થોડા નર નારીએ આ ટેકરી પર ચઢે છે. સાધુ સાધીના વંદ્ન અને ઉપદેશ પછી થોડી ધરીએમાં પાછા ફરે છે. પોતે અહીં આવી ચઢ્યો ત્યારે એલાન સ્થિતિમાં હોવાથી કોણું લાભ્યું તેનો ખ્યાલ ન હોતો. એમાં ગડ ગુંઘડો શરીર પર ફૂરી નિકળવાથી અને સંખિવા થવાથી તરતજ પથારી વરા થયો. લગભગ આ એકાંત અને નિર્જન સ્થાનમાં ભરણું પથારીએ જ પડ્યો હતો. અચાનક એક સાધી મૈયાની નજરે ચઢ્યો. તેઓનું મારા સરખા દુઃખિયાના બેલી અન્યા. તેમણેનું ગામમાં જઈ મારી શુદ્ધૂપા થાય તેવો પ્રઅંધ કરાવ્યો. પાટાપીંડી ઔષધ પણ તેમનાજ કહેવાથી એક વૈદ આવી કરી જતાં. શરીરની સાક્ષુરી તેમજ જડરી ખાન પાન સાચવનાર માનવીએ. પણ તેમનીજ પ્રેરણાથી અહીં આવી રહ્યા હતા. મરો જીવન દીપ ખૂઝાતો બચ્યો. હોય તો એ સાધી મૈયાની ચાંપતી દેખરેખ, આશ્વાસન અને પરોપકારી વૃત્તિને આબારી છે. હું હરતો ફરતો થયો અને માં સંભાળી લેવાની શક્તિ મારામાં આવી ત્યારે ખાસ મારા આગહથીજ સંભાળમાં રહેલા પેલા માનવો, પરમ દિને સાંજે લગભગ અદો મહિને પોતાના ધર ભેગા થયા. હજુ કાલે મધ્યાન્હ પછી પાછા ફરતાં એ ભગવતીને ને વાત કરી છે—

માતાજી ! તમોએ તો મને નવું જીવન આપ્યું છે. તમારો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે. મને એક વાર આપના ગુરુહેનાં દેર્શન કરાવો. ટેકરી ચઢવા જેટકી શક્તિ હવે મારામાં આવી છે. તમો જાતેજ અન્નપૂર્ણા કામ ધેનુ. પવિત્રતાના શક્તાત પુનઃસમા ભગવતી છો. આપના સરખા ગુરુદ્દ્દુરી અહનિર્શ જેમનો ઉપદેશ સાંભળવા જાય છે એ ગુરુ જેવતોવા નજ હોય. એક વાર એ વિભૂતિનાં દર્શન થાય તો માનવ હેરો સક્ષણ થાય. જુંદગીમાં મને એ એકજ આશા રહી છે.

મારી એ બહાલસોયી મા એ વાત કાને ધરી. આજે બ્યોર પછી તેઓ મને પોતાની સાથે ગુરુદેવ પાસે તેડી જવાના છે. એ વિચારથી માંડ હૃદય સાચેજ પુલકિત બની ગયું. નિશાના ઓળા ઉત્તરતાં મારી આ મહુલીમાં હું ખાટલે પડ્યો અને નિદ્રા પણ મધુરી આવી. સૂતાં સૂતાં વિચાર પણ કરેલો હે પ્રાત : કાળે વહેલા જીડી ઝટપટ પરવારનું અને મૈયા હા પાડે તો બ્યોર પછી જવાં કરતાં સવારેજ તેમની સાથે ટેકરી પર પગ માંડવા.

આમાં ‘ભગવતી’ નાજ સ્વભન સેવનાર અને રોજ એમના મુખે દર્શનથી ટેવાયલ હું આ નિર્જન પ્રહેશમાં અન્યનાં આગમનતી કલ્પના પણ કર્યાથી કરે ?

રાજકુમારી ! અન્યયેખી, આભાપણું અને ઉત્તર દેવામાં વિસંવાદિતા ના કારણ ઇપ મેં વગર પૂછે કહી બતાવેલી મારી રામ કહાણી છે. હવે વિદાખનું કંઈ પ્રયોજન નથી. આ સેવકને જે કંઈ ઇરમાવવાનું હોય તે સુખેથી ઇરમાવો.

મૈયાના પરોપકારે જેને નવજીવન આપ્યું છે એ ગમે તેવું કામ કરવાને મદા તત્પર જ છે. અન્ય માટે યથા શક્તિ ધસાઈ છુટવું એ જ જીવનતી લહાણ છે. એમાં જ માનવતા છે. નાતિકારો ‘પરોપકાર વૃત્તિને સાંત પુરુષોની સંપત્તિ’ કહે છે એ ખાડું નથી જ.

નાયક ! તમારી રામકહાણીમાંથી અમારો પ્રવાસ સફળ થવાના ભણુકારા મને સંભળાઈ રહ્યા છે. મારી અન્યયેખી તમારા ‘ભગવતી’ ને ઉદ્દેશી કહાડેલા ઉત્તરમાં નથી સમાઈ, પણ તમો મને ઓળખી શકતા નથી એમાં છે.

‘નાયક’ના ઉચ્ચાર સાથે જ પેલી વ્યક્તિના મનોપ્રહેશમાં પૂર્વ-જીવનના બનાવો ઘડા થઈ ગયા. નાયકનું સંખોધન કરનાર કુંવરીના ચહેરા પ્રતિ એકી રદ્દો એ આંખો માંડી રહ્યો

ત્યાં તો કુમારિકાનો હાસ્ય વેરતો નાદ આજ રહ્યો.

નાયક ! તમોએ જે બાળાનું લીલામ કયું હતું એ જ હું વસુમતી કૌશામ્ભીના ધનાવહ શેઠની પાલકપુત્રી.

• ખેણ ! ખેણે તો ખરાખર મળતો આવે છે પણ આસપાસના અડોડા મેળવતા નથી. તમારા એ સમયે જોયેલા શરીરમાં અને આજની દેહકાંતિમાં પણ ધણો જ ફેર પડ્યો છે.

નારીજીતિના અંગોની ખીલવણી એવી તો ખરી જ; બાકી તમો ભારી મંદ્વાડમાંથી જોયેલા છતાં, મેં તો તમને પ્રથમ દર્શને જ પિછાની લીધા.

સાંભળો, જેલા રથમાં બેઠેલા રાજ્યી એ મારા ભાઈ અને અત્યારના ચંપાપતિ તરીકે ઓળખાતા મહારાજન કરકંદૂ પોતે જ છે. સાથમાં મારી ભાલીએ છે. આ પ્રેદેશમાં અમારું આગમન જે સંતની તમો વાત કરે છો. એમનાં દર્શન માટે જ થયું છે. તસારી વાત પરથી નામ આદિની દિશેષ ઓળખાણ નથી તારવી શકતી પણ એટલું તો નિશ્ચિત સમજય છે કે અહિની પ્રાતઃકાળે તમો જેને ભગવતી તરીકે ઓળખો છો. એ જીએલ્લીજી, સંતના વંદન અર્થે અહીં થઈને ખાય છે. વળી આજે તમને તે સાથે લઈ જવાના પણ છે. હજુ સુધી આવ્યા નથી તો કદાચ હમણું ન પણ આવે અને ભધ્યાહ્ય જિતરતાં જ આવે. નિર્ઝંથો વિના કરણું ગમતાગમન કરતા નથી. મારી તમને વિનંતી છે કે અમારા આવ્યા વિના તમો ઉત્તાવળ કરી ટેકરી પર ચઢવાનું શરૂ ન કરતા અમો સમીપ વર્તી ગામની ભાગોળમાં જ ધીએ અને આવસ્યક કાર્યોથી પરવારી તમારા જતાં પડેલાં આવી પડોંચીશું તો! ખરા જ. કદાચ વિલંબ થાય તો રાહ જો જો.

આટલું જણાની વસુમતી રથ તરફ પાછી કરી અને ભાઈને સુદ્ધા પૂરતી વાતથી વાકેદ કરી, જલ્દી પાછા ફરાય તેવે. પ્રથંધ કરવાની સૂચના સાથે રથ ગામ તરફ હંકારી હેરાવ્યો.

રાજકુંવરીના ગયા પછી નાયક ગહન વિચારમાં પડ્યો. અફસમાતિઝ બનેલ આ મેળાપે તેના હૃદયમાં ભૂતકાળને સજીવન કર્યો, એટલું જ નહીં પણ પોતાની કરણીનો આ લોકો બદલો લેવા ધારે તો ભરણ હાથવેંતમાં હેખાયું. રાજભાગાની વાતમાં એ અંગે જરા પણ ગંધ નહોતી, છતાં ‘ગુનેગારનું હૃદય સદા રાંકિત હોય,’ એ ઉક્તિ અનુસાર મનમાં તરંગ ઉદ્ભબ્યો. ઘડીભર આ સ્થાનમાંથી ભાગી ધૂટવાનું મન પણ થયું. ત્યાં પડોપકાર પરાયણ ભગવતીની મુદ્રા નેત્રો સામે રમી રહી. નવજીવન દેનાર એ મૈયાને કથા વિના તો અહીંથી ન જ ખસલું એવો નિશ્ચય કરી કાર્ય આટોપણી આરંભી.

હેતુ વિહિન પગલું ન ભરનાર સાધ્વીજ રોજ માઝને આને મધ્યાહ્ન પૂર્વે ન આવતાં, જિતરતા પડોડે આવ્યા. રોજ કરતાં સાથમાં આને સાધ્વીઓની સંખ્યા વધુ હતી. રજેહરણથી એટલો સાડું કરી આસન માંડી જરા વિશ્વાનિત લેતાં એમણે પ્રથ્યે કર્યો.

ભાઈ ! સંતના દર્શન આને જરૂર કરાવીશ. તમારામાં ટેકી ચદ્વા જેટલી શક્તિ આવી નહોતી એટલે જ અદ્ધાપિ સુધી એ વાત મેં ઉચ્ચારી નહોતી; બાકી આ રાજર્ષિનાં દર્શન અને ઉપરેશ અવણ એ તો અહોભાગ્ય હોય તો જ પ્રાપ્ત થાય.

ભગવતી માતા ! મેં એ વિચાર બદલ્યો છે. જરૂરી કારણુસર હું હુમણું ‘તોપાલી’ જાઉં છું. અહૃવાડીયામાં તો પાંચાં આપી જાઈશ તે વેળા આપની સાથે સંતના દર્શને જરૂર આવીશ. આપની રજ લેવા જ થોખ્યો હતો.

મહાનુભાવ ! હું સંસારી માનવી છે એટલે કામ અને કારણ સંભવે તો જરૂર. પણ આવી ઉતાવળ છાને તેવી તો નથી જ. ૬૩ માંદમાંડ દેહમાં શક્તિનો સંચય થવા માંડ્યો છે, પ્રવાસ જોડવા જેટલી તાકાત આવી જણ્ણાતી નથી. ગયા પછી અહૃવાડીયું થાય કે મહિનો

પણ થઈ જાય. નયાં આવતી કાલે શું થયે અથવા તો ધડી પછી શું બનસો એનું આપણને જ્ઞાન નથી ત્યાં દિવસોના ભરોસે અંગળું આવેલ અવસર ચૂકવો એ તો ‘તળાવે જઈ તરસ્યા રહેવા જેવું’ કે ‘મહેંમાં આવેલ કાળિયો છોડી હેવા જેવું’ મૂર્ખાઈ ભર્યું ગણ્યાય.

પ્રથમ તીંબુક્કર શ્રી યુગાદિ જિનેશના પુત્ર બાહુભિને તક્ષશિલાના ઉદ્ઘાનમાં પ્રભુના પ્રમલાં થયાં ત્યારે તમારી માઝુક જ વાત ડેલી હતી. તું તો અઠવાડીયાનો વાયદો કરે છે પણ એ બિચારાએ તો માત્ર એક રાતનો જ વિલાં કરેલો; સવારે તો મોટા હાડ માઠથી પ્રભુ વંદન મારે નિકળનાના પયગામ સારી પ્રભનમાં છોડેલા. એ સુજાત સવારી ઉદ્ઘાનમાં આવી પણ પહોંચ્યી. પણ ભગવંત કરુષભદેવ તો તે પૂર્વે વિહાર કરી ગયેલા. એ મહાભળનાન રાજવીની દશા કમલ કોષગત બ્રમર જેવી થઈ પડી.

દિવિએ જાયું છે કે:-

કમળ કાપમન બ્રમર વિચારે, કરણું પ્રભાતે પ્રયાણ
કાળ મતંગન કરે કાળિયો, સમજયો નહીં નાદાન
એ સવા સોણ રતિ છે. સંતની વિહાર નોંધત કથારે ગાજરો એનાં
કેઢાલું નહીં; પાંચ ધાટિકામાં પણ આસન સંક્રલે !

એમજ માની લ્યે ને કે મંદ્વાઉમાંથી ચાર દિન મોડો જાડ્યો હતો ! આ ભવના લાલ કરતાં પરભવના પાથેયની વિચારણા પ્રતિ સાવ દુર્લભ્ય ન દાખવવું. પૂર્વના ભાગ્ય હશે જ ત્યારે તું અમારી નજરે અન્યાં. હંડિલ શુદ્ધિના નિભિતે એવા એકાંત પ્રદેશમાં અમારા પગલાં થયેલાં. વળ્ણ અમારાં વચનો સાંભળી જામવાસી ભાઈ બહેન કરુણાર્દ્ર થયા. વૈશના ઔપધની પણ ટીકી લાગી. આયુષ્યની દોરી બળવાન એટલે તું અચી ભયો. આદી દુર્ગંધયા ભરાયેલ પડ ને લોછી જરતાં ગડ મુમણી હર કાઢતે કંપારી જન્માવે એવા શરીરની શુશ્વરાં પરમાર્થ દૃષ્ટિયે કરેનાર એકદમ કંપાંથી મળી આવે !

पुन्यशाणी ! કામની ચિંતા આજ માટે ખંખેરી નાંખ અને આવ-
વાની તૈયારી કર.

એ નાયક કંઈ જવાંખ આપે તે પૂર્વે તો અથ્વો જોડેલ ધુખરિયાખ
રથ આવી ચૂક્યો.

સારથીએ લગામ ખેંચી અથ્વોને થંભાંખા કે તરતજ કરકંઈદૂ
વસુમતી અને રાણીએ જિતરી પડી. ઓટલા તરફ નજર હેંકતાં જ
કરકંઈથી ઓલી જવાયું.

આહો, પદ્માવતી માતા તો સામે જ બેઠાં છે ને ! દોડતો ઓટ-
લાની પગથીએ ચઢી ગયો અને પ્રણામ કરી સુખ શાતા પૂછવા
લાગ્યો. નારીવર્ગે પણ પ્રણામ કર્યો.

મૌનને ભેટી રાજવી કરકંઈદૂ કહેવા લાગ્યો, પુન્ય સાધવી મેયા !
એ દિને પિતા પુત્રને રક્ષણતા મૂકી આપ તો હોડી ગયા. પિતાએ
શોધ કરવા માણુસો દોડાંખા પણ આપ તો ગયા તે ગયાજ. વાતસલ્યના
લવ નિહૂણું આવું હુદ્ય તો કોઈક માતાનું જ સંભવે ! ધશારો
કરી સાથે પિતાને પણ એ માર્ગે વાળ્યા. મારા જેવા નવિનને માથે
ઉભય રાન્યોની ચિંતાને ભાર આવી પડ્યો. એમાં આપની રમૃતિ
લગભગ દાખાઈ ગઈ. એ તાજ કરી, અહીં ખેંચી લાવવાનું માન
તો આ એનડીના ફ્રાણે જાય છે

આપે એ વાત તો સાંભળી હશે કે ભગવંત વર્ધમાન સ્વામીના
કુપરા અભિગ્રહની પૂર્તિ કોશભ્રમી નગરીમાં ધનારહ શેડની પુત્રીના
શુભ હરતે થઈ.

એ બાકડા વહેરાનાર આ મારી હસમુખી અને બુદ્ધિશાળી
ખણેની પોતેજ. ધનારહ શેડની એ પાંચપુત્રા, નામ ચંદના; ચંપાપતિ
દ્વારિવાહન અને રાણી માતા ધારિષ્ઠીની એ પુત્રી, નામ વસુમતી. તમે

અને ધારિણી એ બહેનો ગણ્યાવ. એટલે સંસારી નજરે આપની પણ
એ પુત્રીજ કહેવાય. માટે મારી પણ એ એક માત્ર ભગ્નિ.

પદ્માવતી સાધ્વી, વસુમતીને ઉદેશી બોલ્યા—

પુત્રી ! તું તો ભારી ભાગ્યવંતી. અર્મ જિનના હાથમાં તાં દાન
એ તો માનવજીવનમાં અમર પ્રસંગ.

સાધ્વી માતા ! આપ કદાચ નહિ જાણુતા હો કે મારી એ દક્ષે
સ્વસાએ તો પ્રલુને પણ છેતર્યા ! કરકંડુએ એમ કહી વાત આગળ
લંખાવી.

વહેઠાવ્યા માત્ર બાકલા અને લીધું રીંની પદ ! ભગવંતેજ
જગતમાં એની સાચી પિછાન કરાવી. તે પૂર્વે ડોધને અખર પણ
નહોતા કે આ દ્વિવાહન ભૂપની પુત્રી છે. ભગવંતેજ એ વેળા કહું કે—

‘આ ચંદ્રનાયા મારા શાસનમાં પ્રથમા સાધ્વી થશે. આવી કાર્ય
પડુ રમણીને ‘ચંદ્રનાયા’ કહેવી એ તો પોતાની જુહિનું પ્રદર્શન
કરાવવા નેવું ! આ તે બાળા કે પ્રૌદી !

મોદભાઈ ! ભૂતકાળને એ રીતે વાગેળી આપણે સમય ગુમાવવો
એ હીંક નથી. ‘વેળા એજ વસુ’ એ અનુભવીએનું વચ્ચેન છે, એમાં
પૂજય એવી આ સાધ્વી મૈયાએ. એમની એળે એળ કિંમતી છે. વળી
આગમનનું ખીનું કાર્ય અધૂરું છે. મારે કૌશામ્ભીમાં જવાની પણ
ઉતાવળ છે.

પૂજય ગુરુણીજ ! ને વિલંખનું ખાસ કારણ ન હોય તો ટેકરી
તરફ ઉગ ભરવાનું શરૂ કરીએ. આપ આગળ થાવ; કેમકે આપજ આ
માર્ગના બોમિયા છો અને સાધુજીનાં દર્શનની અમારી અલિલાખા
આપની સહાયથીજ પૂર્ણ થાય તેમ છે.

આવિકા ? વાત સાચી છે. વિલંખ કરવો પોથાય તેમ નથીજ.

એમ કહી પદ્માવતી સાધ્વીએ પેલા માંદગીમાંથા છિઠેલા ભાઈને ઉદેશા પ્રશ્ન કર્યો !

કેમ મારી સલાહ ગળે જિતરીને ! તમો પણ આવો છો ને ? સાધ્વીજ સાથે વસુમતી અને રાજવીના વાર્તાલાપથી પોતે આ લોંડાનો પાંક ગુનેમાર અને દુઃખમન છે એ વાતનો ઘટસ્ફેટ થયા વિના રહેવાનો નથી. આ ભગવતી એ હુકીકત જણુણે ત્યારે એમને હેવું દુઃખ થશે ! એ વિચારે એનું હૃદય એટલી હેવે ક્ષુદ્ર થયું હતું હે. એ કંઈક ઉત્તર દઈ ન શક્યો. એના ચ્છેરા પર વિહૃળતા નાચી રહી.

એ જેતાં જ પદ્માવતી સાધ્વી કહેવા લાગ્યાં કે—

મહાનુભાવ ! તમારું અંતર હા ન ભણુતું હોય તો મારા આથ-
હથી બેંગાઈ આવવાની જરૂર નથી. ‘ભાવ વિનાની લક્ષ્ણ નકામી છે.’

વસુમતી ઓલી—ગુરણી માતા ! તેઓ આવવાના જ છે. તેમના કહેવાથી તો એમે આટલા જલદીથી તૈયાર થઈ આવ્યા.

એને એ ભાઈ તરફ નજર કરી કહેવા લાગ્યા—

નાયક ! ચાલો અમારી સાથે. આવો યોગ શ્વરનમાં કાઈકવાર જ
આવે છે. ‘ગતં ન શોचામિ’ એ નીતિકારના વાક્યને યાદ કરો.
મારે તમારા ઉપકારનું ઋણ પણ હેડવાનું હોવાથી તમારી હાજરીની
જરૂર હે. પછી આ ભવડાની મહાસુધારમાં સમુદ્રમાં તરતાં લાંડાં
માઝક ચાપણે જુદી જુદી દિશામાં તણુાઈ જાધારું ત્યારે સમાગમ
કર્યાંથી થવાનો છે ?

ચંદ્રભાગા ! તું આ મહાશયને કોળખતી જણાય છે. ચંપા અને
કૌશામ્યીના વસવાટમાં તેં પણ કોળખાણું તો હારમાળા રચી
દ્વારા છે ! પરિચય અને વસવાટ વિના ઋણ હેડવાનું કર્યાંથી સંભવે !

ગુરણી મહારાજ ! આપનું અનુમાન સાચું છે. એ પાછળને
ધૂતિહાસ પ્રસંગ પ્રાપ્ત થતાં હું વર્ણવી બતાવીશ. હાલ તો આપણું

સર્વે ચક્ષુ સામે રાખેલા મુખ્ય સવાલના ઉકેલમાં આગળ વધ્યોએ
એ જ છિ છે. આપ માર્ગ કાપતાં આ સ્થળ પાછળ જે કંઈ
ધતિહાસની કદીએ સંકળાઈ હોય તો તે, અગર આ પ્રદેશમાં
કુદરતે જે કંઈ કરામતો સર્જ હોય તે, ટૂંકામાં અમને સંભળાવતાં જવ.

દીર્ઘકાળથી સંયમ પંથના પથિક અનેલ પદ્ધાવતી સાધ્યીના
મુખેથી પર્વત અને એમાં આવેલી વિવિધ ગુફાઓ સઅંધી તથા એમાં
ધ્યાનમજન રહેતા મુનિગણને કંગતું વૃતાન્ત સાંભળતો આ
સમુદ્ધાય ટેકરીની જાંચાઈએ પહોંચવા આવ્યો. છતાં ન તો ડેલ્લો
સમય વ્યતીત થયો. એની, કે કોઈને વધુ શ્રમ પડ્યો એની જરાપણ
અખર પડી ! વૃતાન્ત શ્રવણુમાં એક રસની જમાવટ કરવામાં સાધ્યી
પદ્ધાવતીએ પોતાના વર્ષો જૂના અનુભવનો દ્યુટ્યો ઉપયોગ કર્યો હતો.
અનુભવીના મીઠા ધૂંટડા ગળવાના જ્યાં ઉગલે પગલે મળતા હોય
ત્યાં સૌ કોઈ ભાન ભૂલે. ભૂખ તરશ યાદ ન આવે ત્યાં થાક કે
સમયની યાદ કેવી !

પ્રવચન મંડપ તરીકે વપરાતી વિશાળ ગુફાના પ્રાંગણુમાં
ઉપાસકોની આ મંડળી આવી પહોંચી ત્યારે એક કુલ્લક સાહુના
મુખેથી સાંભળ્યું કે—

ગુરુ મહારાજ થોડી પગ પૂર્વે અહિરભૂમિએ જયા છે.

સૌ તેમના આગંમનની માર્ગ પ્રતિક્ષા કરતાં નજિકમાં ઐસી
વિશ્રાન્ત લેના લાગ્યા. એમને જાઝીવાર ખોડી થવું ન પડ્યું. અથ્ય
કાળમાં જ મહારાજશ્રી પધાર્યા. સૌએ જિલા થઈ વંદન કર્યું અને
સુખશાંતા પૂર્ણી.

પદ્ધાવતી સાધ્યી શરૂઆત કરતાં કહેવા લાગ્યા—

“હુન્યશ્રી ! રાજની કરકંદુની પાછળ એઠેલ છે એ જ આજરી
મહારાય કે નેમના સઅંધે મેં પૂર્વે વાત કરી હતી. તળાટીના

ગામભાંથી એમને તાતકાલિક શુશ્રૂષારૂપી સહાય ન મળી હોત તો એ અચવા ન પામત.

વસુમતી-સાધી માતાની એ-ઓળખાણુમાં હું એક વધુ મણુદ્રો ક્ષેરવું છું. તેઓ કૌશાભીપતિના એક કાળે સૈન્ય નાયક હતા. ચંપાપરના અચાનક હલ્લામાં એમણે જ માતુશ્રી ધારિણી અને અને ઉડાવેલા. અમે તે કારણે તેમની ધ્રંઘા ધારિણી માતાને પોતાની પતિનિ બનાવવાની થયેલી. એ ખર લાવવા સારુ જાતે કષ્ટ વેઠી અમને એ સુખપૂર્વક લઈ ગયેલા. વિનદણી કરવામાં કચાશ નહોતી રાખી. પણ પતિપતિપણુમાં જરા સરખો ડાઢો લાગવા હે એ રવભાવ માતાને હતો જ નહીં. એટબે તેમના મનામણું નિષ્ઠળ ગયાં. જે સમજવટથી ન બન્યું તે ભયથી કરવાનો ઉદ્ગાર આ ભાઈ જ્યાં સુખ બહાર કાઢે છે ત્યાં તો શિયળવતના રક્ષણ અર્થે માતાએ આપવાત નોતર્યો.

બનનાર બની ગયું. સતીની વીરતા આગળ આ નાયકની ક્ષાત્રવૃત્તિ કારગત ન નીવડી. સંસાર માંડવાની વૃત્તિ નામરોષ થઈ ગઈ. તરફ જ મને પુત્રી તરિકે સંભોધી. ધીરજ આપી અને ધનતા દોષે ગમે તેના હાથમાં ન જવા હેતાં ધનાવહ શેડ જેવા પવિત્ર ગૃહસ્થને દેચી. એ દિનથી મારું નામ ચંદ્રના પરસુ. જનતાની જીબે એ જ વધુ વસી ગયું. માતાના જીવનનો દીપ યુજાવનાર અને પરકીયા પ્રતિ મારી નજરે જોનાર જરૂર એ ગુનેગાર છે. એ વાત સમજુને જ એમણે પોતાની માતૃભૂમિને છેલ્દા રામરામ કર્યો છે. કુર્મે જેને માર માર્યો છે એના દોષ કાલ્વા કરતાં હું તો ગુણાધી દશ્થિ એક જ વાત યાદ રાખી છું કે-ધનાવહ શેડ જેવાના પવિત્ર હાથમાં સાંપાઈ ન હોત તો મારું શું થાત? મારા જીવનમાં ત્યાર પછી જે કંધ પ્રગત થઈ છે અને જે જીવન જીવનાની મારી અભિજાપા વર્તી રહી છે એમાં સુખ્ય ભાગ જીવનાર એ નાયક

મારા ઉપકારી છે. ભાઈ કરકંડૂને એમની પૂર્વ કરણી ભૂલી જવા મારી વિનંતી છે, કેમકે મેં તેમની સાથેની વાતમાંથી જાણી લીધું હતું કે ધારિણીમાના આપધાતમાં નિમિત્તભૂન બનતાર પ્રત્યે ખુદ પિતાશાને અપાર શુસ્સો ઉપજન્યો હતો અને શુનેગાર હાથ આવે તો અને જીવતો ન છોડવો એવું પણ તેમણે લીધેલું. તેઓ પ્રવાજિત થતાં પિતાના વચનને પૂર્ણ કરવાની જવાબદારી ક્ષત્રિય સંતાળા વારસામાં સહજ જિતરે તેથી મારે આ પ્રાર્થના કરવી પડી છે.

આ રીતે એક ભૂલાઈ ગયેલા અનાવ પરનો પડહો વિચકાતાં સૌની નજર નાયકના ચહેરા પ્રતિ એંચાઈ.

એનુ મુખ શરમથી ઝાંકું પડ્યું. નારીમાં ક્ષાત્રતેજની ઝમક હોવાથી તે શુરુદેવતાની સામે આવી, પોતાનું શિર નમાવી, આર્દ્ર વચને કુલેવા લાગ્યો—

કુંવરી વસુમતી ભલે મને ઉપકારો લેખે પણ ચાપાપતિના સુખી ધર સંસારમાં આગનો તથાએ ચાંપનાર, શુનેગાર હું જ છું. સ્ત્રાર્થ વશ અને મોહવિહૃણ થધ મેં ધર્મ નીતિ વિરદ્ધનું નિંદ્ઘ પગદું બયું છે. આ ભગવતી મૈયાના પ્રતાપે મને પુનર્જીવન પ્રાપ્ત થયું છે. એટલે એમના જીવનની સુવાસથી મારા હૃદ્યમાં એ કાળે હતી એવી કાળાં જોકે નથી રહી, અને મારા એ નીચ કૃત્યનો મને પરચાતાપ તો અહો આવ્યા પૂર્વેજ થધ ચૂક્યો છે. છતાં રાજવી ને શિક્ષા ફરમાનરો તે હું દસતે મુખડે વધાવી લેવા, તૈપાર છું. એ પૂર્વે મારી એકજ યાચના છે અને તે એટલીજ કે આપ સૌ મને મારા એ હુષ્કૃત્યની ક્ષમા આપો.

ગુરુદેવ—નાયક ! સ્વર્ણથ થાવ. માનય માત્ર ભૂલને પાત્ર છે. જ્યારથી હું દધિવાહન ભૂપ મરી ભગવાન પુરુષાદાતી પાર્થીજીનના શાસનમાં પ્રવાજિત બન્યો. ત્યારથી મેં સંસારના સર્વ બંધનોને તિલાંજલિ આપી દીંબી છે. ભાવ બ્રમણુના સુખ્ય કારણ સમા રાગ દેખને જડમૂળમા

ઉચેડી નાંખવાનો પાડો નિર્ધાર કરેલો છે. એટલે મને પૂર્વનો એ ભાવ રહ્યો નથી—નાયક ! તમે જરૂર નિમિત્ત ભૂતભન્યા છો છતાં વીતરાગ ગ્રસુના ઉપહેશથી મને સમજયું છે કે ‘સાચા કરવૈયા—ખરા ગુનહે-ગાર તો આત્માના પોતાનાં કર્મો જ છે. વિશ્વની જે કંઈ રોજયરોજ વિચિત્રતાએ નજરે ચેઢે છે એ સર્વ આઠપ્રકારનાં કર્મોનેજ આભારી છે. સમજું આત્મા એ વેળા સમભાવ દરામાં રહી એ અધારે છે જ્યારે પ્રાકૃતજર્નો એ કાળે હાયવેષ અને વેરવિરોધ જ્ઞનમાની, એમાં નવાનો ઉમેરો કરે છે. કોધ, માન, માયા અને કોભડ્ય કૃપાયો એમાં એવી જરૂરવટ કરે છે કે લગ્ભાગ રોચે આવેલ નાવ પુનઃ ભર દરિયે ઘેઠેલાય છે.’ તેથી તો કૃપાય એટલે જ સંસાર; જ્ઞાની ભરગવતે કલ્યો છે, અને કષાય મુક્તિ કિલ રેવમુક્તિ અર્થાત् સર્વથા કૃપાયોનો જરૂર એટલે જ મુક્તા દ્વારા એવું તેમનું ટંકેશાળી વચ્ચન છે. અહીં એઠેલા સર્વને મારી સૂચના છે કે આ વાત ખરાખર અંતરમાં હાતરી રાખજો. જેમ બને તેમ કૃપાયો ઓછા કર્રી, એ ચોકડીને નિર્મૂળ કરવાનો ધતન કરજો અને ઉદ્ઘયકાળે સમતા ધાને સમભાવ જેવા ગુણુને જરા પણ વીલો ન મૂક્શો.

નાયક ! મનમાંનો રહ્યો સહ્યો શંસય કહાડી નાંખો. લક્ષ્મી હોય ગો સંન્માર્ગે અનો વ્યય કરી જીનનું નહું પાતું ઉધાડો.

ગુરુદેવ ! મેં વસુમતીનો વિક્રિ કરી લાખ સોનીયા મેળગ્યા અને આશા રાખેલી કે અહીંથી અનાણ્યા પ્રહેશમાં જરૂર એ ડારા સુખેથી ચંસારના વિલાસ માણ્યાશી. પણ નસીબ ચાર ડગલાં આગળ આવ્યું. માર્ગ એ સારા હેખાવના રમણીઓનો યોગ પણ થયો. એમની સાથના સહિતાસથી મન નવનવાં સોણુલાં સેવયા. પણ લાગી જયું, ત્યાં અચા-નક હેઠળો વ્યાધિ ઊપન્યાસ. એની પીડા વધતી અછ. રોજ જેમના સુખ સાડ હું માડે તન—મન અને ધન કુરાશાન કરતો હતો એ રમ-

છીએ મને શાંતવન આપવાને બહલે એક રાતના પાછળા પહોરે કાંટાળી જાડીમાં ધડકી હઈ, મારી માર્વમત્તા સાથે પલાયન થઈ જઈ. કયાં સુધી તો હું એભાવ દરશામાં પડ્યો રહ્યો. આ ભગવતીએ જ મારો ઉદ્ઘાર કર્યો. ધીરે ધીરે હું સાંજે થવા લાગ્યો. મને આપદ્વાત પૂર્વે દેવી ખારિણીએ ઉદ્ઘારેલા વચ્ચેનો યાદ આવ્યા—“ ધર્મ એક જ તારણુહાર છે. નીતિ વિનાનું જીવન અગ્નગળના અંચળ જેવું નકાસું છે. ગ્રેમ સાચો તારે જ કહી શકાય કે જેની પાછળ નથી હોતો કંઈ સ્વાર્થ કે નથી હોતી કામ વિર્ષુળતા—પવિત્ર ગ્રેમ તો માનવને દેવ બનાવે છે; દૂધાડતો નથી પણ તારે છે. મારામાં રહેલાં ગુણોનું આકર્ષણી હોય અને દૂવા કાંઠેના પ્રથમ મેળાપથી સ્તોહનો અંકુર ઉદ્ભબ્યો હોય તો, હું તહેને મારા બંધુ તરીકે સ્વીકારવા તૈયાર હું. સતી નારી પોતાનું શિયલવત પ્રાણ કુરખાન કરીને પણ સાચવશે. એ ધર્મ એના જીવનના સર્વ સ્વરૂપ છે. એમાં જરાપણ ખાંચી ચાંચી કે સર્વનાશ થાય જ.”

ગુરુહેવ ! એ કાળે તો એ દેવીનાં વચ્ચેનો ન સમજ શક્યો પણ આજે એનું રહસ્ય બરાબર સમજાયું છે. ગોળ-ખોળ વચ્ચેનો બેદ અચન્દના તો કંચન કથીર વચ્ચેનું અંતર મને સમજાયું છે, મારી એ ભગ્નિની ભરણું બેટ કરી મને આખરી અવસ્થામાં પશ્ચાતાપનો પાવક બેટ ધર્યો છે. એ બહેનની બીજી મોટી બહેને મારા કલુપિત જીવનમાં સાચી સુવાસ ભરી દીધી છે. ઉલય બહેનોના સહવાસથી મારું જીવન પાછળના અંતિમ દિનોમાં સાચે જ નવપત્રવિત થયું છે.

પદ્માવતી સાધ્વી—કર્મરાજના તમાશા અન્ય પ્રકારના છે. શાની ભગવંતના નેત્રો સિવાય એની ખરી માહિતી લાભી શકાતી નથી. એટલે જ સંત સમાજમ આવસ્યક મનાયો છે.

ગુરુહેવ એલ્યા—કર્મરાજની ચોપાટના યથાર્થ અંકોડા તો કેવળ જ્ઞાનીજ જેરી શકે છતાં જગૃત આત્મા, શાન-દર્શનના ઉપરોગમાં પ્રગતિ

સાધે તો એ પણ ધણું જાણું શકે. અપેક્ષાપૂર્વક પિયારણા અને ઉપયોગ સહિતની આચરણા પ્રગતિરથનાં ચક્કો છે. નાયકની વાત પરથી અનુમાની શકું છું કે એમને બેટનાર અને લૂંટી જનાર રમણીએ—અભયા અને એની સખી પંડિતાજ હોવા જોઈએ. જેને એકવાર લજા કે કુળમર્યાદા છોડી પછી તેને અધઃપાત તરફ ટળતાં વિદંબ નથી લાગતો.

જાનીપુરુષો તેથીજ થાળા દીપાને કહે છે કે—

પ્રમાદ ન કરશો. કર્મ બાંધતી વેળાજ ચેતતા રહેણે. ઉદ્ઘકણે. તો સમતાનું જ સેવન કરજો. સંયોગોની પરખ કરતાં રહેણે અને ભાનવભવનું સાચું ધ્યેય સુકિત યાને સર્વ કર્મોથી કાયમી છુટકારો એ સહૈવ ચક્ષુ સામે રાખજો.-



પ્રકરણ રૂ મું

મહાસેન વનમાં સંધ સ્થાપના

પ્રાતઃકાળથી જ રાજગૃહી અને પાતાપુરીના વચ્ચા માર્ગમાં આવેલ મહાસેન વન તરફ જન સમૂહની દોડખામ થઈ થઈ ગઈ હતી. એ કાળે જનસમૂહના વિશાળ ભાગને આજીવિકાને પ્રશ્ન ખાસ સુઝનતો ન હોતો. ઐતરોમાં ધાન્ય અને ધર આંગણે જાય આદિ પશુઓનું પાકન સામાન્ય હોવાથી અનાજ અને દૂધ-દહોની રેખાંછેખ રહેતી. દ્વારે આવેલ અભ્યાગત રોટવા નિના પાછો ફરતો નહો. જે સમયની વાત કરીએ છીએ એ કાળે ભારતવર્ષમાં ભત ભતાંતર નહોતા એમ નજ કહેવાય. જુદા જુદા મંતવ્યને આગળ ધરી જનસમૂહને પોતાના ઉપાસક સમૃદ્ધાયમાં જોડવા સાર, સંખ્યાખંધ પંચ પ્રવર્ત્તિઓ અવાર નવાર મોટા શહેરોમાં જમનાગમન કરી રહ્યા હતા. જન સમૂહના અતિ વિશાળ સમૃદ્ધાયને ધર્મ સખાંધી શાન મેળવવાનો ધોરી માર્ગ આવા પ્રચારકોના મુખેથી ઉપહેથશ્રવણ રૂપ હતો. આ સર્વમાં શ્રીપાર્બતીની પરંપરાના નિર્ગંધો-શુદ્ધ ભગવાનના અનુયાયી અમણો અને વેદાંત દ્વર્ણનના કર્મકંડી ભૂદેવોનાં પરિભ્રમણ ઉડીને આંખે વળગે તેવાં હતાં.

નિર્ગંધેમાં કેશી મુનિરાજ આગેવાન હતા. ચાર મહાવત જેવા કંઈન વતને ધારણ કરવાવાળા તેમના શિષ્યો—સાધુઓ અને સાધીઓ— ચારિત્ર પાલનમાં જિય કિક્ષાએ પહેંચેલા હતા. એમના વર્તનન સામે કોઈ આંગલી ચીધી શક્તું નહીં. આમ છતાં એમનો ધર્મ સાંસારિક વિવાસો તરફ ઉપેક્ષા દર્શિક અને આત્મ કલ્યાણ પ્રતિ ઓંક વાળો હોવાથી પ્રાકૃત જન સમૂહમાં આજું આકર્ષણું જમાવતો નહીં. અહિસા ને જ પાયા રૂપ માનનારા અને વીતરાજ દશા પ્રાપ્ત કરવાના ધ્યેયવાળા અમણો સંખ્યાની ભાંજગડમાં પડ્યા વિના, તીર્થકર શ્રી પાશ્ચનાથ ભગવાન પ્રણીત ધર્મ સંભળાવતા; પરિપહેંદો ને ઉપસર્ગો સહન કરતા વિચરતા અને ગોતાના ધ્યેયમાં નિશ્ચળ રહી, શક્તિ અનુસાર શાસન પ્રભાવના કરતા હત.

ખુદ ભગવાન શાક્યમુનિના પંથમાં નિર્ગંધેના માર્ગ જેવી નહોઠી કરકાઈ, અને નહોઠતા એવા તપદારા દેહ દમન. જનસમૂહમાં એમની જય શરૂઆતમાં જોરશોરથી એવાલાતી હતી.

વેદાંતી અને ક્રૈણ કિયા કંડી ભૂદેવેનાં મનમાં ધર્મને નામે ચાલતા જુદા જુદા ધનલાયી અને લુર્વાના રસની લોલુપતાથી દ્યા જેવા ઉમદા ગુણુને મશીનો કૂચડો લગાતી ઊભા કરેલા નિવિધ પ્રકારના યજ્ઞ—યાગોથી લોઢ સમૂહ ધીમે ધીમે પરાંગમુખ થવા માંડયો હતો. રાજ દરખારમાં લાગવળના કારણે તેમજ દ્વિજ સમૂહમાં વિદ્ધાનોની સંખ્યા સવિશેષ હોવાથી યજના નામે પશુઓની હિંસાના તાંડવ તો ચાલુ જ હતાં. સંસારી જનોના સારા માદા અનુસરોમાં દાન. પુન્યના નામે તેમનાં લાગા એઓ નહોઠતા. અજ્ઞાનતા શ્રાપ રૂપ છે એ નીતિકારનું કથન ખાડું નથી જ. ઉપર કદ્યું તેમ આ ભૂદેવેની જન સમાજ પર લાગવળ મધ્યાનહે પહેંચી હતી, તેઓના મુખનો શબ્દ એજ કાયદો ગણ્યાતો મોટા મોટા રજવાડા પણ તેમની આજા સામે આંગળી ચીધી શકતા નહીં. આલાય ગુનેમાર હોય તો પણ નામની ચિક્ષાથી દૂરી જતો જ્યારે વૈશ્ય કે શરૂ

વર્ષુંના માનવીએ પર તો તેમની સત્તાના ચાણખા વીજાતા. વર્ષોમાં અલણ ગુડ પદે ગણ્યાતો. એ ગુડપદના ગર્વમાં એના આગેવાનોએ વહેમ-દંભ અને ધર્મના એથા તળે એછા ધ્વતિંગે નહોતા જન્માબ્યા! પંચેંદ્ર વાળો માનવી હલકાકુળમાં જન્મવા માત્રથી પણ કરતાં પણ નીચ્યા કોઈએ મૂકાયો હતો. ધર્મ શાસ્ત્રના ઉમદા વચ્યનો સાંભળવાના દક્ષથી એ વંચિત રહ્યો હતો! માત્ર સેવા કરવાનો તેના શિરે ભાર હતો. ભગવાન જૌતમ બુંદ્ધના પરિબ્રમણુથી, રાજકુલોમાં વધતી જતી લાગવગથી, કિયાકાંડ પર એછો ભાર મૂક્યા સાચ્યી સમજણ અને એ માટે જુનાર્જન જેવી કાર્યવાહી પર વધુ વજન મૂકવા ઇપ ઉપદેશથી, દિજ મહાશયોએ સર્જાવેલી એક છત્રીય સત્તા પર કાપ પડવા માંડયે હતો! અને જનમસ્મહુમાં ગતાનુભતિક ઇપ થઈ પડેલા કિયા કાંડો પર અભાવ પેદા થયો હતો. આમ છતાં એના મૂળમાં કુહાડાના ઘા કરી, સર્વથા છેદ ઉડાડવાની કારવાઈ તો ચરમ તીર્થપતિ શ્રી મહાવીર દેવના ઝાળે જાય છે.

જેન ધર્મ અને ઔદ્ધ ધર્મ અહિસા-સત્ય-અલયર્ અને અપરિ-અહ જેવા ઉમદા ગુણો ઉપર વજન મૂકે છે. છતાં એ ઉભય ધર્મોની કાર્યવાહીમાં તરતમતાએ રહેલી છે. અભ્યાસી જનો જ એની પારખ કરી શકે. યજા-યાગની હિંસા સામે પડકાર કરનાર શાક્ય મુનિ માંસના ખોરાકથી સાવ હાથ ઉદ્ઘાવી શક્યા નથી! એમના અનુયાયોએ તો દોર છુ! મૂકવામાં કંદ્ચ કંદ્ચ જલી કુંચાએ શોધી કહાંડી છે અને એજ રીતે નૈષિક અલયર્માં પણ લોચા વાળો દીખા છે. એ કારણે જ બિજુક-બિજુણી જેવો વર્ષ હોવા છતાં ચારિઅની દશ્યે એ ઉત્તમ છાપ પાડી શક્યો નહીં.

શ્રી ચાર્થનાથના સંતાનીય અમણુ-અમણીમાં વત પાલનની દીકાશ નથી ધર કરતી. જરા ક્ષતિ નજરે પડતાં જ અચ્છ-નાયકે એ સામે સાલ બતી ધરી છે. બંધારણુના નિયમ પણ કડક રહ્યા છે એટલે જ

છતર દર્શનકારોને પણ નિર્ગ્રથોના અંધારણુની મુક્તા કંઠે પ્રસંસા કરવી પડી છે.

ભગવાન મહાનીરે એમાં શોફાળો આપ્યો તે જોતાં વાતાંપ્રવાહમાં આગળ વધીએ.

છેદ્વા આપણે એમને કૌશામ્ભીમાં જોયેલાં એ પછી પરિપણ સહન કરવામાં એમની કપરી કસોટી થઈ. એક ગોવાળના હાથે કાનમાં ક્રીલિકા નંખાઈ. ઉપસર્ગોમાં આ છેવટનો હતો. થોડા કાળ પછી એ વાતનો ઉપાસકોને ખ્યાલ આવતાં જ્યારે એ ક્રીલિકાએ. એંચા કહાડવાનો પ્રયોગ કરવામાં આવ્યો. ત્યારે ભગવાન જેવા ચરમ શરીરી અને વજાઝબલનારાચ સંધ્યણુવાળા પ્રયત્ન આત્માથી. પણ અરેરાટનો ઉદ્ગાર થઈ ગયો.

અસ્ત પછી ઉદ્ઘ અને રાત પછી હિવસ એ કુદરતી કાનુન પ્રખરમાં પ્રખર કર્મી પણ શ્રી વર્ધમાને આ રીતે ખપાવી નાંખ્યા. એટલે ઝણુવાલિકા નદીના કંઠે સ્થામાં નામના ઘેડૂતના ઘેતરમાં શુદ્ધ ધ્યાનના પ્રથમ એ પાયા ચિંતવતા તેઓશ્રીને ડેવળજાન જીપદ્યું. ચૌદ રાજલોએક અથવા તો ત્રણ લોકના સર્વ ભાવેને તેઓ જાણુનાર થયા. વસ્તુને યથાર્થ રીતે જેવા—જાણુવા અને કહેવાની અનુપમ શક્તિ તેમને પ્રાપ્ત થઈ. દુનિયાના ભારોભાર અંધારાવાળા ખૂણુમાં અનતો નાનો યા મેરો બનાવ, તે પોતાના સ્થાને એહા જણી અને જોઈ શકે એવી સ્થિતિ મેળવી.

એના અભાવે પોતે ધણું ધણું જાણુતાં છતાં ઉપદેશ નહેતાં આપતા. પણ હવે શક્તિ હોયારવી. પોતે મેળવેલી એ કિંમતી વસ્તુનો વિશ્વના સર્વ જીવોને લાભ આપવો એજ એક તેમનો ધર્મ થઈ પડ્યો. ‘તિનાણં તારયાણમ्’ પોતે જતે તર્યાં અને ભીજને તારવાવાળા થયા. એટલે જ પદ્ધતિ સાર્થકતા ગણ્યાછ.

સરિતા તટે તેઓ આજું ન થોબ્યા. ધર્મ પ્રદ્રપણાને થોબ્ય અને સંધ સ્થાપનાને અનુકૂળ સ્થાન એમની નજરે મહાસેન વનનું જણાયું.

શહચાતમાં જેખું તેમ મહાસેન વન તરફની દોડા દોડમાં મુખ્ય કારણ તો ભગવાનના ત્યાં પગલાં થયાં એ હતું.

સ્વર્ગના અનુપમ સુખોમાં તદ્દાકાર બનનારા હેવો મારે આત્મ ઉન્નતિ સાધવાનો માર્ગ ભક્તિમાં જ સમાયો છે. એમના સરખા સુખની ટોચે રમતા જુવો, ન તો તપ તપી શકે કે ન તો કષ વેદી શકે. તેમના સહભાવમાં એ વરતુ નથી અને જે સ્થળમાં એમતો વસવાઈ છે ત્યાં એનો સહભાવ નથી. પ્રભુના આગમનની અધ્યર મળતાં જ તેઓ ભક્તિ કરવા મહાસેન વનમાં દોડી આચ્યા અને આંખના પવદ્રારામાં સુવર્ણ, મણિ અને રતોથી શેલિત હરડેઠને પ્રથમ નજરે આકર્ષે તેવું સમવસરણ ત્યાં ખડું કરી દીધું. દેવશક્તિને આવી કરામતો દુર્બલ નથી જ.

સમવસરણમાં આવવાનો જે માર્ગ રાજયધી નગરીથી ફૂટવો હતો ત્યાં શહેરની ભાગોળે જ સોમગદ્રિજ ન મના સિદ્ધિસંપન્ન ગૃહસ્થે મોટો યજ આરંભ્યો હતો. એમાં દેશ દેશના નામાંકિત ભૂહેવો પવાર્યી હતા. ચતુર્વેદી, ત્રિવેદી, દ્વિવેદી, ઋત્વિજ, પાંડા, ત્રિપાડી, અને જાની વિગેરે અટકોવાગા કેટ કેટલાયે હતા. આ બધામાં અથપદે હતા મહાશય ગૌતમ ગોત્રાય દ્વિજમૂત્રિ. જાયરા વિકાન અને અભિમાની પણ પૂરા ! પંડિત માન્ય હોનાથી પ્રતિવાસુકેવ રાતણુના અહંકારને પણ ટપી જાય !

ક્ષાળ પર તિવક્ત ત્રિવેશુથી શોભતા, જાતજાતના વિશેષણોથી દીપતા આ પંડિત રોખરને વાદ વિવાદમાં ભરભવાને મુંગા બનાતી હૈ એવા પાંચસો શિષ્યોનો પરિવાર હતો. અહિનીશ વેદાધ્યનમાં રક્ષા રહેનારા આ કિયાકાંડી આલણોના કંદમાંથી મધુરો ધર્તિ નીકળતો

ત્યારે હસ્તની અંગુલિઓ પણ એમાં તાતુ હેતી. એ દક્ષય ખરેખર જોવા જેવું ગણુય. યજ મંડપ અને મહાસેન વનમાં સમવસરણ વચ્ચે અંતર જાગ્રું નહોંનું. રાજઘ્રણીના જનસ્થુહુને ટોળાબંધ વિપુલ સંખ્યામાં આવતો નીરખી, પંડિતવર્ય દ્વારાભૂતિને પ્રથમ તો લાભું કે આ વેળા પોતાની આગેવાની હેઠળ ચાલી રહેલા યજનું મહાત્મ્ય જેવું તેવું નથી જ. પણ જ્યાં એ માનવ વંદો યજમંડપમાં પ્રવેશવાનું છોડી દ્વારા આગળ વધ્યે જ ગયાં ત્યારે એ મહાશયની આંખે ચમત્કૃષ્ણનો ડોઢ નવો ભાસ થયો. મંડપના પ્રાંગણમાં આવી પાછા ફરતા લોકને પૂછવા માંડયું—

અરે ભલા આદમીઓ ! આ પવિત્ર વેદીનાં દર્શન કરવાનું ખાળુંએ રાખી તમો આ તરફ ક્યાં ગયા હતા ?

ટોળામાંથી એકે જવાબમાં જણાયું—

પંડિત મહાશય ! અમો તો સર્વજ્ઞને વંદન કરવા ગયા હતા ક્યાં તમારી આ ધૂમાડાથી ધીકો રહેલી વેદિકા અને ક્યાં મણિરતોથી અળ જળાયમાન થઈ રહેલ એ સમોવસરણું ? શું એની રચના ! કેલું મનોહર સિંહાસન વળી એ પર અશોકવૃક્ષની શાળા છાયા ! અને દેવતાએ વાનિનોના નાદથી તો વાતાવરણ ગર્ઝ રહેલું છે.

ત્યાં તો બીજા માનવોને આવતા જોયા.

કટાક્ષ કરતાં દ્વારાભૂતિએ પ્રશ્ન કર્યો—

આ ભલા માણુસ તો માયાવી રચનામાં બોળવાએ ડોઢ જન્માગરને સર્વજ્ઞ માની એઠા અને એનાં ચરણ ચૂમી આવ્યા પણ તમારા જોવા ક્ષમનો મર્મ જણુનારા પણ શું એવી જતની ભૂલ કરી એઠા ને !

ના, પંડિતજી ! લાં સુદ્ધા ક્ષામણ જેવું નથી. એ વિશ્વુતિના ચહેરામાં ડોઢ અન્ય જ્યોતિ અણકે છે. એમની સમાપ્તમાં જણે શાંતિનું સાંનાન્ય પથરાયેલું છે. એ રમણીય, સૌભ્રય અને વાતસલ્ય

પૂર્ણ મુખ્યાકૃતિ પ્રતિ તમો પણ જરૂર મોહાઠ જવ. જવતો ત્યાંથી ખસવું ન ગમે. સાચે જ એ સવર્ણ છે. ત્યાં વાધુઅકરી કે શત્રુ ભિન્ન સાચે. સાથ એહા છે. એવું એ અનુપમ સ્થાન છે. લોકો તો દીંહું તેવું કહો મારે ચાલ્યા.

પણ આવાં વેણુ સાંભળવાની આશા સરખી નહીં એલી અને ‘આત્મા’ જેવા મહત્વના દ્વયના અરિતલ સંધભાં, વર્ષોથી શંકા સેવેલી, છતાં પોતાના જેટલો વિદ્ધાન વર્તમાનમાં ધરતી પર કોઈ નથી. એવી મગજખી ધારણું કરેલી છે જેમણે, એવા જૌતમ ગોત્રી ઈદભૂતિના માનવી પારો પૂરી ડીઓએ પહેંચી જયે. અભિમાનના છુદ્ધગારો તેમના મુખમાંથી બહાર આવવા લાયા. પોતાની વિદ્ધતા સામે, અરે એકધારી પંડિતાંત્ર સામે, જણે આ માયાવીએ બોંઅ ઝેંક્યો ન હોય, જણે વાદવિવાદનું કહેણું ન મોકલ્યું હોય, કેમ જણે ખૂતા ભોરિંગને લાકરી બોંચી જગૃત ન કર્યો હોય એવું મહા ભયંકર કૃત્વનું ગેઠવેલું લાયું !

મન પોકારી જિઠ્યું—અંગ ટટાર બની જયું—અને આંખેએ કોખથી વાલચોળ બની જઈ ! એકજ નિશ્ચય કર્યો. એ માયાવીને હરાવી, એ પડાવી, કાળું મુખ કરી વિદ્ધાય કરવાનેટ

ભાત ભાતના અને જલ જલના અદંકરોથી મુક્તા બિદ્ધાવલિ એલાવતા, પાંચસો શિષ્યોથી પરિવરેલા ઈદભૂતિ જડપી જતિએ સમવ-સરણ નનિક આવી પહેંચ્યા.

સિહાસનરથ વિભૂતિને જોતાજ ઠરી જયા !

અંતરનાદ સંભળાયો—અરે આ માયાની કે ધૂતાં ન હોય. જગતમાં વિશિષ્ટ જથ્યાતા જુલ્યોથી શોભતી આ વિભૂતિને જદુગર કે ઈદળ-શિક્ષની દ્ઘાટિમાં મૂકનાર કું ખરેખર બીંન થૂલ્યો ધૂં. જે વરતુ નજર સામે ચાચા સ્વરૂપમાં મોજુદ છે એને માયાની ઉપમા કેમ થે ?

અરે ને અહેરો જેતાંજ આધિ, વ્યાધિ અંત ઉપાધિદિપ ત્રિવિધ પીડા નાશ પામે, તે અહેરામાં ધૂર્તતાનો સહભાવ નજ હોય. એમાં તો આત્મ તેજના રણકારજ દર્શિ ગોચર થાય છે. કર્મોનાં આવરણ જરૂરુળથી ઓખડી ગયા વિના આ જાતની સિદ્ધિ શક્ય નથી. હું ભણ્યો છતાં ગણ્યો નહીં. અગાઉ સાંભળ્યું તો હતુંજ કે ક્ષત્રિયકુંડ નગરમાં રાજની સિધ્ધારથે ત્યાં એક પ્રતિભાસંપન પુત્રનો જન્મ થ્યો. છે અને લવિષ્યમાં આ ભારત વર્ષમાં ચોતીશમા તીર્થુંકર તરીકે એ ઘ્યાતિ પામનાર છે. ચૌદ મહાસ્વભન રાણી ત્રિશક્તાને આવેલાં એ બાળ અર્ભફંને ઈદ્રો અને દેવોનો સમૃહ મેઝપર્વત પર જન્માલિષેક કરવા લઈ જયેલો પણ ખરો.

આ તેજ વ્યક્તિ હેવી જોઇએ. હું જ્યારે નાલંદા વિદ્યાપીહમાં અધ્યયન કરી પોતાના દેશ પાછા ફરતા વિદ્યાર્થીઓને પદ્વી દાન આપવાના મેળાવડાના પ્રમુખપદે હોં, ત્યારે ત્યાં સમાચાર આવેલા કે ક્ષત્રિયકુંડના વર્ષમન કુંચરે ત્રીશ વર્ષની યુવાન વયે પલિ યરોઢા, ભ્રાતા નંદિવર્ધન આદિને સમજની, રાજ કાજમાં ન પડતાં આત્મશક્તિની સાખના નિમિત્તે અરણ્યનાસ સ્વીકાર્યો. મૌનપણે આવી પડતા ઉપસર્ગો અને વેહવા પડતા પરિષ્કો સામનાથી સહન કરતાં પૃથ્વી તથ અમણું કરવા માંડયું.

ત્યાં તો નાલકમાં જાનેલો વિદ્યાર્થી, યાદ આવતાં કહેવા લાય્યે: ગુરુજ ! આપનું અનુમાન સાચું જણ્યાય છે. આ તેજ વર્ષમાન કુંચર સંભવે છે. સોમિત્ર દ્વિજ કુંલભુરમાં યણ નિમિત્તે આમંત્રણ કરવા આવેલા ત્યારે હું હાજર હતો. અગ્નિભૂતિ અહારગામ જયેલા ને તે વેળાજ પાછા ઇર્યા હતા. એમાણેજ ખાર, આચ્યા હતા કે ક્ષત્રિયકુંડ-વાસી વર્ષમાન કુંચર કે ને સન્યાસ સ્વીકારી છેલ્લા. આર વર્ષથી આત્મશોધનમાં રક્ત રક્તેના તેમને જરૂરુવાલિકાના તટપર હેઠળસાન છુફન્યું છે. નિર્ધારણ તેમને અરિહંત તરીકે આપે છે.

બરાભર, શિષ્ય, તહારી સમરણું શક્તિ પ્રશંસાપાત્ર છે.

નેત્રો સામે પ્રવર્તી રહેલાં ચિન્હો એ વાતની સાક્ષી પૂરે છે.

મને સમજાય છે કે વાદનો આડંબર કરી મેં અહીં દોડી આવવાની ઉતાવળ કરી. એ મારા ગૌરવને હાનિ પહોંચાડશે.

આ તો તીર્થિકર સંપૂર્ણ જ્ઞાન થયા વિના ઉપદેશ આપે નહીં. તેમના નેવા, જાણવામાં રંચમાત્ર ફરક ન હોય. હે બોણા શંખ ! તહારા આ સેવકને માનલેર વંજે માપવાનો કંઈ માર્ગ સૂઝાડ એટલે મંગા નાશ્ચા.

ત્યાં તો ચાંદીની ઘંટડીના રણકાર જેવો ભાડો રવ સંભળાયો. ‘હે કૃદ્રભૂતિ ગૌતમ, તમો સુખ પૂર્વક આવી પહોંચ્યા !’

ભાઈ સુભિત ! આ તો માંડ નામ પણ જાણે છે ને શું ? અરે સામેથી માનપૂર્વક બોલાવે છે !

હં, સમજાયું. શિષ્ય સુભિત ! એ સર્વજ્ઞ કહેતાય છે માટે એ શક્તિના પ્રદીપન કરવા માંગે છે. મારા નેવા વાદીશેખરતું નામ તો આખાલ વૃદ્ધમાં જાણીતું છે. એથી કંઈ સર્વજ્ઞના ન પરખાય હા, ફદ્દયગત શંસય કંઈ દેખાડે તો અદ્ધા જન્મે ખરી ?

પુન : ભગવંતનો મધુર સ્વર કર્ણપટ પર અથડાયો.

મહાનુભાવ ! વેદ પહોંચાયે વાંચતાં તને જે આત્મા વિષયે શંસય ઉહુભવ્યો છે તે, એ પહોની વિચારણા બરાભર કરવામાં આવે તો ઘડીભર પણ ટકી ચકે તેવો નથી. સમજવાના જિજાસુથી છેલ્લા પગથીયે ન ઉભા રહેતાય. અહીં સમીપમાં અવવું જોઈએ અને યુક્તિ પુરસ્સર એની ચર્ચા કરવી જોઈએ; દઢીમંથન ન્યાયે ત્યારેજ, એમાંથી નવનીત ઉપર આવે. જ્ઞાન પિપાસુ વર્ગ માટે પંથની દિવાલો હે મતના વાડા નજ સંભવે.

શુદ્ધભૂતિ હતા તો વિદ્ધાન. જ્ઞાન ગવેષી હતા એટલે કદાગ્રહ કે ખોટા
કુદ નહોંતા પડતા. ભગવંતની મિષ્ટ વાણી અવણુ કરતાંજ પર્ય-
દામાં આવ્યા. વિવેક પૂર્વક વેદપહોની ચર્ચા ચલાવી. પાકી ખાતરી
થઈ એટલે વિના આગ્રહે પ્રશ્નુના શિષ્ય પ્રફને સ્વીકાર્યું. એ કાળે
તેમની વય પ્રભાસ વર્ષની હતી. ગુરુ એવા ભગવંત તો માંડ તેંતાલીશ
વર્ષ લગભગના હતા. પણ જ્ઞાનની ખોજ કોઈ જુદીજ વરતુ છે. એ
પાછળ ઝડપારી લેનારા શોધકોને વય, વર્ષ, નાત, જાત કે પંચના
બંધનો નહતા નથી. અંતરની તૃપા જ્યાં છીપાય, હૃદયની ભૂખ જ્યાં
સંતોષાય. ત્યાં એવા આત્માઓ માન-અપમાનની પરવા વિના
ઝૂકી પડે છે.

શુદ્ધભૂતિનું શિષ્યત્વ તેમના એ બંધુઓ અગ્નિભૂતિ અને વાયુભૂતિ-
ને ત્યાં ખેંચી લાવ્યું. તેઓ પણ રંકા નિરાસન કરી ભગવંતના
શિષ્યો બન્યા. એ વાત પ્રસરતાં યજમંડપમાંના વ્યક્તા, સુધર્મા, મેતાર્થ
અને પ્રભાસ આદિ અન્ય આડ જોડીદાર વિદ્ધાનો પણ પોતાના
વિવાચી સમુદ્દરાય સાથે સમવસરણુમાં આવ્યા. વિનયપૂર્વક મનમાં
ધર કરી એકેલા શંસયો અંગે લંબાણ્યથી ચર્ચા ચલાવી. ભગવંતની
દ્વાલોમાં તથ્ય જોયા પછી જ તેમણે અંતેવાસીપણું સ્વીકાર્યું.

પ્રભુ અને ઉક્ત વિદ્ધાનો વર્ચયેની જ્ઞાનચર્ચા કિંવા વાદવિવાદ
જાણવા સાડ તો ગણુધરવાદનાં પાના અવલોકવા ધરે. એ પાછળ
આમુલી દ્વિવસોની થોડી ઘટિકાઓ નથી ખરચાણી, પણ મહિના પસાર
થયા છે. ભગવંત વર્ધમાન સ્વામીની પદ્ધતિ મારીને મુસલમાન
બનાવવાની હતીજ નહિ. વાડો વધારવાનો મોહ અને ચેલા મુંડવાની
જીત એમનાથી બાર જાડ દૂર હતાં. કેવળ એકજ ધ્યેય. જે વરતુસ્વરૂપ
ચોતે દિવ્ય એવા કેવલજ્ઞાનથી જાણ્યું છે અને જોયું છે એનો જ્યાં
નિશ્ચના સર્વ જીવોને પ્રેમભાવથી અપાય તેટલો આપવો.

આ રીતે અગિયાર પંડિતો અને એમના ચુંભાળીશસોની સંખ્યાના વિદ્યાર્થીઓ મહાસેન વનમાં પ્રભુશ્રી મહાવીરના હાથે દીક્ષિત થયા રખે કોઈ માને કે માતાપિતાની રજ વિના એ મંડી નાખાયા. એ ખાલિથુપુન્નો ખલિયચ્છ અવસ્થામાં હોઈ, અભ્યાસ માટે પંડિતોને તેમના વડિલો તરફથી સોંપાયા હતા. ચાર આશ્રમને મહત્વ આપનારા ચૂદેવોમાં પણ પ્રથમ આશ્રમ વટાવી સીક્ષા. ચોથા સન્યસ્ત આશ્રમમાં પ્રવેશવાની પ્રણાલિકા હતી અને જોવાય છે.

અગિયાર પંડિતો તો પુષ્ટ વયના હતા. શાનાર્જન અને કિયાંકું એમના રોજના વ્યવસાય હતા. એમના ધરમાં રોકડળ જિઠે તેવું વાતાવરણ હતુંજ નહિ. વિશેષતા તો એ હતી કે એ બધાને દીક્ષા આપનાર ખુદ જાની ભગવંત પોતે હતા.

પોતાની પ્રવૃત્તિને સાચી હરાવવા સારુ મહાસેન વનનું ઉદ્ઘાઃરણ આપવું એ લીમસેનની પાખડી પાંચમા આરાના એકાદ માનવીના માથા પર બંધાસેસતી કરવા જેવો બાલિશ પ્રયાસ માત્ર છે. માનવ, માન્યતાના દેનમાં દેરાય છે ત્યારે રતનકુદ્ધિ તરીકેની ખ્યાતિને વરેણી તીર્થ્યકરદેવની માતાઓને પણ રોકડળ કરતી આદેખે છે. અટ કઢી નાખે છે કે જાધ્યભદેવની દીક્ષા પાછળ મરદેવા માતા રહી રહીને આંધળા થયાં હતા. એમ કહી સિદ્ધાંત રથાખે છે કે દીક્ષા પાછળ ગ્રાકડળ તો થાયજ.

મરદેવા માતાની આંખે પડળ બાજુચાં હતાં એ વાત સાચી ખણ રોકડળના બચાવમાં એ ધરવી એ તો એક જાતનું છળ છે.

કચાં એ પરિત્ર માતા-પુત્રના દીક્ષા અગેની સાચી સમજ અને કચાં આજકાલની વિચિત્ર મનોદ્દાશ ! સાચી સમજનો અભાવ ! કેનારની વેવલાઈ ! દેનારની લાલચુ વૃત્તિ ! એ દણાંત દેવું કે બાળવય જોઈ ભગવંત હેમચંદ્રસુરિને યાદ કરવા એ તો નાના મોઢે મોટી વાતો કરવા જેવી અછકલાઈ !

‘કયાં રાજું લોન અને કયાં ગાંગો તેલી.’ અલં પ્રાસંગિકને.

અરે આપણે ઈશ્વરભૂતિ મહાશયની કારવાઈએ વર્ણવતાં, પર્વદામાં નજર ફેરવવાનું પણ ભૂલી ગયા ! સાં માત્ર દેવ-દેવીએ જ નહિ પણ રાજીવીએ અને સાર્થકાહો પણ સુપ્રમાણમાં બેઠેલા છે.

અહો ! રાજીવી એણિઓ ને રાજ શતાનિક તો જોડાનોડ બેઠા છે. ધનારણ રોઠ પણ છેન. મંત્રીશ્વર અભયકુમારની બાજુમાંજ બેઠા છે એટલે તેમના અતિથિ થયા હોય એમ સંભવે છે. મગધનદેશના એ પાટવીઠી સ્વામીભક્તિ જેવી તેવી નથીજ.

પેઢા નારીઓનું દમાં ખૃગાવતી-જયન્તિ-ચેવણ્ણા-નંદા-સુદસા આદિ જાણ્ણોતાં રમણી રતનો આગળી હારમાં છે. એમાં વસુમતી તો ડોષ જુદાજ પોશાકમાં સુનજ થઈ બેઠેલી છે.

રાજીવિદ્વિવાહન સમીપમાં તેણીને છેલ્લી જોઈ હતી. જે કે એ પછી સંખ્યાબંધ દિવસોનાં વહાણાં વાયાં છે. છતાં વાતીપ્રવાહમાં આગળ વધવા, સાડ પાછળ નજર ફેરવવાનો ખાસ અગત્ય નથી. સામાન્ય ઉદ્દેખથી જ સળંગ અંડાડાની એળી રચાય છે. કર્મરાજીના પ્રપંચ પરતો : પડ્હો શુરુદૂના વિવિધ ઉપદેશથી એટલી હુદે ભૂલી ગયો કે અહિનીશ સંસારમાં રચ્યાપચ્યા રહેવાનું જેનું કામ છે એવો રાજીવી કરકંડૂ પણ એના પાસમાંથી કેમ મુક્ત થવું તે જાણું શક્યો. વસ્તુનું યથાર્થ હોન, કર્મના ઉદ્યક્તિએ સમતાથી એનું વેદન અને સતત જાગૃત દરશા, એ સાથે નિરાસકિત ભાવનો યોગ કેળવાય, તો કાયમી વિજય દૂર નથીજ. પ્રવૃત્તિમાં રક્ત જીવો પણ જો ‘ધાવ ભીવાવત બાળ’નું ઉદ્ઘારણ દાણ સન્મુખ રાખી વર્તન કરે તો થોડા દાળમાં-ગણત્રીના ભવોમાં-શીવસુંદરીનાં કેમ અખડાતવા ચક્કિત-માન થાય.

કુમારી પર્વતના રમ્ય પ્રદેશમાં, સંતસમાગમ સેવતી અને અપૂર્વ

આનંદ લુંટી, વસુમતી—રાજવી અને નાયક આદિ મંડળી જ્યાં
સંખ્યા પૂર્વે પાછા કરવાની તૈયારીમાં છે ત્યાં એકાએક સુદર્શન શેહનું
આગમન થયું.

રાજરતન મુરખ્ખી ! આમ અચાનક કયાંથી આવી ચઢ્યા ?
રાજવી કરકંડૂએ શેહને જોઈ પ્રશ્ન કર્યો, અને પૂછ્યું.

‘ ચંપાના રા સમાચાર છે ? પ્રજામાં આનંદ વર્તે છે ને ? ’

હા, મહારાજ ! સૌ પ્રકારની કુશળતા છે. પ્રલુષી મહાવીરહેવને
પરમાવધિ જ્ઞાન પ્રાપ્તિ થયાના સમાચાર મળ્યા, એટલે હવે કેવલજ્ઞાન
નજીકમાં ગણાય એમ સમજ હું રાજર્ષિના હશને આ તરફ નીકળા
આવ્યો. સંયમ સ્વીકાર્ય પણી ભગવાના પ્રસંગ સત્ત્વર ન સાંપડે.
ધ્યાન માટેના આ પુનિત પ્રદેશને જેવાની પણ છૂટા હતીજ. આમ
એટ પથ ને દો કાન જેવું ડોવાથી નીકળ્યો છું. અહીંથી કૌશામ્ભી
જવાનો છું કેમકે મનોરમા અને પુત્રો થોડા દિન પૂર્વે ત્યાં રનેહીને ધેર
છે તેમને તેડી પણ લાવવાના છે. ભગવંત શાસન સ્થાપે એટલીજ
ઠીક છે. પુત્રોના ખમે હુન્યવી ભાર રાખી અમો દંપતીએ પ્રલુષી
વીરની સેવામાં જોડવાનું નક્કી કર્યું છે.

પદ્માવતી સાંધી બોલી કિદુચા—

ધણ્યા જ સુંદર વિચારો. કર્મરાજ, અગના સંધાઓને ઠીકા
અનાવે તે પૂર્વે જ એના પંજામાંથી મુક્ત અની પરભવ પ્રયાણુની
તૈયારીમાં લાગી જવું એ યુદ્ધભર્તા.

મોટાભાઈ ! મને શેહશ્રી જોડ જવાની રણ આપો. અહીંથી હું
પરભારી કૌશામ્ભી જવા ધાર છું. વિલંબ કરવામાં કામ વિલુસે એવો
ઉધાડા સંભવ છે. એ લોકો મારી રાહ કાગના ડોળે જોતા હુશે.
વસુમતીએ નભ્રતાથી કહ્યું.

વાત એટલી રૂપે હતી અને કામ એવું પવિત્ર હતું કે એમાં આનાકાની કરવાપણું હતું જ નહીં. થીજે જ દિવસે સૌ પોતાના પંથે પણ્યા. પંખીના મેળા સમ પ્રાતઃકાલ થતાં જ બિન્ન બિન્ન દ્શામાં વિભરાયા. નાયક પણ, ‘થોડા હિન અમણ કરી પાણો કરીશ.’ એમ કહી નિદ્ધાર થયો.

વસુમતી કૌશામ્યીમાં ચાંદ્યા પછી તેણું જાઓ સમય થોભવાની જરૂર ન રહી. અમણ મહાવીરના વિહાર અંગેના સમાચાર અહો રેને રોજ આવતાં શતાનિક ભગીની જ્યાનિતાએ પ્રવન્નયા દેવાનો નિર્ધાર કર્યો હતો, તે માટેની એ ગોડવણ હતી.

પાલક માતાપિતાના સહ્યાસમાં ચંદ્રનાંએ ને હિતો પસાર કર્યા એ એટલી હુદે મીઠારાલ્યો થઈ પડ્યા કે જ્યારે એ દીક્ષા માટે વર અહાર નીકળી ત્યારે નાનાં મોટાં દરેકની ચક્ષુ ભીતી થઈ. માત્ર માતાપિતાને જ નહીં પણ વરમાંના નોકર ચાકર સર્વને પોતાનું કોઈ આપેજન ચાલ્યું જાય છે એમ લાગ્યું.

ધારિલુના સંરક્ષાર પામેલી આ બાળાએ જ્યાં જ્યાં પગ મૂક્યો ત્યાં ત્યાં ચંદ્રની માફક સુવાસ ને શીતલતા પાથરી ‘ચંદ્રના’ નામનું સાર્થકદ્વારા કર્યું હતું. એનું એવું યશનામ કર્મ હવે સંપૂર્ણ કળાંએ ખીલી નીકળ્યું હતું. વયમાં યુવાન છતાં ભલભલી પ્રૌઢાને પણ રૂપી જાય તેવી પ્રેરણ, જીન એને વર્તન હતાં.

સુદર્શન શેડ પોતાના કુદુરુંઘને લઈ ચંપા પ્રતિ નિદ્ધાર થયા. ધનાવહ રોઠ સાથે ચંદ્રના પણ વળાવવા સાર્થક ભાગોળે આવી હતી. ત્યાં જ કુતુમતિએ આવી રહેલા અશ્વારોહીએ સમાચાર આપ્યા કે—

‘કુજુવાલિકા નદીના કિનારે સ્થામાં ઐડૂતના એતરમાં અમણ મહાવીરને કુલજીનાન ઉપનયું છે.’

ચંદ્રના તો આ સાંભળી હર્ષધીલી અની ગાઈ. ચીર કાળ સંચિત

આશા ઈણી—ભીજે દિને સવારે જ ધામધુમ સહિત, સોના ને ડ્ર્પા જાણું, તેમજ ધાન્ય ને વલ્લો છુટા હાથે હાનમાં દેતી, દીક્ષા માટેના શ્રવેત વચ્ચોવાળા છાઅ માતુશ્રી મૂલાના હાથે રખાવી, પાલખીમાં એમી કૌશામ્ભીના બજાર વચ્ચેથી વાજતે આજતે નીકળી પડી. એ સરવરસને માર્ગમાં જ સમાચાર સાંપડ્યા કે ભગવંત સરિતા તટથી વિહાર કરી મહાસન વત્તમાં પહોંચ્યા છે. દેવાએ ત્યાં સમવસરણની રચના પણ કરી છે.

તીર્થ સ્થાપના કરવા સાડ તો આ સ્થાને પ્રભુએ પગળાં પાડ્યાં—પડતાંવેંત સાધન સામગ્રી તીયાર હતી. શકેન્દ્ર હિંય ચૂણની થાલ મંગાવ્યો. એ આવતાં જ પોતાના હાથમાં ધરી પ્રભુ સામે જિબો. પ્રભુએ સિંહાસનથી જિતરી, એમાંથી ચૂણું અહણું કરી, પ્રથમ ગણું ધર તરફે શ્રી ઈંદ્રભૂતિ ગૌતમના શિરે એ ત્રણ વાર નાંખ્યું. ‘ઉત્પાદ, બ્યય અને દ્વુત્ર’ ડ્ર્પ ત્રિપદી સંભળાવી—અનુકૂમે ભીજ દશને પણ ગણુધર પદ્ધતી આપી. સાધીમાં મુખ્ય એવું પ્રવતિનીનું પદ ચંદ્રનામાને આપતાં પૂર્વદત્ત વિધિ કરી. એ સર્વના ભરતકે પર્વિદા સમુદ્ધાયે અક્ષતોનાં વધામણું કર્યાં. આતક—શાવિકા વર્ગમાં એણિક દંપતીનાં નામનો હિન્દ્યાર કરી, ચતુર્વિધ સંધ સ્થાપ્યો. અને પોતાનું શાસન પ્રવર્તાંયું. ધન્ય એ દ્વિસ. ધન્ય એ વડી.

પ્રકરણ ર૩ મું

શ્રમણુત્વમ ધૃદમ રમણીયતરમ

નીતિવેતાએઓ કંબાણ વિચારણા પછી અમણજીવન યાને સાધુપણાને અતિ રમણીય દર્શાવેલું છે. એમાંજ નિર્ભયતાનો વાસ જોયો છે, અને એ જીવનનેજ માનવભવની સફળતા રૂપ ધૃદમ શખ્ષથી નામ પ્રમાણે ગુણવાળું સાધુ જીવન લેવાનું છે. જે ઇકીરી પાછળ લાલસાઓની જળ પથરાયેલી હોય, વ્યસ્નનાં તાંડવ મૃત્ય જામ્યાં હોય, એહીપણાના અખાડા રૂપ હોય. કે માત્ર કિયાડાંડની અજ્ઞાનતાપૂર્ણ રમઝર સર્જિંહ હોય, એને ઉપરની ઉપમા જરા પણ અંધાસતી નથી. પછી ભલે ને નામ સાંધ, જોગી, સંન્યાસી, જતિ કે સાધુ ના હોય. ટૂંકમાં કહીએ તો, રૂપ્ય વક્તા અવધૂત શ્રીમહ આનંદબનજીએ ગાયું છે કે—

‘ ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે;
ઉદ્દર ભરણાદિ નિજ કાજ કરતાં થકાં, મોહ નહયાં કલિકાળરાજે.’

તે વાસ્તવિક છે. જ્યાં એવી દશા વર્ત્તતી હોય ત્યાં રમણીયતા કેવી પ્રભાવિકતા કેવી? અને સુવાસ પણ કેવી?

રમણીયતાનો નાસ સંપૂર્ણપણે શ્રી તીર્થીકર હેવના જીવનમાં દિશિ-ગોચર આય છે. ગણુધર મહારાજા, તેમજ અન્ય સાંખુ ગણમાં, સાંખી સમુદ્દરમાં અધિકાંશે એ જેવાય છે.

ભગવંત મહાતીરે ડિડિમ નાદ્યી એવો મોદ્દનો સંદેશ ભારતવર્ષમાં વિસ્તાર્યો છે કે—

ધર્મ એ માત્ર સામાજિક રૂઢિ નહિ પણ વાસ્તવિક સત્ય છે. મોક્ષ એ સાંપ્રદાયિક આલ્ય ડિયાકાંડ પાળવાથી મળતો નથી પણ સત્ય ધર્મના સ્વરૂપમાં આશ્રય લેવાથી પ્રાપ્ત થાય છે. ધર્મમાં, મનુષ્ય અને મનુષ્ય વચ્ચેનો બેદ સ્થાયી રહી શકતો નથી. જન-મનુસ માત્રથી ધ્યાલણ એ ધ્યાલણ નથી અને ક્ષત્રિય એ ક્ષત્રિય નથી પણ કર્મથી—આચરણથી એ વાતની પ્રતિતી ગ્રાય છે. માનવ માત્ર મૈત્રો પ્રમોદ-કાર્યાલય અને માધ્યન્ય ભાગનાના જેરે પ્રભાતિ સાધે છે. એ માટે શાન-દર્શન અને ચારિત્ર રૂપ | ત્રવેણીમાં એને વારંવારે સ્નાન કરવું જોઈએ—અહિસાના પોકાર કરતાં, એ અંગેના સાચા અમદમાં જ પરમ ધાર્મિકતા રહેલો છે. ઉત્કાંતિના છદ્રમુકે અહિસાના—સત્ય—અસ્તેય—અલ્યાય્ અને અપરિગ્રહ રૂપ મહાન ગુણોને સ્વજીવનમાં ઉતારવા કરી કસવી જોઈએ.

ધર્તિહાસ નોંધે કે કે ચરમ લીર્ધપતિના ઉપરનો સંદેશ ભારત વર્ષના સાડા પચીસ આયદીશમાં અર્થાત् મગધ, અંગ બંગ, કાશી, કોશિય, વિદ્ધિ, વત્સ, સિંહુ, સૌનીર, કુણુલ અને લાટ આદિમાં ફેલાયો હતો.

રાજઅસીના અભિસાર યાને અણિદ્ધ, વેણાલીના ચેટકરાજ, કાશી - કોશિયના ગણુનાયકો, અમદાકદ્વાનો રાજીની ખેત, વીતભયપતનનો ઉદાયન, પોતનપુરનો પ્રસન્નયંદ, ખતાનિક, ચંદ્રઘોત, શાલ-મહાશાળ-પ્રતિહિત અને પ્રિયયંદ તેમ દર્શાખુલન-મિત્રનાંનીને દા મળી લગભગ ચાણીય રાજીનીએ ભક્તાગણુની સુંખ્યામાં ગણુત્તા.

સંપદામાં યાને પરિવારમાં, અગિયાર ગણુધર સહિત ચૌદ
હજર સાંદુઓ, છત્રોસ હજર સાધ્વીઓ, એક લાખ ઓઝાણુસાઃ હજર
આપડો અને ત્રણું લાખ અદાર હજર સાધીઓની સંખ્યા હતી એ
વાતથી જ પુરવાર થાય છે કે અરિહંતપદ પાણ્ય પછી ભગવંતે
જીવનનાં શેષ વર્ષો અર્થાત ડૈવલ્ય પછીના ત્રીથ વર્ષો, જિન્ન જિન્ન
પ્રદેશમાં વિચરવામાં અને જીવોને પ્રતિઓધવામાં ગાળ્યાં હતાં. શહેરમાં
પાંચ રાત્રી અને જામમાં એક રાત્રી વસવા ઇપ સમાચારીમાં મુનિ-
જીવન કેવું પ્રવાતિશીળ હોવું જોઈએ એનો પ્રતિતી મળે છે. સાથેસાથ
એ પણ અનુમાની શક્ય છે કે આટલી વિપુળ સંખ્યામાં જે નર-
નારીઓનાં હૃદ્યકંભળો વિકસવ થએ, જીવન દીપ બ્યોતિર્મય બન્યો છે
એમાં મુખ્ય શિષ્યોનો અને પ્રવર્તિની ચંદ્નાણાનો ફોળા નાનો
સુનો ન જ હોય. ભગવાનની અસરકારક વાણી સાંભળને જેમને
વૈરાગ્ય જન્મતો, દીક્ષા લેવાનાં પરિણામ પેદા થતાં, તેમને પ્રલું તો
માત્ર એટલું જ કહેતા હૈ—

માતાપિતા કે વડિલ સ્વજનને પૂછીને આવો પ્રમાદ ન કરશો.
પરિણામની ધારા ચઢ્યી જ રાખજો. એ રીતે જેએ આવતા, તેમને
દીક્ષિત બનાવતા. પછી પુરુષ હોય તો સ્થવીર સાંદુઓને અને ખી
હોય તો પ્રવર્તિની ચંદ્નાને એની સુપરત થતી. પ્રલુનાં પચ્યો તો
જમીનમાં થી વાનણીનું કામ કરતાં. એ પછી જળસિંયન આદિથી
સાંભાળ ભરી રીતે નાનકડા થીજમાંથી છોડપણે પરિણામવા ઇપ
અર્થાત આવનાર આત્માએ ઉપર ત્યાગ જીવનનું સાચું ને સચોટ
સંરક્ષાર નાંખવાઇપ કાર્ય તો મુખ્ય શિષ્યો યા તો ચંદ્ના સાધ્વીના શિરે
રહેતું. શરીરાતનો એકડો ધુંટાવનારમાં-પ્રારંભમાં કંજો શિખવનારને
કેવા કેવા સંયોગોમાંથી પસાર થવું પડે છે એ તો અનુભવનો વિપ્ય
છે. સંસારના સ્વૈર વિહારમાં ઉછરેલા જીવો પર સંયમની કૌરલ
જમાવવી એ કપરી કસોટીભર્યું કામ લેખાય. એમાં પણ મરદ કરતાં

એારતના વ્યવહાર-વર્તનમાં તરતમતાએ! ધણી ધણી. એ સર્વેને તરી પાર કરનાર સાધી ચંદ્રનાણા જેમ રમણી રતન તરીકે પ્રકાશી જિડ્યું હતું, તેમ શ્રમણ જીવનમાં પૂર્ણ પણે જગડી રહી, કોહિનુર તરિકેની શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી એ તરફ મીટ માંડીએ-પાંચસેંસ સખીઓના પરિવારે શોભતી પ્રિયદર્શના, શ્રેણીક નરેશની સંખ્યાઅંધ રાણીએ, દેવાનંદા ખાલણી, સતી મનોરમા, ચંડપ્રથોતની અંગારવતી આદિ આઠ રાણીઓ, જ્યાન્તિ, મૃગાવતી વિગેરેનાં જીવન ઘડતરમાં ચંદ્રના સાધીનો ફોણો નાનો સૂનો નથી. શાસ્ત્રોમાં એ અંજેના ઉલ્લેખ વિખરાયેલા પડેલા હોવા છતાં તેજસ્વી મલિન્કલિંકાઓસમ શોખે છે. અહીં તો એમાંના એકાદ એ પ્રત્યે દર્શિપાત કરી સંતોષ માનવો રહ્યો.

અંગ દેશની ચંપામાં, રાજ્યી કરકંઈના આશ્રમભર્યો આમંત્રણુથી પદ્મારી, જ્યાં બારમા તીર્થપતિ શ્રીવાસ્પુન્ય સ્વામીનો થુબ (સ્તૂપ) હતો. એ ઉદ્ઘાનમાં બહુ ધામધૂમ પૂર્વક-સુદર્શન શેઠ અને સતી મનોરમાને સ્વરણસનમાં દીક્ષિત કરી પ્રશ્ન મહાવીરે કૌશામ્ભીમાં પગલાં પાડયાં હતાં. નગર અહાર આવેલ ચન્દ્રાવતરણ ચૈત્યમાં તેઓશ્રીનો ઉતારો હતો. ચંદ્રના પ્રમુખ સાધી સમુદ્દરશી શહેરની વસતીમાં પ્રભુના આગમન પૂર્વે આવી ગયો હતો.

કૌશામ્ભી પતિ શતાનિક એકાએક અતિસારના રોગથી ગુજરી હતાં, આળક ઉદ્યતની અલ્પ વય હોવાથી રાજ્ય કારભાર રાજમાતા મૃગાનતીની સદ્વાહથી પ્રધાનો ચલાવતા હતા.

ગ્રલુ વંદન નિમિત્તે રાણી મૃગાવતીએ, એની નણુંદ જ્યાન્તિએ રાજ પરિવારના જુલુસ સહિત ચંદ્રાવતરણ ચૈત્ય તરફ પ્રયાણ કર્યું. નગરવાસી પ્રજાજનો એમાં જોડાતા ગયા. સરધસ સમવસરણુની ભૂમિએ આવી પહોંચ્યું, ત્યારે ત્યાંનો દેખાવ માનવના મહાસાગર સમ થઈ ગયો. ભગવાન મહાવીર દેવે પર્ષદામાં સૌ કોઈ સમજી શકે એ રીતે આત્મશ્રેષ્ઠને ફેન્ડમાં રાખ્યા ખમોપહેણું દીખેટ સભાજનો પણ કોઈ

જાતના આક્ષેપ કે કટાક્ષણિહૃણી મધુર વાણી સાંભળી સંતોષ પામ્યા. યદ્યારાંકિત બત પચ્ચાણુ ગ્રહણ કરી પોત પોતાના ઘરના માર્ગ પાછા કર્યા.

સલા વિસર્જન થયા છતાં જ્યાનિત આવિકા પરિવાર સહિત થોભી હતી. અનસર જેઠ તેણીએ નિમ્ન પ્રકારે ધર્મચર્ચા શરૂ કરી.

ભગવન ! જીવ ભારે કર્મપણું શાથી પ્રાપ્ત કરે છે ?

આવિકા ! જીવહિંસા, અસત્ય વચન, ચોરી, અખલાચર્ય, અને પરિષહ આદિ અદાર પાપરસ્થાનકોના સેવનથી જીવની સ્થિતિ ભારે કર્મપણાની થાય છે અને એથી મનુષ્ય-તિર્યંગ, દેવ ને નારકી રૂપ ચાર ગતિમાં લાંબા કાળ સુધી બ્રમણ કરે છે.

ભગવન ! મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા જીવોને સ્વભાવથી પ્રાપ્ત થાય છે કે અવસ્થાની વિશેપતાથી ?

જ્યાનિત ! એ જાતની યોગ્યતા, જેને ભવસિદ્ધિ કહેવામાં આવે છે. તે સ્વભાવથી હોય છે. એમાં અવસ્થાની ચાંચ બૂડું નથી.

ગાંગડુ કણુની માર્ક અભય જીવ કદી પણ શીવ સુંદરીના પ્રાસાહની સીડી ચઠી શકતો નથી.

ભગવન ! જે જીવા ભવસિદ્ધિ હોય છે તે સર્વ શું મોક્ષગામી છે ?

હા, જરૂર એ જીવા મોક્ષ જવાના. એમાં શંકા જેવું નથી જ..

ભગવન ! જે એ પ્રમાણે સર્વ જીવાની સિદ્ધિ થઈ જશે તો કાળાન્તરે આ સંસાર ભવસિદ્ધિ જીવોથી રહિત નહીં બને ?

નહીં, જ્યાનિત ! એવું બનવાનું નથી. જેમ આકાશપ્રદેશની શ્રેણીમાંથી પ્રતિ સમય અદેક પ્રદેશ કરી કરવાની કદ્યના કરીએ છતાં. એ પ્રદેશોનો અંત આવતો નથી, તેમ અનાદિ કાળથી ભવસિદ્ધિ જીવા. મોક્ષ જવા છતાં સંસાર ખાલી નથી થયો અને નથી થવાનો. ‘અનંત’

શણ્ઠ પાછળનો ભાવ વિચારી લે. અનંતાનંત હોવાથી સંસાર કદી પણ મોક્ષગામી જીવો વળરનો બનનાર નથી જ.

ભગવન્ ! જીધવું સાંડ કે જગવું સાંડ ?

આવિકા ! કેટલાક જીવોનું જીધવું સાંડ અને કેટલાકનું જગવું સાંડ.

ભગવંત ! એમ કેમ હોઇ શકે ? બન્ને વાતો સારી કેવી રીતે જણ્યાય ?

શતાનિંદ્ર સ્વસા ! એમાં આશ્ર્ય કંધ જ નથી. અધમ્બ કરવાવાદા, પાપમાર્ગ પોતાની જવિકા ચલાવવાદા, સદા કુકર્મમાં રક્ત રહેવાવાદા જીવોનું જીધવું સાંડ છે, કેમકે તેઓ જ્યારે નિદ્રા લેતા હોય છે ત્યારે ઘણું પ્રાણીઓની ડિંસા થતી અટકી જય છે, અરે બહુ જીવો તેમના ત્રાસમાંથી બચી જય છે. પણ જેઓ ધર્મમાર્ગ ચાલનારા, પરનું કલ્યાણ કરનારા, પવિત્ર આચરણવાદા હોય છે તેઓને મારે નિદ્રા પ્રમાદઃપ હોવાથી હાનિકારક છે. તેઓ જગૃત હોવાથી સ્વ પર ઉપકારી બને છે. અન્યને ધર્મનો રૂઢ બતાવી નિર્ભયતા અર્પે છે.

ભગવંત ! જીવોની સથળ દશા પ્રશંસા પાત્ર કે દુર્જણતા ?

આવિકા ! જે નિયમ જીધતા-જગતાને લાગુ પાડ્યો તે જ અહો પણ ઘટાવી લેવો. એવી જ રીતે સાવધ દશા અને આળસ આદિ દહોનું સમજી લેવું.

ભગવંત ! અગણું ઈટિયને વશ પડી પ્રાણી કેનાં કર્મ બાંધે છે ?

જ્યનિંત ! અગણેંદ્રિયના પાશમાંઝસાઈ પ્રાણી આયુષ્યકર્મ છોડી, શાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, નામ, ચોત્ર અને અંતરાય ઝપ સાત કર્મપ્રકૃતિયેનો બંધ કરે છે. પૂર્વે બાંધેલા શિથિલ કર્મોને દદ કરે છે અને અદ્ય સ્થિતિને જાગીમાં પહ્યી નાખે છે. આ રીતે કર્મોની સ્થિતિ લંબાવી ચાર જિતિરૂપ સંસારનું ભરમણું વધારી મૂકે છે.

ભગવન् ! જો અવણુ દૃદ્રિયનો વિકાર આવું ચિત્ર જન્માવનાર હોય તો, ચસ્તુ, નાસિકા, જિહ્વા અને રૂપર્થનું શું કહેવું ?

આવિકા ! એ દ્વેકમાં ઉપરની જ રીત અવધારવી.

જ્યનિત હાથ જેરી બોલી ઉડી—

આવા દારણુ સંસારથી હવે સર્યું.

ભગવન् ! કૃપા કરી મને આપના બિક્ષુણી સંઘમાં દાખલ કરો. ઉદ્ધારનો એ એક જ માર્ગ છે.

ભગવંત મહાવોરે વિહુણી જ્યનિતની પ્રાર્થના સ્વીકારી, તેણું ને સર્વવિરતિ સામાયિકની પ્રતિજ્ઞા કરાની, પંચ મહાવતતું સર્વપસુમળવી, આવાવા પૂર્વક એ ઉત્ત્યરાધ્યા અને સાધ્યી વંદનાને શિષ્યા તરિકે સેંપી.

કૌશાભ્યીમાંથી વિહાર કરી, વત્સભૂમિના પ્રહેશને વીધતાં તીર્થ-પૂતિ શ્રી મહાવીર ‘સવિ જીવ કરું શાસન રસી’ એ ભાવનાની પૂતિ. અર્થે આગળ ઉત્તર કોશલ તરફ વિહરવા લાગ્યા.

આ પ્રકારના વિહારમાં જ ભગવંતના ચુસ્ત ઉપાસક તરિકેની ઘ્યાતિ પામેલા-પિશાળ સમૃદ્ધિ હોવા છતાં બાર પ્રતોને ભાવપૂર્વક અહણુ કરી, નિરતિયારપણે પાળતા દશ શ્રાવકો જુદા જુદા સ્થળની દેશનાથી બોધ પામીને થયા. એ ઉપરાંત અન્ય તત્ત્વવૈધીઓ જુદા જુદા દર્શનના પંડિતો, પરિવાજકો અને તપસીઓનો યોગ સાંપડ્યો. એ જાણવાની ઈચ્છાવાળાઓ શ્રી ભગવતી સૂત્રના, શ્રી ગ્રાતા સૂત્રના, શ્રી ઉપાસક દશાનાં વૃતાન્તો વાંચવા અથવા તો ‘વર્ધમાન દેશના’ અને અમણુ ભગવાન મહાવીર નામા પુસ્તકોનાં પાનાં ફેરવવાં, અમર તો કલિકાળ સર્વર્ગ શ્રીમદ્ હેમચંદ્ સૂરીશ્વર રચિત ‘ત્રિપણિ શલાકા પુરુષ ચરિત્ર પર્વ’ દરમણ વાંચી જલું. અહીં તો પ્રભુની મીઠી ગિરાના.

આજાં છાંટણું માત્ર છે. એ પાછળની બેરી છાંટ, સાચી જમાવટ
અને પૂરી પ્રભાવિકાનાં દર્શન તો ઉપરના અંદોમાં જ વાધરો.

નામિન! આપ આજા આપો તો હું પાટલીપુત્રની દિશામાં
વિહરવા, થક્કિન અનુસાર ધ્યાન ધરવા અને આવી પડતા પરિષહેં.
સમતા ભાવે સહન કરવા, આપનાથી જુદો પડવા છદ્મા રાખું છું.
સાધુ સુદર્શને, પ્રભુને વંદન કરી પ્રરતાવ મુક્યો.

ત્રિકાળદર્શી ચરમ તીર્થપતિને કૈવલ્ય જ્ઞાનરૂપી અનુપમ પણ
પ્રાભ થયેલું હોવાથી નહોતી જરૂર ઉપયોગ મુક્વાની, કે નહોતી
જરૂર શિષ્યની વાતપર વિચાર કરવાની. ભૂત-ભાવ અને વર્તમાન
તેઓઓની ચક્ષુઓ સામે નાયતાં જીલા હતાં.

પ્રિય શિષ્ય, ત્હારી આ છદ્મા દદ છે? ભારી ઉપસર્ગો સહન
કરવાની તૈયારી છે? છદ્મસ્ત આત્મા છો એટલે જ આ પ્રશ્ન છે.

ભગવંત! આપ તો મારા અંતરના ભાવને સારી રીતે જાણો છો.

તો સંભળ, એ પ્રદેશમાં ગરણુંત ઉપસર્ગ થશે. ધ્યેયમાં
નિષ્ઠાની ધારણુ કરનો. બેડો પાર થશે. મારી આજા છે જ.

ગ્રનો! હું પણ એ પ્રદેશમાં જ વીચરવા ચાહું છું.

સાધુ સુદર્શને આજા આપી રહેવા શ્રી મહાવીરનાં ચરણમાં
વંદન કરી પ્રવર્તિની ચંદ્ના સાધીએ પ્રાર્થના કરી. ભગવંત કંઈ
જવાબ આપે તે પૂર્વે જ એક વિનિત શિષ્યા તરીકે એ પાછળનો હેતુ
કહી સંભળાત્મવા વાણી ચાલુ રાખી.

‘કુમારી મહાદ’થી પાછા વળતાં જ ને વ્યક્તિએ મારા જીવનમાં
સેનેરી રંગ પૂર્યો છે એ ‘નાયક’ પાટલીપુત્રના પ્રદેશમાં જ વસે છે
એવા સમાચાર મારા કાને જાવ્યા છે. એકજ તમના છે કે ત્યાં
જવાથી મેલાપ ચાય તો એ વૃદ્ધના આખરી જીવનને સંયમ માર્ગનો
તોક આપવેટ

પવિત્ર શીળા, પજ્જાવતી સાધ્યોનો એજ સંપદ્યા છતાં, અરે ધ્યાન મળું દશામાં રહેતા દધિવાહન રાજ્યિનો સમાગમ સેવ્યા છતાં એ માનવીનાં અંતર્સ્યાક્ષુ પૂરી રીતે ખોલવા ન પામ્યા ! હૃદ્યની કોઈ છૂંપી તૃષ્ણાએ આખરી મંદ્વાડમંથી ઉઠ્યા છતાં, એ પુનઃઅકાકી ભ્રમણું કરવા નીકળા પડ્યેટ હું ઉત્તાપણમાં હોવાથી એ વેળા એના હૃદ્યમાં રમતા કોકડાને ન તો ઉકેલી શકી કે ન તો એને વિદ્ધાય લેતાં અટકાવી શકી.

ભગવંત પાર્વતિનાથના અમણુ અમણીએ એટલે સાક્ષાત્ પવિત્રતાનાં મૂર્તિમંત સ્વરૂપો ઉપહેશથી રંચ માત્ર આગળ ન જય આદેશ દેવાના કાર્યથી હોઠ ગાજ હુર જ્યા ! એ નાયકને કોઈએ અટકાયત સરખી પણ ન કરી. પ્રવર્તિની સાધ્યી નિર્ભય દર્શનનો એ જ ઘેરી માર્ગ. તમારા શુભ આશ્ચર્યમાંથી પણ વાળનાની જરૂર નથી. એ દિશાના વિહારમાં કુચ પ્રાતઃકાળે જ આગળ વધે.

પ્રકરણ ૨૪ મું હૃદય પદ્ધતા એજ લુચન પદ્ધતા

અરે ! આમ દોડતી પાઢી કાં આવી ? આઠલી હાંડે છે શું !
ઉત્તાવળે પગથિઅં ચઢી એટલે ખાસ ભરાય જ ને ! એમ
જવાબ દેતી પંડિતા બોલી કે—

નસીબ ચાર ડગલાં આગળનું આગળ જ ! વિધાતા જરૂર
આપણું ઉપર રહ્યા છે ! ‘ધરના ઊઠાયા વનમાં ગથા, તો વનમાં
લાગી આગ !

અરે પણ ! આમ ઉટપટાંગ શું લવે છે ? વાત શું બની છે—તો તો
કહે, જેવા પડશે એવા દેવાશે. લાજ-શરમને તો ખંખેરી નાંખીને
ઝુંકાવ્યું છે હવે ચિંતાનું શું પ્રયોજન છે ? આ કંઈ અંગેશનો હદ્દનું
શહેર નથી કે જેથી આપણું કોઈ દબડાવી જય ! બાકી તો રાજ-
મહેલ છોડચા ત્યારથી જ વિધિ તો વંકાઈ એડો છે ! એક ખાસ
શુંગાવા જતાં હજાર ખાસો ઉંદસવી છે. એ શરે એવી આશાનું એક
પણ કિરણ મને તો જણાતું નથી. આજે ગુમડે જાણી પીડા ! એનું ફુઃખ

ધરવા જઈએ તો આરો ન આવે. તહારી હાંડ શમી છે તો જરા ઠંડકથી કહી સંભળવ કે અન્યું છે શું ?

રાણીજ ! ચંપામાંથી ભાગી છૂટચા, અને અંભેશની હદ ઓળંગી જતાં આપણુને ઓછાં વીતક નથી વીત્યાં. ભૂખ, તરસ, ઉનિગરા, થાક અને એ ઉપરાંત પકડાઈ જવાની ભીતિ ! માંડ એમાંથી સાંગોપાંગ છટકી સહીસલામતબયો કલિંગ દેશમાં પેહા. સારા નસીબે હાથમાં પેલો ધનવાન સરદાર આવ્યો. એનો શિકાર કરી ધનમાલ ખંખેરી લઈ, દૂર જાડીમાં ફેંકી દઈ, મોકલા હૃદયે મરધના. આ મહાનગરમાં આવ્યા. મન જમતો આ મહેલ ખરીદ્ધો અને હવે મન-જમતા વિલાસ માણુવાની મોજ આવશે એવી સ્વપ્ન ચુષિમાં વિચરતા જ્યાં માંડ હાર પડ્યા, ત્યાં તો પુનઃભય ઝડુમી રહ્યો.

પેલો સુદર્શન શેડ સાધુના સ્વાંગમાં અહીં આવેલ મેં નજરે જોયો. તમો ઝડ્ઝામાં જીભા હતા, નજર તરફ જઈ રહેલા એ સાધુની દિશિ ઝડ્ઝા તરફ જ હતી. ચંદ્રોના હલનયલનથી ફું ખાત્રીપૂર્વક કહી શકું છું કે એ તમને ઓળખી જયો છે. કાલ સવારે હજરો નગરવાસીઓ એ સંતનો ઉપદેશ સાંભળવા વનખંડમાં ભરાશે. એ વેળા આપણી લીલાના પડદા જીયકાશે. નજરમાં હડધૂત બની, કયાં તો પકડાવું પડશે અથવા તો ભૂંડા મોતે યમરાજના અતિથિ થવું પડશે. એ શહેરમાં જોયરી અર્થે ગયેલ છે. માંડ મન પોકારે છે કે સવાર પડે તે પૂર્વે આ રીતે એકાએક કૂટી નીકળેલા શત્રુને જીએડી નાંખવાનો ઉપાય કરવો જોઈએ. તેથી જ ફું લીધેલું કામ પડતું પૂછી, હોડતી પાછી આવી છું.

સખી પંડિતા ! આખરતું લીલામ થયા પણી, અને ધર્મસત અણુદ્ધણવાના કારણે મારા સરખી રાજપૂત રમણુને મરણુની કંધ જ ભીતિ નથી. ભલે રાજકર્મચારીઓના હાથે પકડાઈ, શળાના

માચડે ચઢવા વારો આવે. કૂતરાની ચાટ જેવું જીવન ગાળવા છતાં
મુત્ર મુખ દર્શન તો થયું નહીં! વંધ્યા મહેણું તો ટલ્યું નહીં!

ઓછ ! બા, તમો તો શું એવાંતા હશો ! આંબા કંઈ એક
રાતમાં નથી પાડતા. હજ કંઈ વૃદ્ધત્વ ઉઠયું નથી. લાંબો નિરાશામાં
જ અમર આશાનો વાસ છે. મારા જેવી પંડિતા પાસે હોય અને
એવી અપભ્રાજના થાય એ હરગીજ નહીં અને.

કાળા માથાનો માનવી શું નથી કરી શકતો. ‘ દામ કરે કામ ’
એ તો જણીતી કહેવત છે. સુદર્શનરંપી કાંટાને જીએડવો એમાં તે કુઈ
મુશ્કેલી છે ? અહીં આવતાં જ મેં ઉપાય વિચારી રાખ્યો છે. હું
એની તૈયારી કરવા માંડું છું. મધ્યરાત પૂર્વે વનખંડમાં જવા તૈયાર
રહેણે.

રાણી અભયાના મનમાં રોટ જેવા પવિત્ર આત્મા ગ્રત્યે પોતાની
આશા ન પુરવા બદલ વૈર જગ્યું હતું. છતાં હવે એ જ્યારે મુનિવેશમાં
છે ત્યારે એનો ધ્રૂપી રીતે ધાત કરવો એ હૃદયને જરા પણ ગમ્યું
નહીં છતાં ડંસીલી નાગિણી સભી થાલણું પંડિતાના પાસમાં એ
એટલી હેઠ સપદાઈ હતી કે ન તો વિરોધ કરી શકી કે ન તો તેણુંને
તેમ કરતાં અટકાવી શકી.

અડ્યામાં ચાલતો આ રમણીએ વર્ણને વાર્તાવાપ જ્યાં પૂરો થવા
આવ્યો ત્યાં સુદર્શન સાધુ શહેરમાંથી પાછા કરી વનખંડના માર્ગે
જઈ રહ્યા હતા. તરતજ આંગળી વતી પંડિતાએ રાણી અભયાને
બતાવ્યા. ઉભય રમણીએ ચહેરાપર રિમિત રેખાવતી એમની પૂંડ
પાછળ જોઈ રહી હતી.

પ્રાસાદ સામેના મુસાફરખાનામાં તાજ આવેલા એક પથિકની
નજરે ઉપરનું દસ્ત્ય અચાનક પડ્યું. તે પણ અરખાપ્રતિ મીંટ માંડી
જેવા લાગ્યો અને આનંદમાં આવી બોલી ઉઠ્યો. ‘ હાશ ’ આખરે.

મહેનત કળો. પીઠ પાછળનો ધા કરી જનારી એ રમણીઓનો પતો લાગ્યો ખરો. '

લલના યુગલની હાસ્યભરી ચેપ્ટા ઉપરથી એણે અનુમાન કર્યું કે વનખંડ તરફથી જનાર સાંધુ સાથે આ નારીઓને જરૂર કંઈ રોહ અંધન છે. પવિત્ર લેખાશ હેઠળનો ધૂપો અનાચાર ચાલતો હોય તો એ ઉદ્વાડો પાડવો જોઈએ કે જેથી આમ જનસમૂહ ઢાંગીઓના હાથમાં ઇસાય નહીં. તરતજ કમરામાં જઈ, ડગલો ચાદાવી, માથે ફેટો મૂકી એ વુનખંડની દિશામાં નીકળો પડ્યો.

જયણું પૂર્વક, માર્ગ ડગ ભરતાં સુદર્શન મુનિએ વસ્તીમાં આવી દેહ પરનો અંચલો જ્યાં ઝીઠીપર ભરણ્યો અને આહારના પાત્રો ભૂમિ પ્રમાર્જને મૂકી ધર્યાવહી કરવાની તૈયારી કરી, ત્યાં તો પેલા મહાશય આવી પડોંચ્યા.

મુનિના ચહેરા પર નજર પડતાંજ ચમકી ગયા !

અચાનક ઉચરી દેવાચું—આતો પેલા સુદર્શન શેડ !

હં, તમે નાયક, અહીં કયાંથી ? મારા વેશથી ચમકતા લાગો છો.

પણ મેં ‘કુમારી પહાડ’ પર બધાની વચ્ચમાં વાત કરીજ હતીને કે મારે પ્રત્રન્યા લેવી છે. હવે હું તે કણનો શેડ નથી રહ્યો—સુદર્શન-નામા સાંધુ છું.

મુનિરાજ ! આ પવિત્ર વેશ તો માર્ગ જીવન, માર્ગ આણ્યું છે. એથી મને ચમકવાપણું નજ હોય. એ પાછળ વાત બીજી જ છે. આપ જોયરી લઈ પાછા કરી રહ્યા હતા, ત્યારે આપની પાછળ મારા ઉતારા સામેના મકાનના જરૂરામાં જિલેદી એ પ્રમદાઓ હાસ્યથી મ્હેં મલકાવી હૃદલીક વાર સુધી જોઈ રતી હતી. એટલે મેં ધારી લીધું હે આપ એ મકાનમાંથીજ જોયરી લઈ પાછા કર્યો છો. અને આપની સાથે તેઓને

કંઈ સ્નેહ સથંધ છે. પવિત્ર અંચલા હેઠળ આવું કોઈ કોઈ વાર ચાલતું હોય છે. તે દ્વારા કરવાની વૃત્તિથી હું અહીં દોડી આવ્યો.

પણ આપને જેયા, અને એણખ્યા. તરતજ મારી એ શંકા નાશ પામી. આપ તો શુદ્ધ કુંદન જેવા છો. મેં વગર વિચારે સંકા સેવી એની માહી ચાહું છું. રમણી યુગદાની હાસ્ય ચેષ્ટાનું કારણ કંઈ બીજું સંભવે છે.

નાયક ! એમજ હોવું જેધેએ. પાટલીપુત્ર નગરમાં ગોચરી અચ્છે જઈ રહેલ હું, જરૂર એના મકાનો તરફ મારા નેત્રો ફેરનો હતો.. વળી માર્ગ તરફ નીચી નજર પણ કરતો હતો. બાકી મેં કોઈ નારી-ખુભલ તરફ ખાસ દર્શિ ઇંકી નથી તેમ બહારના કોઈ આવાસમાંથી આહાર આણ્યો પણ નથી.

મહારાજશ્રી ! આપની વાત સાચી છે. એ રમણીએને હું એણખ્ય છું. ત્યાં પહોંચવાથી ખરું કારણ જણુશે. આવતી કાલે તે ઉભયને તેડીને હું આપની પાસે જરૂર આવીશ.

નાયક પાછો ઇરી મુસાફરખાનામાં આવ્યો. અને જરૂરી કાર્યોથી પરવારી જ્યાં સામેના આવાસમાં જવાતી તૈયારી કરે છે ત્યાં સુખ્ય દાર પર માત્ર પહેરેગીરને એડેલો જેયો; જ્યારે ઉપરનાં ભારી આરણું-સર્વ અંધ દીહાં. એણે અનુમાન કર્યું કે ઉભય લલનાએ કોઈ કાર્ય પ્રસંગે બહાર જઈ હશે, માટે હવે રાત્રિનાજ મળવાનું રાખવું. બપોરનો કુરસદ્દો સમય નગરમાં ફરવામાં વ્યતીત કરવો. નિશ્ચય કરી તે પાટલીપુત્રના બજર માર્ગ નીકળી પડ્યો.

અભયા અને પંડિતા વચ્ચે ને વાત પૂર્વે થઈ હતી તે અનુસાર, પંડિતાએ સુદર્શન મુનિ રાત્રિના કાર્યોત્સર્જમાં હોય ત્યારે ઉડાવવાનો. અને નિખિલ સ્થાને આગમાં ભર્મ કરવાનો. તાક્કો ગોઠવ્યો. એ સાર માણુસો, લાકડાં, તેમજ અનિ જલ્દીથી પ્રનવલી ઊઠે તેવાં રાળ લાખ,

થી આદ્ય પદાર્થો એ સ્થાનની સમીપમાં છૂપી રીતે ગોઢવી પણ દીધા અને પોતાની યોજના ડેવી સંચોટ છે એ ખતાવવા સાડું સતતર પાણી કરી, રાણી અભયાને તે સ્થાન તરફ લઈ ગઈ. મહેલના ઉપરના કંઈરાનાયકે બંધ જેવા હતા એનું કારણું પણ તેજ હતું.

‘લિખિતમણે લલાટે શ્રોદ્ધિતુમ् કઃ સમર્થः’

એ વચન ટંકાશાળી છે. મુનિ સુદર્શન ખપોરની જોગરી પણી અધ્યયન કાર્યમાં થોડી ઘટિકાએ વ્યતીત કરી, સંધ્યા આવસ્યકથી પરવારી, વનખંડના એકાંત પ્રદેશમાં ધ્યાન મળન થતા સાડું કાયોત્ત્સર્જમાં જીલા. સંચારો કરતાં પૂર્વે સમરણું કરવાની જાથાએ હૈનિષ્ટ કમ અનુસાર ભણ્યા. પણ જ્યાનમાં લીન થયા હતા, છતાં આવતી કાલે પ્રાતઃકાળ પોતે જેવા નથી પામવાના એવે જ્યાલ સરખે પણ આવ્યો ન હોતો. છદ્રરથ આત્મા, વિધાતાના કરતૂક-કર્મરાજના પ્રપંચ ક્યાંથી અવધારી શકે !

શહેરમાં કુરવા નીકળેલા નાયકના હૃદયમાં ધારણા હતી કે રાત્રે નિરાંતરી રમણીયુગલને મળી, ભૂતકાળ ભૂલી જઈ, આ પાપી જીવનમાં છેલ્લા ઘડીયે સુવાસ પમરાવવા,—પરભવ સુધારવા—કાર્યશીલ જીવના સારુ તેમને સમજલવી, સવારના સુદર્શન મુનિના વંદન અર્થે સાથે જવું અને નિયમ લેવો.

પણ ‘સુઘટિતાનિ જર્જરી કુરુતે’ સ્વભાવી વિધાતાએ જુહોજ ભાગ ભજવ્યો. ‘તૂટ્યા મારા તંખુરાના તાર, ભજન અધૂરાં રહી ગયાં’ જેવો ધાર થયો !

નાયકને શહેરમાંથી પાછા કુરતાં વધુ વિલંબ થયો. નગર બહારના આ પ્રદેશમાં લગ્નલગ મીઠા ભાગનાં મડને બંધ ચુક્યાં હતાં. ક્રોધ ક્રોધ આવાસના ખીંચ ત્રીજા મજલાના એકાદ ઓરડામાંથી રસ્તા પર પડતો પ્રકાશ, અને હીક હીક અંતરે બળતા દીપકો, માર્ગે

જનારા માટે ભોગ્યાનીજ જરન સારતા. આગ્રી અવર જીવર પણ હવે નહોંતી રહી.

ધ્રિષ્ટિન કાર્યની સિદ્ધિ અર્થે જચાં આવાસ આંગળ આવી પગથિયાં ચઢવા માંડે, ત્યાં તો દરવાજે ડિલુંયો. અને પેલું રમણી ચુગલ શુરખા એઠાં બહાર આવ્યું. રસ્તાપર જિબેલી થોડાગાડીને દરવાજે પહેરેગીરે ખોલ્યો હતો. એઠલે તુરતજ અંદરની બેદકમાં એસી જઈ પહેરેગીરને આવાસ સાચવવાની ભવામણુ કરી. તરતજ ગાડી હંડાવી મેલી !

આ બધું એટલી જડપથી અની અથું કે નાયક તો કિંકરંધ્યમુદ્ર અની અથો ! પ્રથમ તો આ શી ધમાલ છે અથવા તો આટલી મોડી રાને આ લખનાઓ કયાં જાય છે એની કંદળ સમજ ન પડી. ગાડી ને દિશા તરફ હોડી જઈ હતી એ તરફ દર્શિ હેંકતાંજ સતરાને અનાવ તાજે થયો. તરતજ અંકોડા સંધાવા લાગ્યા.

એ તો વનખંડનો માર્ગ, સુદર્શન સાધુની વસતી એ તરફ. જડખામાં મધ્યાન્હે આ નારીઓનાં નેત્રો પણ એન્જ દિશામાં દોરાયેલાં; જરૂર દાળમાં કાળું છે !

નાયક પણ હવે એ દિશામાંજ આગળ વધ્યો. પગલાંની જડપ વધારી. અથવ જાડીને પકડી પાડવા પ્રયત્ન કર્યો, પણ તેજુ તુખારની જતિને, માંડ મંદ્વાડમાંથી ઉઠવા પામેલો તે પહોંચી નજ શક્યો !

ભગરંત વચન મિથ્યા ન થયું. નિષ્ઠુર હંદ્યની આ કામિનીએ વનખંડની વસતીથી થોડા અંતરે આવેલા એકાંત સ્થળમાં આવી પહોંચી ત્યારે ત્યાં ડેવલ અંધકારનું સાંબાન્ય પથરાયું હતું. દૂર શિયાળવાના અરાજ અને આકાશમાં ડોઢ પાંખો ફૂલાવી ડિડતાં પક્ષીઓના સાંદ સિવાય સર્વત્ર નિરવતા હતી. એક તરફ વેદિકા નેવું ભનાવી લાકડાં ચોકવી ચિતા તૈયાર કરી હતી. દ્ર્ષ્પા પોશાકમાં

એક માનવી વનખંડની દિશા તરફ જોઈ રહ્યો હતો. ત્યાં તો ધ્યાનરથ મુનિને ઉપાડી લાવનાર માણસો આવી ગયા. ઝટપટ ચિત્તામાં મુનિને પંખરાવ્યા, અને પંડિતાનો આહેર મળતાંજ આગ સળગાવી દેવામાં આવી.

આત્મા અને દેહને બિન્ન માનનાર, આત્માની અમરતામાં ૬૬ શ્રદ્ધાવંત આ મુનિ તો ઉપસર્ગો સહન કરી મુક્ત બનવા જણી જુગીને નીકલ્યા હતા. એતો ધ્યાનમાં નિશ્ચળ રહ્યા. થોડા કાળમાંજ કાયા-ખળાને ભર્યું થઈ ગઈ.

નિર્બંધ બન્યાનો આનંદ માણુંતી, ચિત્ત પ્રતિ રાતી આંખે જોઈ રહેલી રમણીઓ. જ્યાં ઢોયમાનને હાંક મારે છે, ત્યાં તો નાયકનાં તેમની ચક્ષુ સામેજ પગલાં થયાં. ચિત્ત તરફ નજરે પડતાંજ તે કંપી જાણ્યો. અને ત્રાડ પાડી બોલી જાણ્યો.

ધિક્કાર છે નારી જતને ! લ્યાનત છે તમારા પદ્ધર જેવા ૭૩ હૃદ્યને ! પાપિણીઓ ! તમો રમણીના અવતારમાં સાક્ષાત્ ડાઢિનીઓ. છો ! રામજણીઓ – વેશ્યાઓ – પણ તમારા કરતાં ચેટે. તમો તો સ્નેહ કરનારને પણ જળો જનારી લોઢી તરસી ચંડિકાઓ છો. નિર્દોષ એવા મુનિના ઘાતમાં હાથ એળતાં પણ તમો ડરી નહીં ? તમોને ભવનો ભય નથી ? કર્મનો પણ ભય નથી ? પાપ હડકાયું છે, એ છાપરે ચઢીને બોલ્ય નિના રહેવાનું નથી.

પોતે જેને ઝાડીમાં ફેંક્યો હતો અને જેની લક્ષમીના જેર પર વર્તમાનની સંપત્તિ ખડી કરી હતી, એને એકાએક ચક્ષુ સામે જોતાંજ અભયા તો આલી બની ગઈ ! એતું અંતર કેટલાક સમયથી ડંખતું હતું. એ આવા ઉધામાથી કંટાળી મધ્ય હતી, છતાં સખીને કઢી શકતી નહોતી; કેમકે એજ એક આધાર ૩૫ હતી. પણ નાયકની ધર્મધરતા અંગારા જેવી વાળી સાંભળી પોતાના કુકૂર્યો. ૨૫૭ સ્વરૂપમાં જોતાંજ

એની ખાનદાની ઉભરાઈ આવી દોડી નાયકના પગમાં પડી, અને બોલી જિડી—

‘સ્વામી, આપાપિશ્ચીના ઉદ્ધારનો માર્ગ બતાનો, થયેલા દોષો માણ કરો.’

પંડિતા પણ સમજ ચૂકી કે હવે તો ખરાખર રીતે સાણુસામાં સરપદાયા છીએ. ધણુા વખતનું પાપ એકરૂં બની, એવા વિરાટ સ્વહૃપ્ત માં ખડું થયું છે કે હવે એ ઉપર ટાંક પિછોડા કરાય તેમ નથીજ. એ પણ બોળા પાથરતી નાયકના પગમાં ટળી પડી.

નાયકે એ ઉભયને સ્વસ્થ જવાનું કહી, પ્રથમ આ કાર્યમાં રોઢેલા માણુસોને ખુશ કરી વિદ્યાય કરવા જસ્તુંયું. એણે જેઠ લીધું કે આ ખરાખર સવારે રાન્ય દરખારે જવાની. એટલે ઉભય લક્ષનાઓ ગુનેભાર હટવાની. મુનિધાતના અંભીર ગુન્ધામાંથી એ બચવા નહીં પામે. એની આંતરિક છંઢા આમ ન થવા હેવાની હતી. હોછ પણ હિસાબે અભયા

સમનવી, સંત દખિલાહનની સભીપે લધ જર્દ તેણીનો ઉખાર કરવો એનું માત્ર હેતુ હતો. એ સાડ શરીર સ્થિતિ સારી ન હેવા છતાં એણે આ સાહસ ઘેડખું હતું. ભગવતી મૈયાના સમાજમથી પોતાના હાથે પરમાર્થનું એકાદ કાર્ય પણ નિપન્ને એવી ચીરકાળ સેવિત અભિલાષા હતી. વળી અભયાનું પાત્ર તો સંત મૈયા અને પોતાના એક વખતના સ્નેહભાજન રૂપ હતું, યોડા સમયમાંજ એણે એક તરકીબ વિચારી લીધી.

ઉભય રમણીઓને હિદેશી એ બોલ્યો —

આમરથુંત કષ્ટમાંથી પાર જિતવાનો મારી દખિયે એકો માર્ગ જણાય છે. હાલ ને સંપત્તિ તમારી પાસે છે એમાંથી ખપ પૂરતી ચાંચે રાખી, બાકીનીમાંથી જે રકમ ચોકખી રહે, એમાંથી મુનિ ચુદર્યાના. અનિ દાહસાને એક મનોહર સ્નૂપ ચણુંબે આસપાસ

ચોતરો બંધાવવો અને ગરિબ જરૂરાને અનદાન મળે તેવા પ્રથમં કરવો. આ કાર્ય આપણે જાતે કરી શકીએ તેવા સંયોગ નથી રહ્યા. હું આજે નભરમાં એક પરોપકારી ગૃહસ્થના સમાભમભાં આવ્યેં હતો. તેઓ અહીંના સંઘમાં આગેવાન અને પ્રતિષ્ઠા સંપત્ત છે. તેમને આ કાર્યનો સુંપત્ત અત્યારે જઈ કરી દેવી. સ્તુપ એક તકાતી ચોદણી એમાં ડેતરાવવું તુ—

“ આ સ્તુપસ્થાપના પોતાના નિષ્ઠ આયરણુના પ્રમાર્બન અર્થે—
પવિત્ર અને પુણ્ય શ્લોષ આત્મા મુનિવર્ય સુદર્શનની સ્થૃતિમાં—
અજ્ઞાન રમણું બુગલ તરફથી કરવામાં આત્મી છે. ”

સવારનો ઝુકડો ખોડારે તે પૂર્વે આ મમધની ધરતી છોડીને આપણે
આદ્યા જરૂરું.

તમોએ અને મેં જીવનને કાળાં કામો કરી કલુષિત કરવામાં
કચારા નથી રાખી. માણુસ માત્ર જીવને પાત્ર છે. સમબન્ધ પછી મુવઃ
જીવો. ન કરતાં જંગળિતું નહું પાણું ઉધાડતું જોઈએ. આસુષ્પનોં
હાથમાં રહેલો કાળ પવિત્ર કરણીમાં ગાળવા ફરર ફસવી જોઈએ. આ
આશયથી કલિંગ દેશમાં આવેલ ખંડિતિ તરફ પગલાં માંડવાં. ત્યાં
ધ્યાનમાં રહેતા એક પવિત્ર સંતના ચરણમાં—સમીપમાં વસ્ત્રા એક
ચાહણીણા ભમવતી મેયાના કરમા—મારાં અને તમારાં જીવન ધરી
દ્વાં એમાં જીવનની લાખાણું છે અને આત્માનું શ્રેષ્ઠ છે.

નાયકની લાંબી વાત સાંભળ્યા પછી રાણી અભયા જળગળા
સાદે ખોલી —

તમોનું અમારા બેલી છો. મારનું તે તારનું એ તમારા હાથમાં છે.
તમો ને કહેશો તે ફરવા કામો તેથાર છીએ.

પંડિતાનો ગર્વ પણ ચૂર્ણું શઈ જમો હતો રાણીની વક્તા તેણીએ

મૌનપણે સ્વીકારી લીધી. તરતજ ગાડીમાં ઐસી એ ત્રિપુરી નિર્ધારિત કાર્યવાહી પાર ઉતારવા ખસાર થઈ ગઈ.

ભાસ્કર દેવના આગમન સાથેજ વનખંડનો આ ભાગ માનવ મેદનીથી છલકાવા માંડ્યો. સાધુઓ ઉપસર્ગો સહન કરવાજ આવા પ્રદેશમાં એકાકી ધ્યાન મળ રહે છે એ વાતની નવાઈ નહોતી. પણ આ ઘનાવ તો એટલો ઝડપી ઘન્યો હતો કે જેથી સૌ ડોધને આશ્ર્ય થયું હતું.

એમાં વધુ ઉમેરો તો સંધના આગેવાને આવી અહી રત્નપ કરવા સાર ઢાઈ અજ્ઞાત ખાઈએ તરફથી ખન મળ્યાની વાત સંભળ્યા પછી થયેટ તકતીમાં ડોતરાવાના શબ્દો વાળો બંધ કાગળ ત્યાં એણે ઉધાઉયેટ એ વાંચતાં સૌ ડોધને લાયું કે મુનિજીના આ ભરણ સાચે એ રમણીએને જરૂર સખંધ છે.

સંધમુખીએ જગ્યા શોધાવી, પાયો ખોદાવી કાર્યના મંગળ-ચરણ કર્યાં ને પાંચમે દિને એ માર્ગે સાધ્વી સમુદ્દરથી અલંકૃત ખનેલો ચંદનાગાનાં પગવાં થયાં.

શેઠના વંદન પછી ધર્મલાલ નો ઉચ્ચાર કરતા તેઓએ પ્રશ્ન કર્યો —

મહાનુભાવ ! અહી શું બંધાવો છો ? મુનિરાજ સુદર્ધન ક્ર્ષણસીમાં જિતર્યા છે એની તમને ખખર છે ?

પ્રવર્ત્તિની મેયા ! સંત સુદર્ધન સામે દેખાય છે એ વનખંડમાં જિતર્યા હતા, અને તેમને કાળખર્મ પામ્યાને આજે પાંચમે દિવસ છે. સવારના પધાર્યા-મંગલિક સંભળાયું. બીજી દિન એ મહાત્માની વાણી શ્વરણ કરવાનો લાભ જનતાને મળે તે પૂર્વે તો રત્નિના ધ્યાનસ્થ દ્યામાં તેમના ઉપર ભરણાંત ઉપસર્ગ થયો. ડોષે કર્યો ? એ સર્વે બંધારામાં રહ્યું છે. માત્ર ગોડી રાત્રે એક ગૃહસ્થે આવી અને રોકડ

રકમ, તેમ અહોની મિલકતતું ખતપત્ર સોંપી, મુનિશ્રી ને સ્થાને ખાનમાં જિલા હોય ત્યાં રસૂપની દેરી, અને તેટલી સુંદર જણાવવાનું અને ફરતો ચોતરો અનાવવાનું તેમજ ત્યાં અનનદાન ગરીબોને આપવાનો પ્રથમંધ કરવાનું કહ્યું. વધારામાં એક બંધ લીકાડી આપ્યો. અને જણાયું કે સવારે મુનિવંદ્ન અર્થે જાવ અને એ સ્થાન નક્કી કરો ત્યારે જ એ ખોલનો. એમાં લખ્યા પ્રમાણે તકતી ડોતરાવી ચોઢનો. વાત પૂરી કરતાં એ ગૃહસ્થે જણાયું કે મારાથી થોભાય તેવું ન હોવાથી આ કાર્ય પરોપકારી દષ્ટિથી તમારે કરવાનું છે.

હું કંઈ પ્રશ્ન કરે તે પૂર્વે, તે માનવી મારો આવાસ વટાવી જઈ રહ્યા પર અદ્દસ્ય થયો.

આશ્રમ !

ડીક, લીકાડામાં શું લખ્યું છે ?

તરત જ અધિયે સાધ્વી ચંદ્રનાના કરુણમળમાં એ મુક્યો. એમાંના સખ્દો વાંચતાં જ ગુરુણીજ ઠરી જયા !

ત્યાં તો એકત્ર બ્યેલ નારી વૃંદમાંથી એક વૃદ્ધ આવિકા બાઈ આગળ આવ્યા અને ગુરુણીજના હાથમાં પરખીદિયું મુક્યી ખોલ્યા.

પૂજય મહારાજ ! કૌશામ્ભીથી આવેલ એક માનવ આ પત્ર આપને આપવા સાડું મને આપી જયો છે. એ વાતને લગભગ આઠ દિન થવા આવ્યા. આપ પધારો કે તરત જ આપવા જણાવેલું.

ચંદ્રના સાધ્વીએ પરખીદિયું ખોલી વાંચી લીધું.

નજિકમાં રહેલી શિષ્યાને ઉદેશી કહ્યું.

નંદા ! આપણે અહો થોડા કલાક રોકાઠ, તરત જ વિહાર કરવાનો છે. હવે આગળ વધવાનું નથી. પણ બનતી ઉતાવળે કૌશામ્ભીમાં પહોંચવાનું છે. રાણી મૃગાવતીને દીક્ષા લેવી છે.

એમાં મારી હાજરીની ખાસ અગત્ય છે. સાધ્વીઓને ખર્ચ
આપતાં, માત્ર નંદા સાધ્વીજ નહીં, અન્ય સાધ્વીઓ પણ આશ્રમાન્વિત
થઈ. ભગવાન્ મહાવીર ત્યાં પધાર્યા હતા. ગુરુણીની હાજરી વિના પણ
સામાન્ય સાધ્વીદારા દીક્ષાઓ દેવાતી, એ સૌ ચંદ્રાળાણાના પરિવારમાં
જણૂતી; દર વર્ષતે ગુરુણીજ હાજર હોય એમ બનતું નહીં, અને એવી
અગત્ય પણ ન લેખાય. એટલે જ અગયેખી ઉપને એ સહજ હતું.

કંઈ મહત્વબું કારણ એ પાછળ હોવું જોઈએ એ અનુમાન સાધ્વી
નંદાએ બાંધ્યું અને ગુરુણીજએ બગોરના એક પત્ર રાણી મૃગાવતી
પર લખી હૂતને સેંચ્યો. અને બનતી ઉતાવળે કૌશામ્બી પહોંચવા
જણૂંયું. તે વાતથી પુષ્ટિ પણ મળી. આ રીતે પત્ર મોકલવાનો
ગુરુણીજના જીવનમાં પ્રથમ પ્રસંગ હતો. સામાન્ય રીતે જતાં આવતાં
જક્તા ગણ જોડે મૌખિક કિંવા દેખિત સુખશાતા પૂછાવવી ડે
ખર્મલાભ ઇપ અદ્વિતીય આશીર્વાદ પાડવવો એ એક વાત અને ખાસ
દૂત મોકલી પત્ર પાડવવો. એ બોજ વાત-ઉલય વર્ચ્યે મહદું અંતર છે.

ચંદ્રાળાણા સાધ્વી. જડપી વિહાર કરી કૌશામ્બીમાં આવી
પહોંચ્યા. એક દિન પર્બદ્ધામાં ભગવંત મધુર વાણીમાં દ્યાદ્રિયાના કારમા
વિલાસો પર અને એના વિપાકનો ભથુંકરતા પર વિવેચન કરી રહ્યા
છે. એમાં આંધું કે ધુવડ દિવસે જોઈ શકતું નથી, કાગડો રાને જોઈ
શકતો નથી, પણ કામી જન તો એ પક્ષીઓથી પણ અધમ કોઈએ
છે કે જે દિવસે અને રાતે જોઈ શકતો નથી.

એ શ્રવણુ કરી સાધ્વી ચંદ્રાને વિનયપૂર્વક પૂછ્યું કે:—

ભગવંત ! પાટલીપુત્રમાં મુનિવર્ષ સુદર્શનના નિર્વાણ સ્થળે સૂર્ય
ઓનો કરવા માટે ધન ખર્ચનાર એ રૂત રમણીયુમલ એ જ કલામાં
આવે ને ? પૂર્વે ઉપસર્ગ કરનાર પણ તેજ ને ?

હા, મંથરા કૈદોની જોડી માઝક પંડિતા-અભયાએ સુદર્શનના

આત્મા સામે ધર્મિત પૂરણ ન થતાં જખરં વૈર દાખવ્યું. જો કે એમાં ત્રૈધિનો આત્મા તો કુંદનસમ શુદ્ધ તરિકે દીપી નીકળી પ્રગતિ સાધતો ઓછા કાળમાં કામ સાધી અયો. અંતગડ ડેવલી બની આજે તે ચૌદ્રાજ લોકના અંતે બિરાજે છે.

ત્યાં તો, સભાના છેડે જિલ્લેલ એક સ્થામવર્ષી ચહેરાના આદમીએ, હાથ જોડી કણું કે—

પ્રલુ ! મારી પણ એક શાંકાનું સમાધાન કરો, એમ કંઈ એ બાલ્યો—

ભગવંતે પણ એનો ઉત્તર એ જ અક્ષરમાં આપ્યો.

એ સાંભળી પેલો આદમી તરત જ ત્યાંથી ચાલ્યો ગયો. સભા-જોનોને આથી જખરં આશ્રમ્ય ઉપન્યું. થોડા અક્ષરોનો લેવડેવડમાં પૂછનારા તો સંતોષ પામી ગયા પણ પ્રાકૃત એવો જનસમૂહ એ ક્ષાંથી સમજ રાકે !

પ્રલુશ્રી મહાવીરહેવે એ સુમજાવતાં કણું કે—

ભવ્યજીનો ! એ આદમી પાંચસો ચોરની પલ્લીનો. સ્વામી હતો. તેઓના ધર સંસારમાં માત્ર એકજ સ્ત્રી હતી. બધાની ભરજી તે એકલીજ સાચવતી. એક વાર ધાડમાં તેમના હાથે બીજ એક નારી સપડાઈ. પદ્ધીના માલીક તેણીને પ્રથમ સ્ત્રીની સહાયમાં સ્થાપન કરી. આ રીતે પહેલી સ્ત્રીના લાભની નજરે કરાયેલ કાર્ય તેણીને ન ગમ્યું. પોતાના અધિકારમાં—એક છતીરાજમાં આ ભાગીદાર તેણીને ખૂંચી. એક વાર લાગ જોઇ કૂવા કાંડે કુપડાં ઘોતી પેલી બાઈને પ્રથમની સ્ત્રીએ કૂવામાં હડસેલી મુકી પોતાના માર્ણનો કંટક ફૂર કર્યો. આ ધાતની અથર પડતાં જ પક્ષીપતિને પોતાના પૂર્વ જીવનમાંનો એક બનાવ યાદ આવ્યો. પોતે બાળપણમાં શેહની બાલિકાને રમાડતાં એના ચુલાંગ પર આંગળી ફેરવતો ત્યારે જ તે છાની રહેતી. પછી પોતે તો—

આ ખાડના ધંધામાં પડ્યો. એ વાતને વર્ષો વીત્યાં. પોતાની અને પાંચસોની આચા સાચવતી છી એ રોહિતનથા તો. ન હોય એવી શંકા ઉપર. શરભથી એ વાત રપણપણે ન પૂછી શક્યો. સાધી ચંદનાના પ્રશ્ન પછી એનામાં હિંમત આવી અને માર્ગિક રીતે સવાલ કર્યો.

મહાનુભાવો ! કર્મરાજના આવા તો ડેટલાયે વિલક્ષણ ચેનચાળા-
એ અહિનીંસા સંસાર રેટરંજ પર પ્રવર્તી રહ્યા છે. પ્રાકૃત જનો એના
બોગ બધ પડે છે અને ભવભ્રમણ વધારે છે. જીની વિશ્વૂતિના સમા-
નભથી જ એમાંથી છુટવાનો માર્ગ જરૂર છે. આમ છતાં હિંમત કર્યા
વિના જરૂરાયેલો. આત્મા છૂટી શકતો નથીજ.

આવ્યા ચંદના ! તને વેમનાર નાયક કામદશામાં આકંદ ભૂઝેલો
હતેઠ ભાષ્યેજની સલાહ અવગણી, કૌશાભ્યીપતિના રોપને ઢેલી, એણે
તારી માતાને ઉઠાવી જવાનું અયોગ્ય હાર્ય કર્યું હતું. પણ સાધી
ખંખાવતીના સમાગમે એ પતિતને પણ ઉદ્ઘર્યો ! તમો કુમારીપહાડથી
ખાણા દર્યા ત્યારે એ પાટલીપુન તરફ, તે પૂર્વે ચાપ આપી રખડતો
ગુજરી જખેલ રમણીયુગલની રોધમાં જયો. એ વેળા બદદાનત નહોલી.
રનેઢી જનો સંતસમાગમ કરાવવાનો શુભ હેતુ હતો. અહોથી તમારા
એ તરફના વિહારમાં પણ તમારો હેતુ, એ નાયકને સંયમપંચ પ્રતિ
વાખ્યાનો હતો.

મુનિ સુદર્શનના નિમિંતે નાયકનું કામ સરળ બનાવ્યું. રમણી-
મુગદ દારા મુનિનિયિરે આવેલ મરણુંત ઉપસર્ગ થોભાવવામાં એ મોડો
પડ્યો. પણ એ ઉભયને ઠપોડા આપી તેમનાં જીવનપહેણુને બદલવામાં
વિભયવંત થયો. એની સલાહથી જ સૂપની સ્થાપના થધ. પંડિતા-
ગભયાની જોડીને પોતાની સાથે લઈ જઈ કુમારી પહાડ પર સંત
ક્રીષ્ણાઙ્કુના સમાજમાં ગુરુની એ કૃતાર્થ થયો.

તમારી ભાવના ચંદનચાળા ! અષ્કારી ઉપર ઉપકાર કરવાની
દતી. પણ નાખુન્ન ચેલાખો ચેલાન ન હોય ત્યાં બર કર્યાંથી આવે !

સચોગ—વિચોગમાં પૂર્વકૃત કર્મોજ મુખ્ય ભાગ ભજવે છે. પ્રાકૃત આત્માએ તો જમૃત રહી, નિરાય ન થતાં પુરુષાર્થી અનવું.

આ સાંભળી વસુમતી સાધીએ પાછળ બેઠેલ મૃગાવતી પ્રતિ આંખ ફેરવી કંધક વાત પણ રહારાથી જણુંતી.

લલના સમૂહમાંથી રાણી મૃગાવતી એકદમ ઉલ્લો અધ અને અંગ-લી જોડી કહેવા લાગી કે—

ભગવંત ! રાજ્ઞી પ્રદોતની આશા મળે તો હું આજેજ પ્રપન્નયા દેવા દંચું છું. સંસારના ધારમા સુષ્પોમાં માર્દ મન હવે દંચ્ય માત્ર નથી રહ્યું; જે માર્ગ મારી ભગીનીએ વર્ષો ખૂર્વં લીધો અને જે માર્ગ ગ્રહણ કરી ભાલેજ એવા સાધી ચંદ્રના આજે ભારતવર્ષમાં સુવાસ પાથરી રહ્યા છે એમાં મારે પણ જોડાઈ જવું એવો અંતરનાદ થયો છે.

મારા પુત્ર બાળ ઉદ્ઘનના પિતા અકરમાત શુન્ઝરી જવાયી, અવંતિપતિએ મારા ઇપથી આકર્ષાઈ એકાએક હલ્લો કરવાથી મેં એ વેળા છળથી કામ લીધું હતું. મેં કહેવાવેલું કે જે ચંદ્રપ્રદોત રાજ્ઞીનો મારા પર સ્નેહ હોય અને એ મને રાણી બનાવવા માંગતા હોય તો, પ્રથમ મારા બાળતતુજને આંચ ન આવે તે સારુ દીશાભ્યિને મજબુત ડોટ ચણુંબી આપે. કામથી ધેરાયેલ તેમણે એ કામ કરી દીધું. શિયળવતના રક્ષણ અર્થે આ રીતે મેં થાપ આપી કામ પતી જયા પછી કિલ્લાના દાર બંધ કરાયા. તેમનો ધેરો હજ ચાલુ છે. આપનાં પગલાં થયાં એટલે અહો આપી શકાયું છે. દેશના સાંભળ્યા પછો હું મારા અદ્ય વયસ્ક પુત્રની-અના રાજ્યની-સંભાળ તેમના શિરે સૌંપું છું ને રણ માણું છું.

પર્ષદામાં બેઠેલ ચંદ્રપ્રદોત લાંબાયન બની અથે અને ના પાડી શક્યો નહિં. પ્રદોતની અંગારવતી અધી આઠ રાણીએને અને મૃગાવતીએ દીક્ષા લીધી.



મફકરણું ૨૫ મું

ખમત ખામણાનું મહિતવ

અરે ! આને આટલી બધી ધમાલ શા કારણે થઈ રહી છે ! ભાઈ, તું નગરીમાં રહે છે કે નગરીની બહાર ? એટલી પણ તહેને ખમત નથી કે અમણું ભગવાન મહાવીરનાં પગલાં આપણા ઉદ્ઘાનમાં થયાં છે.

અહો ! શું ભગવંત આ પહેલી વાર પધારે છે ! તેઓ તો વિચરતા વિચરતા, અહો ડેટલીયે વાર આવી જયા છે. એ કાળે કંઈ આજના નેવી ધમાલ નહોંતી જોવામાં આવી.

હા ! મેં જાણ્યું કે તું અમારા ધર્મની વાતમાં ઉપર છલ્સોઝ ભાગ લઈ, કેવળ કુતુહળની દર્શિયે સવાલ પૂછે છે ! પણ તારી વાત પરથી જણાય છે કે તું જૂનો નિશાળાયો છે.

શોક સાહેબ ! ભારા એક જાતિ ભાઈએ ભગવાન પાસે સાધુ પણ લીધું છે, ભારા એ સેહીને અવાર નવાર મળવાનું થાય છે એટલે મને આપના ધર્મની થોડી સમજ છે.

તો, ભાઈ ! વાત એમ છે કે આજની આ ભારે ધમાલ પાછળ

એ કારણો એકદાં થયાં છે. તેઓની સાથે જે અમણીઓને સમુદ્ધાય છે એમાં એક સમયના આપણા રાણીમાતા મૃગાવતી પણ છે. દીક્ષા લીધા પણી જુદા જુદા પ્રદેશમાં વિહરતા તે આજે પહેલીવાર માતૃ ભૂમિમાં પગ મૂકે છે. રાજ્યવી ઉદ્ઘટને પોતાની સાધી માતાનું સામૈયું મોટા આડંખર પૂર્વક કરવાનો નિર્ધાર કર્યો છે.

ભીજું કારણ તો ખુદ તીર્થપતિને લગતું છે. ભગવંત મહાવીર એક ભરણાંત ઉપસર્ગમાંથી બચી જયા છે. વ્યવહારી વાણીમાં કું તો ‘નબે અવતાર’ આવ્યા છે. એ બનાવ પણી ઠેર ઠેર સુખ શાતા પૂછવા રાજ મહારાજ અને દૂદ્રો ગયા છે. તેઓશ્રીના અહીં પગલાં થાય છે એટલે આ નગરીને પણ એવા મોટેરાઓનાં દર્શાનનો. લાલ મળવા સંભવ છે. એવા તે કયા અધિમ માનવીએ આ કરણાના ભંડાર સમા ત્રીશલાનંદન ઉપર એવો ભયંકર ઉપસર્ગ કર્યો?

મને જો કે જેન દર્શાનનો ખાસ અભ્યાસ નથી છતાં મારા સાંભળવામાં આવેલું છે કે તીર્થંકર થનાર આત્માઓને ઉપસર્ગોનો સામનો. કરવો પડે છે; પણ તે જ્યાં સુધી તેઓ ડૈવલ્ય પાંચા નથી હોતા ત્યાં સુધીજ. એ વેળાનું તેમનું કર્તાબ્ય સમતાભાવે પરિષહ્નો સહન કરવાનું, કર્મ પુનર્જને જરૂર મૂળથી જિખેડવા સારુ તપ તપવાનું, અને જ્યાં એ ઉભય ચીજો વધુ પ્રમાણુમાં અમલી બને એવા પ્રદેશમાં વિચરવાનું હોય છે. જવલ્લેજ તેઓ પૂછેલા પ્રશ્નનો. ઉત્તર આપે છે.

ઉપરેશનું કાર્ય પણ કરતા નથી. ડૈવલશાનીને ઉપસર્ગ સાંભળ્યો નથી. શાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયનામા ચાર ધાતિ કર્મોનો. સર્વથા નાશ કરીને એ ડૈવલશાન પ્રાપ્ત કરે છે. સચરાચર વિશ્વના પ્રતિસમયના ભાવેના શાતા બને છે. પણ ઉપરેશ દ્વારા ભબ્ય જીવોના ઉદ્ધારનું કાર્ય હાથ ધરે છે. પ્રેમળવાણીમાં શાશ્વત તત્ત્વો સમજવે છે, જનસમૂહની ચંકાઓ કર્યોછે. આત્મશ્રેયનો પણ ખતાવે છે.

ખાકી રહેલાં વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય કર્મો એ હોઈ ખાસ હુઃખદાયી નથી બનતા. એ વેદીને ક્ષય કરવાનાં હોય છે.

જ્યાં આવી સ્થિતિ હોય, ત્યાં વળી ભૂત્યુ નોતરે તેવા ઉપસર્ગ કે?

ભાઈ? ત્યાં જે વાત કરી એ ખરાખર છે. સામાન્યતઃ તીર્થાંકર ભગવાનો કૈવલ્ય પામ્યા પછી કૈવલ શાતા વેદનીય અનુભવે છે. અહીં જે હંધ બન્યું છે તે આશ્રમ રૂપ છે. એમાં વિરોધતા તો એ છે કે —

ઉપસર્ગ કરનાર વ્યક્તિ, એક કાળે તેમના શિષ્ય રૂપે હતી અને જે શક્તિના જેરે એણે પ્રખુને હંદ્દાનવા યત્ન સેવ્યો, એ સાધવાની વિધિ દર્શાવનારા પણ ખુદ પ્રખુજ હતા. આ તો દૂધ પાઈ સાપ ઉછેરવા જેવી વાત બની છે.

મુરઘ્યી! મને એ જાણવાની ખાસ છચ્છા છે. હું ખારું છું ત્યાં સુધી હમણા આપ હોઈ ખાસ કામમાં પણ નથી. વળી આજે તો ખરી ધામધૂમથી સાર્થીયું ચહેરાનું હોવાથી એને નીકળતાં સ્હેને વણેક વઠિકાએ તો થરોઝ.

સાંભળ ભાઈ! એનું નામ ગોથાલક. એનો વૃતાન્ત દૂંકમાં આ પ્રમાણે છે.

ગૌતમપુત્ર શ્રી વર્ધમાન સંસાર છોડી કર્મોને ખપાવવા અર્થે નીકળ્યા પછી થોડા ચોમાસાં વીતાયા આદ ગોથાલકનો સાથ અચાનક થયો. અજ તો એ મંખલીને પુત્ર, અને આયોની શાળામાં જરૂર પામેલ એટલે પ્રસ્તિક્ષિ પામ્યો ગોથાલક તરીકે. આળવયથી જ ઉધમાત વધારે સારાં સારાં લોજન જમવાનાં મળે અને સ્વર્ચંદ્તાથી દૂરવાનું મળે એવા સ્વભાવવાળા એણે, એક વેળા વર્ધમાન સાધુને ઉપવાસના પારણે ક્ષોરનું મિષ્ટાન મળતું જોયું. લોહાને વહેરાવતી વેળા અતિ આગુહ કરતાં નિરઘ્યા એટલે ભાઈઓએ નિરધાર કર્યો હું ‘આ સાધુવા શિષ્ય થઈ જવું હીછ છે.’

વર્ધમાન સાધુ તો પારણું કરી અન્યત્ર વિહાર કરી ગયા. ગોશાલક પાછળ શોધ કરતો જ્યાં એ ધ્યાનસ્થ દશામાં ઉલા હતા ત્યાં આવી પહોંચ્યો અને 'હું તમારો શિષ્ય થડિં છું' એમ કષી તેમની સમીપ માથું મૂડાવી સાધુ અની રહેવા લાગ્યો. મધ્યાનહ થતાં પ્રભુ પારણા દિને ગયા હતા એ રીતે ગોચરી લેવા જવા લાગ્યો. લોડા પણ જીડા બીતાં વિના જાતપુત્રનો સેવક છે એમ જાણી તેને આહાર આપવા લાગ્યા.

'ગ્રાણ જય પણ પ્રકૃતિ ન જય' એ કહેતી અનુસાર ભાઈશ્રી પાંચ તપુરવી સંતની સાથે પણ સખણું ન રહ્યા. જાત જાતના અ/કંચાળા કરવા લાગ્યા. એક પ્રસંગે વૈશાળન ઋષિ નેચો આતાપના કષી રહ્યા હતા તેમની મશકરી કરી. ઋષિએ ગુસ્સે થઈ બાળી નાંખવા સાર ગોશાલક ઉપર 'તેજેલેશ્યા' મૂકી. દ્વારાથી પ્રેરાઈ જાતપુત્રે એ સામે 'શીતલેશ્યા' હેઠાં, આ શિષ્યાભાસને મરતો બચાવ્યો. એ સ્થાન છોડી આગળ ગયા પછી ભગવંતને વિનલણી કરતા ગોશાલાએ 'આવી અન્ય શક્તિ યાને લેશ્યા' કેવી રીતે સાંચા શકાય એવો પ્રશ્ન પૂછ્યો. મનઃપર્યવ જાની એવા સિદ્ધાર્થનંદને ભાવિ ઉપસંગ જાણ્યા છતાં, આ શક્તિ સાધવાનો ઉપાય બતાવ્યો. હોણુહાર મિથ્યા નથી થતું એ આ પ્રસંગ પરથી સમજય છે. થોડા સમજ પછી ગોશાલક પ્રલુથી છૂટો પડ્યો. બતાવેલા માર્ગ તેજેલેશ્યા સાધી અને એ ઉપરાંત અષ્ટાંગ નિમિત્તોનું જાન મેળણ્યું. ભૂત-ભવિષ્ય અને વર્તમાનના કાકડા, એ જ્ઞાનઘે જિહેલવાનું આરંભ્યું, એ રીતે આજીવિક મનની સ્થાપના કરી. કાકતાલીય ન્યાયે કેટલુંક ખર્દ પડવા લાગ્યું એટલે ગોશાલકની ખ્યાતિ વિસ્તરવા માંડી.

'હુનિયા દોરંગી છે' એ સાચું છે. એ પણ એટલું જ સાચું છે કે 'તે આડરીયા પ્રવાહરપ છે.' પરમાર્થ વિચાર્યો વિના મોટો ભાગ જૂઝો પડે છે અને એકાહો ચમતકાર નેતાં કિંવા પોતાનો સ્વાર્થ સંધૂતા એ સામાન્ય વ્યક્તિને ખુદ દૃષ્ટિર માની બેસે છે.

મંખલીપુત્ર ગોશાલકે ભોળી જનતાનો આ રીતે પોતાના પ્રત્યે ચાહ મેળવી, પોતે પણ જિન છે; ઝડણુવાલિકાના તટપર કેવળ રાજ મેળવનાર ચરમ તીર્થપતિ શ્રી મહાવીરના જેવો છે એવો પ્રવાપ આરંભી દીધો; અને ભક્ત ખણુ મારફત એ વહેતો પણ થયો.

આવસ્તી નમરીમાં વિહાર કરતાં ભગવાન મહાવીર સમોસર્યાં અને અલ્પકાળમાં ત્યાં ગોશાલકનાં પણ પગલાં થયાં. ‘હાલાહલા’ નામની કુંભારણ અને ‘અયંપુલ’ નામા ગાથાપતિ એ ગોશાલકના ખાસ ભક્તો હતા. વળો એ ઉભય જનસમૂહમાં લાગવન પણ સારી ધરાવતા એમણે ભક્તિથી ગ્રેરાઈ આવસ્તીમાં ગોશાલકનો પ્રવેશ ધામધૂમથી કરાવ્યો અને જહેરાત પણ કરાવી કે પ્રથમ પધારેલા શ્રી ‘મહાવીર જિન’ માઝક આ બીજ ‘જિન’ પધાર્યા છે.

‘આવસ્તીમેં હો તીર્થકર વિચર રહે હૈ’ એ જનપ્રવાહ કોષ્ટક ચૈત્યમાં ભરાતી પ્રજ્ઞ પર્વદામાં પહોંચ્યો. ગૌતમ ગણુધરે એ સાધુઓ પ્રજ્ઞ કર્યો.

‘સત્ય વસ્તુના પ્રતિપાદન અર્થે ભગવંતે જવાબ આપતાં જણ્ણાવ્યું કે— હે ગોયમ ! એ જિન એક સાથે આ ભારતવર્ષમાં સંભવિત નથી. આ અવસર્પિણ્યો કાળમાં ચોવીશ જિનથી વધુ સંખ્યામાં તીર્થકર ઉત્પન્ન થતા જ નથી. એ સંખ્યા પૂરણ થવાથી નવા ઉમેરાને આવકાસ જ નથી. કોટવાળને દેખી કોઈ ગુન્હેગાર પોતાના હાથથી ખેંઢું છ્રપાવી એની નજર ચુકાવવા પ્રયાસ કરે તો કેવલ હારય પાત્ર જ મણ્ણાચ ઉધાડો પડી જયા વિના ન રહેલા પામે તેમ અહીં પણ સંપૂર્ણ જીનમાંને યથાર્થ હોય છે; એમાં લાગવગ કે શરમાથરમી ચાલી શુકૃતી નથી—કટ્ટિપત જોળા જખડાવી થકાતા નથી.

ગોશાલક મંખલીપુત્ર આજુવિઝ મતનો સ્થાપક ભલે ડોય પણ જિન નથી. આ ભવમાં થઈ સઠવાનો પણ નથી.

દેશનામંડપની આ વાત પ્રસરતી હેઠળ 'હાલાહલા' ના હાટે ખોણુંચી અને એ સાંભળતાંજ ગોશાલકનો મિનાજ વિઝો-હળું ધામધૂમ પૂર્વક બીજા જિન તરીકેની ઘ્યાતિથી પમલાં થતાં વાર નથી લાગી ત્યાં એ ઉપર મશીનો કૂચડો ફેરવવા રૂપ આ ખડાડો કાને ખડતાંજ એ રાતોચોણ બની ગયો. ઝટપટ શ્રી મહાવીરની પાસે પહોંચી જઈ એ આક્ષેપનો પ્રતિકાર કરવા જાંચો નીચો થવા લાગ્યો. ઉપાસક બર્ણની સહાહથી તેણે પ્રભુના શિષ્ય આનંદ દ્વારા ભગવંત પર સહેસો મેનકલ્યો. કે—

આ જાતની ખોટી વગોવણી કરવાનું છોડી દ્યો. તમારો શિષ્ય હતો એ ગોશાળક જુહો હતો તે તો મરી ગયો. અને હું જુહો છું. ઇકત એ શિષ્યનું શરીર ઉપસર્બ સહન કરવામાં અનુદૂળ ધારી મેં અહેણું કર્યું છે. વળી તમારા સિવાય બીજે જિન, નરીહે ઓળખાય એની અસ્રૂયા ન સેવો.

'ચોર કોટવાળને દંડે' તે આનું નામ; આવી ધાક ધમકીને વશ સામાન્ય કોટિના વિદાનો પણ નથી થતા ત્યાં ખુદ તીર્થેકર થાય અરા? જાનમાં જે દેખાય એજ કહેવાય; નથી એમાં ધર્ષાં કે નથી એમાં પદલાલસા. આનંદ શિષ્યની વાત પછી ભગવાને પોતાના શિષ્યને ચેતવણી આપી હતી કે કોઈએ ગોશાળક સાથે ચચ્ચીમાં શીતરતું નહીં.

કોઈકૈત્યની ઉપદેશ ધારા તો પૂર્વવત આસુજ રહી. આ તરફ ગોશાળકની છદ્ય જરભી પણ વધી પડી. વૈર લેવાની વૃત્તિ ભલકી જાડી. અવિબારીપણે એકદા એ દોડતો, ગમેતેમ ઓલતો, કોઈક ચૈત્યમાં આવી પહોંચ્યો અને ભગવંત સન્મુખ ખડો થઈ અપલાપ કરતો એલયો. હે—

હે કાશ્યપ! તમારો એ શિષ્ય તો મરી જાંચો છે! અને શિષ્ય માની

લઈ શા સાર વગોવો છો ? તમે એકલા એજ ‘જિનપદ’ નો છનરો કીયો છો ?

મંખલીપુત્ર ! શા કારણે આત્માને છેતરે છે. તહેને મેં કિષ્ટ્યાંપે સ્વીકાર્યો નથી એ સાચું, પણ તું એજ જોશાલક છે કે મારી સાથે વર્ષો સુધી રહ્યો છે. જ્યોતિષના જ્ઞાન બળથી કે તેનેસેશણની સાધના માત્રથી ‘જિન’ થઈ જવાતું નથી.

આ સાંભળતાંજ અંતરની આમ ખુઝાવવા, પોતાનો પરાભવ કરનારને ડામવા, એણે પ્રભુપર તેનોલેખસ્યા મૂકી. તરતજ એ તેજ શક્તિ પ્રભુપ્રદક્ષિષણ કરીને પાણી વળા, ખુદ જોશાળકના દેહમાંજ પ્રવેશી ગઈ. આ રીતે પોતાનો કુહાડો પોતાનાજ પગમાં વાગ્યો. તેનો જવાળા શરીરમાં પ્રવેશતાંજ અતિ દાઢણુ હાહ ઉત્પન્ન થયો. આમ છતાં ‘મીયાં પડ્યા પણ ટાંગ જીંચી’ ની કહેવત માઝુક એ ભગવાનને શ્રાંગ દેવા અને યહ્યા તકા એલવા લાગ્યો. પણ તેજશક્તિની અસર એના અંગોપાંગમા ફેલાઈ મૂકી હતી. દેહકાંલિ નિસ્તોજ અની રહી હતી. ન તો સ્વર્ણ જીભવાની તાકાત રહી હતી કે નતો આળવિક મતસંખ્યે શાંકાતું સમાધાન કરવાની હવે હિંમત રહી હતી. એ ર્થાનથી તરતજ જોશાળક પોતાના ઉતારે પાછો ફર્યો. એ લેસ્યાની અસર નાખૂદ કરવાના ઉપચાર જેર શોરથી આરંભાયા પણ એમાંથી એકપણ કારગત ન નિવડ્યો. સાત દિનમાંજ એનો જીવન લીલા સંફેલાઈ ગઈ.

અહીં હલેખનીય બાબત તો એ છે કે પ્રભુની પ્રદક્ષિષ્ણા હેતી એ શક્તિની ગરમી એટલી તીવ્રતમ હતી કે ખુદ પ્રભુના શરીરમાં એની અસર છ મહિના સુધી રહી. પિતજવર અને જાડામાં રક્ત ચાલુ થયાં. આમ તો ભગવાંત નિરપૃષ્ઠી હોવાથી રોગને એના કાળે પાકીને નાખ થવા હેતાના વિચારવાળા હતા; પણ સિંહ મુનિના આગ્રહથી, ચેતાના નિભિતે મેંટિય આમમાં વસૃતી આખાપલિ રેખતીને ને

કોળાપાક અનાવ્યો હતો, તે ન મંગાવતાં ખીંને બિનેરામાક એ સુનિ મારફત મંગાવ્યો. એના સેવનથી દરદ ઓછું થવા લાગ્યું અને દેહકાંતિ પૂર્વવત્ત અનવા માંડી.

આમ જનસમૂહ તો બહારના દેખાવ ઉપરથીજ અનુમાન પાંધે છે. ભીતરના બેદ પારખવા જેટલું એનું મનોધળ હોતું નથી. આવસ્તીમાં બનેદા આ અનાવે માત્ર આવસ્તીની પ્રજામાંજ નહિં પણ ભારતવર્ષના અન્ય દેશોમાં—ખાસ કરી ભક્તા જનોમાં જરૂરો સંક્ષોલ પ્રગટાવ્યો હતો. એમાં પ્રકૃને, પૂર્વે કહ્યું તેમ છ મહિના સુધી પીડા બોગવળી પડી. એટલે સૌ કોઈનાં દિલ્લિ જીંચા થયાં હતાં—દેટલાકેને તો ભગવંત હવે અચ્યવાના નથી એમ પણ લાગ્યું હતું. એટલે શાતા પૂછવાના નિભિનના—તેમજ દર્શન કરી લેવાના આરાયના—ગમનાગમન ઝૂપજ વધી ગયાં હતાં.

ભાઈ ! આ કારણુથીજ આને આપણે ત્યાં જ્યોતિષ કોડના દૂદ્રો—સૂર્ય—ચંદ્ર પદ્ધારવાના .

આને બ્યોર પછીની પર્યાદામાં સખત લીડ થવાના, વહેલાસર પહોંચી જવામાં જ લાભ છે.

મુરખ્યી ! તમે વાત પૂરી કરી અને જુઓ, દરખારખદ તરહ્યી રાજ્યવી વત્તસઉદ્યનતની અસ્વારી પણ નીકળા રહી છે. એમાં સામેલ થના સાડ આપણે કદમ ઉદ્ઘાવીએ.

x

x

x

કોણ આવ્યું એ ?

મહારાજ ? હું મૃગાવતી ! આપની શિષ્યા !

કુલિન વંશમાં જન્મેલી અને કુલિન રાજવીને પરણેલી, વળ મારા શિષ્યત્વને વરેલી હારા સરખી સાધ્વી સ્વીને આટલા બધા અસુરા, વસુતીમાં પાણી ફરવું ન હશે.

પુનય પ્રવર્તિનીએ ! આમ થવામાં મારો પ્રમાદ નથી થયો. આપણે સૌ સાથે જે ભગવંત મહાવીર દેવની દેશના સાંભળવા ગયા હતા. વળી આજે નયોત્તિપ દેવોના દ્વારો—ચંદ્ર અને સૂર્ય—મૂળ વિમાને પ્રલુને વંદન કરવા પદ્ધારેલા હતા. ચારે દિશામાં ઝણઝળાયમાન કરતાં પ્રકાશનાં દૃક્રષ્ણો પથરાઈ રહ્યા હતાં. અન્યવાળાના આ એક છત્રી સાંબાન્યમાં અંધકારનું અરિતત્વ સાવ ભૂસાઈ ગયું હતું !

એમાં ચરમ તીર્થપતિની અમૃત કરતાં મીઠી એવી વાણી રજત-ખંટડીના રવ સમી શ્રોતાવર્જના કર્ણપટમાં વહી રહી હતી. એમાં—
‘આત્મા છે, તે નિત્ય છે, તે કર્તા છે, તે ભોક્તા પણ છે, એને મોક્ષ થાય છે, એને મોક્ષ મેળવવાના ઉપયોગમાં ‘જીબ-દર્શન’ તથા ચારિત્ર’ છે. આ છ પદ્ધાર્થ માનનાર, એ ઉપર શ્રદ્ધાવંત બની શક્તિ અનુસાર પ્રયત્નશીલ રહેનાર વ્યક્તિને સમ્યક્તિ નિશ્ચિત છે. એ થોડા કાળમાં સુક્તિની સાધના જરૂર કરે છે. એમાં શંકાને સ્થાન નથી. ઉક્ત છ વસ્તુ પરતે સચોટ શ્રદ્ધા એનું નામ બોધિધીજ પ્રાપ્તિ.

નિશ્ચય સમક્ષિત સખંધી ચાલતાં એ વિવેચનમાં ભગવંતે જે આપ્યાએ કરી અને સાથોસાથ નયદિષ્ટે જુદાં જુદાં દર્શનો જે વાતોનું પ્રતિપાદન કરી રહ્યાં છે; એ સર્વને અપેક્ષા પૂર્વક ઘટાવી, એવો તો સુંદર સમજ્વય કરવા માંડ્યો કે મારું ચિત્ત એ શ્રવણ કરવામાં તલાલીન બની ગયું.

ન્યાયપૂર્વક સમજવામાં આવે તો છે “દર્શનો” જિન ભગવાનનાં અંગ ઇપ છે અર્થાત् નિર્ભય પ્રવચન ઇપ મહા અધિખમાં એ દર્શનો ઇપ સરિતાએ. વહેતી આવી સહેજ સમાઈન્ય છે..

એ સારઇપ વાતનો વિચાર કરવામાં તદીકાર થઈ રહેલી હું આપ સર્વ મારી પાસેથી જાડી રહા તેની પણ મને ખખર ન પડી, તેનું સંભ્યાકાળ થવા આવ્યો છે એ વાતની પણ સાન ન રહી !

ગુરણી મહારાજ ! પ્રકાશના વિશાળ સરોવરમાં કાળવેળા પાર-
ખવાની મારી શક્તિ કુંદિત બની જવાથી હું સાંભળતી બેસી રહી.
જ્યાં એ દીદો પાછા ક્ર્યાં અને એકાએક નિરાસુદૃરીના અંગ—ઢાંકણ
સર્મો અંધકાર વિસ્તર્યો ત્યારે જ મને ભાન આવ્યું. ઝરપટ ઊભી થઈ,
ત્યાંથી સીધીજ વસ્તીમાં આવી છું.

તહારા સરખી દક્ષ સાધીએ કાળવેળા પારખવામાં લક્ષ્ય
રાખવું જોઈએ. અમણી સમુદ્દરના નિયમ પાલનમાં વધુ સચેત રહેવું
જોઈએ. હેવસી પ્રતિકમણું નો કાળ વિસ્મૃત ન થવા હેવો જોઈએ.
પુનઃ આવું બનવા ન પામે એ સાર સદા જગૃત રહેવું જોઈએ.

ચંદ્રના સાધી, સ્વ શિષ્યા મૃગાવતીને આ રીતને મીઠો ઉપાડંબ
આપી—સાધીધર્મના કાનૂનનો ખ્યાલ આપી, સંથારા પર સહજ
નિદ્રાધિન થયા.

ગુરુણીજીની શિખામણ પાછળનો મર્મ અવધારી લઈ મૃગાવતી
સાધી નજિકમાં સ્થાપના રાખી સંધ્યા આવસ્યકમાં લીન બન્યા.
ગુરુંદનંદપ અલુંકૃતોનાં ખામણાં આવ્યાં. પ્રવર્તિનીજ નિદ્રાવશ થયા.
છે એવા ખ્યાલ વગરની મૃગાવતી સાધી તો ગુરુણીજીના સંથારા પર
હાથ રાખી ખમાવવા લાગ્યા, પણ જવાબ ન મળ્યાથી પોતાના
અપરાધની ગંભીરતા ભારી છે અને એથી પોતાના પર મહારાજને
ગુરુસો આવ્યો જણાય છે એમ સમજ, ખમાવવાના વિધાનમાં ભાવના
શ્રેષ્ઠ પર આરૂપ થયા. પોતાના દોષો સંભારી સંભારી એની આલો-
ચના કરવા લાગ્યા કર્મસ્વરૂપના ચિંતનમાં ઊડા ઊતરી ગયા. ભગવંત
ભાવિત ‘છ પદ’ વિચારતાં, અનિત્યાદિ ભાવના ભાવતાં કૈવલ્ય પામ્યા.

એ એજુ રૂનના પ્રભાવે જણાયું કે પ્રવર્તિનીજ નિદ્રાધિન થયા છે
અને તેમનો એક હાથ સંથારાની બહાર સહજ લંબાયો છે; કે જેની
નજિકમાંથી એક સર્પ પોતાના દર તરફ જઈ રહ્યો છે. તેના માર્ગને

અવરોધતો ચંદ્નખાળાનો હાથ, સર્પડંશનો ભોગ ન બને એ સારુ મૃગાવતી સાધ્વીએ હાથ ઉપાડી સંથારામાં મૂક્યો. ત્યાં તો ગુરુણીજી જાગી ગયા.

સહજ પ્રશ્ન કર્યો. ડોણુ મૃગાવતી ! હજુ તું શું કરે છે ?

‘ મહારાજ ! મેં જ આપના હાથને સર્પડંશથી અચાવવા સારુ ઉપાડી સંથારામાં રાખ્યો. આપ સુએ નિદ્રા કરો.

અરે ! આવા અંધારામાં એ સર્પ તહારી નજરે કેવી રીતે ચઢ્યો ?

ગુરુણી મહારાજ ! આપના પ્રતાપે પ્રામ થયેલ જ્ઞાનથી મેં જણ્યું. ઓહો ! એ જ્ઞાન કેવું ? પ્રતિપાતી કે અપ્રતિપાતી ?

મહારાજ ! અપ્રતિપાતી.*

આ સાંભળતાં જ સંથારામાં ચંદ્નખાળા સાધ્વી એહા થયા અને ચોતાને ઉદેશી સ્વતઃ બોલી ઊદ્ઘાટા.

અરરર ! ડેવલજ્ઞાનીની મેં આશાતના કરી.

ડેવલજ્ઞાની મહારાજ ! મારા એ અપરાધની ક્ષમા આપો. મેં ઉત્તાવળ કરી, ગુરુપણુના જેરે, તમને જે કદુવેણો કલ્લાં તે માટે હું ખમાવું છું. એમ બોલતા ચંદ્ના સાધ્વી પણ આત્મરોધનમાં એક તાર અન્યા. એમને પણ અનિત્યાદિ બાર ભાવનાનો ચિંતવન ૩૫ સબળ સાથ મળ્યો. અને જોતનોતામાં તેઓ કૈવલ્ય પામ્યા.

સંસારી નજરે માસી-ભાણુના, અરે ! રાણી અને રાજકુમારી ! પણ અમણું સંધના અંધારણું અનુસારે તો-શિષ્યા અને ગુરુણી-પરરપરના દોષ ન જોતાં ડેવળ ગુણુગ્રાહી દર્શિના જેરે અપૂર્વી

* જે પ્રામ થયા પણ ક્રીને પડી જતું નથી તે એઠથે કે ડેવલજ્ઞાન.

એવા કેવલજ્ઞાનને પામ્યા—એક ખીજના નિમિત્ત ઇપ ખન્યા—સાધ્વી ચંદનબાળા અને સાધ્વી મૃગાવતીનો ‘મિચ્છામિ દુઝડમ’ એ વ્યવહાર પૂરતો ન રહેતા, ઇણદાયી નીવડ્યો અને વધારામાં ભગવંતના સુખે અઢી, આગળ સાહિત્યમાં ‘અમરત્વ’ ને પામ્યો.

પચીસો વર્ષોનાં વહાણું એ પાછળ વાયાં છતાં આજે પર્યુષણ મહાપર્વમાં આપણે એતું પાન કરીએ છીએ.

‘મિચ્છામિદુઝડમ’ સચા હૃદયથી જ દેવાવો ધટે—તો જ વર્ષભરના દોષાનું પ્રક્ષાલન થાય—શિષ્યા—ગુરુણી જેવો ભાવ આવે તો એડો પાર થતાં વાર ન લાગે.

એવા આત્માઓનાં જીવન સાચે જ આપણા જેવા પ્રાકૃત જનુઃ સમૂહને માટે દીવાદાંડી ઇપ છે. એ જીવનનું તેજ આપણું જીવન નાવને ખરાએ ચઢ્યું બચાવે એજ અભ્યર્થના.

મહાસતી ચંદનબાળાનો જ્ય હો !



શુદ્ધિપત્રક

પાઠ	લીંગ	અશુદ્ધ	શુદ્ધ
૨	૨૪	વતીલાપ	વાર્તાલાપ
૩	૬	રત્રે	સ્વરે
૬	૧૩	દેવાની	દેવાની
૧૪	૧૬	કૃપાઈ	કરમાઈ
૧૮	૧૪	પહેંચાડેલી	પહેંચાડેલા
૨૨	૧૬	સ્થાનતો	સ્થાનનો
૩૬	૬	એવી —	એવા અજણભા
૩૭	૫	કરી	કઢી
૪૩	૪	આ વાસના	આવાસના
૫૦	૫	તપારી	તમારી
૬૧	૨૨	વારસમા	વારસમા
૬૬	૬	તાતાભર	તાતાતીર
૮૦	૨૧	જેવાતું	જેવાને
૮૦	૭	મીઠાં	માઠાં
૮૪	૧૪	આનાકાનો	આનીકાની
૧૦૨	૧૩	બારવનિતા	બારવનિતા
૧૨૩	૩	ગમા	ગુમા
૧૨૪	૧૭	દૃષ્યો	દૃષ્ટ્યો
૧૨૫	૧૩	પડ્યા	પદ્યા
૧૨૮	૧૦	તિર્યંત્ર	તિર્યંચ
૧૨૯	૧	તો	તો
૧૨૯	૮	અ	ભૂઅ
૧૩૨	૨૪	લેવદેવદનો	લેવદેવદતો

પાઠું	લીંગી	અશુદ્ધ	શુદ્ધ
૧૪૩	૧	શરત	અરજ
૧૩૮	૨૦	ચાપે	આપે
૧૪૧	૧૪	માન	મૌન
૧૪૨	૮	એને	એને ન
૧૪૪	૧	એક ધા	એક ધારી
૧૪૫	૧	સમતા	સમતાથી
૧૪૬	૭	કુલં	કુલંક
૧૪૬	૧૧	કંચનયુર	કંચનપુર
૧૮૧	૫	રસીકાયું	રસીકારીશું
૧૮૬	૧૭	મળી	મળી
૧૯૬	૧૭	પ્રસંગે	પ્રસંગે
૨૦૧	૬	સંભતિનો	સંભતિથી
૨૦૭	૩	સામા	સાચા
૨૦૭	૧૧	વિષની રહેલી	વિષરી રહેલી
૨૨૧	૧૫	મનમા	મતમા
૨૩૦	૭	ચમત્કૃષ્ણિનો	ચમત્કૃતિનો
૨૩૧	૫	નથી । એલી	નથી રાખેલી
૨૩૨	૬	સામનાથી	સમતાથી
૨૩૬	૧	પ્રાસંગિકને	પ્રાસંભિકેન
૨૩૬	૨	નાષ્ટું	નાષ્ટું
૨૩૬	૩	હાથે	માથે
૨૪૫	૭	ચલાવવાળા	ચલાવવાવાળા
૨૫૦	૨૨	પૂકી	મૂકી
૨૫૨	૪	તરફથી	તરફ
૨૫૪	૨૪	રતી	રદી

સંસ્થાના કાર્યાલય તરફથી

* — * — * — *

ધાર્યા અને જણાવ્યા કરતાં આ ગીજું પુસ્તક
બહાર પાડતાં વિશેષ વિલંબ થયો છે.
કારણ અનેક અને કાખું બહારનાં છે.

તનું

વિવેચન તે બચાવ ન કહેવાય;
પરંતુ

ચોથું પુસ્તક પંદ્રેક ઢાડામાં જ આપીને
તેનો ખંગ વાળો નાંખનામાં આવશે.
ખાકીનાં એ, તે બાદ એ એ મહીને
આપવા ગોઠવણું ઉતારી છે.

* — * — * — *

તે છ એનાં નામ (એકંદર-આ કદનાં પૃષ્ઠ ૧૫૦૦)

ભુખ્ખધન અભયકુમાર	મોહવિનેતા ધલાચીકુમાર
સતી શિરોમણી ચંદ્રનાયા	દાનેશ્વરી જગડૂશાહ
નર-નારાયણ યાને કંસવધ	મૃદુભાષિણી મહિયારણ

* — * — * — *

વાર્ષિક લવાજમ રૂ. ૬૫ : એ વર્ષના સાથે રૂ. ૧૫૦

દરેકમાં પેસ્ટેજ વાર્ષિક રૂ. ૦૩૩ રૂદું

અમે તે દ્વિસથી માહેક થઈ શકાય છે.

અંસ્કૃત રક્ષક સસ્તું સાહિત્ય અંદળા : રાવપુરા : વડાદા

જાહેર વિજ્ઞપ્તિ

૫૬

પ્રથમ વર્ષનો હેવાલ ખહાર પડી ગયો છે. તેમાં ટ્રસ્ટની સ્થાપના,
ઉક્ષેચ તથા હેતુઓ; વળો

કરવાં ધારેલાં પાંચ કાર્યની સંક્ષિપ્ત રૂપરેખા

તથા પાંચ વર્ગના સમ્ભ્ય થવાની યોજના

અને તેના નિયમો ધ. ધ.

અનેક નવનવીન હક્કીકતો જાણવાની મળશે.

————

જનસેવા કરનારી આ સંસ્થાને, કાળ પ્રાપ્તિનો એન્ઝે જેમ બને
તેમ ઓછો પડે તે કારણે, ખરી છચ્છાવાળાએજ હેવાલ મંગાવવો તેવી
આસ વિનાંતિ છે.

લેખકો તથા પુસ્તકો વેચનારા એજન્ટોએ પત્રથ્યવહાર કરવા
વિનાંતિ છે.

સંસ્કૃતિ રક્ષક સસ્તું સાહિત્ય મંડળ

રાવપુર—વડોદરા

શાસન સભાટ આ.ભ.

શ્રી વિજય નેમિસૂરિખરણ મ.સા. નાં શિષ્યરત્ન
પ.પૂ.આ.ભ. શ્રી પદમસૂરિ ત્રંયાલય
દાદા સાહેબ, લાવનગર



ट्रस्टी मंडण

- (१) भाननीय गणेश वासुदेव आपलंकर—
मध्यस्थ धारासभा, न्यू इंडिया : सलाहकार
- (२) सर अखिलाल भालाभाई नाणावटी—नाईट
माल डेप्युटी गवर्नर, रीअर्व बैन्क ऑफ इंडिया—मुंबई
- (३) श्रीयुत कुहनभलण सौ. दिरेशीया—स्पीकर
मुंबई धारासभा—मुंबई
- (४) शेठ शांतिलाल भंगणाळक—प्रभुआ
भालभालिक मंडण—अमदाबाद
- (५) रा. सा. शेठ कानितलाल ईश्वरलाल—इमरेक्टर
शेर अलर—मुंबई
- (६) श्रीयुत अमृतलाल हलपतभाई शेठ—संचालक
“जन-मञ्चभूमि” हिन्दू पत्र—मुंबई
- (७) भान. छायालाल जवेरभाई सुतरीया
लोकग-दीवान-वडोदरा, स्थानिक सलाहकार
- (८) डॉ. त्रिलुबनदास लखेच्यंद शाह
भेनेलग ट्र. गी-वडोदरा

संस्कृति रक्षक संस्तुं साहित्य ठार्यालय
भाजन गली, राव मुरारा, वडोदरा